

૧૯૮૮

# ધાર તથા પહવિગરેના સંગ્રહ\*

પૂછીમાર્ગના વૈખચકાન સારુ

છપાવી પ્રસ્તીક કરનાર

શા. લલુ પીતાંબડ



## આમદાવાદમાં

કાગળીએણ નજીબ જુમાંમથીદની સામે

શા. ઇસમજી ડોસાલાઈના મડાનમાં

અમદાવાદ વિકટોરીઓ પ્રેસમાં

શા. નાથાલાઈ લલુભાઈએ

૫૧૫૧.

સંવત ૧૯૪૭—સાલ ૧૯૮૧

કી.માલ ૧-૮-૦

નાનાન દનર વાહાલા	
૩ એકાદશીનું	૨૫ નંદ ધેર આણંદ ઉનટ્યો
૪ ચોરાશી દૈશ્વતિનું	૨૬ શ્રી લક્ષ્મણ સુતને હું નસુને
૫ ચોરાશી દૈશ્વતિનું	૨૭ શ્રી લક્ષ્મણ ભટજીને ધેર
૬ લક્ષ્મણ ભટજીનાં ભાવે લીધાં ભામણાં	એક કુળ દીવારે
૭ ઘસે બાવતનું	૨૮ આવતે આવ ઉત્તાવળી
૮ દીતતાનું	૨૯ પાસ નામેશ્રી નિઠલનાંથળ
૯ વીનતાનું	૩૦ શ્રી વલભ રાજકુમાર ત- મે ડાંડ કીધુરે
૧૦ શ્રી વલભજી કર વિનતીરે	૩૧ આજ સંજ્યરે વધામણાં
૧૧ પ્રાગયનું ધોણ	૩૨ આજ માહારે આનંદ
૧૨ ધન્ય ઓડો અંધારીશરાત્રે	૩૩ ધન ધન દાહાડેરે આજનો
૩ આનંદસાગર ઉલટ્યેરેલોલ	૩૪ આપણ જઈએરે શ્રી ગો
૧૪ ચાલો સખી શ્રી ગોકુળ જ્યષ્ઠાયે	કુળ ગામ સાહેલારે
૧૫ ગોવરધનવાસી	૩૫ ભરે શૈનાથજી ઘારે
૧૬ શ્રી ગોકુળ ગામ અયીશ્વાભતાં	૩૬ ચાલો તો શ્રીજી જઈએરે
૧૭ ઇક્ષ્વમાણીજ્ઞાશ્રી વલભપૂત્ર	૩૭ શ્રી નાથજી તે છેલ બા
૧૮ ધન્ય શ્રી ગુમનાં કર્પા કર્પા	રાજતા નો
૧૯ શ્રી લક્ષ્મણ સુતને હેલો	૩૮ ચાલો સખી નિરખીએ
૨૦ ચાલો સખી શ્રી ગોકુળ જ્યષ્ઠાયે	નંદકુમાર
૨૧ જુરે યેહુલો વધાવો મા- હારે આવીએ.	૩૯ શ્રી ડાંડરોલો ગામ રળી- આમણુરે
૨૨ આવોને પરમ સોહામણી	૪૦ તેડી જાએ તો હમારાં
૨૩ આવોણું અયા સોહાસણી	મન ઠરે
	૪૧ શ્રી વલભ પ્રાણ આ- ધારને નારખવા ચાલો

# નાથજી

- ૪૩ શ્રી વલભ કૃપાન ..  
 શ્રી નાથજી અલખેલા
- ૪૪ શ્રીજી ભરા જોસા રસીયા
- ૪૫ પૂરે જોયારે માહારા મ્રજન  
 ના વાહાલા
- ૪૬ વંદ્રાવનતારે ચંદ્રમા
- ૪૭ શ્રી વલભ સુતને નિર્ભરે
- ૪૮ શ્રી હુકરાણી ધાર સો-  
 હામણારે
- ૪૯ ધન્ય કાંકરોલી ગામરે
- ૫૦ ઓા વાહાલાજી ઉભલા  
 રહેને ર ન રથ્યોણુ
- ૫૧ તમને સુચેલા છે પ્રાણરે  
 હું છાણાલાજી
- ૫૨ શ્રી દ્વારકાનાથજીને લાગુ  
 પાય કે
- ૫૩ વરણું શ્રી વંદ્રાવન સુ-  
 ખ ધામ કે
- ૫૪ કાંકરોલી ગામનારે વાસી
- ૫૫ અમે આવ્યા તનારે આ  
 હુરે અલખેલાજી
- ૫૬ વનમાં વાગેર વાંસણી
- ૫૭ વાંકેચ્ચાડે શ્રીનાથજીને
- ૫૮ હું બળીહાણું તૈલંગ કુળ  
 કીપક
- ૫૯ એજન પીળુ
- ૬૦ શ્રી વલભ સુત વાહાલા  
 લાગો.

- સાહેલા
- ૬૧ લીલા લેહેરી તું રંગીલા
- ૬૪ માહન મલપતા ઘેર આ  
 વોર
- ૬૫ બંગાયેદ્યેનધોમાંડીયેં
- ૬૬ હરખેશાવલભનાનેગાઉજી
- ૬૭ સાખી આજનોલાહાવોલો  
 જુઘેરે કાલ કાણે દીકીછે
- ૬૮ આજ આનંદ નંદજીને  
 દ્વારે
- ૬૯ ધન્ય ધન્ય શ્રી ગોકૃપણા  
 અ અતી રણીઆમણું
- ૭૦ હારે વાહાલો એહી સમે  
 શ્રી નાથજી
- ૭૧ કાંકરોલી રાજ સાગર તિર્કે
- ૭૨ નાહાનાસરાઓ આનાથજી
- ૭૩ માઠડા ખોલા શ્રી નાથજી
- ૭૪ માહરે મંદીર પદ્મારો શ્રી  
 નાથજી
- ૭૫ પ્રદૂમ સમે શ્રી વલભ  
 નો પગાવારે વાહાલાજી
- ૭૬ ધન્ય ધન્ય શ્રીજીજુમનાંગોકૃ  
 ણ નાટ આરાનેનવસેરાગે
- ૭૭ વરણ જન વલભરે
- ૭૮ સુંદીર ગોકૃપણ ગામરે  
 પીહાશી સ્યામ
- ૭૯ શ્રી મદન મોહનધાલ

ધાળ	વિષય	ધાળ	વિષય
૮૦	શ્રી વલભકુળના રથીયા વાહાલા	૮૮	કોઈ મને કશ હેણાડોરે શ્રી ગોકુળમાં
૮૧	આદો વાદ્રાવનને ચોકુકે	૮૯	માહારે મંદીર પદ્મારો ઓ નાથજી
૮૨	વાહાદો શ્રી વલભ વરેહ પ્રમદ્રીયા	૧૦૦	જીરે વઈથાક વદી ચે- કોદશીરે
૮૩	આજસખીઅનાનાં હું વોરે	૧૦૧	અથ શ્રી પૂછુ માર્ગનાં દસ મર્મનું ધાળ.
૮૪	શ્રી વીઠભનાથ સોહામણુરે	૧૦૨	પૂર્ણી મારગ સોહાંતની
૮૫	ધન્ય ધન્યરે આજનોદીન	૧૦૩	ધન્ય શ્રી વલભ અટેલમાં પ્રભુ વશીયા જુમનાંતરે
૮૬	જીરે ધન્ય ધન્યરે આજ નો દીન	૧૦૪	ઘેર આવોરે જોપીએ- ના વાહાલા
૮૭	ધન્ય ધન્યરે આજનોદીન	૧૦૫	સુખડાનું માંડળ માતી
૮૮	ઉભાં રહેણ તો કહુ એક વાતડી	૧૦૬	ભારેહી ખાજ કાહાતાં તારી બેથ
૮૯	સરદ પુનમણી રાત જોઈ વાહાદે રમજા કાંધુ મનરે	૧૦૭	સામરો ન જનો મારી પીર
૯૦	તમે ક્રયાં ગયા વનમાળિરે ગીરધર શામળીઅયા	૧૦૮	જીરે કારેતક માસ વદી અષ્ટમી
૯૧	પરજ અતો શાલીયું જ ન્ય તન કર્ણી	૧૦૯	શ્રી વલભકુળ લલે પ્ર ગઠીયા.
૯૨	સરવ ગાઈને રદ્ધાં	૧૧૦	સાંભળસુજનીવધામહુણી
૯૩	વાહાલા તાહારાં વચન સાં ભળીને હરણ્યાં	૧૧૧	સેત ગોદ્ધ અમા શો નાથજીને ઘ્યમા
૯૪	સરખી સાહેલી સહુ મ- ળોને	૧૧૨	નાગર નાંજીના લાલ
૯૫	દીકી સરદની રાત જો...। મણી જે	૧૧૩	શો ગોકુળ નાથજીના લાલર
૯૬	માહારાવાહાલાનાવનમાંહ	૧૧૪	આ ડળીયાં કારણુંએક
૯૭	શ્રી વીઠભનાથજી માહા- રાનું ધાળ		

ધારણ	વિષય	ધારણ	વિષય
૧૧૫ ચાલો જણ જુમનરેના હાવા		૧૩૧ ચીરણુણું ચારીએ આઓણ	
૧૧૬ ઉરી તને પ્રસાન તે કે મ થાશ		૧૩૨ વહેવાધ તારોમાંડકુંડાંસં ભાણકે	
૧૧૭ વરુન ચોરાશી કોશના વન યાત્રાની પરીક્રમા		૧૩૩ શ્રો વિઠમનુપરણુંને ૫ ધારાચાળ	
૧૧૮ વારે વારે સામુ ભાજે મુખ લાગે મીઠ		૧૩૪ શ્રી નટવરલાલને ખરણે રે સુંદીર શ્રો છોટાલાલ ખલાહારીર લાલ	
૧૧૯ શો મેકુંગયું મુકીનેક્યાં ઈ જઘણે નહીં		૧૩૫ નાથ કેસે ગજકોઅંધ છોડાં	
૧૨૦ વારી વારો શી ગોકુળ નાથજી તમારા લટકાને		૧૩૬ જીરે જીરે પ્રથમ સુરજ પાણ જાણોણ	
૧૨૧ પ્રગટચા પૂરશાતમ લાલરે		૧૩૭ પૂછિ માર્ગના પાંચ તત્ત્વ નિય ગાયજી	
૧૨૨ લાલ તમારો લટકો નોઈ મનેચટકી લાગોપ્રેમતણી		૧૩૮ સાખી સરદ પૂનમની રા ત સુજને વાહાલાણ	
૧૨૩ ચાલો ચાલો ડાંડીદોને કંઠકુ		૧૩૯ ધન્ય ધન્ય શ્રો દ્વારાં નાથજી	
૧૨૪ અથ શ્રી ગોસાઇજીને, વીવાહ એવ		૧૪૦ શ્રી લક્ષ્માણભરજીનેદ્વા રચાયોત્તોલોવાજપ્યેજી	
૧૨૫ વિવાહ મળીયો શ્રવણ સુંઘાચો		૧૪૧ શ્રી વલભ પ્રગટચા પ્ર ગટચાર	
૧૨૬ પનોતીએ દીક્ષો છે આ શિષ્યજી		૧૪૨ શ્રી વલભ શ્રી વિઠલ શ્રી જ શ્રી કુમનાં	
૧૨૭ બંન ચેક્યું છે શ્રો વીઠલનાથજી		૧૪૩ તગારાં નયાણાં છે કા- મણગારાં	
૧૨૮ વહેલાયાએવારલનાથજી		૧૪૪ સજની સહુકો ચાલોનો વા જઘણે નો	
૧૨૯ આવો પનોતીમૃગાનેજી			
૧૩૦ પ્રભુજીને મારે ત પધરા વાળ			

ધોળ વિષય

- ૧૪૫ લટકાળા બાળ શ વિ  
દલ વરને નરસુ તે ધ  
સ્ય ધત્ય  
૧૪૬ જીરે ધત્ય ધત્ય શાવળ  
ગાસ  
૧૪૭ શ્રી વલભ ફુરલભ જી  
ગમાં કહીએ  
૧૪૮ છાંફિલા છાંફિ તાહારી  
નેછરે  
૧૪૯ ચેત ચેત ચિરણી  
વાતા રેહુંનથી જો  
૧૫૦ આ ગોડુણમાં એક ન  
દનું ધામ.  
૧૫૧ શ્રી વલભ પ્રભુજી પર-  
ણસુ.  
૧૫૨ કળીશુગ સબ જુગત  
અધીકાર  
૧૫૩ તનક હરી માઈ  
૧૫૪ શ્રી કશી કમળ સુખ  
નારખવા  
૧૫૫ ને શ્રી વલભ હેતકી  
૧૫૬ સાધનસબ સુને ભએ  
૧૫૭ શ્રી વિઠલનાથ નામ ર  
સ અમરીત  
૧૫૮ સુંદી ગોડુણીયું જો-  
વાતા સુજન કોડ  
૧૫૯ શ્રી ગોડુણી સુખ બાસ  
ખરાને  
૧૬૦ વિષશીરોમણ તેલંગ નાથ

ધોળ વિષય

- ૧૬૧ શ્રી વલભ વિઠલ જીજી  
રે રમવાને આવો  
૧૬૨ સરવે સૈંપર જગાણી મ  
જી આવોરે  
૧૬૩ શ્રી વલભ ફુરલભ યુગમાં  
કૃતીએ  
૧૬૪ ગોડુણની ગોપીએર આ-  
લી જળ ભરવા  
૧૬૫ સામા સંય ધીય ગોડુણ  
કૃપારે નારસુ  
૧૬૬ ભનો ગોપાળ ભુલ મત  
નાએ  
૧૬૭ આવો મળો સાહેલડીજી  
૧૬૮ શ્રી વલભ વિઠલ નાલ  
એવા તેણે સરેરસ ખોયું  
૧૬૯ શ્રી વલભ પ્રભુજીને શર  
ણ ન આયો  
૧૭૦ વળી વગે દરશન આ-  
પીએં  
૧૭૧ શ્રી વલભ કુળ વરજનું  
જીવત  
૧૭૨ ભલે પ્રગટ્યા શ્રી ગીરી  
વરધારી દાલ  
૧૭૩ ચતુર્ભૂજ છે આરીરે  
૧૭૪ શ્રી વલભ પ્રભુને કૃ  
પરણામજી  
૧૭૫ વેળું મધુંશીરે વાય  
૧૭૬ આજ મારી ઘેર આ  
વીયારે

દ્વારા	વિષય	દ્વારા	વિષય
૧૭૭ પ્રાર્થના પ્રગટચા ઓ વર	જખુખાળાલ	૧૬૩ ગોવરધનથી ગુરુતેમરણે	નમું
૧૭૮ વંહુદીવલભ નાપણુંને	વંશજી	૧૬૪ જુમના જાતારે ધારે	
૧૭૯ હરીખસો હરીખસો મરે	આએ નેનમે હરીખસો	૧૬૫ આદો આદોરે શો મા	હારાજ
૧૮૦ વંડે અંદોડે થાંનાથજી		૧૬૬ ભલે આવી લાગો ન	દ્વાજમ રાત કે
૧૮૧ આવોરે આવોરે સુહાગી		૧૬૭ પંચ રંગ પ્રભુજીનાગા	ઈંગેરે
૧૮૨ હરી ભજન વીના સાનર	જીવે કેસો	૧૬૮ જય શો ઠકેરે ભાઈ	
૧૮૩ જ્યે આદો શો વરભરા	યનાલની	૧૬૯ શીગોવિંદ્રાયજીરેશ્યિયા	
૧૮૪ આનંદ સાગર ઉલટ્યો	રસનાય વેહુછે પ્રવાહ	૨૦૦ શોલક્ષમણુ સુતનેરેગાજ	
૧૮૫ શો મદન માહનલાલ	આગળ વીનતી ડોધી	૨૦૧ કુમદાસમે ધન મનમા	દ્રકૃ ધાણું
૧૮૬ શીગોડુણ ગામરે અતો	રળીઆમણુંરે	૨૦૨ સંભરવાળા દાસ દામો	
૧૮૭ શો ગોડુણનાય સાહા	મણુજી	૨૦૩ પદમનાલ તે દાસ વ્યા	સ સુખ અતિ ધાણું
૧૮૮ જ્યે જ્યે લાલ ગોરધન	ધાર્યા	૨૦૪ પૂરુણાતમદાસ સદા સુખ	અતિ ધાણું
૧૮૯ સંખીરે શી વીઠલ નંદ	ન આવોરેમાહારેભારણે	૨૦૫ ગદાધરદાસ કુપીલ કડા	માંહુ ઘરા
૧૯૦ તાહારા દલ કર્યુ વાત	શે જાણુરી	૨૦૬ શરાવણુ શુદ એકાદશી	નું ધોણ
૧૯૧ ડોમળ અંગેરેઓસુજનની		૨૦૭ વઢશાખ સુદી એકાદશી	નું ધોણ
૧૯૨ શી દામોદરદાસ હરચા	નારે હરચે ભર્યા	૨૦૮ શી વાડભનાથજીના લા	લ છો અતી લટકાળા
		૨૦૯ અય શી કફાનો ભાવ	

શાલ	નિવ્ય	શાલ	નિવ્ય
૨૧૦ મેહેતા નમા ગેડેતા ત મા જાણી આર	૨૧૬ શીંગ નાગ લટકાણા		
૨૧૧ સલની ચાલો ઉછ્વ આજળુ	૨૧૭ આજ આણું માહારે		
૨૧૨ લ્યાકુ એદ રેણ	૨૧૮ ન સમાયળુ		
૨૧૩ ઉનમ કુણ અતારે ક- હચા લો	૨૧૯ તાતે જાની અને વનવારો		
૨૧૪ ચાલો સઘપરો સુંધીર વરને જોખો	૨૨૦ હેસો હરોન્યુંડા એક દંન ભાર		
૨૧૫ પરમ કૃપાણ શ્રી વલભ નંદન	૨૨૧ શ્રીવલભ જુડો ભારી		
૨૧૬ મિહિન્દુગયેદયનપાણે	ભઇસો		
૨૧૭ શો વલભ વિઠલ હરો ન જાણું	૨૨૨ શ્રીગોર્ધનકી રહીએ તથેઝી		
૨૧૮ તનાં લોચા સરખુંડુંપ	૨૨૩ તથુ શરણગત આયો		
૨૧૯ ચાલો સખી આજ વં- દ્રાજનમાં જઘણે	૨૨૪ અમતો શ્રીવાડલનાય ઉ		
૨૨૦ શો પૂરશોતમ પ્રમટહુના	પણો		
૨૨૧ શો વંદ્રાતે વનની વાર્ટે	૨૨૫ દ્રદ્ધિન ચર્ણનકે ભઇસો		
૨૨૨ રથીઓ રસ ભરયેરે	૨૨૬ એક પલક લો રહીએ		
૨૨૩ લાગી મને નેહ જરીરે	વંદ્રાતે		
૨૨૪ ધેણી થન કરે ધેણા ગી સધાગના રાંગેરે	૨૨૭ સીવલભ આરારાજ		
૨૨૫ પ્રિણી વાતડીરે નેને લાગા હ્યાય તે જણેરે	૨૨૮ સાપન સોજ નિચારી		
૨૨૬ કારણ એ શું કહુંડે	૨૨૯ આજ કામ કલ કામ		
૨૨૭ માહારા ઇપાણા રણછોડ	૨૩૦ નિશ્ચિત લેહેરી શૈં		
૨૨૮ અયભો જગનનાય જુના	ગીં ॥		

શિળ વિષય	શિળ વિષય
૨૪૬ લો બસુહેન કીએ મૂ.	૨૬૫ રાવસ્કરે કહે ગોપ આજ ખજ હુનીપર
૨૬૭ તથ	૨૬૬ નહિમલોલા હોતો જુની
૨૫૦ જીના ગોપાળ ગોપાળ નહી કો અપનો	૨૬૭ કેતે દીન હરી રમરણ વિ ના જાએ
૨૫૧ જીવન નેસે ભજન વીના	૨૬૮ કેતી કહી સમજાઈ
૨૫૨ તનમાં અણોરી બસો મે રે તનમાં અણોરી	૨૬૯ દાઉ તમે એકા નહીયાપ
૨૫૩ કૃપાં ગરાવત વાડવાં	૨૭૦ મનતુ જયગો અમજાની
૨૫૪ શુલ્લાગતવિચારી કાઢી	૨૭૧ કોઝુ કામ નહી આયો
૨૫૫ હેઠાત ગોપાળ એંગારે	૨૭૨ જીવન એસે જે બની આવે
૨૫૬ કદા કીએ તેં જુગમે	૨૭૩ હાડોરજુને જગાડવાનાં ૫૬
૨૫૭ અખમોરી હોન ગતા અનુ જનાય	૨૭૪ ભગવાનને એલાનવાનાં ૫૬
૨૫૮ રાખો તેસે રહુ નેસે	૨૭૫ ભગવતનાં નોષાવરનાં ૫૬
૨૫૯ એર એર નહી આવે	૨૭૬ શ્રી હાડોરજુના મહાતમ નાં ૫૬
૨૬૦ સુદીરમેખ્યાત્યો ગોપાળ	
૨૬૧ કોન પત રાખે ભરો	
૨૬૨ કદુ મન ઉર સંતનકીશ્વરા	
૨૬૩ શ્રીગોકુળમાં રહીએ	
૨૬૪ નેસે હું તેસો તોહારો	

વર્ધસનાને નિત્ય નિયમ રાખવાની શીક્ષા।

અદ્યાય રહેણાં તથા પ્રકરણનું પ્રમાણ સ્કંધ લિશ.

શી દ્વારિકાની પરિક્રમા।

# धोळ तथा पद विगेरेनो संग्रह

## धोण १.

अध श्री सर्वोत्तमल्लुं विण.

भवे प्रगट्या श्री वद्वद्वद्वद्व, पूढ़वोतम भूतण इरी-  
ए; नडी प्राकृत धर्मना वेद, अप्राकृत निज वयु धरीए. १ करे निगम् निःपापु अम, ते साकारनी सुती करेए;  
माहाकाली कालाक्षिं हाथ, पंडीतनो द्रष्ट तिमर भरीए. २  
महीमा नव लखे नेह, ते कहीये आरा सुर हरीए; वाले  
हा करी सुप्य ३५, निज लीला प्रगट करीए. ३ नेहे-  
री वाली अति दुर ऐध, थाए सुआध लेखे इरीए;  
नेनां अष्टोतर सत नाम, ते कहीये माहा अध हरीए. ४ नेना ३५'र अग्निकुमार, जडती छांद नामे धराए;  
श्री इमन कमल सुप्य है, गीज द्रष्ट कृष्णा भरीए. ५  
करे भक्तिमां अंतराय, तेहना सनपीये लखे सरीए;  
आपे अधरामृतनी सीध्य, ते अध्य निश्चय करीए. ६

चाल इरी छे.

वाहासो आरांद ५२भानांद कहेवाय, श्रीकृस्त कमल मुख  
इपानिधि धाय. ७ वाहासोद्दी ओधारन प्रेतना उपाय,  
नेहना शमर्ण मानथी आरत ज्य. ८ श्री भागवत गु-  
दार्थ प्रगटाय, ते साकार अल्पना वाह स्थपाय. ९ वेद  
मारग अउद्ध भावन कहेवाय, माया वाह निराकार सुँ  
गाय. १० सरवे वाह निराश करे ते लभाय, लक्षित भा-

२० सरम इमण विकाय. २१ સ્થો સોદ્રાદ્વિકા ઓછા  
 ૨ સમરથ, નેતા સાધન અળથી ન ચાય અરથ. ૨૨ અં  
 ગીકાર આત્મથી સરવમ કોણે, કીધાં શી જેપીજન પણીને  
 પ્રોણે. ૨૩ અંગીકાર કરે મર્યાદાનું સાર, માહા કરણા  
 વત સમરથ અપાર. ૨૪ વાહાલો અમેદાન હવાને ખડુ  
 અતુર, માહા ઉદાન અરિત્ર કરે ખડુ મૂર. ૨૫ લીલા હસા  
 ડી પ્રાદૃતની નેહ, તેને મિશ મોદ્યા છે સુર રીપુ તેદુ.  
 ૨૬ વિમાનર શી વલભ છે નામ. વાહાલો: સુંદર ૨૭  
 શ્વલન હિત ગમ. ૨૮ બાહાલા ભક્તિ કરે જીજા શિક્ષા  
 ને ક્રાન, આપે અભિલ દ્રષ્ટ શી વલભરાજ. ૨૯ સરવ  
 લક્ષ્મણથી જાંપન વિવેક, આ કરા જાન દાન ગુરુ એક.  
 ૩૦ પોતાના આનંદ યકી ખડુ મૂર, છે કુમણગતણાને  
 ન સંતુષ્ટ. ૩૧ કુપાદ્રશ્યાની વૃદ્ધાયા હરખાં મન, કરે  
 દાસ દાસીજન પીચેછે ખનાન. ૩૨ શૈશ્વદરદી કરે ભ-  
 કિત શનરૂ પ્રલણ, ભક્તિ સેવીત સુખ શ્વા રાણ. ૩૩  
 જીરે ભક્તિ વીના નહી શ્વા સાધ્ય, તે કારણથી કહીએ  
 દુરારાધ્ય. ૩૪ નેતા અરણ શરણ ફુરલભ દરશાય, તેના  
 હુચ પ્રતાય વિલોક કરેવાય. ૩૫ વચ્ચનાના કરી પૂર્ણા શુ  
 વકના અરથ, શી ભાગવત અમરત મયન ને સમરથ. ૩૬  
 એનું સાર કહીએ વૃજ સુંદરાના ભાવ, તેનું પરિપૂર્ણ છે  
 હુહ ભરાન. ૩૭ સાનિધ્યાનથી દાન કરે કર્ષટ પ્રેમ, ભક્તિ  
 મુક્તિ હવાને નેતા નેમ. ૩૮ એક રાસ લાલામાં તેનું તા  
 ન, પ્રભુ કૃપા કરી કરે કથાનું દાન. ૩૯ વાહાલો વિરહના  
 અનુભવને એ ક્રાન, સરવ લાગ જાગુવો શી વલભરાજ  
 ૪૦ ઉપરેશ કર્યો ભક્તિના ચાર, લોક માણી કર્યો કર્મ  
 મારગ પ્રચાર. ૪૧ વેદ શાસ્ત્ર કરે જગતાચીક દાન, તેનું

કુણ મર્યાદા ભક્તિનું દાન. ૩૨ પ્રભુ પૂર્ણાંદ હે. પૂર્ણાં  
 કામ, સરશતનાના પતો હેન જથ અભિરોન. ઓ વાહાલે  
 સહસ્ર કર્ચાં પુરુષેતમ નામ, નિજ જનને આસ્થાં એછે  
 ધામ. ૩૩ ભક્તિ મારગની ગુતનો કરવા ઉપદેશ, બહુ  
 અંધે કરી ટાણ્યો સંસયનો લેશ. ૩૪ નેને પામનાન છાંડચા  
 પ્રાણથી પ્રિય, એવા ભક્તિ સમાજ નારાજ હૃષે ઓ  
 આપ સાધન કરે નિજ દાસને કાજ, એવા સમર્થ શી  
 વલભ માહરોજ. ૩૫ કરો ભક્તિ પ્રયાજ તે ભૂતણ માહ  
 વથ કીધા પીતા થઈ અહીને બાંહ. ૩૬ સરવે સામરથ  
 ધરચુ પોતાને વાચ, સરવે દુર કરી ટાણ્યો નિશ્વનો આંશ  
 ૩૮ પ્રભુ પતિરોગના પતિ રાખ્યાત, કરે આ લોક પરલોક  
 દાન વિક્ષાત. ૩૯ નેના અતઃકરણનું યુદ્ધ અપાર, અંગ  
 કેનો જાણનો મનનો નિચાર. ૪૦ ઉપાસનાદીક મારગ  
 ને આચ્ય, તહુનો મોહ ટાળી છીધી શેવક અનાચ. ૪૧ ક  
 રો નિયે ને ભક્તિ સરવથા નિશ્ચ, કીધો શરણ મારગનો  
 જુદો ઉપદેશ. ૪૨ શી કસન નામની જાણાવી વત, લી  
 લા કુંજ નાહાયી પરિપૂર્ણ બાત ૪૩ કથા રસ મગત  
 સુદા છે ચિત, વિસરચુ છે તેથી સરવે નાજુ નિ. ૪૪  
 પ્રીય છે ધાર્ણ વૃજને વૃજનો વાસે, કરે પૂજા લીલા એકાત  
 વિજાસ. ૪૫ કરે ભક્તિ છઢા પરિપૂર્ણ દાન, નહા નિજ  
 લીલાનું ડોઘને સાત. ૪૬ આતી માહોક નેતું શાળ ધાર્ણ,  
 નહી લોક વિશે આશકિત છે અલ્યુ. ૪૭ નિજ ભક્તિ ને  
 શ આશકિત છે એક, પ્રભુ પાવન ધીધા પતિત અનેક. ૪૮  
 ને કરે પેતાના યુગનું ગાન, તેના રેણુ કમળ રેણવાનું  
 હામ. ૪૯ પ્રભુ નિજ સ્વરૂપ અભત લેણેરી, તણે રસ વાસ  
 ના ખાજ સરવે હરા. ૫૦ પ્રભુ પોતે સરવ થડી છે પર,

નન કરે તુલ્યતા કોઈ અપાર. ૫૩ લીલા રસ અમરત તો  
રંગ બડુ, લીજવ્યાં છે ભક્ત શરીર સહુ. ૫૪ ઇચ્છી આ  
વે ગોનરવન ગીરી વાસ, તે લીલા માણે અતિસે ઉલાસ.  
૫૫ કરે પણ ભાગ પસનાં કરેન, આપે અરથ ડામને મો  
ક્ષાનું ધરેન. ૫૬ પ્રભુ સત્ય વચન છેણ નીગુણાતીત, ૫૭-  
ત્ય અતુરાદ છે અતી અગ્નીત. ૫૮ ને કરે પોતાની છીર  
તી પ્રદાય, કરેયું વ્યાસ સુનતે નોતાન ભાસ. ૫૯ અતી  
તુલ્ય તુલ્ય ને માયા વાદ, કરી ભરેમને રથાપો ખજ્ઞ ભા  
સ. ૬૦ આખ્યાણ અલોકીક અતી ડાના, હસતુ મુખ શો  
લે છે બડુ લાંત. ૬૧ પ્રભુ વીલાકુનું જુથણું સાર, વાણ  
લા પ્રગટ ભાગ ધરેણીનું અપાર. ૬૨ પ્રભુ સુદૃદ્રતા છે  
અતી અનુપ, કૃપમ વરણન હરો શકુ એ ૩૫. ૬૦ માગે  
છે સહુ પોતાના જન, અરથારવિદ્ધની રજ ને ધન્ય. ૬૧  
એ કદ્યાં એકસોને આડુ નામ, શી વનભ આનંદનું ને  
ધામ. ૬૨

આલ ઝી છે.

એ શુદ્ધ કરો નીત્ય ગાયરે, તેનું મન પહેલું રથીર  
થાપરે; ૬૩ અધરામૃતની શીર્દ્ય વામેરે, જ્યાંહાં સંસાર ન  
દી તે નામેરે. ૬૪ એ પામ્યા વિના મોક્ષ હિનરે, અંક-  
તમાં સુર્કલ છે લીનરે. ૬૫ તેથી સરવોતમ જ્ય કરવારે  
શી કર્ણ રસે મન ભરવારે. ૬૬ શી વિઘન ઇચ્છીત એ ના  
મરે, ને વાય તેનું ધાય ડામરે. ૬૭ તેનો જનમ સુદ્ધા  
છે લાયરે, શી વરજભુપણનાં સુખ દેખરે. ૬૮

### ધોણ. ૨

અથ શી નવરત્નતું ધોણ.

શીમદ વનભ માણ પ્રભુને નશુણ, શી વીઠલ પ્રભુને

લાગુ પાય; ઓ વ્યાળકભૂજને પરણમુજુ. ઓ વ્રજભૂપતિજુ  
 પરમકૃપાગ. ઓમ૬૦ ૧ શ્રીવલભહંગ માહા કરણા કરીજ,  
 જેથી જ્ઞાનું કાજ થાય; સર્વ વૈમાના કાની એ કુ-  
 રીજ, સધગી ચીના નીર્દત થાય. શ્રીમ૬૦ ૨ દ્વદ્દ આ-  
 થય શ્રીમહાપ્રભુજનો રાખ્યાએજ, ચીંતા નવ ધર્યાએ  
 લગારે; સર્વ આત્મા ઓજુને સમર્પિણજુ; એછે ભક્ત  
 તણો આધાર. ઓમ૬૦ ૩ પુષ્ટી માર્ગનાં આજ રેહે સદ્ગ  
 જુ, જ્ઞાન કીધા છે અંગીકાર; અલોકીકની ગતા ના  
 આપે કદા, પ્રભુ નથો જોતા અવીકાર. શ્રીમ૬૦ ૪ નામ  
 નિવેદન કીધા થકોજુ, પ્રભુ રાખ પોતાની પાસ વશ ન  
 થાય એ પ્રભુ કોયકોજુ, વશ થઈ રહ્યા શા વલભભી પાસ  
 શ્રીમ૬૦ ૫ નિવેદન મગનું સમરણ કરવુંજુ, સર્વદા ભગવત  
 સાથ; એ વધુમાની સંમે ના કરવુંજુ; કૃપા થાય નાદથો  
 હાય. ઓમ૬૦ ૬ ઇળની ચિંતા નવ રાખી ગેજુ, પ્રભુ સરવે  
 સર કરેથાય; સરવના આત્મા ઓજુ એ સાખીઓજુ,  
 કરે ભક્તપો કથન રેહેથાય. શ્રીમ૬૦ ૭ એમન ગમે તે ક  
 રો એવું જણવુંજુ, હથીનું બર્દ હેરે દ્વારા; ખ્યા પૂત્રાદ્ધ  
 પૂર્ણીમાં આણવુંજુ, જોગયાના નિયાર મયાણ. શ્રીમ૬૦ ૮  
 નિવેદન કરવું સરવે સંગાથશુજુ, અનવિન ચોગના ચીતા  
 ન રાખ; અતાના હોય કી વા જ્ઞાનશુજુ, સમજુ અધિક  
 છે એવું માં રાખ. ઓમ૬૦ ૯ જેણું આત્મા નિવેદન કીરુ  
 છેજુ, તેના એધારમાં સંસય ના જાગુ; સંગાથે શ્રાગાહા  
 પ્રભુજુએ દીધુંછેજુ, તેથી મનમાં સંસય ના જાણું શ્રીમ૬૦  
 ૧૦ સમર્પણ મંત્ર માહા સમર્થશેજુ, ન જાળુાય પોદ્યો  
 સાક્ષાત; એક અંશકાંગ નથો પૂણુંછેજુ, આજ પૂર્વોત્તગ  
 સાક્ષાત. ઓમ૬૦ ૧૧ એ પ્રભુ સર્વ થકી પોતે પરછેજુ,

વળી મહા સગર્યે હેઠાં નાથ; અક્તાનાં દુઃખ હરે સુખ કરેછે  
 જી, ચાંતા ના કોળુંગુલ માયે એ નાથ. શ્રીમદ૦ ૧૨  
 લોકીક વજનીક કર્મજળુ, તે હજા નિષ્ઠ થાવા હે નહીં;  
 તોએ પણ શેના સુમરાણને ધર્મજળુ, તેથા મન દુર કોને  
 નહીં શ્રીમદ૦ ૧૩ પુરુષી માર્ગનાં પ્રભુજળ રહે સદાજી, વ-  
 ણી જીવનું કોણું શું હાય; પ્રભુ કરે તતો સુખ માની રહો  
 એજી, ઉદ્ગે ન ધરે મન માંદ. શ્રીમદ૦ ૧૪ દીનતાખાત  
 મનમાં રાખીએજી, એજા સા જન્મું શું ડામ; શ્રીસરવે  
 શેના માધવાજી, ગુરની આસ્તા થકી એ ડામ. શ્રીમદ૦ ૧૫  
 ગુરુની આસ્તા ગોપનીગત ના કરીએજી, એનની દુષ્ટાએ  
 થાય તે થાય; આપણા મન પ્રભુજળમાં દીજીએજી, પ્રભુથી  
 અધીક રાખીએ ભાત. શ્રીમદ૦ ૧૬ શેના કરો (નિયે) ચિત  
 પ્રીતશુંજી, તો સુએ રહો કુગમાંદ; પણજી અર્થ કદા થી-  
 જી ચીતશુંજી, સાક્ષી ધ્રુ રહે સુખ હોય. શ્રીમદ૦ ૧૭  
 તોએ ધારણ રાણી શેના કરોજી, હજી સુખ કર્તાએ સ-  
 ત્પ; એનની લાલા જાણું ચાંતા દુર કરોજી, વધરનવને  
 એહ જીગત ૨૮ એકાદશ ઈંડીએ પ્રભુજળતા સનસુખજી,  
 શેનાનાં દીવસને રાત્ર; એકે ઈંડી વીજુણા નન કોળુએજી,  
 સરવેતામ અહીં એહ રાત્ર. શ્રીમદ૦ ૧૯ શોકસન શર્ણુંગ  
 મ રદા જર્પોજી, ન નિસારીએ પળમાત્ર; જ્ય જીગતે કરી  
 ચિતા દુર તળોજી, થાશા અલુની કપા પાત્ર. શ્રીમદ૦  
 ૨૦ શ્રીમહા પ્રભુજળ કહે માહરા એ મતજી, વળી એ છે  
 નિરાધાર; શરવે વધરનવ રાખ્યને ચિત ધર્મજળુ, શ્રીજ આ  
 નથલભ આધાર. શ્રીમદ૦ ૨૧ એ અમુદ્ય રતન ને કોઈ  
 ચિત ધર્મજળુ, તેહને પુરુષી અહીં કરુ ફળ હોય; ને કોઈ  
 ધોણ ગાએ ને સાંભળોજી. તેહને ધર્માનંદ સુખ હોય.

શ્રીમદ૦ ૨૨ ઈતિહાસી નવ રણનું દોષ સંપૂર્ણ.

### ધોણ છ

ઉત્તમ વરત એકાદશી, સાહેલીરે; આજ માહારે અપત્તા-  
સ, જુમનાળું જઘણે ઝીલવા સાહેલીરેં રંગાખી ગલી  
રણીયામણૂં સાહેલીરે; વદ્ધસ્નવની ઝીડાલીડ, જુમનાં  
સાહેલીરે. સરખી મધ્યર ગોળે મળી આહેલીરે; હંદે ૬૨-  
૫ ના માય જુમનાંલું જઘણે ઝીલવા સાહેલીરે. વહુ  
એટી હીંઢે મલપતાં સાહેલીરે, સહૃદેને દરસન થાય જુમ-  
નાંં સહેલારે. સાક્ર કેરા કહરા પડ્યા સાહેલીરે, દુધડે  
વરસ્યા જેહ જુમનાંં સાહેલીરે. ગોકુળ ગામ રણીયામણું  
સાહેલીરેઃ સંદર જુમનાંં નીર, જુમનાંં સાહેલીરે. જુ  
મનાંલુભાં ઝીલવાં સાહેલીરે, છુદા મહેલી ડેશ જુમનાંં  
સાહેલીરે. એમજુ રેતામાં સાઠાં સાહેલીરે, રૂટ્યા નવસરહાર  
જુમનાંં સાહેલીરે. વરજવાશી સાગા મળ્યા સાહેલીરે. હ  
રખે સાઈદું ડેશ જુમનાંં સાહેલીરે. પરસાદ મહેલો મો-  
ક્ષણા સાહેલીરે, હોર તણો નહી ૧૨ જુમનાંં સાહેલીરે.  
માધવામની વાતની સાહેલીરે, આપોના વરજમાં વાસ  
જુમનાંલું જઘણે ઝીલવા સાહેલીરે.

### ધોણ ફ

અથ ઓ ચોરાશી વદ્ધસ્નવનું ધોણ.

શ્રી ગુરુ જગપદ કુમાર રજવંડ, નંડ નિત્ય ધર્મ નેમઃ  
દુઃખ છરણ સુખસેં નિધી, દુણદાયક ભક્તિ પ્રેમ. ૧ શ્રી  
વદ્ધલભ શ્રી વીકાન પ્રભુ, આ કરન પૂર્ણ કામ; ચોરાશી  
મહા ભક્ત તેતો, કર વર્ણન નામ, ૨ નેતું સ્મરણ કરેથી,

અધ્યાતુઃખ કળેણ નાય; પુરુષી પંચ પ્રભૂ પ્રસન હોય, માહા  
 પતિત પાત્રન થાય. ત અન વાંછિત ઇણ સીધ પામે, ગા  
 તાં એ અલિધાન; શી મહા પ્રભુ નીજાનંદનું, કરે તેને  
 દાન. ૪ ॥ ટાળ ॥ શી દામોદરદાસ હરથાંન્દરે, કસનદાસ  
 ભિદ્ધત વહે વાણીરે. ૫ સંમરવાળા દામોદરદાસરે, નેનો  
 કનોઝ મધ્યે વાસરે. ૬ પદમનાભદાસ હર્ષાભક્તતરે, પુલથાં  
 ૭ પ્રભૂ આશ્રયતરે. ૮ વહુ તેની કહીએ પારવતીરે, સુત  
 ઇમનાયદાસ સમરતીરે. ૯ રળેખાઈ વર્ધસનવ ક્ષીત્રાણીરે, શ્રી  
 વા શ્રી વલ્લભજરની આણીરે. ૧૦ વર્ધસનવ સેઠ પરસોતમદાસ  
 રે, કાશીપૂર મધ્યે તેનો વાસરે, ૧૧ ખાઈ રૂક્ષમણી પૂર્ણી  
 તેનીરે, શ્રીવા અતુલીન કહીએ જેનીરે. ૧૨ શણના સુત  
 ગોપાળદાસરે, શ્રીવા સ્મરણુથો ઉલાસરે. ૧૩ રામદાસ હર્ષ  
 રંગ રાતારે, ગદાધરદાસ જગત વિષ્યાતારે. ૧૪ વેલ્લાદાસ  
 આધ્યનદાસ ભાઈરે, હર્ષવંશ પાઠક સુપાદાષરે. ૧૫ ગોવીં  
 દદાસ્ય ભલા લો વખાણીરે, વર્ધસનવ કહીએ એમાં ક્ષીત્રા-  
 ણીરે. ૧૬ ગજનધારને શેવ્યા મારાણીરે, દાસ નારણુ ખ-  
 ણ્ણ માણીરે. ૧૭ માહા વનની વર્ધસનવ ક્ષીત્રાણીરે, જાદ્વદાસ  
 સુર્યિલો જાણીરે. ૧૮ પ્રભુદાસ ભાઈ હર્ષજનરે, દાસ પૂરી  
 શીતમ ધન્ય ધન્ય. ૧૯ નીપુરદાસ વર્ધસનવ કાયરતરે,  
 પુરણમન રથીક રસમનરે. ૨૦ જાદ્વ ધંદ્રદાસ પ્રજાપતરે,  
 ગોપાછદાસ શ્રીના હરી અંતરે. ૨૧ આધવમટ ડાસમીરમાં  
 વાસરે, વાંસવાડાના ગોપાળદાસરે. ૨૨ પદમ રામલાલા અ  
 તી શ્રવારે, પુરણતમ લેશી તેવારે. ૨૩ જગતનાય જોશી  
 તેનો ભરાતરે, વળી વર્ધસનવ તેની માતરે. ૨૪ લેશી ન-  
 રેદ્દી હરીના દાસરે, ગામ જોધરે રાણી વાસરે. ૨૫ વર્ધ-

સનન રાજ્યાદાસી હરીની દાસીરે, રામદાસ ચુલ્લરોતના વા  
સીરે. ૨૬ દવે મોચીંદ હરી રસ માતારે, રણે માધવ બેઠ  
ખાનારે. ૨૭ ઊમ અષ્ટ લોકદાસ શ્રવા ભારીરે, શેવડ અથી  
છુતા રહેતા મહેતારીરે. ૨૮ છરસરદાસ દવે રસ મળનરે, હં  
રી હરી જન શુચિત બળનરે. ૨૯ વધુસન છકડા વાસુદેવ  
દાસા, શ્રવા અરથે રહેતા પ્રભુ પાસરે. ૩૦ કલેદાસ ગગ  
ની સુખ કાઢરે, બાયા વેચુ હરીત દુખ કાઢરે. ૩૧ એ  
એકના એક ખવાસરે, તેનું નામ તે જદદાસરે. ૩૨ રથા  
નેસ્વર વિપ્ર તે જગતાનાદરે, શ્રવ્યા અંદી હરી આતી આનંદ  
રે. ૩૩ ખાલીંદી અદેલીની વધુસન બાધરે, આનંદદાસ  
વિશાભરદાસ ભાધરે. ૩૪ વધુસન ક્ષત્રાંદી પ્રભુ પ્રાતરે,  
રામદાસ મીરાંના પરોહીતરે. ૩૫ કસ્નદાસી ખવાસદી  
નાંદીરે, નેની માંતી અં વલભે વાંદ્ઘારે. ૩૬ યુલામીઅં  
અં વલભ વરનારે, રામનાં પંડોત સ્થાનેસ્વરનારે. ૩૭ વ  
ધુસનદાસ રસપૂરસરે, જુનણુદાસ તે ક્ષત્રી કપુરરે. ૩૮ સાર-  
સ્વત દ્વોત ભગવાનદાસરે, નેનું ચિત રદી પ્રભુ પાસરે.  
૩૯ વધુસન ભગવાનદાસ ભીતશીઅારે, આજીના શ્રવામાં  
દરીઅારે. ૪૦ ચતુરદાસ સનોટીઅા કહોએરે, જોડ વિપ  
અચ્યુતદાસ લહીએરે. ૪૧ સારસ્વત વળી અચ્યુતદાસરે, ના  
રાણુદાસ અંબાસે વાસરે. ૪૨ નારાણુદાસ ભટ મયુરાનારે,  
નારાણુદાસ લવાણી ઠડાનારે. ૪૩ ક્ષત્રાંદી ગોરલસ ભરા  
ઈરે, સાસુને વહુ વધુસન બાધરે. ૪૪ સીંહાનંદના ક્ષત્રી  
સારારે, વધુસન અદેલના એક સુતારરે. ૪૫ એક વધુષ  
વ હરી ચુંણ ગાતારે, દામિદરદાસની માતારે. ૪૬ સીંહાનંદ  
ક્ષત્રાંદીના વાસરે, કરી લવા પૂરશામદાસરે. ૪૭ કરીશાજ  
ભાઈ ગુણુ ગાવેરે, જોપાળદાસ છટારાના કહાવેરે. ૪૮ એ-

નારદનદાસ વદ્ધખુણ ક્ષત્રી, ગવદ્ધનામી ખ લણું હતી મી-  
 નરે. ૪૬ કૃત્યાસાન ક્ષત્રી પ્રકાસરે, નિપ્ર એ ડાચાના હરીદા  
 સરે. ૪૭ ઘાળકથણ બદ્રાયણદાસરે, સેવા સમરણના અભ્યા  
 સરે. ૪૮ વદ્ધખુણ રામદાસ યુહાશરે, સેવા સમરણમાં સુ  
 લાણરે. ૪૯ મધ્યુ ચિત સફુ પાડે ભવાનારે, નરોયાધ હ-  
 તી મન માનીરે. ૫૦ તરફર સત્યાસી હથી ભાતરે, જેના-  
 હરીપદ નિરમળ મતરે. ૫૧ ગોપાળદાસ કહીએ જટાનારી  
 રે, વાસ વજમાં શ્વયા ગારધારરિ. ૫૨ સાંત પોખર રન  
 વેચ્યું નારીરે, ક્રેસનદસે પર છુ સોંપી નારીરે. ૫૩ આશ્રે  
 ચાપડા સનદસરે, સરદાસે શેંના અવિનાશરે. ૫૪ પટલ  
 મહાનજી રણુ સહીતરે, પતી પહિન પ્રભુ ચિતરે. ૫૫ ગોપા  
 ણદાસ નરોડાના કહાનેરે, શૈવે શામન હર્ષે હુલરાવેરે. ૫૬  
 સુરદાસ શીરેસણુ ભક્તને, ગાયા ગારધારો જણે જડતરે.  
 ૫૭ સારદોપરિદાસ પરમાનંદરે, ગાયા યુણનાંધી બાળસું  
 દરે. ૫૮ કુંભનદાસ માહા રસ કંદરે, સાંપી ભાવે શ્વયા  
 શી ગોવિંદરે ૫૯ સુન ક્રેસનદસ દફ એનારે, છોડચા પ્રા  
 ણ ન છોડી ગઢ શ્રારે. ૬૦ કરણનદાસ કહીએ અચિ-  
 હારોરે, ગાયા શ્વયા આ રાસ પીહારારે. ૬૧ ગાયા વદ્ધશા  
 વ એ ચોરાશરે, આ વલભ પદ નિકટના વાણીરે. ૬૨  
 ચાલ હરી છે. સર્કણ તત્વનું તત્વ છે, એ સાર  
 માંહે સાર; એ પાઠ કરતા માત્રમાં, વશ થાય શી નંદુ-  
 માર. ૬૩ શી વલભ શી નિંદલ પ્રભુ ને પ્રસાન કરવા  
 આહે; નથી અત્ય ઉપાય એહને, હરી ભક્તના યુણ ગાય  
 ૬૪ શી આચાર્યજી માહા પ્રભુજુના, અતરંગ એ ભડત;  
 મૂજ ઉપર કરણા ડરો, હો આ વલભ આશકત. વદ્ધસુનવ  
 ૬૫ કુમળ રજ રતી તણી આચ; ગાય યુણ હરીદાસના,

( २१ )

દ્યારામનો દાસ. ૬૬

### ધોળ ૫

અથ ચોરાશી વર્કશનવનું ઘ.ણ.

( તે જીલ્લામાં ને ને સ્વરૂપ હતું તે સ્વરૂપ સાથે લખ્યુ છે,) (

શ્રી વલલભ અરોગું રજને, નમું નિત્ય ધરી માન; ચિંતા ચિત્પો સહુ રણે, ને મીટે ઉર આત્માન. ૧ શ્રી નિઃલ પ્રભુ પદ પરશ, રજવંદું નિત ધર્મ નન્મ; કુઃખ હરણ સુખ શ્રી નાધી, વળી દાચેક લક્ષ્મિન પ્રેમ. ૨ શ્રી આચાર્ય જી માહા પ્રભુના, ચોરાશી ને ભક્તન; તેના ગુણ વરણવું નુંગ માહે જાણે જગત. ૩ તેમના સુણ સ્વરૂપનું, કરે નામ તે વિક્ષ્યાત; સાંભળતાં સુખ અતી ધાર્ય. પ્રભુ પ્રતીન હેઠાં સાક્ષાત. ૪ ટાળ. હથી યાલતો. શ્રી દામોદરદાસ હરસા હુરી, લલીતાળનું પ્રાગદ જાણી. ૫ કલીદાસ મેધન વળી કહીએર, વાચાખાળનું પ્રાગદ લહીએર. ૬ હેતે દર્શિભક્તના ગુણ ગાણેર, તેનો જન્મ કટારય ધાણેર. ૭ સંભરવાળ દામોદરદાસરે, કંન રચનામાં ચિત્ર હુલાસરે. ૮ એ કદીએ સાતમાં ક્ષત્રોરે, હતી દાસી વીજુરણના ખાડે. ૯ પદમનાભદાસ ભરપૂરરે, કોશ્યકમાં વીરના સુરરે. ૧૦ ચંપદલતા સખી ને કહીએર, મધ્યા કુંઝા તે તુલસા લહીએર. ૧૧ વધું સુતની કહીએ પારવારે, હ્રદ વાલીની ઈપવતીરે; ૧૨ રખનાપદાસ સુક નામરે, સખી ઈપ તે ચુખ અલીરામરે; ૧૩ રલોભાઈ વર્કશન ક્ષત્રાણીરે, લલોતા જીની દાસી જાણીરે; ૧૪ રતીદળા સખીનું નામરે, માદા પ્રભુજી સેવાનું કામરે; ૧૫ દાસ, શેડ પૂરણતમ કહીએર,

१६ लेखानुं प्रागट लहोअरे; १७ सभी भाइनी तेहनी ज  
 थीरे, यत्री इक्षमधु तेतो वापाथीरे. १८ शेठना सुत गे।  
 पापदासरे, सभी गायन छानो ढुलासरे; १९ रामदास हि  
 २० सारस्वतरे, प्रेम मंजरी सभी रस भतरे. २१ ग-  
 दाचरे कपील सारस्वतरे, गाम कडामां रेहेता आव्या धन  
 रे. २२ गुथ फुगारिकामां नामरे, कल कडी सभी शुभ  
 आमरे २३ वेहुदास ते क्षत्री कहीअरे. घल नदीपुण  
 ना लहोअरे. २४ माधवदास तेनना खातरे, सभी रनप्र-  
 भा साक्षातरे. २५ हश्चिंश खोड़े सुखदाघरे, सभी ग-  
 भी छनालीका ताढ़रे. २६ गोवीद्वास भला तमे आवेशारे  
 नं८ रायछुना धरना लेयारे. २७ कडा मांहु अंगा क्षत्रा  
 थीरे, लीला भांडे राहछुण जाछुरे. २८ गजन धावन  
 क्षत्री चेनारे, सभी नाम ते ओनुं शुभ तेनारे, २९ अद्य  
 आरी नारायणदासरे, माहा वनमां तेना निवासरे. ३० स  
 भी भयुरे दक्षिणा नामरे, जनील अतुरा धामरे. ३१ क्ष  
 त्राल्ली भाहा वनमां रेहेतारे, सभी नाम ते नद्रा केहेता  
 रे. ३२ गुम्मादास शुर वणी क्षत्रंरे, सभी नाम ते शामा  
 वतीरे. ३३ वर्धक्षन क्षत्री ते हन कपुररे, सभी नाम प्र-  
 विना पूररे. ३४ खी तेना ते श्वाय शीलरे, सभी नाम  
 तेनुं रथीलोरे. ३५ शेठ दीनकर श्रवण रथीनारे, सभी आ  
 पुर्णी नाम ते लीलारे. ३६ धरानं८ ते दीनकर दासरे, धरे  
 नं८ ते सुकद्वासरे; ३७ क्षत्रो प्रबुदास नण लाटारे,  
 सभी नाम ते भनभय भाटारे. ३८ शीहानं८ भाट प्रबु-  
 दासरे, कुल हेयी सभी साक्षातरे; ३९ पूरश्चामभदास ते  
 क्षत्रीरे, वणी वर्धमा हेमनी खीरे; ४० पुरथ नाम ते भा-  
 वनी इहोअरे, सभी खी भालती लहोअरे; ४१ त्रीपूरदास

વैभव डायगते, सभी नाम ते हरेण्ठी प्रसंसनतरे; ४० फूरण्डु  
 मल अंभाले वासरे, सभी चित्रलेखा सुप्र रासरे ४१  
 ज्ञान इद्रधास प्रलयतरे, गाया नाम ते भद्रानमरतरे. ४२  
 गोसाह्यास भयुरांना वार्षिके; गोविंदकुँडनासुवा नावाशी  
 ३; ४३ माधवलट काथमेवु इहीओरे, नाम रेता कुमारका  
 भां लहीओरे. ४४ वांसाना गोपाण्डासरे, रस प्रकाश-रस  
 भां हुआसरे; ४५ पद्म राजन उलेखमां इहीओरे, राज  
 लीला द्वारकांमां लहीओरे; ४६ आ इकमाण्डु ज्ञनी अवार्थिरे  
 सभी नाम ते गामणा कुखार्थिरे; ४७ वर्धनन ज्ञेशी पु  
 रशातम नेहरे, गुण चुडा सभी नाम तेहरे; ४८ खो व  
 धर्नन अमनी इहीओरे, दुरवा सभी नाम ते लहीओरे.  
 ४९ नगानाम ज्ञेशी वणी इहीओरे, सभी नाम सौरजः  
 लहीओरे; ५० सभी छन्ना सीधो तेहना भातरे, गंधा रे-  
 खा ते नरहर भातरे. ५१ राष्ट्रा व्यास गोधरा वामरे,  
 नागरचेल राष्ट्रीनु नामरे; ५२ गोराए दुरे वडालीमां इ-  
 हीओरे, तन मध्य द्वारकांमां लहीओरे; ५३ रा रेत दुरे भा-  
 धन दुरे इहीओरे, ललीताञ्जना सभीओ लहीओरे ५४  
 राजे सभी ते कुञ्ज्यु नामरे, भाषा रस रनाणीका आम  
 ३. ५५ उन स्लोक्यास श्वा भारीरे, सभी शिल्पा ना-  
 म नारधागरे. ५६ लक्ष्मीस दुरे वणी इहीओरे, सभी ना-  
 ते भिनां लहीओरे; ५७ वर्धनन छक्का वासुदेव दासरे,  
 शीघ्रानंदमां तेहनो वासरे. ५८ सभानंद रामज्ञना इही  
 ओरे, गनसुखा गोप ते लहीओरे. ५९ भाषा षेष सभी  
 मुरशनीरे, उस्तुःस इमण्टा तेहनीरे; ६० ज्ञानवदास अ-  
 वास ते इहीओरे, सभी नाम तीलकी लहीओरे. ६१ रथा  
 नेथर निध नवतान दरे, सभी माधुर्य भन आनंदे; ६२

આનંદાસ નાગરી કહીએરે, વિદ્યારથાસ વાલભા લહીએ  
 રે; ૬૩ ખાલ્ચું એક અદુલમાં રહેતીરે, સાખી શથી કુણ  
 સહુ કેહેતીરે; ૬૪ વધણવ કૃત્રાલું એક વાદરે, સાખી  
 નામ તે લોલા ગાંજરે; ૬૫ કૃત્રાલું ગોરણ સંભરાદરે, સા  
 સુ વહુને સદા સુખદાદરે; ૬૬ સાખી નંદા તે શુરળ કહી  
 એરે, સંભરાદ તે વૃંદા લહીએરે; ૬૭ કરુણાસ ખતાસછું  
 જાણીરે, વરજ મંગળ સાખી વખાલુંરે; ૬૮ બોલા મિશ  
 લાહોરના કહીએરે, સાખી નામ ચુમંદા લહીએરે; ૬૯ રા  
 મદાસ મીરાંના પ્રેહીતરે, સાખી ઉદાય નામ સહીતરે; ૭૦  
 વધણવ રામદાસ ચોહાણરે, મધુ ઝેની સ વી પ્રમાણરે; ૭૧  
 રામાનંદ પંડાના સ્થાને સરરે, કુંજ લોલા માતમ ચરે;  
 ૭૨ ચિનુદાસ છીના રસ છકમારે, સાખી કમળા અતોજ  
 ગ-સંગમારે. ૭૩ કૃત્રાલ જીવાણદાસ ક્ષૂરરે, સાખી છસ્ત્રની  
 અતી સુખ પૂરે; ૭૪ સારસ્વત દ્વિજ ભગવાનદાસરે, વ  
 સુ ગંધ સાખીના સુવાસરે; ૭૫ ભગવાનદાસ લોતશ્ચા  
 કહીએરે, સાખી નામ સુદરી લહીએરે, ૭૬ અચ્યુતદાસ સ  
 નોડીએ કહીએરે, સાખી માધુરી નામ તે લહીએરે; ૭૭  
 અચ્યુતદાસ ને ગૌડ ખાલ્ચારે, મેહુની સાખી નામ તે જ  
 ખિરે; ૭૮ અચ્યુતદાસ કડાના કહીએરે, સાખી નામ રસા-  
 તીકા લહીએરે; ૭૯ નારણદાસ અભાલેક વારરીરે, સાખી  
 નામ તે વરજ વિલાશીરે; ૮૦ નારણદાસ ભાઈ મયુરાના  
 રે, નેતો ઘાદર ગોકુળમાંનારે; ૮૧ નારણદાસ લવાંણા ઠ-  
 હામારે, સાખી કેતર નામ ધર્યામારે; ૮૨ કૃત્રાલું સીહા  
 નંદમાં રહેતીરે, સુનદા નામ સાખી કેહેતીરે; ૮૩ દમાદર  
 દાસના માતરે, વિરાયાઈ નામ સાક્ષાતરે; ૮૪ લીના માહે  
 પુલી દીળ કહીએરે, વન દૂરી તેતો લહીએરે; ૮૫ સ્વી પુ

૮૫ ઓનાંકે કહોયે, વિશાળાજી સાચીએ લહીએ.  
 ૮૬ રામાનામ તે પુરુષ જાહેરે, દશા નામ તે ખ્રી વાયા-  
 છેરે. ૮૭ સુધાર ખાતી અદેલમાં રહેતારે, શાયા નામ સુ-  
 દામા કહેતારે. ૮૮ ક્ષણી અનુ મારગીનો સ્નેહીએ, સાચી  
 માહીની નામ તે તહીએ. ૮૯ કવિ લધુ પૂરુષાતમ કહી-  
 એરે, નંદરાય તણા ભાઈ લહીએરે. ૯૦ ઉમાશંકર તનું  
 નામરે, જથું વરણબાનું તને કામરે. ૯૧ કવિરાજ ભાઈ  
 મધુરાંનારે, સાંડેલ નામ પૂરાનારે; ૯૨ ગોપાળદાસ નરોડાના  
 ક્ષત્રીએ, મંગીત કળા ગુણ પ્રતીએ. ૯૩ જનારદનદાસ ક્ષ-  
 ણી કહોયેરે, સાચી કભાવતી નામ લહીએરે; ૯૪ ગડુ સ્વા-  
 ભી ખાકાંગ વદ્રાવનમરે, રાખી વંદી નામ હે આનંદ-  
 મારે; ૯૫ કનેદ્યા શાન ક્ષત્રી નેહેરે, આમાના વાંશી તે  
 હેરે. ૯૬ સાચી લનીનાજી કહીએરે, સાચી નામ કમોદ  
 ના લહીએરે. ૯૭ નિપું એઠાંયા નરબધીદાસરે, શુંગર સા-  
 ખીનો સુવાસરે. ૯૮ નરહર સાત્યારી વળી કહીએરે, સા-  
 ખી નામ ગુલાંની લહીએરે. ૯૯ શદુ પાંદુ આનોરમાં  
 વાસરે, ગંગાણુ ગોપ સાક્ષાતરે; ૧૦૦ વળી ભાઈમાં  
 શ્રેષ્ઠ કહીએરે, મધુ મંગળા નામ તે લહીએરે; ૧૦૧  
 શદુપાંદુ વધુ ભવાનારે, એઠી નરો ઘણી મનમાનારે; ૧૦૨  
 જસેદાજી નાણુદીએ હોયરે, એઠી રામહે થામહે હોયરે;  
 ૧૦૩ ગોળગદાસ કહીએ જગાધારારે, સુલાદ્રા સાખી નીર-  
 ધારીએ; ૧૦૪ કભાસ શાખી આનાદ્રારે, સાખી નામ તે  
 નંદા ચુમંદારે; ૧૦૫ શાદાન ને ચોપડા ક્ષત્રીએ, સાખી  
 ચંદ્રિકા નામ પ્રમલનીએ; ૧૦૬ સુંદરદાસ સાખી નામ શી-  
 લારે, આધવાસ સાખી નામ લોલારે. ૧૦૭ પેન આધવણ.  
 વારણે કહીએરે, રાખી સુયા હરણા લહીએરે. ૧૦૮ ગોપા

ણાસ નરોડાનો વાસરે, જથુંત નંદનો ખવાસરે; ૧૦૯  
 ખાળકમ બાદરાપણદાસરે, ખ્રી સહીત મેરવીમાં વાસરે.  
 ૧૧૦ શૂન્નિદ્રા સખી નામ કહીએર, ખ્રી નામ તે ગંગા  
 લહીએર. ૧૧૧ સુરદાસ તે સાગર શુરે, ગયા ગીરધારી  
 શુણ ભરપૂરે; ૧૧૨ સખી કસનનું પ્રાગટ કહીએર, સખી  
 ચંપદલતા તે લહીએર; ૧૧૩ સાગર વળી પરમાનંદદાસરે  
 ખાળ લીલામાં તાન ઉલાસરે; ૧૧૪ સખી તુડનું પ્રાગટ  
 નેહેર, સખી ચંદ્રભગા કહીએ તેહેર; ૧૧૫ કુંદાસ ડે  
 ર સમસારે, શ્રીજીના સ્વરસ્પમાં આયકતરે; ૧૧૬ સખી આ  
 રાજુન તેતો કહીએર, વિશાળાજીનું પ્રાગટ લહીએર; ૧૧૭  
 સુત કસનદાસ દ્રદ્ર પૂરારે, જો શ્રીવામાં અણી સુરારે; ૧૧૮  
 લીલા માટે તે હંમનું નામરે, ગોપ જાયો ચરાવતાનું કા  
 મરે; ૧૧૯ અધિકારી તે કસનદાસરે, રાત લીલામાં તમ-  
 નો અભ્રાસરે; ૧૨૦ સખી શુશ્બ નાન તે કહીએર, લકી  
 તાજીનું પ્રાગટ લહીરે. ૧૨૧ ॥ વલાણ ॥ ચોરાશી  
 ચિત ખાય કે, કરે પાઠ નિત્ય ધર્મ નેમ; પૂજિ પ્રથમ પ્રસ  
 ન થયે, રહે ખાદાવે અણી પ્રેમ. ૧૨૨ કિયા જી હણી રાય  
 જી, કરી ઘન જણી દાસ; મુલ ચોરાશી લકનનાં, તે ના  
 મ કરચાં પ્રકાશ. ૧૨૩ શ્રી આચાર્યજી માહા પ્રભુનાં, અં  
 ગ દ્વારથ નેહ; ધર્મ સાથે ધરમી કહીએ, સમ દ્વારથ તેહ  
 ૧૨૪ ચોરાશી વરજ કોચ માટે, ચોરાશી એ અકત; પેમ  
 લક્ષ્મણ પૂરી પુરે, શ્રી વલભ પદ આશાંત. ૧૨૫ એ વધ-  
 દીન પદ કર્યાણ ૨૮, રતી તણી છે અતી આશ, ગાય  
 ગુણી હશીદાસના, પદરજ શ્રી વલભદાસ. ૧૨૬

## ધોળ. ૬

શ્રી લક્ષ્મણુ ભરજીનાં ભાવે જીને ભામણાં, ગોતંગ  
તીજિકને વિપ્ર શોરોમણ ભુપ નો; એમના સુત મો વદન  
ભનાં સેડુ વારણાં, દીય દેપે પ્રગણચા અનર અનુપ નો;  
શ્રી લક્ષ્મણુ ૧ ધરમ ધારણન એ સુત વદનભ હેવના  
પ્રગટ કર્યો વેદ તણો વિરાસત નો; ગુણ સહેલ્લર ભાગ્યા  
શ્રી ગોપીનાથજી, હુણ સુધ્યગધર હણધરનો અવતાર નો.  
શ્રી લક્ષ્મણુ ૨ શ્રી ગોવરધનધર વીર શ્રી વનભહેવના,  
રસના રૂપી ડહીએ નંદકુમારનો; એ પૂર્ણશાતમ પ્રગણાયા  
શ્રી વીજનાયજી, નિરયુણ ઘર્ઝ તે સાગુણ રનેણી સારનો  
શ્રી લક્ષ્મણુ ૩ શ્રી વાઠલાનાયજીના સાતે લાલ સેહામ-  
ણા, સહૃથી ભાટા શ્રી ગીરધરજી માહારાજનો; શરણ આ  
વે તે સાંપે શ્રી નાયજી, કરના શું સેવા કરાં કાજ નો. શ્રી  
લક્ષ્મણુ ૪ શ્રી ગોવી દરાય તણા મન પ્રસન ઉલાસમાં,  
આવે તેને આપે આનંદદાન નો; શ્રી બાળકરણજી ડોમ  
ન અંગે રસે ભરચા, કરાવે છે અધર સુધ્યારેસ પન નો  
શ્રી લક્ષ્મણુ ૫ શ્રી ગોકુળનાયજી જણાવે કુગમાં જીવને,  
એવા પોતે ડહીએ પરમ દ્યાળ નો; શ્રી રધુપતીજી ઇડલે  
નારખતાં, વદન સુધનની ભુલે લે સંભાળનો. શ્રી લક્ષ્મણ-  
ણુ ૬ જોવા સરખા દીસે આ જ્વનાયજી, એ છે બહુ  
ની અભણાનો આધાર નો; દ્વારો હૈરી જીવ સના ધનણા  
મજી, થીરપરરે અમરત રસની ધારનો. શ્રી લક્ષ્મણુ ૭  
એ સાતે લાલ તણો વંશ સદા સંસારમાં, પ્રગટ ખીરાને  
પૂર્ણશાતમ પરિઘર્ઝ નો; જુમનાદાસ અધમને ડહીએ એ  
દીન એ, શું જણે શ્રી વલભ કુળનો મરમ નો. શ્રી લક્ષ-  
મણુ ૮

## ધોળ ૭.

આથ અં બસે બાળનું ધોળ.

અંમદવલન પ્રભુજીને, નમું ઓ વીઠલેણ; સાત ક્રમદ્વિપ  
સહિત સખોણો, વંશાત્મક વિશેષ. ૧ શેષક શ્રી નિઃસે  
સજીના, બસેને બાળના નેહનું નામ ઉચાર માત્રથી,  
થાપ સહુ પાવત. ૨ ટેક. ગુણ ગોળીં દાસના ગાઈએરે,  
દીત સ્ત્રાગી પરાયન લઘુએરે. ૩ ન દાસ કસન આશકતરે,  
અત્રભૂજદાસ જદા આનુરકતરે. ૪ નિસ નાગણ્યાઘ ઓ-  
ચરોએરે, કસન ભટ્ટજીને મન ધર્યાએરે. ૫ ચાયાળ ના-  
રણદાસરે, નિઃસેનાસ ભક્ત ઉરાથરે. ૬ કસનાસ મારાણ  
દાસરે, ઘાય જેડા મંત હુનાથરે. ૭ હશીદાસ જનાઈદા-  
સરે, ૮૫ મારાણ રસ રાસરે. ૮ અલીખાન વલીખાન  
નાદીરે, નેમલ રનખુન હશીવાદીરે. ૯ માધવદાસને નાહા-  
લયંદરે, માધવદાસ ડાયસ્ય ગુણગતરે. ૧૦ ડાયસ્ય ધણ્ણાને  
ધણ્ણાયાછીરે, ઇપંદ નંદા સુભવાય્યારે. ૧૧ એક આદ્રાણ  
રાધવદાસરે, ગોપાળદાસ યુનરાતનો વાસરે. ૧૨ રાજ  
લાખાને એક પાઈરે, હશીદાસ અવાસ સુપદાધરે. ૧૩  
શેડ ગાનંદ જફુનાથરે, ભાઈલો કોઢાણી હણી હાયરે. ૧૪  
માણેકયંદને એની નાણીરે, હરજ કોઢાણી ગુણ ભાગીરે.  
૧૫ ગોપાળદાસ પ્રાણાણ બંગાળીરે, વ્યાસ ગણેય પણું  
ભાગ્યથાળીરે. ૧૬ મદસુદનદાસ છે હરી વાહાલારે, એક  
કાણાણી મંના વાણારે. ૧૭ એક વદ્ધિનવતી છે કન્યારે,  
રામાનંદને પરણાણી કન્યારે ૧૮ એક વદ્ધસના જેણી ટેકીરે,  
તતો પરણી ધર્મ વિવેકીરે. ૧૯ વદ્ધસના એક તરના સંગી  
રે, પાથો શુદ્ધાણી હરી રસ રંગીરે. ૨૦ એક વૃજ વાસી

સુત નાગરે, ગોપીનાયદાસ ગાડે આઈએ. ૨૧ કણુંભી  
 ગ્રામરાતી એ લાખરે, દ્વિજ પતિન આગે રાહરે. ૨૨ એક  
 ગોડાઓ પંડિત શાલેરે, એક રધુપતી દરસન લોલેરે.  
 ૨૩ એક પેણને કાહાન બાઈએ, વર્ષસ્તનવ કૃતીઓ આગ-  
 રાઈએ ૨૪ મેહ ઠીમરને દ્વિજ રેણે, નારાયણદાસ હશીને  
 તેણેરે. ૨૫ એક વર્ષસ્તનવ સુતર વાગારે, રાજ આચકણું  
 પ્રલુબ વાહાનારે, ૨૬ એ હની પનીત એ કણુંભારે, ૨૭  
 અજામ કુંનર ઘડું ધર્મોરે. ૨૭ એક પ્રોહાત વેસ્પા કન્યા-  
 રે, ગંગાયાઈ છે પૂર્ણ ધર્મારે. ૨૮ એક રાખને ચક-  
 ધાનારે, એ સાચોરા રસ લોલીરે. ૨૯ એક વર્ષસ્તનવ મ-  
 દન ગોપાળરે, એ કાળ ના પટેન રસાળરે. ૩૦ એક શેરક  
 એક વિરકનરે, દ્વા ભવુદ્ધા આચકાતરે. ૩૧ એક વા-  
 ધીઓને એક નાશુરે, એક પરમ વર્ષસ્તનવા ધાશુરે. ૩૨  
 એક કૃતાણી વિરકતરે, વાધળ રજ્યું આચકારે. ૩૩  
 એક ગોપાળદાસ ભીતશીયારે, ખાન આઈ શેરક અનુસ-  
 મીયારે. ૩૪ ગોપાળદાસ સીધલ ભોળાલાઈરે, શેડ પૂત્રો  
 દીવાનની જાહરે. ૩૫ એક કલડો ઝપા ભાઈરે, હશીદાસ  
 સુતા સુખદાઈરે. ૩૬ એક કૃતા વર્ષસ્તનવ બાઈરે, રાજ  
 રાણી પૂત્રને દાઈરે. ૩૭ શાહુકારનો એઠા ખીલાસારે, એક  
 વર્ષસ્તનવકોડ પ્રકાસીરે. ૩૮ એક વેસ્પા ભીવનની વાસીરે,  
 તે હરી ગુણુ માંદી નીગાસીરે. ૩૯ પૂત્રળ નોં વિરકણ-  
 રે, વેલ્લીદાસ છીપા છે ભકતરે. ૪૦ એક સાનળદાસ એક  
 નાશીરે, પૂત્ર પડાણનો સુખદાઈરી, ૪૧ એકા દામોદર  
 દાસ છે ભકતરે, એઠા શાહુકારની આચકતરે ૪૨ વર્ષ-  
 સ્તનવ એક ખરખુચાનાળોરે, શેડ આગરાઈને મન ભાળોરે.  
 ૪૩ એક ડાપડનાળો શાલેરે, છણુંભી આંજણો વર્ષસ્તનવ

લાભરે. ૪૪ એક થાણી મોરાશિદાસરે, લાધ્યાપાઈ ભાઈ  
 ગુણ રાસરે. ૪૫ રાજ રાજી હશીમન ભાવેરે, એક વ-  
 મહનવ ડાળ જુનાવેરે. ૪૬ દ્વિજ શેડ સોની પરમાન-  
 દરે, ભેણરા પુરુષોત્તમ ગુણવંતરે. ૪૭ એક એ લાધ્યિંદન  
 ભાવ્યારે, ચોપડા લંડાશીન મન ભાવ્યારે. ૪૮ ઠગએકાદસ  
 એકશુંગોરે, માતા એટા હશીરસ રંગીરે. ૪૯ એક ઘરસીને  
 વિરકનરે. નાલ એ ભાઈ આથકારે. ૫૦ જુગા પરખને  
 જેપાણરે, દાશી માધવદાસ દ્વાલાનરે. ૫૧ એટા પટેનોનો  
 નિત્ય આવેરે, એટા પટવાશીને મન ભાવેરે. પર હશીદાસ  
 જમાઈ માણસંદરે, પ્રલુ ત્વાગ છોરો એ મનરે. ૫૩ એક  
 ગીશિકી પરિકમા કરતારે, એક નિત્ય ઉઠી વૃજમાં ફરતારે.  
 ૫૪ એ કાણાંનીએ કરી હેઠીરે, લેઈ કુરાનાં નાંખી હ-  
 વીરે. ૫૫ કાણાંનુ ગુજરાતની વાસીરે, એટા જારાયલની  
 સુખ રાસીરે. ૫૬ રાજ જોખસીંગ દક્ષિણનારે, વળી  
 પ્રોદ્ધિત તેના ઘરનારે, ૫૭ સાસુ વહુ સુરેતના વાસીરે,  
 રાજ પૂર્વના સુખ રાસીરે. ૫૮ શેડ ચુત નારો ગુજરા-  
 તીરે, એક ખાદ્યાણની નાગર જાતીરે. ૫૯ શ્રોવાઠલેય શ્રી  
 જુને ઇપેરે, દાખું દરસન એન અનુપેર. ૬૦ એક ફુસંગ  
 મીટો વિરકનરે, જીલ ભાઈ આથકનરે. ૬૧ વેણુદાસ  
 જીના છે ભકનરે, એક રજયુત કાંઠાના આથકનરે. ૬૨  
 દ્વિજ પતિન વર્ધસનવ સંગર્થારે, ખાતા ડોડ પોતાના અંગ  
 થીરે. ૬૩ એક નુંય અધિક એ આવેરે, એક દ્રવ્ય સા-  
 ભયી લાવેરે. ૬૪ એક કાણાંની ગાય ચરાવેરે, એક રા-  
 સની રન ચિં લાવેરે. ૬૫ એક ઠગને એક ગુજરાતીરે,  
 સીતાપાઈ છે દક્ષિણી જાતીરે. ૬૬ એક વર્ધસનવને એક  
 નાંદરે, દમીદરસ સુખ દાઢરે. ૬૭ વડનગરીમાં માધ-

વદાસરે, એક વદ્વિનવ મહા વતગાસરે. ૬૮ જુજરાતને  
 દાસ નોરાશરે, અડન લીમ અતી હિતથારીરે. ૬૯ એક  
 દાસ ગોત્રરધન ધારીરે, રામદાસ પરમ આચારીરે. ૭૦  
 જ્યાદાસને નરહરીદાસરે, રાજ ટોડર મન સુખ રાસરે.  
 ૭૧ નરસીદાસ પીગાયરદાસરે, ધર્મદાસ ગોપાળ પ્રકાશરે.  
 ૭૨ એક વ્યાલથુને એક નાશરે, એક વેપાણી સુખ રાથરે.  
 ૭૩ એક ધ્રાષ્ટ્રાણુને એક નાશરે, એક ખ્રીછે સુખડારીરે.  
 ૭૪ એક જન ભગવાન એ ભાઈરે, એક ઢીમલ સુખ-  
 દાઈરે. ૭૫ દ્વિજ પતિન પતિન : ટેલરે, એક સંદાગર રસ  
 રેનરે. ૭૬ મૌખીદાસ ચનૂભૂલ ભાવેરે, ગોપાળદાસ ગોર-  
 વા કંહાવેરે. ૭૭ એક ક્ષત્રી રઘુનાથરે, આવા તરવાડી  
 હરી હાપરે. ૭૮ દ્વે ધર્મરદાસ સાચોરારે, સત્રદાસ ક્ષત્રી  
 ગુણ ગેરરે. ૭૯ ક્ષત્રી સુતને સુત વ્યાલથનારે, એક પૈ-  
 જીવ રાજનગરનારે; ૮૦ પૈશવ ભગવાનદાસ સોદાવેરે, એક  
 દક્ષાણી વેમા આવેરે. ૮૧ સ્વામી કશીદાસ વીજાસીરે, એ  
 ક ક્ષત્રી મધુરાં વાણીરે; ૮૨ દ્વિજ જીથી રાજ લીમારે, શા  
 હુડાર સુત સુખ સીમારે; ૮૩ એક ક્ષત્રી જાદવદાસરે, હ-  
 રીજારન મધુરાંગાસરે. ૮૪ શાહુડાર વળી ક્ષત્રીણુરીરે, એક  
 વરણવાણી શુભ વાણીરે; ૮૫ દાસ પૂર્ણાતમ પોકરાણુરે  
 વળી દુરગાદાસ શુણ ગાણ્યાતારે; ૮૬ ક્ષત્રી ચાન્ડા ધાનદા-  
 સરે; લક્ષ્મીદાસ શુન્નરાજમાં વાસરે; ૮૭ તારાયદને અતુ  
 ર પ્રાહારારે, વેસનન શુન્નરાતી અતી ભાશુરે. ૮૮ હરીદા-  
 સ માહનદાસરે, ભાવેસાર સુત શુણ રાસરે; ૮૯ દ્વિજ એ  
 હી ક્ષત્રી ડંપારે, એક ચ્ચાર શ્રીનિવાસ ધન્યારે; ૯૦ એક  
 ઉત્તમ અષ્ટ લોક દાસરે, એડાળણ ભગત રસ રસરે. ૯૧  
 સાસુને સસરો તાનારે, રંજુનાની એઠી પરમાણૂરે, ૯૨ સા

ચોગ દ્વિજ આનંદારારે, એક લંબી છે સુધ્ર રાસરે; ૮૩ સંઘનદાસ હેઠાભાઈ કાળુંનારે, રાજ્યપૂત્ર માહનદામ ધર્મારે. ૮૪ નર નાગુ વસેછે પ્રાગરે, માધવાદ સુરેન અનુરાગરે, ૮૫ ભર્ત કલાણું વિરાધારીરે, મધ્રા પૂરુષીત મ સુખનારે; ૮૬ રડા રતનાણ અધિભરીરે, ૮૭ બાઈ પરમ શુણુ ભાગીરે; ૮૭ વેણવ ક્ષત્રી છે આગરારે, એક મહાધરને કુન બાઈરે; ૮૮ હેવ લીમ ભાગીરે, રાજ માનસિંહ અધિકારુરે. ૮૯ દ્વે પ્રોહાત સુત વિષ્ણીત રે, કલનદાર ગોરવા જાતરે. ૧૦૦ વડનગરા માધવનદાસરે, દ્વિજ ઉન્નેંણોના સુધ્ર રાસરે. ૧૦૧ નારાણુદાસ સાનાડીઓ સાનારે, લક્ષ્મીદાસ રણે ક્ષત્રાણીરે. ૧૦૨ રાજ "પીરખને તાતસેને, આનંદ નાગણી સુદર બેનરે. ૧૦૩ વેણુદાસ દમોદરદાસર, વીજા નગશ્યામા છે વાસરે. ૧૦૪ એક એક દુગ લાયી લીધુરે, લાયી સ્વરૂપ હદ્યામાં લાંધુરે. ૧૦૫

આન રાજુ છે. જથ્યા મતોણે કદુચાં છે, વળી બીજા છે અપાર; પરમ તત્ત્વનું તત્ત્વ છે, એ ભડાના આધાર. ૧૦૬ ભડત રજ શરોમણીને, એકનો આધાર; કર્યા છે બળી કરે છે, બળી કરેણ નારધાર. ૧૦૭ ત મારે સરવે પ્રાતઃ ઉડીને નામે કરો કરાહાર; કંદમાં ધારણ કરો તો, હરી મળે સુધ્ર સાર. ૧૦૮ સરવે ભગવતાને નમ ન કરીને, એજ માગુ નેમ; ઓ વિઠન વરતી અછિ કિપર, રહેણ કુલ્લંબ ક્રમ. ૧૦૯

### ધોળ ૮

અથ આ દીનતાનું વેળ.

શ્રી વિઠલ વર માહારારે તમને તો શું કદીએ, પ્રાણું

વણ છોરે પ્રભુ ને રાયો તેમ રહીએ. ૧ આથ તમારી  
રે અલોદૂર વાતા અમને, છાં નવ દેશારે અરજ કરેલું  
તમને. ૨ ઈયા કરીને દરશન અમને ઢેંને, ઓ વરજલુખ  
ણું લાલજીરે જીવને શરણે લેને ઉ વહેલબ કુણ પ્રગટ્યા  
રે અનેક જીવને નાર્યા, કોઈ જનમનારે પ્રભુ મારગથી ઉ-  
ગારચા, ૪ એ વિસ્તારે અમા રહ્યાં છીએ વળાયાં, પા  
લન નહીં સુકુરે કેમ કરી કરશા અણગાં. ૫ ને પોતાના કી  
ધારે તે સુક્ષ્મા કષ્ટમ લાયે, પરદતમારારે પ્રભુ ભડત વચ્છન  
કરેવાયે. ૬ જીવના હ્રાગાલે ડેહેઠાં પાર નહીં આવે  
અધોર ડોનીમાંરે પ્રભુ તમ વીના કોણું છોડાયે. ૭ પરદેશ  
પદ્ધારારે દાસલાને કાજ, રીત ચલાવાર થી વહેલબજી મ  
દ્વારાજ. ૮ કલ્ય હમારોને જો વાકાલા ચિત ધરશા, જીવ  
અથડાણે એવું તો ન કરશા. ૯ પૂરેણ પુરશાતમરે, પ્રભુજી  
તમે ડાહાવો, અમારે ભરવસરે તમ સાથે છે દાવો. ૧૦  
શિક્ષા અમનેરે ને ધરે તે હેળે, થી વીડલ વર નાયજીરે  
જીવને શરણે લેને. ૧૧ દાસની વિનતારે પ્રભુ હર્ષયામાં  
લઈએ, ઓ વીડલ વર માદારારે તમને તો શું કહીએ. ૧૩

### ધોણી છ

અથ ઓ વિનંતીનું વેળ.

વૃજના જીવન કર વિનતો ઓ ગોકુળનારે ચંદ, વરજના  
જીવન કરું વિનંતી, થી વહેલબનંદ. વેગે, તે આંણું માંડ  
લો, ઓ ગોકુળનારે ચંદ; વરજના જીવન. ૧ તમારા દ-  
રશન વીના વહેલબરે, કોહેણું કેમ રેહેવાય; મનડાં તે કેઈ  
ગે વાળીએ, નયાં નીર ભરાય, ઓ વરજના જીવન રે  
નાંની આદર કરું, ઓ જીમનાંલું માંદ; વીયોગ

તથ્ય હું દોહલું, ડોહાજી ક્ષમ રહેવાય. વરજના જીવ  
 ન૦ ૩ હુર રહે ક્ષ્યમ ચાલશરે, ડોહાજી ડોની એ શીત;  
 આજ ડાલનું ડોધિનથી, છે પુરણી પ્રીત. વરજના જીવ  
 ન૦ ૪ હશીર હશ્યામાં જાગણે, છે પુરણો સ્નેહ; દ્યા  
 કરોરે દીનાનાથજી, નીકર તજ્જ્યુ આ દેહ. વરજના જીવન૦  
 ૫ નયણે ભરી છારે નિરાધીયુરે, શી ઠડરાણી ધાર; અં-  
 તરમાં હંદ્રા મળી, જોડુ વરજનીરે વાદ. વરજના જીવન૦  
 ૬ આરે સુડોછને શશીર થારે, હૃદી હાંદર વીર; નયણાં  
 તે રાખ્યાં નવ રહે, ભરી ભરુ આવેશે નાર. વરજના જીવ  
 વન. ૭ રાંદુપર શાં ઇસણાંને, પ્રભુ દીન દ્યાણ; દાસ પો  
 તાના જાણુને, કરલેરે સંભાળ. વરજના જીવન૦ ૮

### દ્વોણ ૧૦

શ્રી વખતજી કે વીતનીરે, ગારા પ્રાણુ આધાર; દીન  
 જાળી કરીણા કરીરે, પ્રભુજી ઢાણે રાણ્ય. શ્રી વખતજી  
 ૧ અનુક્રમ કર્યને વરજાલુંરે, શી નાગવત ઇય; દ્વાદસ અં-  
 ગ પ્રભુજી તથા, શાલા પરમ અતુય. શ્રી વખતજી ૨  
 અધિકાર ભોલા પ્રથમ સ્કંધ છેરે, દ્વાદું ચરણનું ધામ;  
 પાંચ ચરણનું ધામ છે, દ્વિતીય સ્કંધ લીલા સાન. શ્રી ૩  
 લખજી ૩ સ્વર્ગ લીલા નવિય સ્કંધ છેરે, હણુને એક  
 ખાડુ નેહ; નિસ્વર્ગ લીલારે ચતુર સ્કંધ છે, ખાળે ખાડુ  
 નેહ. શ્રી વખતજી ૪ સ્થાન લીલા પાંચગ સ્કંધ છેરે,  
 પાછલો ભાગ કરું જાણ; પેણગ લીલારે સાણમ સ્કંધ  
 છે, કરી ઉત્ત વાયાણુ. શ્રી વખતજી ૫ ભોલા સમગ્ર  
 ધ છેરે, દ્વાદું હસ્ત કહેવાય; એક હસ્તને અછુમ ગ  
 છેરે, મનવંતરે ભીલા ગાય. શ્રી વખતજી ૬

વે એસાનું કહ્યારે, એને રથાન નેદ; દસમાં રહ્યે નિરોધ  
લીલા રહેછે સમરે ધરી નેહ. શ્રી વલભજી ન સુચિત લી  
લા એકાદસ રહ્યું છે, એતો સુસ્તગ; આસરે લીલા દ્વારા  
દસ રહ્યું છે. શ્રી વલભજી હરીદામ પ્રભુ શાખા  
નીરખાને, ધરી બજીએ ચિત; ક્ષાળું ક્ષાળું હરોને નાહાળી  
એ, ગુણ ગાઢાને નિય. શ્રી વલભજી કર વિનંતીર, મારા  
રા પ્રાણું આવાર. ૬

### દોષ ૨૭

અમ શ્રી પ્રાગટનું વિણ.

લક્ષ્માણ ભટજીનું ખામરે, દિસે અતી સુખભારો; કાક-  
રખંભા ગાનરે, તે ઉપર જાહ વારો. ૧ છે તૈલંગા ધાલણ  
ણરે, માહા યુગ પવિત્ર જાણી; એમના કુળ મધેરે. ઓ  
વલભ પ્રગટચા જાણી. ૨ શ્રી વલભ ગુણું ગાડિરે, આનંદ  
પ્રેમ ભરે; શ્રી હરોના સુખથીરે, પ્રગટચા દેહ ધરો. ૩ તૈલં  
ગ કુળ મંડનરે, ઓ લક્ષ્માણ તાત રાહી; શૈખતાગ સરોખા  
રે, નેને ગાયે સહસ્ર ઇણી. ૪ તેતો પાર ન પામરે, લી  
લા રસ સિંહું તાણી; અગિન મધે પ્રગટચારે, શ્રી વલભતા  
થ ધણી. ૫ અગિન મધે રમતારે, માતાજીએ દીઠ જ્યારે  
એ છે સુત માહારારે, ખાઈને આયાં તારે. ૬ અગિનએ  
માંગ દીધિરે, માતાજીને આયાં જાણી; એવી કર સાહીને  
રે, કુંવરને લીધા તાણી. ૭ અમરાનતી જીવેરે, રલ પૂર્ણ  
પેગાન અડી, દેન ફુંદલી વાગ્યારે, ચોદિશ લાગી અડી. ૮  
સુર વીનતા સહુકારે, નેવાને આયાં મળી; અંજળી લ  
રી નરારે, પૂર્ણપણી વૃદ્ધિ કરી. ૯ કેરી વરજ પ્રગટચારે. દ્વિજ  
૩૫ ધરો; એ શાખા નોઈર, કહે હરીદામ વળી. ૧૦

વરજમાં વાસ આપનેરે, વિતંતી અગણે ધરી; શ્રી કૃત્ય  
એ ભરજાનું ધામરે, અતિ સુખકારી.

### ધોળ ૧૨

ધન્ય આડો અંધારી રાતકે, ભાદ્રેવા વદીરે લોલ; ધન્ય  
મધુરાં ધન્ય ગોકુળ નામકે, ધન્ય જુમનાં નદીકે લોલ.  
૧ જ્યાંહાં પ્રગટ્યા આ શુંદીર સ્વામકે, ડમળ દળ લોચના  
રે લોલ; પૂરવા વજ જંન કરી દામકે, ભક્ત હુખ મોચ-  
નારે લોલ. ૨ પ્રગટ્યા મધુરાનાં જરૂરાયકે, શ્રીવસુદેવ અર્દેરે  
લોલ, નિરખે હૃતકીળ મુખચંદ કે, મંન આનંદ લહેરે  
લોલ. ૩ વિતંતી કરી કરું ધન્ય આજ કે, હેઠા પ્રભુ નિ-  
રખીઓરે લોલ, આંગણે ઉભા ત્રી વસુદેવ કે, અતી  
ધલું હરખીઓરે લોલ. ૪ રતનતણાં કરવા બહુ જળ કે,  
ક્રોણ ક્રુષન કોળુઓરે લોલ; એહેવું રવરૂપ હુર કરો નાથ  
કે, બોળું વધૂ લાળુઓરે લોલ. ૫ પ્રભુજીએ કોણું બાળ  
રવરૂપ કે, ક્રોણે નાતનેરે લોલ; સુજન ગોકુળમાં જઈ  
સૌંપા કે જસેદા માતનેરે લોલ. ૬ ભાગી ભાગળ આલી  
કુપાઈ કે, કાળા અહે તાણુરે લોલ, જેહેના કસન સરોખા  
પૂત્ર કે, તેહેને રોમણારે લોલ. ૭ સુતા દ્વારપાલ સર્વસા-  
થ કે, કરણું કર્ણિકા હરીરે લોલ; આતા માગી, શ્રી ગોકુ-  
ળ કે, આયા આવતીરે લોલ. ૮ સુસ્તક લીંઘા શ્રી જ-  
રૂરાય કે, આદ્યા શ્રી ગોકુળ ભણારે લોલ; વરજ અધ  
ધરી રહ્યો છ્યાં કે, શ્યામ સહસ્ર રૂપારે લોલ. ૯ પધાર્યા  
નંદ તણે દરખાર કે, સુતાં સહુ દીકડારે લોલ; પોઢાડા જ-  
શાદાળુની શજ કે, ગીરખર મોઠડારે લોલ. ૧૦ કન્યા લી-  
ધી શ્રી વસુદેવ કે, આવ્યા મધુરાં ઝરીરે લોલ;

નાગ્યાં દીઠા પુત્ર કે, કહે હર્ષ ભરોરે લોલ. ૧૧ તેડા સ  
ણાં કુટુંબી આજ કે, સહુ વરજ સાથનેરે લોલ; તેડા એક  
ન તમારી ચાર કે, નવમહે માનનેરે લોલ. ૧૨ આપો મણી  
માણેક ભાડાર કે, આખણ નેહનેરે લોલ; આપો દ્વિજ  
જનને બહુ દાનકે, ગૈાવચળ તેહનેરે લોલ. ૧૩ આંગણે નાં  
દ તણે અતી લીડ કે, આંધા વરજ જન તાંહીરે લોલ;  
બાંધી ક્રાચળ જલે નર નાર કે, હણધ ઘૃત કુદ દહીરે લો  
લ. ૧૪ એવા ઓદ્વજન નિત્ય અખાડ કે, શો વલભ બા-  
રહુરે લોલ; હંડુ હર્ષ તણે, નહીં પાર કે, વૈસનગ જાપ  
વારહુરે લોલ. ૧૫ શાભા જોઈ કહે હરીદાસ કે, દરશન  
નિત્ય આપનેરે લોલ; તમારી લોલા નિત્ય અપાર કે, દૂદ  
યમા સ્થાપનેરે લોલ. ધર્ય અડો અંધારી રાત કે, ભાદર  
વા વરીરે લોલ. ૧૬ સંપૂર્ણ.

### ધોણ કૃત.

આનંદ સાગર જિલ્લાયેરે લોલ, શ્રો વાસુદેવજીને દ્વાર  
નો; આઠમ આનણની વદીરે લોલ, રોહણી નક્ષત્ર યુધજા  
ર નો, પ્રગટ્યા શ્રી કુલન મન ભાવતારે લોલ. ૧ પીણાં પી  
તાંખર પેહેરીઆરે લોલ, ઓઢી ઉપરછી સાર નો; સુરસ્તક મૂ  
ગટ પીરાજતારે લોલ, કુંઝન અળકે છે કાનનો, પ્રગટ્યા  
ર ભાલ તીલક અગ મદ તણારે લોલ, પીઠનીઆણા કેશ  
નો; ચારે બુલણે આધુદ ધરીરે લોલ; સંસ અઠને ગદા  
પદમ નો, પ્રગટ્યા ૩ નાડે નથ બેસર શાભીતારે લોલ,  
ચુની છે લાભ ચુલાલનો; અધર પર ભાતી લટકનાં રેલે-  
લ, હબચીએ હીરલાની ડાંનત નો. પ્રગટ્યા ૪ બાંહે બા  
જુખાધ ઐરખારે લોલ, પોંચી છે રન જડાવનો; હથે હા

થ ઈણ સેહોએ મુંદ્રિકરે લોખ, ઉર ગજ મોતીના હારણે,  
 પ્રગટ્યાં ૫ કૃતું બાંધી છે ડ્રી મેખળારે લોખ. અરણે આં  
 લેનેા જમકારણે; એવા પ્રભુજીને નારાયતારે લોખ, સરવે  
 અપાં છે હુઃઅ ફુરણે. પ્રગટ્યાં ૬ વસુહેવ દેશ્ઠોણું ૬૨-  
 ઘીઆં રેલોલ, નારાયા શ્રી સુખ સ્વરંપ ને; એવા પ્ર-  
 ભુને ડ્રાં રાખશુરે લોખ, કૃપે છે ડાંસ રામ ભૂપ ને; પ્રભ  
 ટ્યાં ૭ ત્યા રેપ્રભુજુ એમ બાલીઓરે લોખ, રાંભણો  
 મારી વાત નો; શ્રી નંદ નાણ દેખારનારે લોખ, તેડી સુધી  
 આવો મારા લાત નો. પ્રગટ્યાં ૮ કન્યા લેધન ધેર આ  
 વળેરે લોખ, સરણે સધગાં કાજ નો; તે તમે કંશને દેખ્યા  
 ઉલેરે લોલ, તો માડણે એનાં માન નો; પ્રગટ્યાં ૯ એ  
 મ ડાં ધાયા કુરોરે લોલ, ધરીઆં છે જાળ સ્વરંપ નો;  
 વસુહેવ હંડી ચિસ્સે થયારે લોલ, રણનું લાંદ્યું છે મને સા  
 રણે; પ્રગટ્યાં ૧૦ ભાગી ભૂંગળ જોલાં પાણીઓરે લોલ,  
 સુતા છે સંકુ દરવાન નો; સુતાંકે લેધ હરાને નિસરચારે લો  
 લ, લીધો થ્યા ગોકુળની વાઠ નો; પ્રગટ્યાં ૧૧ કરમર વ-  
 રસે છે મફુલારે લોલ, ચોદશ અમદે છે વીજ નો; આ  
 એ ચિંહ ધડુકીઓરે લોલ, શ્રદ્ધનાગે કીધી છે છાંપ નો;  
 પ્રગટ્યાં ૧૨ થ્યો જમનાજુ વેહે છે રસપૂરમાંઝ લોલ, ઉ  
 ડેછે લહેર તોરંબ નો; હરોના ચરણું સ્પર્ધિનારે લોલ, હે-  
 ઠાં થપાં છે જળ નાર નો; પ્રગટ્યાં ૧૩ દીવો માનને આ  
 દ્વા ઉતરોરે લોલ, પોહાતા થ્યો નંદ દ્વાર નો; સુતા દીઠા  
 સંકુ સાથનેરે લોખ, મનમાં કીયો છે નિયાર નો; પ્રગટ્યાં  
 ૧૪ થ્યો જસોદાજુની શનમારે લોલ, પોઠ્યા થ્યો ગીર-  
 ધર લોલ નો; કન્યા લહ પાણી વચ્ચારે લોલ, જોણે પ્ર  
 ભુજુણાં ઘ્યાલ નો; પ્રગટ્યાં ૧૫ જળ્યાં જસોદાજુ તે

સમરે લાખ, નિરખા શો સુદીર સ્વાગતો; ૧૯૭ મળ  
હરખા ધર્મશુરે લાખ, આખાં છે રતનાં શાન જો; પ્રગટચા,  
૧૬ ઘર વેર તારણ આંદ્રીઓ લાખ, ભાનના મંગળ ગા  
ય જો; વરજ સહુ ઉપાગો પ્રેમશુરે લોલ, આનંદ એ-  
છા થાય જોં; પ્રગટચા ૨૦ હળધર રહી અથ કુદુતનારે  
લાખ, મચ્યો છે કીયા દીય જો; તાણી વાગે ને કેવે પુદ-  
ડીરે લાખ, નાચે છે સહુ નર નાર જો; પ્રગટચા ૨૮  
અદ્ધાને શિવ સુની દુનતારે લાખ, માલે જ્યે જ્યે જ્યકાર જો  
દુનતાં દુંદભી રાગીઓ રે લાખ, પુરુણી વૃદ્ધિ થાય જો;  
પ્રગટચા ૨૯ એ સુખ શાભા શી કહુરે લોલ, કેણેતાં ના  
આવે પાર જો; આ નલજ ચરણ પ્રતાપશુરે લાખ, શાલા  
જુવે છે બલીહાર જો; પ્રગટચા ૩૦

### ધોળ ૫૪

ચાલો સખી અર્ગોકુળ જઈજો, વિનાંની વાહાખાને કુ-  
દીજો; કે સેહેલે સુખીઓં ખડુ ધરુજો, ચાલો સખી. ૧  
ધર્ય ધર્ય શ્રી ગોકુળગામ, પ્રગટચાં પૂર્ણિ ડામ; જેહેનું  
સુની ધરે ધ્યાન, ચાલો સખી. ૨ મળી સહુ વરજ ત-  
ણી નારી, ષેહેની કસુંાલ સાધી; કે લટકે દુંધરડો આ-  
ગ્રી, ચાલો સખી. ૩ મળી સહુ સધ્યરની ટોળી, પેહેની  
પચરંગી ચોળી; ચાલો ભમર લોળી, ચાલો સખી. ૪  
કુર સુકનાદગની થાળી, જેનાં વદન શદન વાળી; કે સા-  
દો માહે લે તાળી, ચાલો સખી ૫ તોરણ ભાડ્યા છે  
ટોડે, જ્યે જ્યે શબ્દ જયક માલે; કે વર્ધાત્રે જન ભ-  
ળીયા તોડે, ચાલો સખી. ૬ ધર્ય ધર્ય કરાણી ધાંદે,  
એઠા શ્રી વિઠલનાથ; સોહીએ કુવર શાત, ચાલો સખી. ૭

धना धना गुमनानी देहरी, भद्रसी माहननी वेष्टी;  
सुणतां थड गर्छ छुं चेडेला, यालो सभी. ८ प्रगट्या  
गीर्शवर गोरधारी, कश वरजलीला विश्वासी; माधवदास  
लोटी जप अवीहाई, यालो सभी आगोकुण जघगो. ९

### धोणि १४.

अथ श्री गोवरधन वाशी लीभ्य ते.

श्री गोवरधन वाशी सांतरो, लाल तुम विनार; श्रीष्ठ  
तुम विना रखो न अयेण, वरजराय लडतो लाडेलो;  
नाडी माहनरे, आठी भाँडुही शी मार्को अलयहेण; श्री  
गोवरधन वाशी सांतरो. ११. अ१५ यित मुश्किपके लाल,  
सुंदीर खद्दन हेलाय, लोयन तजपेण सीन जुँ लाल; क्षी-  
खुमरे पलड अही लाय हेण; श्री गोवरधन. १२ सम स्वर  
बंधानके लाल माजन अन अलाय, सुरत सुहाई बांधके  
लाल, भद्रे भद्रे गाय; श्री गोवरधन, १३ सीक रसीली  
मोलनी लाल, ओझी अठि जैवां भोलाय; गंग भोलाय  
धुमरिये लाल, ओचे हेरे सुनाय हेण; श्री गोवरधन. १४ दृष्ट  
परि ज्ञां दीवस ते लाल, तम ते इचे नही अन; १५-  
नी निंद्रा तर आवही लाल, विद्यरो भोजन पानहेण,  
श्री गोवरधन. १६ दरथनकु नेनां तपे लाल, असन सुनतोडा  
झान; भाजवेडा हेरो तपे लाल, भेरे छुओडा छुन त्रा-  
णहेण; आगोवरधन. १७ मन अभिलाखायुं रही लाज,  
लागी नेननी भेष; ओक १८ हेचु आवनो लाल, नागरे  
नक्षवर अभेडा; श्री गोवरधन. १९ पूर्णि सशि सुभ वेषके  
लाल, यित भोटा आही देव; २० सुधारस पानके लाल,  
सादर चंद्र अडोरहेण; श्री गोवरधन. २१ दोक लाज कुण.

એકી લાલ, છાડો જકળ વિવેદ; કમળ કલિ રેવી જ્યું  
બહે લાલ, ક્ષાણું ક્ષાણું પ્રિત વિશ્વકરે; શ્રીગોવરધન. ૮ મ  
નમય ડોડીક વારણે લાલ, હેણા ઉગમગા ચાન; જુગતી  
જન મન ફંદના લાલ, અંધુજ નેન વિશ્વાળે; શ્રીગોવ-  
રધન. ૯ એ રથ લાગી લાડોલે ભાસ, જેસે ચાનક ભાર;  
પ્રેમ તર અખાંય કે લાલ, નવ ધન નંદ ડીશારેણ; શ્રી  
ગોવરધન. ૧૦ કુંજ મોચંન કીડા કરે લાલ, સુખ નિચી  
મદન ગોપાળ; અમશો વંદાવન ભાસતી લાલ, તુમ ભોગી  
ભમર જૂપાળેણ; શ્રીગોવરધન. ૧૧ જુગ જુગ અવિચન  
રાજુએ લાલ, એ સુખ સૈન નિવાસ; શ્રીગોવરધન ધર  
૩૫ લાલ, અલોહારી ચતુર્ભૂજાવાસેણ; આ ગોવરધન. ૧૨

### ધોળ ૧૬.

શ્રી ગોકુળ ગામ અતી શાલીતા, શાલીતા મંદીર ભા  
જીઓં; ચોક ચિત્રામણ શાલીતા, શાલીતા જડાનને જ  
જીઓં ૧ મહુણી આણક સ્થંભ શાલીતા, શાલીતા હીડોળા  
ઘારે; પાઠીએ પચરાંની શાલીતા, શાલીતા ચુગળીના  
ધારે. ૨ તાંહારે પીરાને શ્રી વલભારાયજી, ભલી ભલી  
વધુઝીના જોડે; પ્રેમે પ્રમુજુ પધારીઓ, પૂરવા નિગમના  
કોડેરે, ૩ કુળ કુમ થાળરે ૪૨ ધરી, ભરા મુક્ત કુણ સારે;  
વજ તીવા વગે વધાવાને, આવે છે માંડવા માંદુરે. ૪  
અંગિન થડો વાહાલો પ્રગટોઓ, કંધિં છે અલી ધણો અ  
મરે; દેવા પણુણને નિર્ભોને, ડેખ ના જણે તેહનો અર્મરે.  
૫ શ્રી વલભ અરણે નન્દ, તેના તે પેણેતે છે આશરે;  
માધવાદાસના વિના, રાખણે ડઠ વિસ્વાસરે. ૬ શ્રી ગોકુળ  
ગામ અતી શાલીતા, શાલીતા મંદીર ભાજીઓં. સંપૂર્ણ.

## ધોળ ૧૭

ઇક્ષમાણી જાય શ્રીવલભ પુત્ર, વધાવો વરજરાજને; સખી શ્રીર ગોડુળના ભૂગ, વધાવો વરજનાથને, એમનું નામ મનોહરે રૂપ, વધાવો એક સકુલ સોહાસિણી, મળી વરજ કેવી નાર; એક આવે ઉતારણી, વીસરી વાવેક નિચાર, એકનાં મનમા મોદ ભરુંથાં, મળી મંગળ ગાંયે આર. વધાવો. ૧ એક ગેડની ભાલે આગળી, પેહુરચાં પીતાંણર ભાર; એક દક્ષશીલાં શ્રીર પેહુરચાં, ચોળીએ ભાતીના હાર; એકને અરણુ ચુંદી, એકે સજુચાં શાળ શાળ-ગાર. વધાવો વરજનાથને. ૨ એકને વાગે દુધરા, તનો શબ્દ રાર સર લાલ; એક નાર ના બહે કોઈન, ઉંગંગી ઉમંગી જશ ગાય. વધાવો. ૩ એકે કદળીના રથાંભ રોપા, સાચીઓ સુભ સાર; એક કુમ કુશના હાયા હતી, તેરણુ ઘેણા દ્વાર. વધાવો. ૪ એક એક એક ઘેણ પુરતી, એક ગોત્ર ભાલે છત્રાશ; એક કુમકુમ તીજક કરતી એક હતી આશીશ. એક ઉતાર આરતો, જીવો સોભા એદીના વીર. વધાવો. ૫ જીવો કમળા એદીણના વીર, વધાવો. ૬ જીવો જુમના એદીના વીર, વધાવો. ૭ એક સુકતાકૃષ્ણની થાળ લાવીને, વધાવે વરજરાજ; એક વદન લીલાણતી, આબી લોકમાં વારંવાર. એક માગે વધામણી, ખલીહારી તે માધરદાસઃ વધાવો વરજરાજને. ૮ સંપૂર્ણ.

## ધોળ ૧૮

ધનથી જુમના કણ કરી, શ્રી ગોડુળ વરજ રૂખ ચાપણે; વરજની રૂજમાં આહરનિશ હમને, રથરે કર્મને રથા

પણ. १ તમે મોટાંદો. શ્રી માહારાણી, તમે જગતાની કરુણા લક્ષ્મી; શ્વર્ણુ હમને લેલે તાણી, ધન શ્રી જ્ઞાનનાં. ૨ શ્રી વદ્રાવનની વાડમાં, નાહાવું શ્રી જ્ઞાનના ધારમાં; વાહાસે રાસ રમાડચા શીરાતમાં, ધન શ્રી જ્ઞાનનાં. ૩ ચાલો તા ધઈએ વરન વાણી, પરિક્રમા કરી ચોરાશી; માહારા જનમ ભર્જની રળી કંશી, ધન શ્રી જ્ઞાનનાં. ૪ પદરાવો સપ્ત શાર્દ્રે સેવા, આરોગ્યાવો મીઠા મિતા; વધુસ્થને લાલ ધર્ણા લવા, ધન. શ્રી જ્ઞાનનાં. ૫ ગોકૃણ મધુરાણી ગલી-ઓમાં, માહારાજ મુજને લાંદાં મળીયા; માહારા જનમ મનોરથ સફ્રા થયા, ધન શ્રી જ્ઞાનનાં. ૬ નાનુંનો વાહાસે વનમાળી, ડાળંદ્રી કંડે ઘેતુ આશી; વાહાસે હથી હથી હમશું લે તાળી, ધન શ્રી જ્ઞાનનાં. ૭ જીવ લણે શ્રી જ્ઞાનાણ નાહીએ, એવા અખંડ વરજવાશી ધઈએ; એ નહિતમ લીલા નિત્ય ગાઈએ, ધન શ્રી જ્ઞાનનાં. ૮ સખી સમરોને સારંગ પ્રાણી, દૈસ્થને વાહાલી એ વાણી; એ લીલા હરીદારે લણી, ધન શ્રી જ્ઞાનનાં કપા કરી, શ્રી ગોકૃણ વરજ સુખ આપણે. ૯

### છોટી ૧૬

શ્રી લક્ષ્મણુ સુતનેરે હુલો, એમને નિરાય સરવે ફેહલો ૧ એમના ચુણનેરે ગાણી, તેના ભવનો ઝૂરો જાણો; ૨ સુત ગોપીનાથ શ્રી પિલ જાયા, જાણીએ કલ્પ વૃક્ષની છાયા. ૩ પ્રગટચા દૈવી જીવ અધિકારી, સુખ છણી ઉપર જાઉ ઘણોહારી. ૪ માહાર ચીતક એશુ બાંદ્રું, એમની ચરણું કુમળ રજ માગુ. ૫ ચરણે રાખ્યો શ્રી વલભનાથ, માહારે સુશ્તક ધરણે હાય. ૬ શ્રી માહા લક્ષ્મીજ માહા

વર આપો, આહારા ભવનાં બનયત ગયો. તે પુરેવા શ્રીમતિ  
જનતા ડાડ, એમને સાત કુંવરની જોડ, ૮ સાત કુંવર  
છેર ઓળા, સાતને સમ સ્નાનપણ સેના. « શ્રી ગોવરધ-  
ન નાથજીરે » રાને, શ્રીવા સમ સ્નાન નારાને. ૧૦ એ  
શ્રાબા જોદ વિદાસ ગુણ ગાયે, એ છસી લોચન મહી  
સમાયે. ઓ લક્ષ્માણ સુતનંર હેલી. ૧૧

### ધોણ રે.

આવા સાચી શ્રી ગોકુળ જઈએ, નિરમળ શ્રી જીમનાં-  
જ નાહીએ; કે અખંડ વરજાશી થઈએ, આલો. ૧ નિ  
ત્ય પ્રીત ન સોધજ ધારે, માણ પ્રલુ ઉભા રંગિલી વારે;  
કુંપ્રગટ્યા ભક્તિ રસીડ મારે, આલો. ૨ શ્રી ગોકુળાપતા  
દા પ્રલુ મહા મંગળકારી, આલો. ૩ પ્રાણજીજી મંદીર  
રાને, ભક્ત તણાં માણ કુંઘ ભાને; આનંદ શ્રી ગોકુળ  
ભાને, આલો. ૪ નવણાં ભરી પ્રીતમજી નિરખ, જ  
ન ગાને, આલો. ૫ નવણાં ભરી પ્રીતમજી નિરખ, જ  
ન સ્થળ સુદીણ કરી પરખુ; વાહાનાળનાં સુષ્પદાં નંદ કુ  
ંપ્રલ, આલો. ૬ શ્રી ગોકુળ રંગ તણી રેલી, લતાદ્રોમ કુ  
ંપ્રલ, આલો. ૭ શ્રી ગોકુળ રંગ તણી રેલી, આલો. ૮ સ્થા-  
લી રહી જેલી; નિરખાં થઈ રહી જેલી, આલો. ૯ સ્થા-  
લી રહી જેલી શ્રી ગોવરધન સોહીએ, શ્રી વાદ્રાવન જોતાં મ  
દીક મણી શ્રી ગોવરધન સોહીએ, આલો. ૧૦ ન  
ન જીહીએ; કૃપા સ્થળ જન્મ જન્મ સોહીએ, આલો. ૧૧  
શ્રી ગોકુળ વશીએર હેલી, માણારાણીજ સાર કરે વહેલી;  
અહુ નંદ પ્રીતમજી ચહેલી, આલો. ૧૨ શ્રી માણારાણી ચે  
રાં બહુ લાવે, ભક્ત રાહુ દરશન આવે; માધવદાસ હેઠી  
સુખ પાવે, આલો સાચી શ્રી ગોકુળ જઈએ. ૧૩

## ધોળ રૂ.

જીરે પહેલાને વધાવો માહારે આવીઓ, શ્રી ગોકુળપ-  
તીને દ્વારા; માતા જસોદાજીએ હરએ વધાવીએં, એમના  
સુખ ઉપર જાડુ અભીહાર, ભલે શ્રી ગીરુતરધર જનમી-  
એંબા. ૧ જીરે વરજ જન સરવે આનંદિએં, મળી વંદીએં  
ચરણ સરોજ, ગીરુતરધરભુ નવજ નંદલાલના, એમ કેરતાં  
નીશદીન ડોય. ભલે૦ ૨ જીરે પ્રભુ ઇપે નયણે નીહાળીશુ,  
મળી ટાળીશુ ભગનાં દુઃખ; જીરે તનમન સરવે વાદ્યશુ,  
હવે સુલભ થયાં છે સરવે સુખ. ભલે૦ ૩ જીરે દ્વધી કુ-  
ધ અત મધું રસ ભરચા, મળી છીડ કે નરને નારો. નંદ  
દાન હેણે ખાડુ રસ ભરચા, હરીદાસ શ્રાબા અની જાય.  
ભલે શ્રી ગીરુતરધારી જનમીએં. ૪ જીરે જીલેને  
વધાવો માહારે આવીઓ, શ્રી રાનલ હુનારે આનંદ; ભગ  
ઘાન કીરતી ધાણું હરખીએં, કુંવરી જન માહારે સુખ  
અંદ્ર, ભલે શ્રી રાધા વરજ પ્રગતિએં. ૧ જીરે વરજ  
જન સરવે ટોળે મળી, મળી ગાયે સુમંગળ ચારે; કુંવ-  
રી પ્રગટચારે પરભાવશુ, શુણુ ઇય જગત વિષ્યાત. ભલે૦  
૨ હવે દો જસોમતીને વધામણાં, રળીલામણું સાંભળી વા-  
તા; હવે નીથ દીન નયણે નીહાળીશુ, લોલા રસ સિંહુ અ  
પાર. ભલે૦ ૩ હવે સરવે મળીને કાહું શ્રી નંદને, આપ  
ણે કરવો વેચીથાળ; એવા નવલકુંવર નંદલાલના, તેવાં શ્રી  
ભખુભાન કુમાર. ભલે૦ ૪ જીરે જોડી અવીયણ સહા  
શ્રી વાદ્રાવન વીલાસ; કર જોડીને કરું વિનતા, હરીદાસશો  
ભા અની જાય. ભલે શ્રી રાધાજી વરજ આવીએં. ૫  
જીરે જીલેને વધાવો માહારે આવીઓ, શ્રી લક્ષ્મણભટ-  
જીને ધેર; શ્રી એનંભાજીએ ઉર પધરાવીએં, કણી જ

વ ઓધારવા માં; શ્રી વલભ ભુતળ પ્રગટ્યા. ૧ ની-  
જ ધામથી પ્રભુજી પદ્માશીલા, કરવા શેષક જનની સેંભા  
ણ; એવા દ્વિજ કુળ રૂપે પ્રગટ્યા, એવા અદ્ભુત પરમણો  
ધાર. શ્રી વલભ૦ ૨ છુરે તામર હૃત્યારે તૈસેાકના, તખ-  
લાગ કુળ ઉદ્ઘાતરે સુર; છુરે મારણ પૂર્ણ હૃદાદીણો, સાં  
પી શ્રવા રહેય. શ્રી વલભ૦ ૩ છુરે શ્રુત સહૃદ્ય સુખ  
ઓચરે, ના બહે એમના ગુણનો પાર; કર જોડાને કર  
વીનની, હશીદાસ શાલા બની જય. શ્રી વલભ ભૂતળ પ્ર  
ગટ્યા. ૪ છુરે ચોંધો ને વધાવો માહારે આવીણો  
ભલે પ્રગટ્યા ઓ વાઠશેશ; છું, ભગત સંકા મન હરાયી  
આ, ગણો અનેક જનના મનનો ઠસેશ, ભલે શ્રી વાઠશેશ  
પદ્માશીલા. ૧ છુરે લેણો એ સુત જાનમીણા, ધન ધન  
કહીએ એ માત; લેણો એછોંગે લેઈને હુતરાદીણા, તેની  
કિરતી જગત વીચ્યાત. ભલે૦ ૨ છુરે સુરીનર મુની જન  
હરાયીણા, છુરે વરાયીણા કુસમ અપાર; શ્રી વલભજીને  
વારણો, જોતાં આનંદ મણ જય. ભલે૦ ૩ છુરે કણાજી  
કારણ જાણુણો, વણાણનો દ્વાર કુલ રાણ; કર લેડીને કર  
નિતી, હશીદાસ શાલા બની જય. ભલે૦ ૪

### ધોંડ રાણ

આવોને પરમ સોહાસણી, માણી મણગ ગાઈણો; ગ્રામ  
આનંદ મારે અતી ધરણો, સરવે વાળુન વાઈણો. ૧ પ્ર-  
ગણ્યા શ્રી વિઠલનાથજી, જન્મનોરે દાહાડો; માતો તે કેરા  
સાથીણા, મંદીર માણે ડાહાડો. ૨ ગણ્ણી સુકલાકુળ કેવડો,  
વચે ચોક પૂરાણો; શ્રી વલભજી દાન આપે ધરણાં, કેણે-  
તાં પાર ન લાવો. ૩ ભાડ જાયકરે મળી ધરણા, એલે જ

૫ જથું થાય; ભગવતી મત આનંદ ધર્ષો, ૩  
મનમાય. ૪ માધવદાસ પ્રભુના જથું સહૃદો ગાય,  
પરમ સોદાસાખી, મળી મગણ ગાંઘએ. ૫

### ધોળ રક્ત

આવોજુ અચાળ સોદાસાખી, મળી સહીયરે સમાચી;  
આ ગોડુણનાથને નિરાખીએ, જુગ વજન લાખી આવો.  
જ. ૧ કાળાંદ્રિને કાંઠડે, થ્રા ગોડુણ નામ; તારે જીરને  
શરૂએ, પુરૂરુંણ કામ આવોજુ. ૨ આ વિઠળ કુણ મંડ<sup>૧</sup>  
ન, મંડન પાખાંડી; નેને જળ્ય કળી કાળગાં, કળી રૂપ  
કડાંડી આવોજુ. ૩ નાય શિખ સુંદરતા તણો, કાઈ પા  
રું ન પામે; સુર સુની નારદ ચારદ, કૃપ કહે વખાણુ  
આવોજુ. ૪ સરળ સુદેશ સોદામચા, શરીરવાળ વીશાળ;  
વદન કણળ પાસે રહો, જણે મધુકરે માળ. આવોજુ ૫  
લક્ષીત લોલા ટણણે ભલી, હશીય દન રેખા; ખગડા કામ ક  
આનને, ખડુ ખાળુ વીશાખા. આવોજુ ૬ વાહાલા વીન  
વીનતા તણો, ઉર અંતર ભેદ; તનદીશુ નરણે નિરાયા,  
કુગ શકુગ છેદ. આવોજુ ૭ લોયન લોલ હસંતા, સુતા  
મંડળ પરમે; તાડકણા ભર સદા, બાહુ રસે વરણ. આવો ૮  
નાલ નિરાપણ નાશીછા, ગળ રથળ કળદે; કંચન મ-  
ણી કુંઝન તણી, આભામ અતી ચણકે. આવોજુ ૯  
અધર અધ્રત ભરચાં, દંતા દાઢમ ચ્ચોર; નાડ સુધારસ  
દણતી, ખજ્જાદોક ભૂતા. આવોજુ ૧૦ કર પર આવા ઉ  
દરની, ઉપના ધી દીને; ચૌભિનનાં હો નદી, તેના રમી  
વડ લીને. આવોજુ ૧૧ શાલા જોતાં સુખ હેણ, તેતો  
મનજ જણે; મૂગો મીહાઈ તરો, કૃપા સ્વાદ વખાણુ,

અનુભવીના આતંદનું, પ્રેમરૂપ કૃયમ જ  
જ્યાંહાં વાણી વરમી રહે, કૃતી કૃયમ કરી ગાઢાયે  
આવોણું ૧૩ નુમ નુગ જીવો જગત પ્રભુ, શેખડ સુ-  
અકાડા; નારાયણ ગુણુ રૂપને, જય લલીહાંગુ. આવોણ  
અચળ સોહાસાણી મળી સહીપર સમાણી. ૧૪

### ધો. ણ ૧૪.

શ્રી વલભનંદનરે વાહાલા લાગોછો, જેનું સમરણ કર  
તરે કુષ્ઠાં ભાગોછો. ૧ પૂર્વેતમ લાલજીરે પ્રિતે આવો  
છો, જોઈ રૂપ રસાણુરે મનમાં ભાવોછો. ૨ માહારા કો-  
પા જનમનારે, સુકીત ઇણીએં છે, માહારા જનમ જનમ-  
નારે કુષ્ઠાં ટળીએં છે. ૩ અમને નામ સમર્પણારે, વાહાસે  
આખ્યાં છે, માહારા પૂર્વન જનમનારે, પ્રાયચ્છ્વા કાયાં છે.  
૪ માહારે ગંદીર પથારે મનડામાં વશીયા છો, વાહાલો  
હેત કરીનરે હૈયામાં હરીયા છો. ૫ મહેતો રૂપ રસાણુરે  
નુગતે જોંઝ છે, હરી હૈએ વશીયારે મનડ માલુ છે. ૬  
વાહાલુ પાદ સોરણીરે થીર પર ધર્શાયો છે, આભૂષણ  
અંગેર આપે ધર્શાએં છે. ૭ કુમકુમનાં તોલડરે ભાલ ક  
રીએં છે, વાહાલો મંદીર. અમારે મનમતા આવે છે, પ-  
લુઃસને પ્રિતરે લાડ લડાવે છે, ૮

### ધો. ણ ૧૫.

નંદ ધેર આતં ઉલટ્યો, શ્રી ગારધરલાલ; વરજની શો  
ભા શી કૃષુ. ૧ ઘાવન ચંદ્ર ગડ રણી, મેતાડી પૂર્ણા  
છે ચોંગ વરજની ૨ રંગે અંગેશુ નિસરચા, મહુનો સ  
રેણે શયુગારઃ વરજની ૩ રોડ તારણ બાંધીએં, કુમ

ણાં કુલેછે ગોય; વરજની૦ ૪ દીપક જોતરે જળહળે, મે  
હેલો દ્વારને ગોય; વરજની૦ ૫ નોયત વાગેરે નવરંગી,  
રંગી રાજ દરખાર; વરજની૦ ૬ નાહાનું સરચુ શી ગોડુ  
ળીયું, ચાચા ઇડા નાદજીના લાભ; વરજની૦ ૭ વેહેતી ન  
ગરીમાં નીરાર, કાંઈક કારણ રૂપ; વરજની૦ ૮ એ છે વા  
હાલો દ્વારાના, પૂરણું પૂરથોતમ લુપ; વરજની૦ ૯ ગીર-  
ધર ગાયો ચરાવતા, સુંદર ગાયો ચરાવતા, સુંદર જી-  
મનાને તીર; વરજની૦ ૧૦ કાળીંદ્રને કાંઈક, ઉલા હણ-  
ધર વીર; વરજની૦ ૧૧ મારાદાસની નિતા, રાખણે દુ  
દ વિસ્તાર; વરજની શાખા હું થી કંડુ. ૧૧

### ધોળ રક.

શી લક્ષ્માળ સુતને હું નમુને, કરે તે પ્રાણામ; વાણી તે  
અમને આપળો, નેણ ગાઉ જથું વિસ્તાર. મનમાં તે આ  
નાંદ અતા ધરણો, સુખડે કલ્પો નવ જય; કોપા હેઠાં જો  
તમ તથી, તો દાસ કોઈ ગાય. શી લક્ષ્માળ ભરજી તાન  
અમના, શી અલંખાળ માત. પ્રગટ લાલા તમ તથી, જાં  
ણો કંડુ એક વાત. શી લક્ષ્માળાટજીના સુપતમાં, શીજી  
પધારચા ધેર; વિલ્લાધાર તમ ધેર પ્રગટશે, તની તે કરલે  
પેર. છાણીએ જણો વેગે કંડુ, શી અલંખાળ જેને રા  
થ; પૂરણું પૂરથોતમ પ્રગટશે, મારગમાં એ નાથ. સાત વ  
રસ અહિંચાં રહેણા, તોએ ના પ્રગટ થાય; ગરભવંતાં કુ-  
ઝ પામશે, શી અલંખાળ માન. વચ્ચત લેછ માથે ચડાચાં  
પ્રયું નમ કહી તે સત્ય, કદ્યાં તમારાં સત્ય છે, મારે ચા-  
લવું નારધાર. લાંધો તે વાહાનોળ પધારુંબા, ગાળા તે  
આપી એ; એક કંઈ કંઈ ધરી, બાળ જય કર વળી તે

હ. ભગવ સુધ શિતે ભાયા હેપી, માણકા ઓડસોને આદ; તે માણા નિત્ય કરવો, અંથનો કરવો પાઠ. ઉપરાંખો શી અંગનો, શીજુંગે આયો સાર; વખ્ત લેઈ ઓટાડલો, બા ણકને વળો ત્યાંહ. ત્યાંથી વાલોજુ પધારીએ, અંપારેણુ રહ્યુ ગાઉ ચાર; રાતે રસોધાયો ત્યાં કરી, મનમાં તે કરે વિ ચાર. શી કશજુને પ્રીયાજુ, સંગે સુંદરી એ સાથ, એઉં ને દરશન ત્યાં હણાં, સુપનામાં નારધાર; નેતૃ ઉધાડાને ના-હાજીએં, ત્યારે દ્વાં વખ્તને ભાલ. એઉને દરશન તાં થ-પાં, સુપનામાં વળી સાર; તંબોળ લેઈ શી પ્રીયાજુએ આ પાં, જાનગ ધુંધી બાલ. રેસના વરશ તે તણી, ખોજુ વા-ણી તણો નહી પાર; પ્રગટ શી વલલાં હેવનાં, હંઈ તે એ રખ ન માય. હેવનાં તે દુંદભી વાગીયાં, પુષ્પની વૃદ્ધિ તે થાય; પ્રગટ ઘણ પરાક્રમ શીધાં, હંઈ હરાં ન માય; જુગ જુગ જુવો મારા વામમા, ખલીહારી તે માધવદારા

### ધોણ ૨૭

શી લક્ષ્માણ નાટને ધેર એક કુળ દીવોરે, ભલે પ્રગટચા શી વલલભરાય એ ધાણુ જુવોરે. ૧ આ એમના સુત છે એઉ અતીશ ઇંગરે, ને ન ન નામે એમને શીશ તે જન કુ-ડારે. ૨ શી અકાંજુ કુઝે અવતારીં સુખડારીર, ગોપીના-થ શી વિઠલનાથ એ પર વાશીરે. ૩ બળદ્વા શી ગોપીના-થજુને જણોરે, શી કાશ શી વિઠલનાથ એ બજરાણારે. ૪ એ પુરુષોત્તમને દ્રેમ ધરીને ગાયરે, તેનાં જાણ જાન-નાં પ્રાચ્યિત સરવે જાપરે. ૫ શી વીઠલનાથજુને સાત કુ-વર સુખદાતારે, કળીયુગમાં પૂર્ણ પ્રાય એ વિષ્ણ્યાતારે. ૬ આ ગારધરજુ શુભ્રવાત સહુને જમતારે, જઈ જુવો શીજ

નવનીત પ્રીયાજુષુ રમતારે. ૭ શ્રી મધુરાંતાય મનોરથ પુરૈ  
મનતારે, તમે સમરો ઓ નદ્વરલાન લય કુલ તતનારે.  
૮ શ્રી ગોવિંદાય રસ મળન રસ ભરુ નિરખોર, નેતે મ  
દીર ઓ વાઠલેચાપ જોઈનોઈ હરખોરે. ૯ શ્રી બાળકા-  
મજુ કાપા કરી સુખ આપોરે, શ્રી દ્વારકાંતાયજુનાં ઇપ  
દૃદ્યાગાં સ્થાપોરે. ૧૦ શ્રી બ્રહ્મહૃદ શ્રી ગોકુળનાય, શ્રીનાઓ  
ગીરધારુરે, લેણે રાખ્યો માળા પ્રસંગ એ પર વાશ્રોરે. ૧૧  
શ્રી રધુનાયજુને જોઈ મનડાં ચોહીએરે, લેણે મંદીર શ્રી  
ગોકુળ અંદ્રમાળ સોહીએરે. ૧૨ શ્રી જફુપતીજુ જુગતે  
નેવા નેવારે, શ્રી બાળકમજુ કરી સુદ્ધાર શેવારે. ૧૩ શ્રી  
ધનરવામજુ પુરણ કામ છે, ધારું રથીયારે, શ્રી મદનમોહન  
જ ગાહારાજ માહારે મન વથીપારે. ૧૪ એ શાભા જોઈ  
હરીદાસ લય બખીણારુરે, એ લીલા ગાન્ને નિત નરને ના  
રુરે. ૧૫ શ્રી લક્ષ્માણ ભરજુને દીર એ કુળ દિવોરે.

### ઘોણ સ૮

આનને આવે ઉતાવળી, લાંને જોવાને જઈએ; મનક  
તે પ્રેમે લોળાને, આપણુ નિરબજ થઈએ. ૧ નાહાનડીએ  
શ્રી દ્વારકેશજુ, માહારે હૃદી વધીયા; તણો નિંદ્રા નહી કરે  
જોવાના છે રથીયા. ૨ અમીએ ભરી હરીની આંખડી,  
અની છે અલૂયાળી: સાચુ જોવાને સુંદરી, લાલે મીડ.  
ડી માંડી. ૩ ચાંચ જાણે એપણ તથી, એપના નાડુંડી ડાં  
ડી; જાણે પરવાળાં અધર, દીસે એમ રાતડી. ૪ સુસ્તક  
નવરણ માળીએં, શાલી કુમળને વાને; એ પાસ શાલીતા  
લાલને, માળી બળું છે કાને. ૫ ઓઢાન આધી લોખડી,  
કૃદે કાંકની માળા; ઓક જુલ્યાએ શુ કહુ, એમના એ

ગતા આળા. ૧ ચિતડ તે માહાર ચોશિયું, ભારલીને નાહે કાળી બોળી એલાવતાં, અમને સરવે સાદે. ૨ એવો ડેઢ સાંભળ્યો નથી, નથી નરહોર દીડો; હીડ છે જોડા ભાડતે અતી લાગેછે મીડો. ૩ સનાકારીક શ્રેવે સદા, એનો રસ છે ઇડા: ધરમાં રહો શું શાળાએ, સંસાર છે કુડો. ૪ મ તુસા દેહ પામીને, રહુ રેતાજ લીધુઃ આ ગીરધરનાલ જીવ નશુ, માહાર ચિતાજ બાંદ્યું. ૧૦ જુગ જુગ જુગો મારો વામમો, શેવક સુખકારી: નારાપણ યુણ રૂપને, જાઉ બ્ર-  
ભીહારી ૧૧ આવતે આજ ઉતાવળી, બાલને જોવાને જ છેએ. સંગૂર્ણ.

### ઘોણ રૂપ

પોસ નામે શ્રી વિઠળનાથજી, હારે વાહાલો પ્રગટ્યા શ્રી વધ્યલભ દ્વારાનો; અમને જોવાને યદ્ય આપુરી, હારે વાહાલે કીચી સેવક મારે જો; પોસ નામે૦ ૧ તારે શ્રી નાંદધે રે પ્રગટ્યા, હારે વાહાલે પુરચા નસોદાજુ કોડ જો; રમતા  
સરખા સંડુ સાયમાં, હારે વાહાલો હણ હણધરની જોડલે  
પોસ નામે૦ ૨ હણ શ્રો વલન સુત ન ધ્યા, હારે વાહાલો  
શ્રી ગોપીનાથજીના ભાત જો; ગોદ લેધને હુલરાવતાં, હારે  
વાહાલો ધન્ય શ્રી અકાંજુ માત જો. પોસ નામે૦ ૩ એ  
મતા સુખની કાંઈ કહી ન શકુ, હારે વાહાલો વેદ કહે છે  
નિતિનો; શ્રીપ ગાહસ્ય સુખે આયરે, હારે વાસો ધન્ય શ્રી  
જુમનાંજુની રેતિલો, પોસ નામે૦ ૪ તારે વાહાલો ગાયો  
ચરાવતા, હારે વાહાલો રમ છે રાસ વિલાસનો; વેણુ વ-  
ગાડી વાળે વનમાં, હારે વાહાલો પુરી શ્રો વરજ સુંદરી  
ની આશનો, પોસ નામે૦ ૫૦ રાસ જીહારી વરજવલબો.

હારે વાહાલે ગ્રાયો અની વરણમાં વાસણે; ફરણેડિને કર  
વિતની, વાહાલે શાખા જુયે છે હૃદાસણે. ૧ પોતા  
નામે અની વિઠળનાયજી.

### ધોળ ઉ૦.

• અની વધણ રાજ કુમાર; તમે કાંઈ કીચું રે; માહારે  
ચિત નિન ગોકુળનાય, હરીને લોધુરે. ૧ ગીરધારી એ  
ઘેલી કરી, મુને આપા ન ભાવે અંતરે, ધન્ય કુંવર આ  
અદાજુએ જાયા; તેથી મોહુ માહાર મન, તમે ટાઈ કાંઈરે  
ર લોભાગા લોલી રહ્યા ને નંદ કુંવર રંગ રેલરે, રસીએા  
ઢાકેર ભીમના; મારી અરજ શુશ્રો અલપેલ, તમે કાંઈ  
કીચું, ૩

### ધોળ ઉ૧.

આજ સહિઅરરે વધામાગાં, વરજ વાગ્યાં નીસાણ; પ્ર-  
ગરચા અની વીઠળનાયજી, હવાં ડોયી કેદાણ. ૧ લાલની  
ચાલ ઉતારણી, લાલને જોવાને જઈએ; તન તપે મન  
બેળાને, આપણે આનંદ થઈએ. ૨ અમીરે ભરી હરીની  
અંખડી, નયણાં છેરે રસાલ; અચુને કરે મન ભાવતાં,  
પાલછુણે પોહેડા. ૩ એ તો નીંદા નહી કરે, જોવાના  
છે રસીએા; માધવદાસના પ્રભુજી, માહારે મન વસીએા. ૬

### ધોળ ઉ૨.

આજ માહારે આનંદ ઉરતા સમાજ, પ્રગતચા શ્રી  
વરવલભ સફુમારજી; ભુતળ ભાગ તણો નહી પારજી, હૈંચી  
તે જુગનો કરવા હૃદારજી. ૧ અંદીરમાહ તે ચ્યાક પૂરા-  
જી, તોરણું ખાગળો બંધાપજી; હુંએ કરું વાધ વાધના શ

શગરજી, હરએ તેડાવું તે સધ્યર સાથજી. ૨ નાચુ ગાઉ  
તાળી પાડુ હાથજી, ડેને કહું કહું નવ કહેવાયજી; છખી  
પરજન રસીક બખલાયજી.

### ધોળ ઉત્ત

ધનધન દાહાડારે આજનો, ધન શ્રી ગોડુણ ગામ; ધન  
નધન નંદ જગ્યામતી, પ્રગટચા સુંદર શ્યામ. ધનધન. ૧  
આવણ માસ સોલ્લામણો, નોભરી તથમારે નામ; વરજમાં  
આલી વધામણી, અરચ્યા દશ જણા હામ. ધનધન. ૨ વર-  
જમાં પ્રેમરસ ઉલટચો, રાખવા દુનિયાના દોષ; ઇથીને તે-  
તેરે રાયજી, જુગતે જોકાને જોષ. ધનધન. ૩ આનંદ  
ઓછવ અતી ધર્ણો, ગોપીએ ગાયછે ગોત; માણ્ણો મા-  
તીને હીરાનાં, આપાં હીમનાં દાન. ધનધન. ૪ કુદ્ધા  
કુદ્ધારે સહુ ઝરે, કુદ્ધા શ્રી ગોપીરિજન: કુદ્ધા શ્રી જુ-  
મના જોઈને, કુદ્ધા શ્રો વંદ્રાર્થન. ધનધન. ૫ સુરીનર  
શ્વર્પને હેઠે નહીં, શીયજી સરખારે સંત; ખજ્દ્રા નીમન  
નાણે નહીં, કોઈએ ન પામિરે અંત. ધનધન. ૬ માહોયાં  
ભાગ્ય આહીરનાં, શાલા કહી નવ જાય; પ્રેમે પ્રગટચા  
શ્રી નાથજી, ગુણ માધવદાસ ગાય. ધનધન. ૭

### ધોળ ઉત્ત

આપણ જપએ શ્રી ગોડુણ ગામ સાહેલીરે, શીજુને  
નિરાધીએ, જરે જુતતીનાં જુથ ટોળે માણાં, ગોપી શળ-  
યારે નવસાન શણુગારે; સાહેલારે. ૧ ગોપી વગે તે આસો  
ઉતાવણાં, જર્દ જોઈને અનુપમ નાથ; સાહેલીરે. ૨ ગોપી  
કંચન થાળરે કર લોએ, માંહી ભ રિપાર મુકૃતારૂપ સાચ-

સાહેલીરે. ૩ માહાર ભનરે ગયુરાં ચિન, શ્રી ગોકુળમાં મત-  
હારિ જુનડોર, રદ્ધો શ્રીજીના પાસ; સાહેલીરે. ૪ ગોપી  
અરણ કુમળ રજ લઈ રદ્ધાં, વાહાલો આપેર અનેપદ દા-  
નઃ સાહેલીરે. ૫ ત્યાંહાં તો સાત મંદીર સોલ્લામણાં, ગો-  
પી આવ્યારે ઠુકરાજીને ધાર; સાહેલીરે. ૬ મધુરાંમાં તે  
વાળું ત્રણ વાગોપા, ગોકુળમારે ગરગડીયાં નીથાન; સાહેલીરે.  
૭ જાગે વલ્લભ સુતને વારણે, બલીહારુરે જાય માધવદા-  
સ; સાહેલીરે. શ્રીજીને નિરખીએ. ૮

### ધોણ ડા.

મરે શ્રી નાથજી પારે, દ્રગનસે હોળુ ભત ન્યારે; દ્ર-  
ગનસે હોળુ ભત ન્યારે મરે શ્રી નાધજી પારે. ૧ ગસે  
નમા દદામીડા, કમર પટડા બદામીડા. ૨ શારંગી પાધ  
શીર સોહીએ, લસત ઘનમાત અન જોહીએ. ૩ લગી હો-  
પ કાનમાં ફૂતી, તજ માછ સેન્યમાં સુતી. ૪ મિશ દીલ  
સ ગયા આલા, લગી તનમાં તાલાનેલો. ૫ ભત ભૂલ  
દ્વારી તન ગોરા, જુગમાં જુગના થોરા. ૬ કડાણું મા-  
દ્વી જવારા, બહાલતાણું સંસારા. ૭ સદા-વનદ્વિષજી  
ગાવે, છાંનાપર વારણે જવે. ૮ મરે શ્રી નાથજી પારે,  
દ્રગનસે હોળુ ભત ન્યારે.

### ધોણ ડા

આલો તો શ્રીજી જઈજેરે, શ્રી મુખ નેવાને; આપો  
તો તલાર ધઈજેરે, શ્રીમુખો ૧ મને ધરમાં લાગે એ.  
ધેણુંરે, શ્રીમુખો હુંતો કાંય ન સમજુ પેહેલુંરે, શ્રીમુખો  
૨ હુંતો ધરનો ધાયા લુલીરે, શ્રીમુખો હુંતો અંગોઅં

કુદીરે, શ્રીમુખો ૩ મને ભુષે જોનન ન ભાવેરે, શ્રીમુખો સેજડાએ નિંદ્રા ન આવેરે, શ્રીમુખો ૪ માહારા મનમાં મનમધ વર્ણિયારે, શ્રીમુખો માહાર દામ સદ્ગમે ધરીયુરે, શ્રીમુખો ૫ મેરલીમાં ડામણ કાઢુરે, શ્રીમુખો ૬ માહાર મન હરીને લીધુરે, શ્રીમુખો ૭ કોઈ ન દળનો લાલ લોવા ચાલ્યારે, શ્રીમુખો ૮ સેવાજીના જીવન પ્રાણ્યારે, શ્રીમુખો ૯ હેવા રસીકરાય ગીરધારુરે, શ્રીમુખો ૧૦ દાસનો દાસ જય અલોહારુરે, શ્રીમુખ સુંદર લોવાને.

### ધોણ ઉઠ.

શ્રી નાથજી ને છેલ જીરાજતાને; ૧૧. સાખી માલો તો જઈએ શ્રીજ શૈલેરમાં નો, શ્રી ગોવરધન નાથજી જીરાજે લીલા લેણેરને; શ્રીનાથજી. ૧ પેહલાં દરસન તે મંગળાનાં હરણીયાંને, માહારા નાથનાં રદ્રદ્રય નરણે નિરણીયાંને; શ્રીનાથજી. ૨ જીજાં દરસનમાં શણુગાર વાહાલે બહુ ધરાલે, માહારા નાથજીને લક્ષ્મીનીજ વસ્યાંને; શ્રીનાથજી. ૩ ત્રીજ દરસન તે જ્વાલ ભાલ જોગનાંને, મુષે ભારલી તે છડા લીધી છેલમાંને; શ્રીનાથજી. ૪ ચોથાં દરસન તે રડાં રાજ્ય ભેગનાંને, વિવિધ ભાતની સામની સ લોગમાંને, શ્રીનાથજી. ૫ પાંચમાં દરસન બિલ્યાપનાંસ સાંભાલ્યાંને, બંગ વાળ્યો નેવેસ્ટન થયા ઉતાવળાને; શ્રીનાથજી. ૬ છડાં દરસન ને ભોગ સંલોગનાં નો, વિવિધ અમૃત મેવા ધરા ઉમંગાંનો; શ્રીનાથજી. ૭ સાતમાં દરસન તે આરતિનાં મન ડરચાંનો, ભીડ ભાડી ને પૈસનન બહુ માણાલે; શ્રીનાથજી. ૮ આઠમાં દરસન તે સર્વ કર્યાં શ્રી દર્શનો, દરસન કરુને પૈસન આનંદ

ભરીનો; શ્રી નાથજી. ૬ ચરૂભાળ મડુભાલજી જોડેછે લે,  
ગીરધરભાલજી ખરાને ભોલા લેહુરમાંનો; શ્રી નાથજી. ૧૦  
વહુજી ભાલીજી ને બૈદ્યજી માહારાણ છેનો, એમને આડો  
દરથનનો ધર્ણો ભાત છેનો; શ્રી નાથજી. ૧૧ લે કાંઈ ગા  
ય શ્રીએને ભાંણો લે, તનો ચરણુ કમળમાં વાસછેનો;  
•શ્રી નાથજી તે છેલ ખરાળતાનો, એમના દરથન થકી સુ  
ખ થાપછે લો, દરીદરા તે વલભ ગુણ ગાયછેનો. ૧૨

### ધોણ ઉઠ

આણે સખી નિરખયે નંદ કુગાર, લટકતા આવે હણી  
દીન દ્યાન; જોને હણી છેલ છાંધીલા હણીની આલ,  
શ્રીએને ચતુર ધડી હણીની ચાંખડારે લોલ. ૧ અસાધીએ  
કાંઈ ધરેરે મુનીવર દ્યાન, લાકુમાં કાંઈ લખ્યારે નામર વે  
લ પાન; ચરણુ સેડામળ કંકુ વર્ણિવાન, કાર્શાગરે ડોશીને  
કુરતી મેલી પાંખડારે લોલ. ૨ પાંનાયે કાંઈ હંસ પોપટને  
ભાર, સુસ્તક ભમરાને ઉપર ભાર; તનો આગલ શારે  
અગારો તેલ, કીછું શ્રીછું ધુધરી શખદ કરે ધર્ણોરે લોલ.  
૩ રાંકળીનું કાંઈ ગાંઠારે સોના કેરે તાર, હીરામાણુક ચુખ્યા  
હણીના હાર; કુલપ એછેરા કીધા વાણાલે ભાર, પીળાને  
પચરંગી પારાને હણીનાં પુમતરે લોલ. ૪ લંગરમાં કાંઈ  
સુધી રલને ચંદ, હાથે છે હીરલાને પોહાંખીયે નંગ; તે  
તો હેઠી માહાર મન થાય ઉછરંગ, આંગળીયુંમાં વીઠી  
આંગુઝીમાં આરશીરે લોલ, ૫ કષ્ટના કડકાની કીધી વા  
હાલે સાર, એટલેને શીદ લીએ હમારી સંભાળ; પોહાંખી  
આના પુન્ય તરો નહી પાર, પોહાંખીને પધાર્યા ગોવાળી  
પાની ઘેરમારે લોલ. ૬ એક એકની સાતમાં સમજુ જાપ,

નહેન જેવા ભાગ હોય તેવા ગાય; પ્રથમ નિરખું ને પછી લાગું પાય, શ્રી વખલ કુળને નાથે તે સહુને લીધા દેહરમારે સાલ, ઉ ચાલો સખી નિરખીએ નંદ કુમાર.

### ધોણ ઉદ્ઘ

શ્રી કાંકોલી ગામ રળીથામણુરે, તાંહાં તે જીરાને શ્રી દ્વારકાંનાય; પ્રગટચા શ્રી વજબુખણ લાલજી. ૧ ઈડી વાલો શેવડ કારેજ આવીયારે, ઉછા ધરુને મન સંગાયે લાલ. પ્રગટચા. ૨ શ્રી પદમાતી વહુજીએ લાલજી જનમીયારે, જુગમાં વરતયો જ્યપ જ્યપકાર લાલ. પ્રગટચા. ૩ સાંવત ૧૮૭૪ માં, અઈત્રી સુદી ૮ ને રળીયાર લાલ. પ્રગટચા. ૪ સહી નક્ષત્ર લગ્ન પૂનરવશુરે, પૂણી છ-ધડી જીથ્ય પ્રમાણ લાલ. પ્રગટચા. ૫ લગ્ને અદૃસ્પતિ આવા સહીનારે, કીને રળીસ્વર તોળાના લાલ. પ્રગટચા. ૬ પાંચમે કેતુ આવા ધનનારે, આડુ યુધ શુકે રવી મીનના લાલ. પ્રગટચા. ૭ નવમે મંગળ આવા મિથનારે, અગિયારમે રાહુમંદ્ર મૈયુનના લાલ. પ્રગટચા. ૮ હેવે ન જોગે વાહાલો જનમીયારે, શ્રી વિદુલ વસે હરખ ન માય લાલ. પ્રગટચા. ૯ શ્રી યારોમતી માણ હરખ્યા ધાણુરે, સહુને હેઠે આદરભાવ લાલ. પ્રગટચા. ૧૦ બાંધાં તેરણ પુરચા સાથીયારે, ગુહીજન ગાયે મધુરે ગાન લાલ. પ્રગટચા. ૧૧ વૈમન જીથે જીથ મણ્યા ધણારે, આનાને વાહાલાને હુલરાવે લાલ. પ્રગટચા. ૧૨ કંચન યાળ ભરચા શગ મોતીએરે, આવી વાહાલાને વધાયે લાલ. પ્રગટચા. ૧૩ દાસ વખલપર દ્વા કરોરે, રાયા અરણ કમળતી છંય લાલ. પ્રગટચા શ્રી વરણબુખણ લાલજીરે. ૧૪

## ધોળ ૪૦

તેડી જાઓ તો હમારાં મન છે, હુંતો જાડ શ્રી ગો-  
કૃણની શીતરે; હુંતો જઈ નિરખું ઓનાથજી, છે પૂર્વી જ-  
ન્મની પ્રિત્યરે. ૧ લ્યાહાંતો સાત મંદીર શાભા ધર્મા, આ-  
વન બોનન વશ વરણનાથરે, વશ છે કરભા આર્પણજા  
લાડીલા, માહા મહોદી સુની વસ્યારે. ૨ શ્રી વાંદ્રા તે વન  
રણીઅભાખું, શાલ્વામણાં ડકરાણી ધાટરે; શાલ્વામણી  
વાય વાહાલો વાંસળી, તેતો બળભદ્ર કેરા વિરરે. ૩ શ્રી વ-  
દ્રા તે વનની કુંજમાં ચેમાં હેઠા સરળ ચારરે; અમીં  
હુલ કરત નંદા નંદશું, નથણે નિરખત નંદીશારરે. ૪ હુંતો  
વરણ દર્શનની બ્યાડુણી, જરે જરણ માહારી હેણ; હુંતો વહું  
બૃદ્ધાને પાણે પડુ, નિહાળુંઓ સુખ નાગરે. ૫ નેણે  
નયણે ના નિરખ્યા ઓ નાયજી તેણે થાને ધરી આ હેણરે;  
નેણે શ્રી ગોનર્ધન જેયા નહીં તેનો સુનો ગયો સાંસારરે.  
૬ નેણે શ્રી વલભકૃણ જાણ્યા નથી, તેનો અણે ગયો અ-  
વતારરે; ધીક ધીક પડ્યો આ હેણ, જા નાણો શ્રી જુન  
નાં વિરરે. ૭ ધન ધન જીજક વરણવાસીનું, નેણે વરણ  
માં તે પુરેણ વાસરે; કરણેડીને કર વિનતી ઘલોહારી તે  
માધવદાસ. ૮ તેડી જાઓ તો હમારાં મન છે હુંતો  
નેડ શ્રી ગોકૃણ શીતરે.

## ધોળ ૪૧

શ્રીવલભ પ્રાણુ આપ્યારને નિરખવા યાલો એ સન્નની  
જ, શાં શાં સુખરે વાણાણુ એના જાણ્યુ દિવસને રજનીજી  
આ ગોવરધન ધરથા " " હરી ધર્મા હેણજી, નેણે તે  
પણક લાગે નહીં.                  મનૂ અલ કેખાણ, ૧ તે ક-

પરમાત્મા હસી હસી વયત કલ્યાં તે એવાં એવાંજુ, જો જો કહ્યાં તે તે કીધાં તે પ્રોતભ અંગીકાર એવાંજુ; મા કલી અમ્રી આવીએ જુન પેતા તથા લોજ, પેતે કરીને હખાડીજુ વિનાધ પ્રકારની સેવાજુ, ૨ ઘણ્ણ સંબંધ કરાવીને જીવનો કોધી અંગીકારજુ, ઓછી ભાગવત મધ્યવક્ત જોયાંજુરે સણ્ણાધનીજ સારજુ; શ્રી ગોકુળ ઇશીને વસાની પુસાધ સરવેને તેડીજુ, લોલા કરી તે શ્રી કહું રસના એક જો પાંચીજુ, ઉદાસ ગોપાળની વિનંતી પર્યાવાર થારે કરી પાંચીજુ, શ્રી વલભ પ્રાણ આધારને નિરખવા માલીએ સજાનીજુ.

### ઘોણ ૪૨.

શ્રી ગોકુળ સાસરીએ જાવું, માહન વરનું આણું આણું. લઘ્યાં હસ્ત તાણું ભાવું, શ્રી ગોકુળ. ૧ જાવું છે લટકને ગટકે, માહનવર જોઈ જોઈ મન અટકે; પાયે નેપુરીએ ઠાં મફકે, શ્રી ગોકુળ. ૨ આચણ પેહેરચાં છે અગે, સખી સહુ શાંખે છે સાંગે; માદ્ધા માહિયા માહનવર ૨ંગે. આ શાંખે છે સાંગે, નયાંસાંજ જુવે છે વાટો, સખી વગે વેહુલાં ગોકુળ. ૩ વાહાલેણ જુવે છે વાટો, સખી વગે વેહુલાં ગોકુળ. નયાંસાંજ જાગુ પ્રીતમજુ નાહાયો. શ્રી ગોકુળ ૪ સાસરી સુને વાહાલેણ લાગે, ત્યાંહાં માહાયુ કામ વાસના લાગે, માહનવર જોઈ જોઈ રઠ લાગે. શ્રી ગોકુળ. ૫ સખી માહારે આ અવસર રૂડો, અચ્યણત શાહાંગય પેહેરચો સુડો, માહાર શ્રી ગોકુળપતી વર રૂડો. આ ગોકુળ ૬ અદ્ભુત લેહેરનો ૨ંગ લાગુ, શ્રી જુમનાં જળ ભરવી છે આગુ, માહનપર વાંવાર વાગુ. શ્રી ગોકુળ. ૭ આ વલભ નાગ સદ્ગ રઠ, સંજતીમાં રહેવું, સારસરીએ જાવું. ૮ રહેવું, શ્રીજ ગોવરધન નમયુ.

## ધોળ ૪૩

શ્રી વલભ કુળને વારુરે શ્રી નાથજી અલખેલા, શ્રી વિઠલતાય વિદ્ધાશરે, શ્રીનાથજીં ૧ રૂડ એમના સુત છે, રાતરે, શ્રીનાથજીં કણયુગમાં વેદ વિક્ષાતરે, શ્રી નાથજીં શ્રીગીરધરજી ગુણવંતરે, આનાથજીં શ્રી મધુરાંતાય નિધાનરે, આનાથજીં ૩ શ્રી ગોવિંદજી રસ રૂપરે, શ્રીનાથ-જીં વિઠલશ્ય પરમ અનુપરે, શ્રીનાથજીં ૪ શ્રી ઘાણ-કળ્ણ પ્રતાપાળરે, શ્રી નાથજીં શ્રી દુર્ગાનાથજી દ્યાપરે, શ્રીનાથજીં ૫ શ્રી ગોકુળનાથની શાલા સારુરે, શ્રીનાથ-જીં ૬ જેણે શચ્ચા ધેર ગીરધાશરે, શ્રી નાથજીં ૬ શ્રી રધુપતી રૂડ જેઠાએરે શ્રી નાથજીં શ્રી ગોકુળ અંદ્રમા સો-હીએરે, શ્રીનાથજીં ૭ શ્રી જ્વાપતી માહાનરે, શ્રીનાથજીં શ્રી ઘાણકળ્ણ ગરુદ નિવાનરે, શ્રીનાથજીં ૮ ધનરસામ-જી પૂરણુ ડામરે, શ્રીનાથજીં શ્રી મદનમાહન સુખ ધામ-રે, શ્રીનાથજીં ૯ સુખ મહીમા નવકેદુવાપરે, શ્રીનાથજીં નટવરજી નવનિધરે, શ્રીનાથજીં ૧૦ સહુ શાલીતો શણુ ગારરે, શ્રીનાથજીં ૧૧ પાય જાંબરનો અમડારરે, શ્રીનાથજીં ૧૨ એ નિત્ય નિત્ય લોલા ત્યારુરે, શ્રીનાથજીં ૧૩ નાથદામ અભીહાશરે, શ્રીનાથજી અલખેલા. ૧૨

## ધોળ ૪૪.

શ્રીજ મેરા એસા રસીઓ, મુજ પોલાવે ધડી ધડી માર મુગટ પીતાણર સોહીએ, ઘનસી ઘળવે વાહાલો ત્યાંહાં ભરુ. શોજમેરા, ૧ સબ સખીયનમાં રાસ રચ્યોહે, દૂરસન હેવે ધડી ધડી. શોજમેરા. ૨ હોડ હોડુ દૃશ્યન • જાવે, આપણ વાગે તડા તડી. શ્રીજમેરા. ૩ આર ચોકડો

મંદીર ઘનાયો, આપ ખોરાને વાહાયો છપર તરી. શીજું ૪ નાદસ પ્રભુકી છળી નિરખત, શીજુકે અરથમાં જ્યાં હી. શીજુ મરા એસા રસીયા સુજ પાલાવ ધડા ધડા. ૫

### ધોળ છૃ.

પુરે નેત્યારે માહારા વરજના વાહાલા, વરજ સુ'દરી સ'ગ  
માદ્યારે માહારા વરજના વાહાલા. ૧ તમણું શા આશ'-  
ગોડે. માહારાં તમારે બહુ પછેંચોરે, માહારાં ૨ જ્યાં-  
હાં જાયો ત્યાંહાં સુઅધીયારે, માહારાં ૩ વેદ પૂરાણુ જાયી-  
યારે, માહારાં ૪ ઉત્તમ કુળ અધિકારીએ માહારાં સુ-  
દીર વર ગીરધારીએ, માહારાં ૫ પેહેલે એમ કથાંહાં કી-  
ધૂરે, માહારાં ૬ સરવસ્ત હમારે લોધૂરે. માહારાં ૭ શ્રા-  
કચને સાધક દીધૂરે, માહારાં એવું કામણ હમને કી-  
ધૂરે, માહારાં ૮ દરદ નિશા અજવાણીરે, માહારાં ૯ ગોપી  
રાસ રમાડારે, માહારાં ૧૦ હથી ધઢી લાજ છોડાવીરે,  
માહારાં ૧૧ ગોડુણમાં અસવારીએ, માહારાં ૧૨ રૂપામણીજ  
સુઅડારીએ, માહારાં ૧૩ માધવદાસ બલીણ ગરે, માહારાં ૧૪  
પૂરે પ્રેમ નેત્યારે માહારા વરજના વાહાલા.

### ધોળ છૃ.

વંદ્રાવનનારે ચંદ્રમા, આજ માહારે આનંદ અતી ધર્ષા,  
મગટચા શ્રી વિઠળનાથકે, વંદ્રાવનનારે ચંદ્રમા. ૧ માગ-  
શર આસ સોહાભર્ષા, નોમીનો ધીનકે; વંદ્રા. ૨ કાન્દેપદ્ધ  
વાડે ડુદે હવા, ગોકુળ માહેરે, રતન. વંદ્રા. ૩ જુવતીનાં  
જુથ ટોળે અધ્યાં, સંજ્ઞાના નવસત શણુગારે કે વંદ્રા. ૪  
પેહેરખ નારંગી ચુંદી, આલે ગજ અતી ચાલકે વંદ્રા ૫

કનક થાળરે કરશુદી, માંહે મુક્તાકુળ સારે વંદ્રા. ૧ આ-  
તા અંગળ વિણ સોહામણા, આચાં ભી અડાજુને દ્વારક  
વંદ્રા. ૨ શ્રી વીઠલજર ભાતાએ વધાવીયા, આનં અંગ  
ન માયકે વંદ્રા. ૩ તીળક ફરે ને વધાવે પ્રેમશું, ગાય શ્રી  
ગોકુળપતીનું ભીત. વંદ્રા. ૪ ભી જસોદાજુના જીવણું ભા  
ડીલા, આ અડાજુના કુનર ડોડામણા; જુગતીના જીવણ  
પ્રાણ. વંદ્રા. ૧૦ જસોદાજુના જીવન કાહાનકે, ૨ંગી લોલી  
ન લે વાન કે વંદ્રા. ૧૧ કુંડણ ઝણકે ઘેહુ ડાનમાં  
રેણી કસી ડોઢી સમાન. વંદ્રા. ૧૨ શીરપર કુલેણની પાધ  
કે કુલો નવાંગી ખાગ કે રતાપણી માહા અનુરાણ કે વંદ્રા.  
૧૩ તરાણ ખાંધ્યારે ખારણે, તોડે ટજકે છે ભારકે; બાસ  
હણધર વીરકે. વંદ્રા. ૧૪ પ્રાતઃસમે માંહી ધુમતાં, ધુમે ધ  
મકે છે પ્રાત; કંદાણ ઘલકે છે હાથકે, વાળું વાને ખહુ  
ભાતકે. વંદ્રા. ૧૫ જુગ જુગ જીવે માહારો વાહાલમા,  
ખલોહાણી માધવદાસ કે. વંદ્રાવનનારે ચંદ્રમા, ૧૬

### ધોણ ૪૭

શ્રી વલભ ચુલને નિરખારે, માહારા શીજુના વાહાના  
સુંદીર જોના સરખારે માહારા શીજુના વાહાના ૧ વેદ  
પુરાણે લખીએચારે, માહારા ૦ જ્યાંદાં જાએ ત્યાંહાં સુ-  
ષ્ટીએચારે, માહારા ૦ ૨ શ્રી જુમનાજુની તિરરે, માહારા ૦  
પણ હરચાં હણધર વીરરે, માહારા ૦ ૩ શ્રી વંદ્રાવનની  
વારેરે, માહારા ૦ મહી લુટરા ચા ભાટેરે, માહારા ૦ ૪  
સોણ સહસ્ર દોરે નાશીરે, માહારા ૦ તોએ ડેહેવાયા ખલ  
આશીરે, માહારા ૦ ૫ શ્રી ગોવરધન ગીરધાશીરે, માહારા ૦  
માધવદાસ ખલીણાશીરે, માહારા ૦ ૬ના ॥ વાહાના.

## ધોળ ૪૮.

શ્રી હુકરાણી ધૃત સોહામણારે, છોકરો લેકે છે દ્વારા, માહાર ગોકુળ રણ પામણુરે. ૧ શ્રી વલભ વંશ આરાજ તારેને શ્રી વોકનતાયનો સાથે માહાર રે ગુણ નિધી શ્રી ગોપનાયજીરે, હળવરનો અવતારરે. માહારો ૩ કુ-  
ણનિનિ વીડલતાયજીરે, આ કરન તારો અવતારરે- મા-  
હારો ૪ શ્રી ઇક્ષ્વમાણી વહુજીના કંથરે. શ્રી પદમાવતી  
વહુના કંથરે, માહારો ૫ ગુણવંતા શ્રી ગીરધરલાલજીરે,  
શ્રી બામાણીજી વહુના કંથરે. માહારો ૬ ગુણવંતા શ્રી  
ગોપનાયજીરે, શ્રી રાજીજી વહુના કંથરે. માહારો ૭  
ગુણવંતા શ્રી બાળકરણજીરે, શ્રી કુમણાવતી વહુજીના  
કંથરે. માહારો ૮ ગુણવંતા શ્રી ગોકુળનાયજીરે, શ્રી ૯  
રવતી વહુજીના કંથરે. માહારો ૧૦ અણતને જીતી દળા-  
રે, રાખ્યો માળાનો ધર્મેર. માહારો ૧૧ ગુણવંતા શ્રી  
રઘુનાથજીરે, શ્રી જનકીજી વહુજીના કંથરે. માહારો ૧૨  
ગુણવંતા શ્રી જગતનાથરે, શ્રી મહારાણી વહુજીના કં-  
થરે. માહારો ૧૩ ગુણવંતા શ્રી ધનરામજીરે, શ્રી કચ્છા  
વહુજીના કંથરે, માહારો ૧૪ દ્વાંશી સતમામા બે-  
હુરે, અગ્રજાતી અતુલારે. માહારો ૧૫ શ્રી નવ નિ-  
ત્ય પ્રિયજીને રીજવારે, શ્રીવા વિનિધ્ય પ્રકારે. ૧૬ શ્રીબ્રા-  
મણુના ડમણા દૈવતારે. જેને શાત પાંચ જેહાગરે. મા-  
હારો ૧૭ શ્રી ગોકુળથી શ્રીજી પદમાણારે, ૧૮ શ્રીગો-  
લદ્રણ ટેકરે. માહારો ૧૯ સાઠમાં શ્રીજી પદમાણારે,  
આપ શ્રી ગોવરધન નાથરે. માહારો ૨૦ ૨૧ શ્રીજીની શ્રી-  
વામાં સોણીયારે, સાત કુંવરની લોકરે. માહારો ૨૧ જોગ

ધરાને શ્રીશ્રીને ભૂતુતારે, શ્રી જુમના જી આજી હાથે.  
 માહારે, રૂ. સાતાસાં કરાડી પ્રાડાં ખરચારે, આરતી જિ-  
 તારે વર્ષાદીનારે, માહારી ૩૦ ૨૧ દર્શય ધરે મન મોદયુરે,  
 માળા પહુંચવે હાથરે, માહારી ૩૦ ૨૨ અનશીઘટના ચોક  
 ભરે, માહારે વાહાલે કર્યો વોઝું નાફરે, માહારી ૩૦ ૨૩ ર-  
 મધું રાખાજીના રાસમારે, તાળી ગોવરધન હાથરે, મા-  
 હારી ૩૦ ૨૪ કંલેડીને કરુ વિનતીરે, નમી નમી દંડવરત  
 થાપરે, માહારી ૩૦ ૨૫ માધવહાસની વિનતીરે, આપો શ્રી  
 ગેડુણ વાસરે માહાર શ્રી ગેડુણ રળીપામણુંરે, ૨૬

### ધોણી ૪૬

ધન્ય કંડરોલી ગામરે, વાહાલે। વસે વરજના ધણીરે;  
 ધન્ય કંડરોલી ગામરે, દ્વારકાનાથની શોભા ધણીરે, ૧  
 ધન્ય કંડરોલી ગામરે, પુરુષોત્તમ શેવા કરેરે; ધન્ય કંડ-  
 રોલી ગામરે, રળીપામણી રાય સાગરરે. ધન્ય કંડરોલી ગા-  
 મરે, દુલીપા દરશન જાપછેરે; ધન્ય કંડરોલી ગામરે, મા-  
 નુંતી મંગળ ગાપછેરે. ૩ ધન્ય કંડરોલી ગામરે, આનંદ  
 ઓછવ ધયછેરે; ધન્ય કંડરોલી ગામરે, ને જીવ શરણે  
 જાપછેરે. ૪ ધન્ય કંડરોલી ગામરે, તેનું જીવતર સદ્ગન  
 થાપછેરે; ધન્ય કંડરોલી ગામરે, માધવદામ ગાય છેરે. ૫  
 ધન્ય કંડરોલી ગામરે, વાહાલે વસે વરજના ધણીરે, ૬

### ધોણી ૫૦.

એ વાહાલાજી ઉભા રોડોને રંગ રથીપાજી, મુનાને  
 મળથાનુ કંદાને રંગ રથીપાજી; વાહાલાજી માહારા વશ ક  
 રીતને ચુકો, અગુર પછ શું ચુચારે રંગ રથીપાજી. ૧ વા-  
 હાલાજી માહારા કામણીઆ ચુને કીધાં, માહારાં ચીત

ચોરી ભીખારે, રંગ રથીપાળુ. ૨ વાહાલાળુ માહારા અ-  
 ખળા માહુસ તે શું કશીએ, સાવરીઆથી ઉદ્ધોરે, રંગ  
 રથીપાળુ. ૩ વાહાલાળુ માહારા ગઈતી જુમનાળુને ઘા-  
 ટે, ગીરેખારી મજીયા વાટેરે; રંગ રથીપાળુ. ૪ વાહાલા  
 માહારા કાળ નાખુફલ હુતી સાથે, ઐડાનો ભાર માયેરે,  
 રંગ રથીપાળુ. ૫ વાહાલાળુ માહારા તે મારે નવરે કા-  
 લાપાં, તમ સાથું નવ જોવાયારે. રંગ રથીપાળુ, ૬ વાહા  
 લાળુ માહારા રથીયા તે સારુ, ના જાણું દુઃખ માછારું  
 ૭. ૮ રંગ રથીપાળુ. ૭ વાહાલાળુ માહારા સુખ મરડીને  
 રહ્યા છો, નિરદ્ય શું થયાછોરે, રંગ રથીપાળુ. ૮ વાહા  
 લાળુ માહારા દરેદ હુમારું જો જણો, તો હ્યા મન આણો  
 રે, રંગ રથીપાળુ. ૯ વાહાલા ૧ માહારા રાન ધીવથને રે.  
 હેઠળી, ના જાણું સૂગા નેણુરે; રંગ રથીપાળુ. ૧૦ વા-  
 હાલાળુ માહારા ડોઢાના આગળ વાત કડીએ, રાડુડોનાં  
 મેહેણાં સહીએરે; રંગ રથીપાળુ. ૧૧ વાહાલાળુ માહારા  
 રાડુડો કાનુડાની ડેઢેથે, હવે તો હગો દેઢરે; રંગ રથીપાળુ.  
 ૧૨ વાહાલાળુ હુમારા "॥૧॥ રાયુ હવે કોહુાની, નથ્યા વાન  
 છિડતારે રંગ રથીપાળુ, ૧૩ વાહાલાળુ માહારા વચ્ચન આ-  
 પુ તે ૬થો કરમાં, જાસો તો રાયુ ધરમારે. રંગ ર-  
 થીપાળુ. ૧૪ વાહાલાળુ માહારા ખાડાં નલે "॥૨॥ ને લાડુ,  
 નનો તો થા યાડુરે; રંગ રથીપાળુ. ૧૫ વાહાલાળુ ગા-  
 ધારા સામયી સરસ અનંતી, સુખ આગળ ધરાવી : રંગ  
 રથીપાળુ. ૧૬ વાહાલાળુ માહારા ને જોઇએતેકેહુનો,  
 મીડા મેવા બેળોરે; રંગ રથીપાળુ. ૧૭ વાહાલાળુ માહારા  
 હરીજસને હરી કરુનો, ઉતર હમને દણોરે રંગ રથીપાળુ. ૧૮

## ધોળ ૪૧

તમને સુંપના છે પ્રાણરે હો છાળીલીજી, ખાશુરે તુતો  
લો-ની ડું શરીરે સુકાયો; તુજ રૂપમાં લોભાયોરે હો છ-  
ણીલીજી. ૧ ખાશુરે સુજને તુલયીના અનુત્તભાવે, નિંદ્રા  
નવ આવેરે હો છાળીલીજી. ૨ ખાશુરે તાહારે નિત્ય નો-  
હુતાં દરશન હોયાં, ચીત નોહુતાં હરી લોચારે. હો છાળીભી  
જી. ૩ ખારીર હુતો અરજ કરે ઓચી, જ્યાંહાં હું ત્યાંહાં  
તુ જેવારે. હો છાળીલીજી. ૪ ખારીરે તાહારી શરડીએ તુજ  
આરે આવું, સાચે કોને લાખુરે. હો છાળીલીજી. ૫ ખા-  
શીર હુતો હરીદાસ હરીને કરેલે, ઉત્તર હમને હલેરે. હો  
છાળીલીજી. ૬

## ધોળ ૪૨.

શ્રી દનારકાંતાયજી ભાગુ પાયકે, મતી દીજો ભલીરે લોલ;  
શ્રી બાળકભજુનો જન્મ પવિત્ર તે ગઢાએ સહુ મળીરે લોલ;  
૧ સંવત સોણસેહેને ખટકે કરત સહીરે લોલ, આસો  
માસો નંદ કુમાર કે; ફરી પ્રગટ્યા મહીરે લોલ. ૨ રાધી  
દ્વારામણી માતને કુખ્યકે લાલજી પ્રગટ્યારે લોલ; શ્રી વિ-  
દુલનાયજી હેંગે દાનકે, લયક સહુ હર્ષીયારે લોલ. ૩ સાં  
ભળી આનંદ નરને નાર કે, સહુ મળીયારે લોલ. કંધી  
દ્વીનાં શીકાં ધરેચાંક, સહુ મન ભાવીયારે લોલ. ૪ આ વ-  
લભ રાજકુમારને ઘેર કે, દ્વીકાદા મચોરે લોલ; શ્રી વિદ  
લનાયજીને ત્યાંહાં કુ બધાઈનો રંગ રચારે લોલ, ૫ એક  
એક નરને એક નારકે, હાથ તાળી દીએરે લોલ; નાચે ગાવે  
આછા યાયકે, સહુ ને ને કેહુરે લોલ. ૬ નાચે ઢાડી  
શું કણે શું જાનકે, આજ સેઈ હાપમારે લોલ; વાગે બાંઝ

મૃદંગ ઉપરકે, કવીતા કરી તાળમારે લોલ. ૭ ઝાવે દુસ્તન  
જન નર નારકે, વિણ પ્રગટ્યા તથારે લોલ; લુણવે શી વ-  
લભ નંદ ઉદારકે, મિષ્ઠાન મોદ્ડા ધણારે લોલ. ૮ શી ગી  
રખરજી પ્રકુલોત મન કે, ગોવીદ હરખીયારે લોલ; આવી  
હવ એચી પૈમાન કે, કુથુમ બહુ વરખીયારે લોલ. ૯  
આવ્યા જોશી સહંસ્ય પ્રવિષ્ટકે, લાલ પ્રગટ્યા સુંધરારે  
લોલ; એમને ઘટ પુત્ર કર્યા એક કે, એમ કેહે છે સુનારે  
લોલ. ૧૦ આવ્યા વાગાદિક માહા સુંપ, કુણી કહે વ-  
દીરે લોલ; શી ગોસામી કરી પરમ ઉદાર કે, આપી વ  
ધામધૂરે લોલ. ૧૧ આવી ગોકુળની સડુ નાર કે, કુડે  
કુડે મળીરે લોલ; લેણા આ સુંપ સ્યામ રવદ્ય કે, આ  
શીશ હે સડુરે લોલ. ૧૨ ચિરણજીવો આ વિઠન રોજ કુમા  
ર કે, ભડત શીર ગાજનોરે લોલ; પ્રમુજી શેવા કરને  
નિત્ય કે, ગોકુળ માંહી માહલનોરે લોલ. ૧૩ અવીયા  
અપણા રહેજો નિત્ય કે, ભડત હુનરાવનોરે લોલ, હું છું અ-  
રણ શરકનો શાસ કે; પણ પાખી ધણોરે લોલ. ૧૪ રાખો  
અરણું કમળના પાંસ કે, ઘરદ છે તમતણુરે લોલ; ઘલીહારી  
નાય માધવદાસ કે, દેખ નિવારનોરે લોલ.

### ધોળ ૫૩

વર્ણિબું શી વંદ્રાવન સુંપ ધામકે, શાભા તાંહાં ધણારે  
લોલ; જુમનાં નીર વહે ગંભીર કે, ગોવરધન ગીરોરે લો-  
લ. ૧ બનશીયટ સુંદાર ધનથેર કે, નીજકુજ છણી શી  
કુદુરે લોલ; કુદાં ભાર અટારે દ્રમકે, નામ પણ શું કહુ  
રે લોલ. ૨ કુદ્યો અંધો ને કયાનોર કે, કમળને કેતકારે  
લોલ; કુણી યુન ગાઢી ચુલણારકે, ચંણલી માલતીરે

સાલ. ૩ ત્યાંથાં ધનસ્યામ ચરાવે ધેતું હે, ખજાવે વાંસળી રે લાલ; ૪ વરે સુધી ગોકુળની વરજનારી, ચીતડેથી અ-  
જીરે લાલ. ૫ કીધા અવળ સનળ શાણગારહે, સાડુ. રોળે  
મળીરે લાલ; ચાનો સાડુ સખીએ। મળી સાથ કે, સુખ  
.અભૂષાન ટળીરે લાલ. ૬ આવી વંદ્રાવન સુખ ધામ હે,  
ન્યાંથાં ઉભા હરીરે લાલ; દિશાપર કર સુક્ષ્મો વરજ નાય  
હે, અધર ચારલી ધરીરે લાલ. ૮ એવી છણી જોઈને  
વરજ નાય કે, ધણી યદ આતુરીરે લાલ. કીધા હાજ  
ભાવ રાતમાન, વધારી આતુરીરે લાલ. ૭ સુદરસ્યામ હં-  
રી કર કાદ્યોગયા મળી કુજમારે લાલ; મદ્યો ત્યાંથાં રાસ  
ઘીનાસ અનેક, રની સુખ રંગમારે લાલ. ૮ હેઠી લીભા  
અપરમપાર હે, નહી ગાઈ શકુ રે લાલ, ઘદરો છેણ શું  
ગાડે કે, માહા ગતી મંદધુંર લાલ. ૯ વરણતું ઓ વંદ્રા-  
વત ધામ કે, શાભા ત્યાંથાં ધણીરે લાલ.

### ધોળ પ૪.

કાંકડોલી ગામનારે વાણી, તંતો વાહાના સુજને શીંચી  
છે દારતી. ૧ પૂર્ણ જાળનારે પ્રીતે, તે રમ માણણું રંગ  
શીતે. ૨ નિરમે થઈનરે નાચુ, ન્યારે ઓ વરજભુષણજીને  
નાચુ. ૩ એ વીના સરવેરે કાચુ, નિગમ કરુછે એ છે જા  
ચુ. ૪ દ્વા કરી છેરે દ્વાળે, કંપા કરી પ્રભુ જીવપર ભા  
ણે. ૫ માહા સુખ પામારે લોતાં, હવે માહારાં ભટકણું ભા  
ણાં ગોથાં. ૬ તર્ણાનું ડેકાણુંરે એ છે, દાસ મનોર નારખી  
કેહેછે. કાંકડોલી ગામનારે વાણી. ૭

## ધોળ પ્ર્ય.

અમે આવ્યા તમારે આશરે અલખેલાજુ, હું કું કુ-  
રુચી જઈ સાસરે અલખેલાજુ. ૧ ફેરા તથું કણ એ મ-  
ધ્યું અલખેલાજુ, મન ગમતું મુજને મજ્યું અલખેલાજુ.  
૨ હોરણો બાગ્યો હાથમાં અલખેલાજુ, તમે શાખી સંઈયર  
સાથમાં અલખેલાજુ. ૩ તમારું શાખણું અંગ આડશામાં  
અલખેલાજુ; ચુગુંંતીને લાંછન લગાડે માં અલખેલાજુ.  
૪ ને કલાખણે ગાહારી મારડી અલખેલાજુ; ડેની સાથે  
પ્રીત છે જેવડી અલખેલાજુ. ૫ અમે કાજળ આંખમાં  
આંજુશુ અલખેલાજુ; તમા નેણાંજી ચોટ નાંખો માં અ  
લખેલાજુ. ૬ હુંતો દાણ નહી આપું રાડુડો અલખેલાજુ  
અમે જવાય આપીશું રાડુડો અલખેલાજુ. ૭ હું વાય-  
રાની બીહોઠો નથી અલખેલાજુ, હું ચોશાયાળો ડોઈની  
નથી અલખેલાજુ. ૮ હું ઓંઘીયાળો પ્રભુ તમ તથી અ  
લખેલાજુ, ચી વહેનના ઈવામી તમો છો ધઢી અલ-  
ખેલાજુ. ૯ અમે આવ્યા તમારે આશરે અલખેલાજુ.

## ધોળ પ્રક

વનમાં વાગેર વાંસળી, ભાહાર માંદી હુચો સંભળાય; ૧  
વનમાં ૧ મોદ રાઉ પાનીરે સોહામણી, રૂષડો આકુળ  
બ્યાકુળ યાય. વનમાં ૨ વેગે ચાલીરે વીનતા, મેતો ધર-  
માં નત રેહેવાય. વનમાં ૩ દેહની દ્યારે વાસણુ, અગે  
આનુભણુ બદ્દાય. વનમાં ૪ લોવન લોંવનદ્યારે ભાન-  
ની, ચાની છાન કરી ધર તાજ. વનમાં ૫ સાસરૂ મહી  
ધરે મહેલીયું, લાપી લાડાપાંની ભાજ. વનમાં ૬ વન  
સહુ આવીરે ગોપીઓ, નરણે નીરઘા ચામ શરીર. ૭૦

૭ ઇગનામ નરાયોરે હજાએ, ધર્મી સુંદર જુમનાં કેવી તી  
૨. વનમાં ૮

### ઘોળ ૫૭.

વાડે અંબાડ ઓ નાપળુને, સુંદર સ્થામ સ્વરૂપ; ઓ  
લહિલ સુત શ્રદ્ધા કરે, એ ઓ ગોકુળના ખુબ. પાદ બાં-  
દે વાહાલે જરૂરી, ને સુંદર વાદા સાર; પટડા રે છે  
પચરંગના, સણુઆ તે સોણ શણુગાર. ૨ કેમરી તીમક  
સોલ્લામણાં, નારીડા વીસ્તાધાર; ચીંબુકની અતી ડાંતી છે  
કરે ભાતીના હાર; ૩ હડખચોએ હીરથા જગમગે, એનો  
તેજ તણો નહી પાર; અધર બાંધ એ રસીડ છે, કણકે  
તે નોત પ્રકાર. ૪ બાંદે બાળુંધ બેરખા, હરીના એ-  
રણાંખાણા કેશ; નિરખાને વળી નીરખશુ, એનો પાર ન  
પાણે શૈપ. ૫ ડાઢી બાળુએ ગીરીર ધરવો, જમણે ક  
દી મધ્ય ભાગ; જાપા કરો ઓ નાથળ, માહારાં હઠડાં  
દાઢાં થાય. ૬ પાએ ધુધરી રણજણે, મોજ હાંએ ભાતીની  
દીર; કંપા કરો ઓ નાથળ, બલીહારી માધવદાસ. ૭ મા-  
ધવદાસ કરે હરી, માહાર મારું આપો માહારાજ; વળી ૧.  
જી કરુ વીનતી, સુને હૃદે વરજમાં વાસ. વાડે અંબા-  
૩ ઓ નાથળ, સુંદર સ્થામ સ્વરૂપ. ૮

### ઘોળ ૫૮.

૧. બલીહારી તેલંગ કુળ દીપક, ઓ લક્ષ્મણ તાતને  
લાલ; ને કુળ પ્રગટ્યા ઓ વહિલ હેવ, જરૂર હીત કાર  
છુરે લાલ. ૨ માદ માગ જાણુ એકાદશી, ભર દેશાંકનીરે  
સાલ; માગટ ધરણુ અગ્ન મધ્ય કે, અગ્ન રૂપ સંદરે સા

अ. २ संवत् पांडुरसे पांचोस के, वारे ३ वी खरोरे लोल;  
 सरवे सर्वियां शेवकनां काज के, वरज जन आवी भयारे  
 लोल. ३ पुष्टि गारग चाल्यो भरलाद के, भर्यादा धर्षारे  
 लोल; जुने आप्यां दान अनेक हे, वार नव लागी क्ष-  
 यरे लोल. ४ जगतने द्रठ करनाने काज के, ओजु आवी  
 भाव्यारे लोल; वाड्य कहु ओ कमी प्रस ते, एउ ओडांत.  
 भयारे लोल. ५ जुन हेन राघ्यो नीरधारे के, लर्ह भरणे  
 प्ररघोरे लोल; भावी सोपी हमारा चर्णु के, द्रठ राघ्युरे  
 लोल. ६ अनां वयन सुंचीने हरीया के, जुने द्या कहु  
 रे लोल; निश्च वयन कल्यां प्रभाणु के, तण वार कही कही  
 रे लोल. ७ पद्मी विचारहु दान द्याण के, त्यांहां हरसाली  
 सहोरे लोल; पूछवा भाव्या दीन द्याण के; छहा कछु कांहां  
 सुनारे लोल. ८ त्यारे यिथ नमाऊं नाथ के, हुं समन्यो  
 नहीरे लोल; कपानाथे जापा कहु कहु के, सांभण द्रठ कहु  
 रे लोल. ९ भक्त जन उपर द्या धारण के, हरसालीये ल-  
 हुरे लोल; भक्तने आप्यां दान अनेक हे, भन आनाद  
 पञ्चारे लोल. १० वाहाले ओधायी जुन अनेक हे, जुग वी  
 सूरनारे लोल; प्रथम हरी हणधरे प्रगट्या के, रथना यी  
 कहुरे लोल. ११ मायावाद दावो भार के, प्रभु समर्थ स-  
 हीरे लोल; त्यांधी आगण चालो विस्तार के, वान भवे  
 रत भर्षारे लोल. १२ वरजनो ज्ञाण ओ विचाम के,  
 भा गेहुगानाथ धर्षारे लोल; लेखे जला खण पाप्तु के,  
 आहा नांहांगीर सहीरे लोल. १३ आपी जन मुडतानी भा-  
 ली के, प्रभु रामे नहीरे लोल; लधने सोंभी आ जुमनां ग-  
 ध्य के, जुमनांये हाथे गहीरे लोल. १४ त्यारे कहो जो-

હાંગીરને વાત કે, શાહા માણા મહીરે લોલ; માળા હલે હ-  
મારી નાય કે, ખદસે કુરી કડર લોલ. ૧૫ શાહાને લેઈ એ-  
ડા પ્રભુ નાવ કે, ૩૫ જુમનાંચે ધરધુરે લોલ; માણા આ  
થી તતક્ષણ હાય કે, શાહા રીજચો ધાંધુરે લોલ. ૧૬ એ સુ  
ખ નારખી આ વલભદાસ કે, મન આનંદ ધણોરે લોલ;  
હું અલીહારોતેલંગ કુળ દીપક કે, આ લક્ષ્મણ તાતનેરોલ

### ધોણ ૫૬

હું અલીહારી તૈલંબ કુળ દીપક કે, આ લક્ષ્મણ તા-  
તનેરે લોલ; એ કુળ પ્રગટચા થી વલભનાય કે, જગત હિત  
કારછુરે લોલ. ૧ એમના એડ સુત પર્મ કુપણ કે, અ-  
પુર શીરોમણુરે લોલ; શ્રી ગોપીનાય આ વિઠળનાયને કે,  
હું શીર એ ધણુરે લોલ. ૨ તે શ્રી વિઠળનાયને સાત  
કે, કુંવ! પ્રગટચા સહીરે લોલ; જાંણુંએ પોતે સાતસ્વ-  
ંય કે, ધરીને પ્રગટચા મહીરે લોલ. ૩ આ ગીરધારોળ  
પરમ સુશીળ કે, સુભટ અતી શાલાતારે લોલ; શ્રી ગે-  
વીદ્રાય તણો મુખ્યચાદ કે, ભડતજન લોભતારે લોલ. ૪  
આ બાળકશ્રાગનાં અતીશ્યાનીલ કે, અરણુ ચિત્ત લાવીએરે  
લોલ; શ્રી ગંકુળનાયજીના અરણુની ડેણકે, જગતમાં ડાઢા-  
વીએરે લોલ. ૫ અતુર શીરોમણું શ્રી રધુનાય કે, તેણુના  
ગુણ ગાઈએરે લોલ; શ્રી જાહુપતી નાયના અરણ સરોળ કે,  
તેણું હુલભ ધારીએરે લોલ. ૬ સામર્થ વેદ તણો નહી કે,  
ગુણ ધનસ્યામનારે લોલ; રાખો અરણુ કામળની છાંપ કે,  
એંકે ડામનારે લોલ. ૭ સાત સ્વરૂપ તણો નિજવંશ કે  
જગતમાં ખારાજનેરે લોલ. સરુળ સ્વરૂપના અરણની  
રણુ કે, અમ શીર વાજનેરે લોલ. ૮ એ આ વલભનો

निवृत्ति के, जगत् हित करणे रे साल; श्री वरजलभुज्यु  
नेह सुख्यंद्र के, भय वारणे रे साल. ६ तु खलोहारी  
तैमंग कुण्डोपक.

### धोणि ५०.

श्री वल्लभ सुत नाहाला लागो, के तेथी भय सध्यो  
लागो; सुकीत सेने थु लगो, श्री वल्लभ. १ प्रगट्यः श्री  
पुरुषोगम पोते, द्वाज सुंदीर वर भनसुः ते; इच्छी प्र-  
गट थया ले ते, श्री वल्लभ. २. २. रात कुंवर कहीओ तेवा,  
श्वरुपनी सांपी सेवा; जुवने दान धायां हवा. श्री वल्लभ  
उ सेवक नन कुष्ठीमां पाण्या, अणगा अथडाता टाण्या;  
समर्पण सुप्य वाटे पाण्या, श्री वल्लभ. ४ चोराशो अरणे  
कीधा, अष्टृष्टापी आधा लीधा; भगवद् २ स भावे की-  
धा, श्री वल्लभ. ५ ले जन हश्यमर्हे रहेश, निर्मण जु-  
मनांशु नाहाश; अप्युः वरज्ञवाशी थाश, श्री वल्लभ. ६  
श्वेष क नन कुंवर दास कहीओ, ध्यान सदा ऐमनु धरीओ;  
आपाशु श्री गोपीनाथजुने गमीओ, श्री वल्लभ सुत नाहा-  
ला लागो. ७.

### धोणि ५१.

आनंद सागर उलट्यो सभी आज माहार भन भा-  
हुंर, अंगो अंमे कुल्यां अती धयां; सभी इल्यां ते  
डेनां नन जयरे. ८१. भले प्रगट्यारे, भले प्रगट्यारे श्री  
गोकुणाथ, श्री विठ्ठलनाथ हो झेली हरीने वधांमणां १  
पावन चाहन खडु वणी, वचे चोइ नवली जतरे; पाण्य  
करतां कुलडां; वचे वेलडानी जतरे; सिंहासनरे, सिंहस-  
नरे, मेहेले धोडता हाथ, लटकता हाथ; हो झेली हरीने

વધાંમણાં. ૨ બહુ રતન મુખ હીરે જડચાં, માતીડ પૂરી થાણ  
૩, કુમ કુમ ભરચારે કચેલડાં; મહો પૂર્સ્પ ડેરી ભાણરે, સો  
વાયણુરે, સોવાયણુરે, ગાજ મંગળ ચારે; ગીત રથાણ,  
હો હેલી હરીને વધાંમણાં. ૪ ઓછાજું ઉપનો અતી ધણો,  
સખી આંશીએ નવરંગરે; વાજુન વાગે અવનવાં, સખી  
ઢાલ બેર ભદ્રંગરે. આજ મન ઉપન્યારે, મન ઉપન્યારે  
સખી અતી આનંદ; હો હેલી હરીને વધાંમણાં. ૫ પ્રિત્યે  
પ્રભુજી નિરઘયા, શ્રી ગોકુળપતી માહારાજરે; હરીદાસ  
કૃષ્ણ માહારા મન તણા, યોહુતા મનોરથ આજરે. હવે  
સરીઆંરે, હવે સરીઆરે શ્રવણાં કાજ; વૈકેનાં કાજ,  
હો હેલી હરીને વધાંમણાં. ૬ આણંદ સાગર ઉલટ્યો સ  
ખી આજ માહાર મન માલુંને.

### ધોણી દ૧

શ્રી ગોકુળ ગામને આંદરે સાહેલીરે, આ શા ઝાડમણોળ  
ગોંસાઈજી ગોકુળમાં પધારુંબા સાહેલીરે. ૧ મંડપ છાયો  
માગરે સાહેલીરે, તારણના છે માર ગોંસાઈજી. ૨ ચોડ  
ચિનામણ અતી ધણું સાહેલીરે, ધેર ધેર કદળીના સ્થંભ,  
ગોંસાઈજી. ૩ ધેર ધેર મંદીર ઉધડચાં સાહેલીરે. ધેર ધેર  
ઓછાજ થાય. ગોંસાઈજી. ૪ રંગાલી ગલી રણીઆમણી  
સાહેલીરે, ભડતની લીડ અપાર. ગોંસાઈજી. ૫ ચુન્ઝરાતા  
આવે મલપતા સાહેલીરે, વૈકેવ સોરઠ-દેશ. ગોંસાઈજી. ૬  
માધવદાસના સ્વામી મળ્યા સાહેલીરે, સરીઆં શ્રવણાં કાજ  
ગોંસાઈજી ગોકુળમાં પધારુંબા સાહેલીરે. ૭

### ધોણી દ૨

સુરેજ ઉગી ઉદ્ધ્ય થયો, સરવે સંસારને મોહ રહ્યો લા

લા ખેણી તુ રંગિલા. १ મને કુંડળ મકરાં ભાતી, હુંતો  
શ્રી દુત્કાંનાથજીનાં મુખ જેતી. લાલા. ૨ શરીવાળી કુલ.  
૩ વેરુ, આવતાં જતાં હું તમને ઘેરુ. લાલ. ૪ માદરે  
ઘેર આવજે દાહાડી દાહાડી. માહારે ઘેર કુલ ચંપાનીછે  
વડી. લાલા. ૫ મહારે ઘેર અટકે અટકે, લવીંગ સોપારી  
ખાંધું દા પટકે. લાલા. ૬ માહારે ઘેર આવો હશી રમત,  
મતા; તમે માહારી સાસુ નણંદને ખડુ ગમતા. લાલા. ૭  
આત્મ આવો ચોગી ઓળું, પલંગે પોઢો તો પ્રભુજીને વા  
ઢોળું. લાલા. ૮ માહારે ઘેર આંધો હશે ભણે, કુધ સાકરી  
ચાં પાડુ રસે રમે. લાલા. ૯ લાડકડા આવો તો રમાંડ,  
ધરમાં પદ્મારો તો જમાંડ. લાલા. ૧૦ ૯ મહેતો તમ સાથે  
પ્રીતિ આંધી, છોડાવી નવ છુટે હીરની ગાડી. લાલા. ૧૧  
દાસ ઠલમ કહે ભરણે લાગે, તેથી માહારા જન્મ જન્મનાં  
ભય ભાગે. લાલા લકૃષ્ણ તુ રંગિલા. ૧૨

### ઘેરણ ૫૪.

માહન મલપતા ઘેર આવેરો. માહારે ઘેર પૂર્વોત્તમ પ-  
ધારચારે, ચંતા લઘને ભાતીડે વધોવ્યારે. ૧ વાહાલે મા-  
દારે કરુણાની દ્રષ્ટિ જેયુરે, બાઈ માહારે એ વરણું મન  
માલુરે. ૨ પડું માહારે નંદના કુંબર જાયે પાનુરે, હવે  
હુંતો કૃપમ કરો રાખીય છાતુરે. ૩ દુરીજનને કેહુંદું હેણ  
તો કેહુન્નેરે, વાહાલા માહારા ઇદ્દીયા કમળ વચે રહેન્નોરે.  
૪ ધન્ય ધન્ય ગોકુળના ગીરધારીરે, વાહાલાને જોવા ભ-  
ણી વરજ નારૂરે. ૫ હારે હુંતો વલભ કુળની દાસીરે. હારે  
વાહાલા કર્પા કરો વરજવાસીરે, ૬ વાહાલે માહારે વરજ  
માં તે આચ્છો વસરે, હારે બલીદાની તે માધવદાસરે.  
માહન મલપતા ઘેર આવેરો. ૭

## ધો. ૮૯ દિન

ગાંગા બેટ્ટીએ અધડો માંડીઓ ગીરધારીનાં લખ્યારે  
પ્રમાણ, વારી જાઉ ઓનાથજી. ૧ વાદસાહે તે પ્રમાણો  
મોકલો છોડો છોડો શો શો કોડુણ ગામ, વારી જાઉ. ૨  
છોડો છોડો શો મંદીર માળીઓ, છોડો છોડો ને બરે  
શાન ગામ. વારીનાઉ. ૩ વ.૧૧ વાશીએ મનમાં વીમાશી  
આં, એમના સામા બાંધાને હથી આર, વારીનાઉ, ૪ શ્રી  
નાથજીએ આમાઓ નવ કંદી, નોય નોય એ દેવતાનો  
ધરમ, વારીનાઉ. ૫ ત્યાંહાં થકી શો નાથજી પધારીઓ,  
મધર, વારીનાઉ. ૬ ત્યાંહાં થકી શો નાથજી પધારીઓ,  
આવી પંચારેચા દસ વીસ ડોસ. વારીનાઉ. ૭ નરખાડ તે  
અધી આપણી, ચોદીયા ચોખાજીનાં રાખ્ય. વારીનાઉ. ૮  
વાહાલે તળાવે તંધુ તાણીઓ, અંપારણ વિશે ગાડી ચાર  
વારીનાઉ, ૯ ત્યાંહાં થકી શો નાથજી પધારીઓ, મધરાતે  
ભિનાડ દેથ. વારીનાઉ. ૧૦ રાલ પ્રજને કુઈરે પધામણી,  
આપણી શો નાથજી પધારેચા નળુક, વારીનાઉ. ૧૧ રા-  
ના પ્રજને મનમાં વિમાશીઓ, આપણી શી રી કરીશું બેટ  
વારીનાઉ. ૧૨ એમને સોય ઘોડાને બસે હાથીઓ, એ  
મના રથને જાખનો નહી પાર. વારીનાઉ. ૧૩ વાહાલે કું  
ગર ડોશી મંદીર કરેચાં. પધારેચા શો ગોવરેખન નાથ. વા-  
રીનાઉ. ૧૪ એમની ઊચી માડાને મંદીર માળીઓ, ની-  
પના નીપના પગથીઓ ચોડો. વારી નાઉ, ૧૫ નીપ-  
ની નીપના તે એરડાને એરડી, નીપની નીપની રસો-  
છુંએનાં ઠામ. વારીનાઉ. ૧૬ કુમળ ચોકમાં જુલે ધમર  
હાથીઓ, એમને ટોલડે રૂકે છે ભાર. વારીનાઉ, ૧૭ એમ  
મધરા તે ગોવરેખન લઞ્ચો, ખલ્યા સજળ તે ગહારાણીએ.

નાં નારી વારીલા. ૧૭ જળનો તે ગોપીના કુંડ ભ-  
ર્યો, તેહેનાં મધુરાં ભરચોરે ભરયૂર, વારી લા. ૧૮ એક  
વડલો તે ખનથીખટ ભયે કાંકરોલોં, તે ખનસીખટના ચોડો.  
વારીલા. ૧૯ ત્યાંહાં તો સાડર કેરા કરા પડ્યા, ત્યાંહાં  
તો દુધદે વરસ્યા છે મેહ. વારીલા, ૨૦ ગંગાબાપાદ્યે તે  
નિનતી એમ કરી, સુને આપણે વરજમાં વાસ. ૨૧ વારી  
લા ઓ નાયજી, ગંગા એટાએ કૃગડો માંડાએ.

### ઘોણ કુદુ

૨૨એ ઓ વખલ નંદન ગાવુણુ, ઓ વીઠલ નાથને વા-  
રેણે લક્ષે, ૧ નેહેના તેહના મન તણો મહિમાયજી, સ-  
કુળ અમંગળ અળગાં થાયજી, ૨ નેણે તે પૂર્ણીનુ કીધું  
છે દાનજી. ૩ અયું ટાળયું જીવ તણું અસાનજી. ૪ કીધી  
કીધી માદા મોહોરો ઉપકારજી, દૈવિત જીવનો કીધી વિ-  
રસારજી, ૫ મનડાની આશા પૂરેણુ કીધીજી, દિક્ષા તે શ્રી-  
વા કરવાની દીધીજી. ૬ મટચો મટચો અસુર તણો આદ્ય  
જી, કીધી કીધી ભડતી તણો ઉપરેશ્યજી. ૭ જીવને ઘજ્ઞ  
મયંધ કરેવાજી, ને થકી પૂરેશ્યાતમ મન ભાવ્યાજી. ૮  
વારંવાર અને આય્ય જીવ જાતજી, રાખો રાખો અસ  
મરપિત વશ્યુ આતાજી. ૯ શ્રીમદ્ ભાગવદ ઇપ્ પ્રકાશજી  
તે થકી તત્ત્વ વેદનું ભાયજી, ૧૦ બાંધી બાંધી લડત સિ-  
કુની સ્વેતજી, કીદું કીધું હેરી જીવનું હેતજી. ૧૧ સમ તે  
લાલ કેરા ને તાતજી, શા ગોપીનાથ તરી ને આતજી.  
૧૨ શ્રી અકાંમાણજીના ગર્ભે તણો એજ તનજી, પદ્ધારેચા  
લડતોનું કરવા જતનજી, ૧૩ તેમની લડતી તણો શીર સો-  
હીએજી નિયતાં નિજ જનનાં મન માહીએજી. ૧૪

શ્રીમદ વિઠળના ને દામજુ, તેમના તે ૫૬ રજની આશ જ. ૧૪ વળી વળી એહણ વિનંતી કીનેજુ. વરજં શેનકને અમેપદ દીનેજુ. ૧૫ તેડાવું તે સહીપર સાથજુ, નાચુ ગાડુ ને તાળી પાંઠ હાયજુ. ૧૬ કોને કંઠું કંઠું ને નવ કેહેવાયજુ, છાંખીપર જન રથીક બળી જાયજુ. ૧૭ હરએ શાવભલ નંદને ગાંઠુંજુ.

### ધોણી ૬૭

સખી આજનો લાહાયો લીજુએરે કાલ કોણે દીઠી છે. ૨૫. કુલની ગાડી ને કુલના તથીયા, કુલનાં એણાના એણાવીએરે, કાલ કોણે દીઠી છે, ૧ સોનાનાં સોગટાં નેરે. થભી ચોપટ: હીરલાના પાસા ટળાવીએરે, કાલ કોણે દીઠી છે. ૨ સોનાનું પારણું ને રેથભી ઢોરી, હરએ ઓનાયજુ કુલાવીએ, કાલ કોણે દીઠી છે, ઉ વાણીના મેહુલાને આ. નંદની હેલો, સુખને શરવતે લીજાઈએરે, કાલ કોણે દીઠી છે. ૪ વચભના રવાભી પ્રભુ રસીક સીરોમણી, વળી વળી મુખડા નિહાળીએરે, કાલ કોણે દીઠી છે, ૫ સખી આજ નો ભાહાયો લીજુએરે કાન કોણે દીઠી છે.

### ધોણી ૬૮

આજ આજનંદ નંદજુને દ્વારર. વરજમાં થઈ છે લિલા દહેર. ૧ ગોપી અતારે ઉલટભરી આવેરે, ધાણ ભાલી નો ભરી લાવેરે. ૨ વાહાલાને વિવેકે વધાવેરે, વાહાલાની ભાવનાય કહેવાયરે. ૩ વાહાયો હશનનાં ધાવણું ધાવેરે, વાહાયો ગોપીઓને ભાડ લડાવેરે. ૪ જેવાં હેત ગોપીપર કીધારે, ધ્યી ભાંખણું ચોણુને ધીધારે. ૫ વાહાલા મધુરામાં શું મીડુરે, એવું કુખ્યાલમાં શું દી ૬ વાહાયો

કુમલની ભંગે મોદ્દારે, વાહાલે ગોપીયેની સત્યે સોદ્ધારે.  
 ૭ ગોડુળ આવોને વરજના વાહાલારે, તમે નંદ જસેદાના  
 લાલારે. ૮ ગોડુળ આવોને વરજના વાદીરે, તમે પ્રાણ ભો  
 સ્થા છે માશીરે. ૯ ગોડુળ આવોને ગીરુવર ધારીરે, ત-  
 મારી વાટ જુવે વરજનારીરે. ૧૦ વાહાના જુમનાળુને ધાર  
 રે, તમે વખ હૃદાં થા માટરે. ૧૧ વાહાલે ગીરુ ગોવી-  
 ધન ધારેરે, એવા મદ ધંડનો ઉતાર્યારે, ૧૨ વાહાલા  
 વરંધનતની વાટરે, તમે મંડી લુટ્યાં થા માટરે. ૧૩ વા-  
 હાલા જુમનાળુને તારેરે, વાહાલે મોરલી વગાડી ધરે  
 ધરીરે. ૧૪ ધન્ય ધન્ય જુમનાળુનો આરોરે, માહારો સ-  
 કુણ ફર્યો જન્માશરે. ૧૫ વરંધન રમીના રાસરે, પુરી  
 સર્વ ગોપીની આશરે. ૧૬ ઘડીહારી જાય માધવનાસરે, મા  
 ગે ચર્છિકુમગની આશરે. ૧૭ અનુજ આનંદ નંદળુને દુરીરે.

### ધોઠ ૯૬

ધન્ય ધન્ય જી ગોડુળ ગમ અની રળીયામાણું, ડોઢ-  
 એ દીઠા શ્રી પુરુષોત્તમલાલ જુમનાળુમાં અલિતા; વા-  
 હાલે બાલ અધૂરા એલ સુખમાંયા માતી ગરે, વાહાલે  
 માનુષ અમણી ચાલ કંકુનાં પગનાં પડે. ૨ ધન્ય ધન્ય શ્રી  
 માહારાણી માની કુણ, લેહેની કુણે રલ જડચા; હેવા  
 ડોઢના નાંની સ્થામ સ્વરૂપ, થોડે થોડે કનક ધડચા. ૩ એ  
 મનાં સુખ પુતમ ચાદ્ર દૃષ્ટી માહારાં મનડાં હરચાં; એ  
 મનાં અણૂયાણાં લોચન, ગાંધે ઝડાં ગળીઓં પડચાં. ૪  
 વાહાલે જુદ્ય મેહેલ્યા કેશ, કેસણું તીલક ઘન્યાં; વાહાલી  
 માતી કેરા , પેતાને અગે ધરેચા. ૫ માહારે ર-  
 હેવું શ્રી ગોડુ ૧૮, સાસરીયું ઘાડું; એહેના શું કરુંએ

संसार, ए भड़क्षु भाहुदु ६ अभीहारी ज्या मापवदास,  
ओ वीठव वरने; राख्ने अर्थु कमणी पास, इवा करी  
नाज जनने, धन्य धन्य श्री गोदुगा गास अग्नि रणीपामधं.

### धो. ७०

हांरे वाहादो श्रेष्ठ अमारे श्री नाथजु, हांरे भवता-  
रणु हांर श्रेष्ठ अमारे श्री नाथजु. १ ज्ञे ग ज्यु वृ-  
त डा कुरेजु, हांरे तप तीरथ अपारे, श्रेष्ठ अमारे श्री  
नाथजु. २ सोस सभ गया ए गयाजु, हांरे मन माने  
चारार, श्रेष्ठ अमारे श्री नाथजु. ३ श्रेष्ठ अक्षर  
सुरदास कहे, हांरे भव शरणु सार, श्रेष्ठ अमारे श्री  
नाथजु. ४

### धो. ७१

कांक्षेली राज सागर तीर ३, वसे हमारे ५ व.लमारे  
लाल. १ दरशन हेछे दिनद्याण के; ओ द्वारकां नाथजुरे  
लाल. २ साथे वरेज्वारीती भीड के, मंदिर सोल्लामण्डारे  
लाल. ३ शेवा डरे श्री गोदुणनाथ के, संसारने तरवारे  
लाल. ४ वाहादो भाहारो प्रीतवारे नाथ के, प्रेलुपी  
डरे आरतारे लाल. ५ आठे दरशन हेछे नाथ के, शेवकते  
झारखोरे लाल. ६ सनमुख ३हे छे श्री गोदुणनाथ के श्री  
द्वारकांधिशनरे लाल. ७ ज्ञे हण तज तज्जा अंगार के  
ज्ञेतां सुभ पाभी ऐरे लाल. ८ घडु सप तथी अती  
प्रित के, सारस धारी ऐरे लाल. ९ क्षाणु क्षाणु धरीआ न  
वला १० ग के, बानक भेडु नरे लाल. १० धन्य धन्य ल-  
रतभंड के, भाग्य भूभी तथुरी लाल. ११ मायावादी श्रीधा

ત્યાન કે, ભાર ઉતારીઓરે લોલ. ૧૨ સુરનર બાધે જ્યથી  
જ્યથી કાર કે, કુદાંલી ગડગડેરે લોલ. ૧૩ ધન્ય ધન્ય નર  
નાણીનો હેહ કે, નેણે એકને ઓળખ્યારે લોલ. ૧૪ એ-  
વા પ્રભુજી નિરાયા નિત્ય કે, બાળે ડોઈ નથારે લોલ ૧૫  
દાસ મનોહર નાચે ગાય કે, નિરંગ ધડીરે લોલ. ૧૬ કાંક-  
રાલી રાજ સાગર લાર કે.

### ઘોણ ૭૨

નાહાના સરખા શીનાથજી, નાહાના નાહાનારે હાથ;  
નાહાની લખુટ્રાઓરે કર નહીં, સુંદિર દિસોછો પ્રાણનાથ,  
નાહાના૦ ૧ નાહાના સરખા ગેવાણીયા, નાહાની સર-  
ખીરે ચાપઃ સાથે સીંગડા શાલીયા, ગઉ વેન આરોવારે જા-  
ય. નાહાના૦ ૨ નાહાની ઘનસીઓએ કરે અણી, હરીઅં  
ગોણિનાં મન; ઇડો નંદજીનો લાડાદો, ઇડો વંદ્રાનન. ના-  
હાના૦ ૩ નાહાની સરખીરે ચાંગડા, નાહાના સરખા છે-  
પાય; પાંચે રણજથ ધુયણી, અખુષટ વીંછુડા સાર. ના-  
હાના૦ ૪ પ્રભુજીનાં ચુખ્ય પર જારલી, વાઈ વેણુ રસાન;  
શખ્ફે ભાડીરે ગોરિડા, રોતાં જોડેદ્યાંછે ખાળ. નાહાના૦  
૫ કાળંદ્રોને કાંકારે, ભિભા વગડોછો વેળુ; જવાહાને જા-  
દ્વા, કે વરજમાં થાણ પોકાર. નાહાના૦ ૬ આંગળી સા-  
ણી ન હરી તાણુશા, પ્રભુ ગાહાર ધુનેછે આંગ; સથળા  
ગોરિડા આવણ, તમને પેરણે માડારાજ. નાહાના૦ ૭ કે  
ઘનસીઘના ચોડમાં, ઉભલા વળડોછો વેળુરે; માનવ-  
દાસની વિનંતી, આપો વરજમાં વાસ, નાહાના સરખા  
શી નાન્દુ.

## ધોળ ૭૩

મીડડા ઓલા શ્રીનાથજી, મહીરા મારગ માંડે; જુદી  
સુખ આપેર શેજમાં, ૨૬ ॥ મનકુ ગાહાડરે મોડી રહ્યું  
પુંચ જન્મનારે પ્રીત; શાલા કી કંદું સ્વામતી, નિત્ય નિ  
ત્ય નવલીર રીતે. મીડડા૦ ૧ વાંડો પાથ વરાણસિયા,  
ખાંડી આતે છે ચાલ; વાંડો નઘણાં સોદ્ધામણાં, કે વાંડો  
ચેણ રસાળ. મીડડા૦ ૨ નઈયા તમારાં શ્રીનાથજી, ડ્રયમ  
કરી કરે વધ્યાંથ; શુદ્ધ ન રહીર શાસ્ત્રની, માનુની મુકેછે  
આન. મીડડા૦ ૩ શી જુમનાંણનારે કીલાં, પુઠથો નજ-  
સરહાર; માતી સધળાં વડી ગયાં, હીરદો લાધી છે હાથ.  
મીડડા૦ ૪ કે મનકુ મારે મોડી રહ્યું, દેખી છાભાલાની  
માન; ધન ગોરીંદ્ર પ્રભુ ઓહી માણ્યા, પાસના માહુડો ઉ-  
લાથ. મીડડા ઓલા શ્રીનાથજી.

## ધોળ ૭૪.

માહારે મંદીર પદ્મારી શ્રીનાથજી, હુંતો જોડુરે તમારી  
બાડ માહારે ભાઈર પદ્મારી શ્રી નાથજી, ૧ હુંતો શરી  
વળાની મન કર, હુંતો કુલદાં વરાવું સાચી પાડ. માહા-  
રો ૨ હુંતો ચીરના ચંહેવાં પદ્માવતી, હુંતો પથરાવું  
લીલા ચીણા પાડ. માહારો ૩ હુંતો શણુંનાર કરાવું હૃ-  
ના લાવતા, હુંતો દરપગુ દેખાડુ માદારા નાથ. માહારો  
૪ હુંતો મીડડા ભેવા ભાગાવતી, આરોગ્યાન વષકુંઠનાથ,  
માહારો ૫ હુંતો શરીરા કરાવું સ્નેહ નણો, જુગણ આરોગ્ય  
તમારે હાથ, માહારો ૬ હુંતો ગુમનાનણ કાચ ભરાવતી,  
આચમન કરો શી વૈકુંઠનાથ. માહારો ૭ બાસદ પાતરાં  
એડિયાં બંધાવતી, મુખાવાસ કરોને વૈકુંઠનાથ માહારો ૮

હુંતો સોનાનાં શાગરડાં મંચાવતી, રમત રમનો ભારી રાત. માહારે૦ ૬ હુંતો સજ્જા પથરાવું સ્નેહનણી, પોઠાણ કરો શ્રી ગોકુળનાથ. માહારે૦ ૧૦ હુંતો પુલના પંચા ભરાવતી, વીજાણ કરે સાગી રાત. માહારે૦ ૧૧ હુંતો પુલની જણી ભરાવતી, માણે ખરાને શ્રી ગોકુળનાથ. માહારે૦ ૧૨ હુંતો થાળ ભરુ સભ માતીએ, વધાવું અંગભકુળ પરીવાર; માહાર માંદાર પધારો શ્રી નાથજી ૧૩

### ધોળ ૭૫

પ્રથમ સમર શ્રી વલભનો પરીવારરે વાલાજી, વાહાલા તેજસ્વી ઉત્તરવું માહારે પાર માહારા વાહાલાજી. ૧ શ્રી વલભ શ્રી ગોપીનાથ શ્રી વીડલ કહીએરે વાદાલાજી. વાહાલા ભક્તિ માર્ગ સ્થીર સ્થાપો શર્યુ રહીએરે ગાલારા વાલાજી. ૨ પ્રથમ વરણવું શ્રી ગોવરધન ગીરધારી વાલાજી, વાહાલા તમ છો સુખ થાપ રૂકેમાં ભારી માહારા વાલાજી. ૩ ખીને શ્રી નરનિધ પ્રીયાજીને વાલુરે વાલાજી, વાહાલાને હરાભી નિરખી હરખ હૈયામાં પાલુ માહારા વાહાલાજી. ૪ શીને શ્રી મયુરાં નાથ છાંદીલો ગીરાનેરે વાલાજી, વાહાલે કરચા મનોરથ પૂરાણ અમ રીર છાને માહારા વાલાજી. ૫ કોથે શ્રી વીડલથશાપ લોઘ લોઘ હરખુર વાલાજી, વાહાલો જુગન સરષ્પ ખીરાને સરખી સરખું માહારા વાલાજી. ૬ માંચને શ્રી દ્વારકાનાથ કરે રાઙ્ઘધાતીરે વાલાજી, વાહાલે શંખ મરી ગઢ પહેલ ધર્યો ગીરિશાનરે વાલાજી, વાહાલે છાંદીલો મહ માડ્યો સર્યાં છજ માહારા વાલાજી. ૮ સાતમે શ્રી ગોકુળ ચંદ્રમાંથેણું ધાર્યે વાલાજી, વાદાલે

કુદી છે રાસ વિનાસ તેણાં વરજનારી માહારા વાહાળ. ૬ આચમશી મહન માહાળ ગવિ રણ સોહીપેરે વાહાલાળ, વાહાલા જીગલ ક્ષામની સંગ વરજ રહુ માલું માહા. ૭ વાલાળ ૧૦ નામે શી ગીરધાળ છે યુગુના ભંડારે વાહાલાળ, એહને શરણ રહીએ તા હાશમે પાર માહારા વાહાલાળ. ૧૧ દ્શમે શી ગોત્નાદ્રાપ રથાલાને નિરસુરે વાહાલાળ, નેહે શવ્યા શી વિઠલેશરાપ હઈપામાં હરાયું માહારા વાહાલાળ. ૧૨ ઓકાદ્શી ચેતો ખાળકાશુને દીકારે વાહાલાળ, વાહાલાનાં દરથન કરતાં લાગે મુનમાં મીડાં માહારા વાહાલાળ. ૧૩ દ્રાદ્શી શી ગોકુળનાથ સેણ્યા ગીરધાદીરે વાહાલાળ, નેહુને રાખ્યો માળાને ધરેમ એદરે વાશી માહારા વાહાલાળ. ૧૪ વયોદ્ધી શી રદુનાથજીન ગાવુરે વાહાલાળ, શી જાંનકીજીનત-નથ ચરણ રજ પાડું માહારા વાહાનાળ. ૧૫ ચતુરદ્દી શી જરુનાથજીની શેવા નલણીરે વાહાલાળ, એમને નમે છે મોહેયા લુપ રાપને રાણી માહારા વાહાલાળ. ૧૬ પુના પુરખચદ અધિગા સ્યામરે વાહાલાળ, વાહાલાના દરથન કરતાં પોદોચ્યા મનના કેડ માહારા વાહાલાળ. ૧૭ પંદર તથો પૂરણ થઈ એમ નાણીરે વાહાનાળ, વાહાલા રાખો ચરણની પાસ દાસ વંઘાળી માહારા વાહાલાળ, ૧૮ શી વલભ કુળની કૃપા થકી હું ગાવુરે વાહાલાળ, વાહાલા સાત સ્વરૂપની ચરણ કુમળ રજ પાડું માહારા વાહાલાળ. ૧૯ પ્રથમ રામું શી વલભનો પરીવારરે વાહાલાળ.

ધોણી ૭૩૦

ધન્ય શી જીબનાં શી ગોકુળ નીકઠ એરાને નિલે ન

વલે રંગે, નઠ તો રંગ તથા આખર સુંદર સોહીએ  
અની મળીયા હના વાટે. ૨૫. અલોકીક ડોગર રાને, ત્યાં  
હાં વર્ધમણ જન ઘેરે ગાને, ત્યાંહાં મંદીર શાભા સુખ કા  
ને. ૪-૫૦ ૧ ત્યાંથાં નિત્ય કીડા નાંદાલ કરે, વરજ જી  
વતીનાં જીથ હરે, ત્યાંહાં રમણ રેણી તન તાપ હરે. ૫-૫૫  
૨ ત્યાંહાં કુશુમ દૂમ ઘને બેણી સોહીએ; જેને દીકે  
ત્રીજૂષન મન મોહીએ, ત્યાંહાં અચ્છાં આતંદ નિત્ય પ્ર-  
તિ હોએ. ૫-૫૦ ૩ ત્યાંહાં કમળ કમળ રંગ રસ ભરી-  
એં, પ્રાતમ ઉપર અંતર પર વગ્નિયાં; આવે મધુકર અંત  
કારજ સરીયાં. ૫-૫૧ ૪ ત્યાંહાં ગોવરધન ગારી સંગ  
ડાલે, ત્યાંહાં વરન્વારી મુખ પણ બાલે; નહીં તપ તીરથ  
વરત તે પુછ્યે, ૫-૫૦ ૫ ત્યાંહાં વચામ ધાર મહુપુરા  
જાતાં, ત્યાંહાં બેઠક વનમન સુખ હતા; નીલ ધાર અનેક  
મુનીવર હતા. ૫-૫૦ ૬ ત્યાંહાં ઉત્તી શ્રી વસુદેવ આ-  
બ્યા, ડેવલા ધાર શી વલન મન ભાયા; એવા જસોદા  
ધાર લખી લાબ્યા ધન્ય૦ ૭ ત્યાંહાં અલ્લાં ધાર અનીકા  
મીઠી, છડી દર્શન વસંત સમે દીઠી; ત્યાંહાં ગોપ કૃપ અ  
ધર રસ છુટી, ૫-૫૦ ૮ ત્યાંહાં ગોકુળ નાહા વન ગીર  
ધારી, ત્યાંહાં જમલા અરજન સુખાડારો; ખાણે પૂતના પ્રા  
ગઠ સંહારી, ૫-૫૦ ૯ ત્યાંહાં ગોકુળ શી માહા પ્રભુ રા-  
ને, અલ્લ છોકર નિત્ય ગુણ ગાને; શી કુરોણી ધાર ને  
ઈ ભવતા ભય ભાને, ૫-૫૦ ૧૦ ત્યાંહાં જમના ધારે  
નાહાતાં; અશ્ર રાખા અલ્લ ધાર નિત્ય ગુણ ગાનાં; તાંદાં  
રાવળ રજ નિય પ્રિત જાતાં, ૫-૫૦ ૧૧ ત્યાંહાં દાસ  
ગોવરધન શુણુ ગાઈજે, કરો કરો કાપા તો વરન્વારી થ

દર્શા; મન કામ વચને આનંદી ધર્મદ્વારા, ધર્મ શી જુદી  
તાં શી ગોકુળ નીકટ ખારાને નિત્ય નવલે રહે. ૧૨

### ધોળ ૭૭

૦ વરેણ જન વલભરે, શ્રી જસોદા જીવણ નોઈએ એ  
સુખ દુર્લભરે, શ્રી વલભ કાપાથી લઈએ. ૧ પ્રગટ પીરા  
નોરે, શી ગોવરધન ધરે પોતે; યુષ યુષ ગાનોરે, નિત્ય  
પ્રતી અખાડ અધાતે. ૨ મુગટ મનોહરે, મકાઠતાનીનો  
તે; સાંભળ સહીયતરે, નાથા લટકે ગજ મીતાતી. ૩ સુખ  
છણી ઉપરે, કેશ કુદીલ છણી છાને; આંખ અચૂયાણીરે  
ક્રોટ કમળ શીલાને. ૪ ચીંબુ; પીરાનોરે, તેજ તથાં ચિ-  
ત હરીએં; અપાર અનોપમરે, અરૂપ અમી રસ બરીએ. ૫  
નાથ શીખ શામે, શુષળ પાર ન પ.મે; નિજ જન  
નિરખે, વરેહ તથાં દુઃખ વામ. ૬ અ.ગે આલણારે, વી  
વીધ પસન હરી ધરીપા; એ છણી નોઝનેરે, નિજ જન  
નાં મન ઠરીએં. ૭ નાથ ધન નાગરારે, કણીયુગ પ્રગટ પી-  
રાને; શાલા સાગરરે, લાલ તથા યુગ ગાને. ૮ દુર્લભ  
સુર્દલભરે, શ્રી વલભ એ સુખ આપે; કોઢી બનમનારે, ભ  
વ ધંધત વાહાવા કાપે. ૯ નાથ પીરાનોરે, જુણ ભા-  
ગે આબ્યા. એ છણી છાનેરે, લકુત પ્રેમ મન ભાયા. ૧૦  
નોઝે નવ દીઢારે, શી નાથ ગોવરધનધારો; ભવોભવ ગાં  
ઠધારે, અવસર બેઢા દુસી. ૧૧ આસુરી અગગાં, સાધી  
એ રસ માણે; સુદ મારી વાહાલરે, ભર જળ તે શું જા-  
ણે. ૧૨ શી કાશ કપાનીધિરે, આ વલભ નીકટ પીરાને;  
કળીમાં કારણરે, રમરણુથી અખ ભાને. ૧૩ નોને નવળ

એથારે, શ્રી નાટકર નંદના નંદન; કોઈ નવ માત્રારે, પડીઆ  
ભન કુઃપ ઇંદ્ર ૧૪ ધીક ધીક કુહુછરે, હે। સુરીજન તે  
ને; અવસર ઘોયેરે, કુઃપ બગાડી કુહુને. ૧૫ જેણે નવ  
નિરાખારે, શ્રી જુમનાંજુ માહારાયી; મન નહી વળીયુરૈ,  
પાપી જન તે પ્રાણું. ૧૬ વરજ રન લોટોરે, હરાય તે દેંદુ  
ચે ભરીયા; સુરીજન શાક્ષીરે, તે ભવજાયો તરોઆ. ૧૭  
હીત ની ચિન હુખસેરે, હરી શવા સુખુડારી; એ સરવ વીલા-  
સરે, બડલાયી નર નારી. ૧૮ શરણે રાખેરે, ઓ વલભ  
વરજ રન દીને; કાંઈ નવ જાણુંરે, દાસ ગોવરધન કીને  
વરજ જન વલભરે, અ જસોદા જીવણ જોયા. ૧૯

### ધોળ છઠ.

સુંદર ગોકુળ ગામરે પીહારી સ્વામ, અદ્ભુત સંધનું હા  
મરે પીહારી સ્વામ. ૧ દુર્લીજુને કાજરે પીહારી સ્વામ,  
પ્રગટચા શ્રી વલભ રાયરે પીહારી સ્વામ. ૨ પોતાના જે જ  
નરે પીહારી સ્વામ, વિચાર યથા છે બડુ દીનરે પીહારી  
સ્વામ. ૩ પુરુષોત્તમ કરુણા કરો પીહારી સ્વામ, શ્રી વલ  
ભજુણે દેહ ધરી પીહારી સ્વામ. ૪ જાચ નીચને શરણે  
લીધા પીહારી સ્વામ, દોશ કોશ નીવારીઆ પીહારી સ્વા  
મ. ૫ સમરપણ આખ્યા સાસરે પીહારી સ્વામ, શુનાને  
કીથા છે અધિકારે પીહારી સ્વામ. ૬ દ્વા કરુણ દીન-  
નાથરે પીહારી સ્વામ, શવા ગીરધારીજુને હાથરે પીહારી  
સ્વામ. ૭ રાયો મરણની છાંયરે પીહારી સ્વામ, શાલા  
નોઈ હીદસરે પીહારી સ્વામ, હંલે ને વરજમાં વાસરે  
પીહારી સ્વામ. ૮ સુંદર ગોકુળ ગામરે પીહારી સ્વામ.

( ८५ )

### ધોળ ७६

શ્રી મદન ચોહનલાલ, તમણું કોહે ભાગી; માહારે તમ  
ઉપર ધયું વાહાલ, મેં ભવતી ભાગી. ૧ હું અંગુંડમળની  
દસ, ચિત ચરણે રાખો; મને આપણે વરલામાં વાસ,  
સુખ જંપન દાખો. ૨ માહારા પ્રાણું તાજા આધાર, અ-  
ણગા રહેશા નહો; હરી છે। હઈયાના હાર કોઈને કેહેશા  
નહીં. ૩ માહારા કુટ્ટાં સહીત દરેશન, તમારાં શીધાં;  
વાહાલા તમે મરાંધા તાથ, દર્શન ખડુ દીધાં. ૪ માહારી  
વિનતી સાંભળો નાથ, તો તમને કહીએ, મને આપો વર  
જમાં વાસ, તો શરણે રહીએ. ૫ નાહીએ જળ જુમનાં  
નાર, દરેશન નાત્ય કરીએ; એમ કહે છે હરીદાસ, ભવે  
ભવ તરીએ. ૬ શ્રી મદન ચોહનલાલ.

### ધોળ ૮૦.

શ્રી વલભ કુળના રણીયા વાહાલા, શ્રી ગોવરેખન નાથરે;  
આવોને અલંકાર વાહાના, કરું ચેક વાનરે. ૧ પ્રિતલડી  
શીધીરે વાહાલા, મેં તમારી સાથરે; પ્રિતલડીની સાથે  
મારા પ્રાણ ખંધાના નાથરે. ૨ વાહાલાયાની વાત વાહા-  
લાની, કોને નવ કુહેવાયેરે; તમને મળવા મનકું માહારી  
આકુળ વ્યાકુળ થાયરે, ઉ પ્રિતલડી પાસ માહારા, પ્રાણ  
ખંધાણો; શામળોયા ચુંદીર વર, મનડામાં આણોરે. ૪ ન  
મ જિના વાડાલું ગીરુ કાંઈએ નવ જાણુંરે; સાસારનો  
લે કદી હું, હાડે નવ આણુંરે; ગીરધારા ગુજુવંતા ઓ-  
વો, ગોડાડી તો કીનેરે, હઈદું દરે જો વાહાલા, આલી  
ધન દિનેરે. ૬ કુલાણા ના રહીએ માહારા દીનખંડું નાથરે;

શ્રી વનમ પ્રભુએ ગુલસી આપી, મેળાંગો છે હાયરે. ૭  
સાચો સખંડ અથે માહારા, અગુર સુજાણે; હોડાવ્યો  
પણ છુટે માહારા, જીવણ પ્રાણરે. ૮ માહાનાળની માપાએ  
ચુને, મારચાં મિાના બાળરે. વરેહ તળ્ણી વેદનાથી હુંતો  
લુલી ગઈ શુદ્ધ ને સાનરે. ૯ જીસાચ્ચા નવ રહીએ માહારા,  
પ્રાણ આધારરે; હરજી મને હેત ધણું છે, હઈડાના હારરે.  
૧૦ અંતર ના કીને, માહારા અંતર લમીરે; ઉચ્ચ તપ-  
ને ચુન્યે હુંતો. ચુંદીર વરને જામીરે. ૧૧ પ્રભુજી પાતળી  
આ વાહાલા, એનકું ના કીનેરે, વરજ સખીની દાશીને  
તો, શાલાનીને લીનેરે. ૧૨ શ્રી વનમ કુળના રથીયા વાહા.

### ધોળ ૬૨

( પંચક્રિ રાગ ગરૂની. )

ગાલી વંદ્રાનને ચોક કે, ચાલી મહી વેચપારે લોલ.  
૧ મારગ મળીએંના ગાહારો નાય કે, મુજને આંતરીરે  
લોલ, ૨ માહારા હોડચાં મહીનાં માટેકે; ગોરસ માહારાં  
ઢોળીયાંને લોલ. ૩ ચાષ્યાં નંદ તળે દરાયાર કે, જઈ ઉ-  
ભા રહ્યારે લોલ. ૪ માતાજી તમારા કાંહાન કે, અળચીત  
નાડુ કરેરે લોલ. ૫ માતાજીને ચઢી રીસ કે, મંતીર થકી  
નીસરચરે લોલ. ૬ માતાજીએ લીધી હંથમાં સાંશી કે,  
કાંહાનજુને શાખાવારે લેલ. ૭ માતાજીના હાયમાં દીઠી  
સાંશી કે, કાંહાનો કદમ ચઢ્યારે લોલ. ૮ ઉનરો જીતરો આ  
હારા નાય કે, કંદું ગોક વીનતીરે લોલ. ૯ સાંભળો સાં-  
ભળો માતાજી ગારી વાત કે, આજની વીનતીરે લોલ.  
૧૦ ઝૂંડો જનસીઅટનો ચોક કે, ત્યાં હું એકલોરે લોલ.  
૧૧ એક હરી નેણુની સાન કે, હું તો ત્યાં અયોરે લોલ.

૧૨ એક મરડી માહારી પાંચી હે, અંગુઠી ઉતરીરે લાલ.  
 ૧૩ કાંહાનજી નદીને છે ખાળ કે, અળવીતાં શાં ફરેરે  
 લાલ. ૧૪ ખાં ધન ગોકુળની વરજ નારે હે, જેહેને ઘેર  
 નહીંરે લાલ. ૧૫ માહારી સોના કેદ્યેહેડું હે, ઇપલા ઉ  
 ઢાણીરે લાલ. ૧૬ આ તું જળ ભરવા ક્યમ જાઉ હે, કાં  
 ટૂ ઉલા કાંહાનજીરે લાલ. ૧૭ કાંહાના કાંડરડી માં માર હે,  
 સોના બહેડું નંદશરે લાલ. ૧૮ છોડો જુઠડા બોલી નાર  
 હે, તુ કોણ ગામનીરે લાલ. ૧૯ છોરા તાહારે શી પડુછ હે,  
 ગોકુળ ગામનીરે લાલ. ૨૦ જોયુ ગોકુળિયુને ગામ હે, આ  
 પાસે રહી બયુરે લાલ. ૨૧ અળિયો નરસઈયાનો નાથ હે,  
 રસ વાદ્ય ધણીરે લાલા. ૨૨ માલો વંદ્રાનને ચોક  
 હે, ચાલી મહી વેચવારે લાલ. ૨૩

### ધોળ ટૃ.

વાહાલો શી વલભ થોડે પ્રગણીયા, સુંદર વરજ, શી  
 વિષન ધરણા નામરે સુંદર વરજ. ૧ એનું ઇપ રમણ  
 ધણી ચાતુરી સુંદર વરજ; એનું સુપ જોવાને ચાતુરી  
 સુંદર વરજ. ૨ એને સેહેજ ડસુરી તીલક લાળરે, સું  
 દર વરજ; ઓવાં લાયન લાલ ચુલાલરે, સુંદર. ૩ એને  
 અન્નન બાડુએ હણી, સુંદર૦ એની કદીપર વાર કેદ્યાં  
 સુંદર૦ ૪ એના ચરણ કમળ શાના ધણી, સુંદર૦ ૫-  
 ક્રાનન માથે એ ધણી. સુંદર૦ ૬ એન કેમરી ધાતી  
 સોહીયો, સુંદર૦ એન તેને વોભાવન માહીયો. સુંદર૦ ૭  
 એના ઉપરણો છે જરકરી, સુંદર૦ સુર વીતા છણી  
 દુંધી હણી, સુંદર. ૮ એમ કહું પૂરા વૃદ્ધી કરે, સુંદર,  
 એ સુંપ જોઈ હણું હરે. સુંદર. ૯ પૂર્ણ લતા બહુ પા-

સરે, સુંદીરો ત્યાંહાં ઓ હથી રમીઆ રાસરે, સુંદીર. ૬  
ભાગ્યનડાં વરજાસીનાં, સુંદીરો વાહાલા શું રમતાં રાસરે,  
સુંદીરો ૧૦ એડુ કરણો ઇને વીનયુ, સુંદીરો શ્રીજીમનાંજ  
ને હું નસું, સુંદીર. ૧૧ શ્રી જીમનાંજ લોતાની આશરે,  
સુંદીરો મુને આપણે વરજમાં વાસરે, સુંદીર. ૧૨ હથીવાસ  
શાભા લોતાં, સુંદીર માહરા મનતા મનોરથ સહુ પેં  
તા, સુંદીર વરજ. ૧૩

### ધોખી ૮૩.

આજ રાખી આનંદ હુંવોરે, આપણા શ્રી નાથજીને  
જુનો; નેને કાંઈ નગભાતા હૃતાંદાડા, તેદ્વાર ચેદ્યાં છે  
ઉધાડો. ૧ વરજ ક્રીયા વેગે કરા શણુગાર, પેહેરો॥ ૧૧  
સર માતીના વાર; આવે છે વરજ શુંદીરનો વાદસો, તને  
તે નધણું ભાડી ભર્યુ નાહાયો. ૨ લોતાં તૃપ્ત ન થાપ,  
માધવદાસ અલોહાડી જાપ.

### ધોખી ૮૪.

શ્રી વિઠળનાથજી સોહામણારે, એમનાં લોજીએ પેરે પેરે  
ભામણારે. ૧ દ્વારા કુળમાં વાહાલે પ્રગટીયારે, હેખી નાજ  
જન મન અતી હસ્તખીયારે. ૨ રાજ્ય શુરીમણુ રાજ્યા  
રે, હેખી રોળ કણા સમી લાલુ ગારે. ૩ સજ્જન સર્વ સં  
તાકીયારે, અતે અન્ત વાણીએ પેખીઆર. ૪ તન  
મન ધન કરે વારણેરે, પ્રભુ પ્રગટીયા બગતને ઝારણેરે. ૫  
કોડ પૂર્ણી વાહાલે નાકત તણા, સુખ પામયા માંદા માંદે  
અતી ધણારે. ૬ દાસતાં દાર કરે પિનતી, અરણુ જીવો  
આ ગોકુળ પતરે. ૭ શ્રી વીઠળનાથ સોહામણારે.

## ધોળ ૮૫

ધત્ય ધન્યરે આજુનો દીન, આજુની રાત રણીયામણી  
જુ પધારચા શ્રી વાહનતાથ, વેગે તે આપો વધામણીજુ  
૧ જુરે ઉલટ અંગ ન માય, આજુની શાભા અતી ધ-  
ણીજુ; જુરે માનું તે મળીરે આજ, છાંડી નિરખવા  
પ્રમું તણીજુ. ૨ જુરે હીંડે તે માંડલા માસે, કનક કુળથ  
શીરપર ધરીજુ. ૩ જુરે તે ઉંર શીરુણ સાર, મુક્તા  
થાળ સગે ભણીજુ; યાહારા વાહાલાને વધાવાને જીઉ, ઉ-  
મંગા ઉમંગી આનંદ ભરીજુ, ૪ જુરે ચરણ જુવોરે  
જુગસ કૃષ્ણાર, આ જોડા અરીયળ સદાજુ; ખલીહારી  
આ વિઠલતાથ ડોડ પૂરો માહારા મનતણીજુ. ૫ ધત્ય ધ-  
ન્ય તે આજુનો દીન,

## ધોળ ૮૬

જુરે ધન્ય ધત્ય આજુનો દીન, શ્રી વિઠલતાથ પદરી  
આજુ; સુણી સુરીનર હરખા મન, ડણજુગ જુન ઓધા-  
રિયાજુ, ૧ જુરે ધત્ય ધત્ય શ્રી વલભ તાત, પ્રગટ પુર-  
ષોતમ સુત હણાજુ; જોતાં જાણુરે અદભુત વાત, પુરણ  
પ્રિત્યે પામગાજુ. ૨ જુરે ધત્ય ધન્ય આ આકાજુ માત,  
કુંચ ડે હુંલરાવાયાજુ, જુરે એના સુખમાં તે ખીડા  
ઘરારા, વૈજ્ઞા જનને આપીયાંજુ; વાહાલે આયાં તે અ-  
રવિતનાં દાન. ભવનાં ખંધન ડાપીયાંજુ. ૪ જુ, ધત્ય ધ-  
ન્યરે જુમનાજુનુ નાર, નિત્ય નિલ નાય કિંડા કરેજુ;  
વાહાલે ઓઢેર ઉપરણા સાર, દીંડે મારા મન ઝરે. ૫  
જુરે ધન્ય ધન્યરે વરલવાચી લેંક, વદન નિંદાળે વળી વ-  
ળીજુ; જોતાં જાણુ તે ડારણ કાંય, મંગળ ગાંધે મહી મ-

ળીજ. ૬ જુરે ધન્ય ધન્યરે શ્રી ગોડુણ ગામ, વરેજ ના-  
યક વાસો વચ્છેલુ, હવે સરીઆં શ્રીવક્તનાં કાજ, મરાળદી મ-  
નમાં દરેશ્ચ. ૭ જુરે ધન્ય ધન્યરે શ્રોધ્ય આજ, શ્રી  
શ્રી વખભને બાણશેલુ; તાંહાં તો વાગેરે તાલ પણ્ણાજ,  
ઘાંધીજન બહુ જથુ ભણેલુ. ૮ જુરે ધન્ય ધન્યરે માગશર  
માસ, ઉલમ વદ નામી ભલીલુ; સુખ પામોરે સહાંપર  
સાથ, લોલા ડાખી નિત્ય નવી નવીલુ, ૯ બલીદારી તે  
માધવદાસ, શાલા માહારે મન વઢીલુ; શ્રીવક્ત જનનાં સ-  
રીઆં કાજ, એ લીલા સડને મન ફરીલુ, ૧૦ જુરે ધન્ય  
ધન્યરે આજુંના દીન.

### ધોળ ટ્રે.

ધન્ય ધન્ય તે આંજુનોનો દીન આંજુની રાત રેળીઆ  
મણીલુ; પણારચા શ્રી વિઠલનાથ, વગે તે આપો વધામ-  
ણીલુ. ૧ આપણું સદા સોહાગ હ્યા નાર, આપણું શીરપર  
એ ધણીલુ; તમા પેહેરાને નોતમ ચોર, સુંદરી નવ સત  
વરસ તણીલુ. ૨ તમા પેહેરાને આખણું અંગ, સરખા  
સરખી સંચરીલુ; સખી એક કરે પૂષપની માળ, ખાલે તે  
કરે કુમ કુમ ભરીલુ. ૩ ઉપર શ્રીકૃષ્ણ કોણળ સાર, કાંક ક-  
ખસ ડેસર ભરચાલુ. માહારા વાહાલાલુને નિરખજા લાડી,  
નિરખી હરખી માહારાસે ભરચાલુ. ૪ જઘ જંયા શ્રી જુ-  
ગલકીશાર, દેહના દથા ગર્ભ વાસરીલુ; જોયા શ્રી રૂકી-  
દી વહુલુના કંપ, ઉર ઉપર અની ભરોલુ. ૫ જોયા શ્રી  
પદમાતો વહુલુના કંપ તે દીકે મારાં મન ફરે લ; માર  
માયુ આપોને માહારા નાથ, મનગતણાં કરેજ સરેલુ ૬  
સદા શ્રી ગોડુણ માહારા નાસ, પ્રભુની છાંની માહારે મન

( ૬૫ )

કારીજ, અલોહારી તે ભાગવતાસ, એ લીલા અ ૧૬૨ અ  
૧૬૩. ૭

ધો. ૮૧ ૮૮

ઉભા રહ્ણે તો કહુ એક વાતડી, શ્રીનાથજીં તાપ ગઈ  
ગાળી છે સંતો જાતડી શ્રીનાથજીં ૧ તે દીવશે ભગવાન  
હતા વ દ્રાવતમાં શ્રીનાથજીં ૨ તે દીવશની તાલવેણી તન  
માં શ્રીનાથજીં ૩ શ્રીનાથજીં નેયાના મને ડેડરે, શ્રીનાથ  
જીં ૪ પૂરી ભારા મન કેરે આશરે શ્રીનાથજીં ૫ હસોંછો  
મધુર વાંકુ લોઈને, શ્રી નાથજીં ૬ ક્ષુણુ ક્ષુણુ ભજુકારા  
વાગે કાનમાં, ધરેમાં જાડ ને ગાઉ તાનમાં, શ્રીનાથજીં ૭  
ચિન ચાટું વથી ધર કામમાં, શ્રીનાથજીં ૮ બેનો બેનીકે-  
હુ છે ગોકુળ ગામમાં. શ્રીનાથજીં ૯ કેહેનારા ના કેહુ છે  
પાવ માથે છે; ધણી, શ્રીનાથજીં ૧૦ પૂરી ભાહારા મન કેરી  
આશરે, શ્રીનાથજીં ૧૧ રંધે આવ્યો છું તમ દાસરે. શ્રી  
નાથજીં ૧૨ લવોભવ પાર ઉતારીએ. શ્રીનાથજીં ૧૩ અલો-  
હારી જય ભાગવતાસરે. શ્રીનાથજીં ૧૪

ધો. ૮૧ ૮૯

સરદ્દૂનમની રાત જોઈ વાહાસે રનવા કીદું મનરે,  
વન કુનાં તે લીલા શકતે તે મન ચંદ્ર જતન; હસુ રસ  
માતારે. ૧ વેણુ વળ ઢા ચિત્ત હરથું, પ્રગઠથું અંગે અ-  
નંબરે; સાંભળતાં ગોપીજન આવ્યાં, કશ જમીએ સંગે હણ-  
દી. ૨ વેણું સાંભળીને હોહેણું સુકૃષું, હોહંતા વાસણરે;  
ઘીર ચડાવી તેમજ મુકી, વાહાદા પાસે મન હણી. ૩  
તાતાં ફુધ જમાનાં, પતી શેવા જોજનરે; લેસુનતાં સાચન

આંત્રાં, નિષ્ઠ તે આખરી હશી. ૪ પતીયાનાં રોકચાં ન  
 રહ્યાં, આત્મા હશી રસ માનરે; ડેટલાએક પતીયે રોકચાં,  
 માધવ અરણે ચિત્ત લગ્ન હશી. ૫ સહૃદ્યું આગળ તે જઈ  
 પોઢ્યાના, સચુંગું મુકી તનરે; ત્યારે રાણ એ પુછ્યું; એ કેમ  
 પાચે જન હશી. ૬ શુદ્ધ ત્યારે ઓમ ઓચરચા. પેહેલું ક-  
 કું તે સતરે દૂધ ભાવે રથશુપાળ ઓચારચો, એતો ભીયા  
 જીગત હશી. ૭ વરજ રલાં આખ્યાં જાણ્યાને, પ્રભુજીએ  
 કથ્ય વચનરે; આખ્યાં તેતો સાડ કર્યાં, કરણ કરે પ્રસ્તન  
 હજ. ૮ રલાની એવી જંતુ ભવંડર, દમાણાં જાગ્રો ઘેરરે;  
 માન ભીતાને પૂત્ર ભાંડિં, શુંકે તેણુંના ગેર હશી. ૯ વન  
 હિંદું અંદ્ર કર્યું શાલે, કાળાંદ્રી નળ લેમરે; ઘેર જઈ પ-  
 તી શ્રવા કરો, પાણો ભાળક જ્યેમ હશી. ૧૦ ને માહરે  
 એમ આખ્યાંછ, તોએ તે પણ જેણુરે; પતીને મુકીને આ  
 વ્યાં, પતીવરના ધરણ ઓચ્ચું હશી. ૧૧ ધરડા સુરખ રોગી  
 હેવા, તોય પતી નવ તજાએરે; નિદ્રા આવેસરવે જીવે,  
 તેથી અન્ય નવ ભજુંનો હશી. ૧૨ અગણ કીરતન ધ્યાને  
 આવું, એમ નહીં ડાંદ ઘેરેલાંને; એવાં વચન સાંભળી  
 ગોપી, વિભગ ધ્યાં સંત ઘેરેલાં હશી. ૧૩ મુખની ચુંચી  
 બાદર સુકે, શાક કર્યું નિસાસેરે; નઈંછે ભામા લખીને  
 માગો, અવસ્થ વીમળ વીમારો હશી. ૧૪ પ્રભુજીએ દાન  
 કરી મન નેંયું, એમ કર્ણ શું વાહરે; નહણે આસુ કેરેલી  
 લીદું, શ્રાદ્ધાં ગદ ગદ કરે હશી. ૧૫ ન સુકાય તે સુકી  
 ઓખ્યાં, એવું કહેલું નવ ધરેરે; ને "ધીયું" કર્યું તે જાણ્યાં,  
 ધરણ કાળથી પ્રગરે હશી. ૧૬ ધરમ ઇપ કરીતમનો જાણ્યાં,  
 તમ ભલે સહુ વિભશેરે; મુકી નિત્ય અનિત્ય શું કર્યાએ,  
 અતુર થઈ ઓળખશા હશી. ૧૭ ધણું દિવસના તાપકુ-

તાપ તે, તમો વીના કોણ સમાવેરે; કો કોહેશ ને છુંન  
માણું, કોહો કથમ ધેર જવાપ; હશી. ૧૮. ચિત છું ને  
કામ નવ સુને, જ્યાં ચાસો ત્યાં ન છુંઓરે; અધરાજીન કરી  
વરહે સગાવો. વરહે અનિન નવ અગાંઘે. હશી. ૧૯. નહીં  
સમી તો પદ્ધતી યાશા, થરાણ તમારાં સોધાએરે; અરણ ૧ -  
નાને દુર્લભછેરે, તે જોઈ સરકારું હેડાંગો. હશી. ૨૦ વૃ-  
ક્ષ સમક્ષ લક્ષ્મી રાને છે, તોએ પદરજ છાંછેરે; સમ-  
રથ વાણું તમ દીઠા મારો, દાઢી કેરા સહુ પછે. હશી. ૨૧  
૨૧ અલકાવૃત શ્રી સુખ અવિલોક તે, થઈ અપ્રયર આ-  
જરે; વેણું જ્યાન સાંભળતાં મોહી, નૈલોક જુવતી સંમાજ.  
હશી. ૨૨ ગોદ્દીન વૃદ્ધ પુલકીત યથાં, ખીજની શી વાતરે;  
સ્તન મુસ્તક ડર પાંક ધરે, આરત મીટો ગાત. હશી. ૨૩  
નેદ વચ્ચન સાંભળતાં પ્રભુ, ગોપી સંગે રમણ કરચાં, ઉ-  
ડાયાને વચે ચંદ્ર નેમ લેમ ગોપી પ્રભુ હરચાં. ૨૪ સ-  
તનાં જુથ મળીને ગાંઘે, વરજમાં કરેવા લાગ્યારે; જુમનાં  
પુલીને મળી સહુ આધ્યાં, કેવળ રસમાં પણગાં. હશી. ૨૫  
સ્ત્રીમાં અધિક કોણ અમ વિના, એમ કરું મદ મનરે;  
પ્રભુજીએ જાણી મનની વારતા, ત્યાં થયા અંતર ધ્યાન.  
હશી. ૨૬ ઓ વલલ શો વિઠલ પ્રભુજીની, કુપાથી ગાય  
એમરે; તમ નીજ દ્વારકેશ ઉર લાવે, લીજા વરણુવી પ્રેમ.  
હરીરસ માતારે. ૨૭ સરદપૂનમણી રોાં જોઈ, પાહાસે રમજા  
ડીધું મનરે.

### ધોણ ૬૦

પંચકી રાગ અરણી.

તમે છચાંદાં ગયા વનમા જીરે ગીરધર સામળીએ, ૨૫.

વરેજ ભક્તે અંતરે હેત જાળુને કલેશ ચિત્તને ડીધુરે,  
 દાસ્ય વિલાશ વિદાર જોઈ જોઈ મન હરીને લીધુરે. ગી-  
 રધર. ૧ હું ધૂં કરેન તમેછો ઠસન, કહે સાડુ તમને ધ્યાં;  
 વન નવ જોને જિચે ગાય, અહોચાં છે કે નથીરે, ગી-  
 રધર. ૨ અવસ્થને જઈને પુછું, નાંદ સો વન કઈ દીઠા;  
 કુર્ઝાદીકને ત્યમ પુછું, ઓમ ગયા છે આઠારે, ગીરધર  
 ઉહે તુણથી હતીયરણ પ્રિય છે' અનીસે પ્રભુજી જોપારે;  
 હું જાય મલીડા માનતી, તથ છોટે રસ માદ્ધારે, ગીરધર.  
 ૪ હે રસાળ દપગારીછો, પમનાં ઉપકરે વસીપારે; હે ધ-  
 રધૂની તમો તાં માઠા છોા, ઓમ ગયા છે રથીયા. ગી-  
 રધર. ૫ હે મગપત્ની દીઠા પ્રભુજી, ખાશી સ ગે રસ મી-  
 હુરે; કંદ્રાપ રાગે હે તરે સંરવે. નમન તમાં દીહુ. ગીરધર.  
 ૬ હે વેલડીઓ પ્રભુજી જોયા, હીસોછો. રસ ભીમારે;  
 ઉનમતે પુછું સરવને, કરીએ પ્રભુજીની લીલા. ગીરધર. ૭  
 ઓક પુલા ધ્ય કામ, એક ક્ષતન દીહુ તે શતેર; રાકડા  
 અરણ ગાડુ. રીગણુ કીધુ શીતે, ગીરધર, ૮ એક રામ-  
 ગોપી, બગાસુર ઘક મારચોરે; ગાય દુરી સુખ વંધું ન-  
 જાડા, તેડા વદન નિહાળો. ગીરધર. ૯ એક ખાડુ ઘ-  
 ધપર રાખી, કથ લીલા ગતે જોએરે; એક એક રેતાન  
 ઊંચો કરી, વરખા જેમના ખુલે. ગીરધર. ૧૦ એક ચ-  
 રણ તે મુશ્તગ મુકી, કહુ કુટ ખલભી ચોરે; દાવાનળ  
 નું પાન કરુછુ વેહેલાં આંખો મીઠીરે, ગીરધર. ૧૧ એક  
 પૂપપમાળથો બાંધ્યાં, એક હૃતન અનુભળ ભોતાચાં; એ  
 લીલા કરી વન વન ચાદ્યાં, દીઠા તે પદમાં. ગોરધર ૧૨  
 નંદસો વનના હે પદ નિસ્ચે, ખજ અંકુશપદ લૈખારે;  
 પાણ જોડે ચંણ વિલાદિત, મન વિમાસી રહ્યારે. ગી-

૨૪ર. ૧૩ હે લોતુ ૫૬ જુઓ કેહુતાં, જ્વામ હેઠળી હે-  
શી; જુઓ એનું ભાગ સહું કહીઓ, એમ મુકી બીજ  
સ્ત્રીને. ગીરધર. ૧૪ અરણુરણની સુતીથું કરીએ, અસા  
કષ્ટ અહનિથ લાચે; ને ૫૬ લોખા તે ના દીડા, ભાણું  
અને નાચેર. ગીરધર ૧૫ પૂષપ વચે થયું આ હાજે, ૫૬  
મુદ્ધાં દૂખજ્યાં; એછાં પૂષપ કેદમાં યુધાં, જ્યશી નિ-  
શે થયારે ગોરધર. ૧૩ આત અમારાં મરે માણા કરે  
તે લેતાં દીનતા લોઈએર; અમો જરવને વા મુકીને,  
એન ભજતા છોઈએર. ગોરધર. ૧૭ સુખ જરવેમાં હું  
છુ જાણું, માન કરું તે શુંતે; મુજલ્યી હું ચલાએ નાણ  
યાથો તે ૫૮ મીતેર. ગોરધર. ૧૮ સુધ ચડો કલું ક-  
સન, વિશ્રી તેમ ન જાણુંરે; ત્યાં થયા અંતર હેત વાણ-  
લાળ, વળી વળી વિશ્રાપ વાણુંરે ગોરધર, ૧૯ લેતાં  
જરવે, હે પણું કુઝ લગુંનાર. એના મુખનાં વચન સા-  
ભળી, વિરમે થઈ સહુ રહ્યારે. ગોરધર. ૨૦ ચંદ્ર પ્રકાશ  
ગયાતાં શાલી, તમ લોઈ પાણા કર્યોં; લગવદ યુણ અ-  
લાપે પ્રભૂના, ગાઈ ગાઈ ધર નિસરીએં. ગીરધર. ૨૧ જુ-  
સના પૂણીન ભગી સહુ આવ્યાં, કામ ગવા પિત લૈએ;  
દ્વારકેશની અનુચ્ચર જાણી, કાપા કટાક્ષ કર્યારે, ગોરધર  
સાગળીએં. ૨૨ તમે કચાંદાં ગયા વનમાળીરે.

### ઘોણ છ્ય

પંચધી પદ ઉ જું લલીત છાંદ.

વરજ અતિ શાભીયું, ન.મ તવ કરી, રમા શાભીયું હોએ  
મળયા હૃ. ૧ વિરમે જગ પકી મત્સુ રાષ્ય, નીરધરે

કરી ગોહ જાળીયું. ૨ આનંદ ગોપિકા અખિલ જીવને,  
 ઘણ પ્રાર્થના, જાદ્વ કુળે થયું. ૩ સ સાર ભય થકી, અ-  
 રાગ શરોગ છુ, લક્ષ્મી કર અદ્વો, તજ કર ધરો. ૪ શી  
 ડાર તો થશે મુખ દેખાડીયું. સરવ ભક્તાં ગવે તે હ-  
 રયું. ૫ પ્રશ્નિત જીવનું પાપ છેદ્વં અરાગ કબગાચી, કામ  
 લેદ્વં ૬ મધ્યા વાણીએ, આનંદ ને થયું. એવા ભક્તાં  
 ને અન્ન પાખવું. ૭ તન કથાનત હી ટૃપ જીવને, અ-  
 વણ મંગળે દુઃખ તે ગયું. ૮ હાર્ય વખાણું વેરદે દ્વા-  
 નથી, રહે છોડાને સ્વિત આભીયું. ૯ ગાય ભારતાં વરણ  
 ધારીયું, લદ્ધાતી ન્રાગશાલ ચિત રેખીયું. ૧૦ ગોપ આ  
 અવાસમે, વદન ગૈર ને, જોઈ પાંચ રવરે, પ્રગટ તે થયું.  
 ૧૧ મન પાભીયું રમાએ રચ્યું, ધરચા જુખણે એહાજ થયું.  
 ૧૨ વેણું નાદથો શાક નાચીયું, અન્ય ન મન ન જોઈ અ-  
 ધ્ય પાવવું. ૧૩ અમણ અન્ય કરો નિમિય જીવ થયું,  
 વદન હૃદાતાં પલક દુઃખ ગયું. ૧૪ સરવ સુકીને સમિપ  
 આભીએંબાં, જ્યાન સાંભળી કલ્યા કચાં ગયાં, ૧૫ અતિ ઉ-  
 દારછો છંદ્ર રાખવું, તે જોઈ વામાનું મન મેલ્યું. ૧૬ સ-  
 રવ નાકતાં વ્યક્ત રૂપછો, સરવ રહેનું કયણ તાગીયું. ૧૭  
 અન્ય અમણ પુભાશગ ઝુચીયું, તજ રહે પદ ધરો કલ્યું  
 માનવું. ૧૮ જુગલ અરણની રેણું આપવું, દાસનો દાસ  
 દારકેશ જાગું ૧૯ વરણ અતિ શાલીયું.

### ધોળ છદ.

પાંચથી ૫૬ ૪ થુ.

રારવ ગાઢને રહ્યા, પ્રભુજીને આચારાં એમ, શુરેષરે કરી  
 દૂદન કીદુઃ; દુઃખ મનમાં દાન, કરીએ પ્રાણ નિદ્યની

વેદ્ય. ૧ પ્રગટચા ત્યાંથી કસણજુ, સુખ સદન સુખારવિંદ  
 પીતાંખર અરુદરો માળાઃ એહ ગોકુળયંદ કહીએ. ૨ જા-  
 રવ ઉલા થયા ગોપી; કરી દ્રષ્ટ પ્રશન; પ્ર.જી આંદ્યા;  
 હાથ પગથી, થયા ઉલા મન કહીએ. ૩ કેટલા અંજુલી  
 કરી કી, અજ્ઞાં વેદ પ્રસન, યદન મરચિન ખાડુ લેધને  
 ઘર સંગ અંશ, કહીએ. ૪ કેટલા અંજુલી કરીને, અ-  
 ખો છે તંબોલ; એક દસસરોજ લાડુ ધરુ અસુદ્ય ક-  
 હીએ. ૫ તેટાં લકુઠી કુઠીલ રાખી, પ્રેમનો આ વેદ;  
 વચ્ચ દ્રષ્ટ કરીને લેખું, રંસ ભરચા આવેશ કહીએ. ૬  
 એક દ્રષ્ટ ટીક લોઈ રહચા, સુખ પાનથી ન અધાય; નૈન  
 ઢૂરો રહ લાણી, ન મેદ્ય ન લીધાય. કહીએ. ૭ તાં કરી  
 લોઈ લેધ પ્રસુજ આનંદીએ; ક્રેણ તાપ સંગાય; વરણ  
 ભક્ત હુરો સરળતી છે, તે અંબિક શાલા થાય. કહીએ.  
 ૮ ડાળીદ્રો સાડુ પુલીન આંદ્યા, હરાય મનમાં અપાર; એક  
 કુરણે નિશા નિશા નિરભન વળી માની સમાર. કહીએ  
 હુદ્ધાહે કરી મતિ નામનો ર્યા જ્યમ પૂરમાં કામ; ઉન્ન  
 વખ્ય કુમ કુમ અંકીત, પાયરચા તે ઢામ. કહીએ. ૧૦  
 તાં ખીરાણ્યા પ્રાણ નિધિ, ગોપી સ્વામ સ્વપ્ન, રાખ્ય  
 હશ્ચ અનંગ દીપન; રમરણ ગોચરી દ્રષ્ટ. કહીએ ૧૧ બાંન  
 તહેન લને લે કોઈ આપ આપણે અર્થ, નિપ્ર લેંગે અ-  
 ને છે, તે જાણને જુગસ કહીએ. ૧૨ એક લેંગી કાદ  
 પૂરણ સુદુ ગુરુ હોણાએ; ચ.ર જાણતી એક રીત છે, કહું  
 છે ગોચરી કહીએ. ૧૪ અચા તો ભજતાં નથી, તે ખાણ  
 છુટી જાપ, દ્રષ્ટ પામા જાપ ત્યાર, અંધોડ તનમાં થાય,  
 કહીએ ૧૫ અચા ભજત પરોણ કીધુ, જાણણે એ સત;  
 તેમ ભજતું શું કંદુ, કેદતાં ન આવ કો કહીએ, ૧૬

શીરણ કાળનું આખુષ બેઘને, ઓચીંગળ ડેમ થાડે; ૬-  
રેશ ફેલેછે છ'િપર, નિરંતર ઘલણા કહીએ પ્રાણનિધ  
ની વેદ્યા,

### ધોળ છે

પંચવી પદ પ સું રાગ ગરાવી;

વાહાલા તારાં વચ્ચા માંભળીને હંઘ્યા; વાહાલા તારાં  
નિરહ તાપ કરાયા; વાહાલા તાર જવાં આનંદ પર-  
ખ્યા, રાસ રમીશું શી ગોકુળયદ્દર્શને લોલ, ૧ વાહાલા  
રાસ આરંભણ કીંદુ, વહાલા ટૂં મેં ગળી સીંદુ; વા-  
હાલા બાડુ પરસ્પર લીંદુ, રાસ; ૨ વાહાલા ઉછવ રાસ  
આમુખ્ય, વાહાલા અનેક મંડળી ગોળ; વાહાલા કુદ્રાન  
આહે તે સોળ રાસ. ૩ વાહાલા દેવ શ્રી દરશાયાં; વા-  
હાલા વેમાન અહુ આવ્યા; વાહાલા સંગે શાન કાહાળાં  
રાસ. ૪ વાહાલા હેવ દુદંભી વાને, વાહાલા ગાંધરવ  
આનંદ રાને; વાહાના પૂર્વ્ય વરશદી કરી સાને, રાસ; ૫  
વાહાલા નેપૂડ કંકણી વાને; વાહાલા પાહેમાં મદ્દા મ-  
ણી રાને; બાંલા રાહાના રાસ મંડળી રસ સાને રાસ  
૬ વાહાલા શ્રમ કણુ સુખપર અલંક, વાહાના જુવીલાસ  
જુની લખંકે; વાહાલા બલીત મેધ જળ અણકે, રાસ, ૭  
વાહાલા જાંચે સ્વર તે ગાય, વાહાલા રાગ રંગ લાંદાં યાય;  
વાહાલા ને રસનું શું કેહેતાય, રાસ. ૮ વાહાલા આધિક  
સરવકે નિરાખી, વાહાના ઇક કેહેણાં દુરાખી; વાહાલા સંગ  
સાખી સહુ સરાખી, રાસ. ૯ વાહાલાને રાસ અનિત કોઈ  
કહીએ, વાહાનાને બાડુ કંઠ કર ચહીએ; વાહાલાને મળી  
અમી લિકા લહીએ, રાસ, ૧૦ વાહાલા મંદન લુજને દાઢુ

वाहाला अति शुभाश मन लीडु; वाहाला पूजकीन सुअन  
 कीडु, रास. ११ वाहाला नित्ये विष्णुन राश, वाहाला  
 सुअ कपोग ४२ परसेः वाहाला भरवित जिंकु दरसे, रास.  
 रास, १२ वाहाला नृत ग्यान मन डरयुं, वाहाला नेपूर  
 दिंकंजी रमीयुं; वाहाला हरेन इहेपर करेयुं रास. १३  
 वाहाला एकल पामां गोपी वाहाला कंठ घाडु आरपी  
 वाहाला २० ग रेली मन सोपी, रास. १४ वाहाला करोगु क  
 मण भीराने, वाहाला द्रूम अलक मुअ भाने; वाहाला  
 अमर रस गुण जाने, रास. १५ वाहाला मांग माती के  
 ली, वाहाला तेम गोपी २० ग रेली; वाहाला कांधिक दरपाण  
 एनी, रास. १६ वाहाला व्याकुण रस आनंद, वाहा-  
 ला कुरेतां न आवे छंद; वाहाला ए वंद्रान अंद,  
 रास. १७ वाहाला एचर खी रस लोयुं, वाहाला डान  
 द्रष्ट मन भाईू; वाहाला वरदाने रस सोत्यु, रास. १८  
 वाहाला अती वीरवथो आंणो, वाहाला प्रेम अमर्गत  
 सुअ जागो; वाहाला पूछ न कीडुं पाण्ये, रास. १९ वा-  
 हाला स्पर्शे आनंद थागे, वाहाला लीला थक्त ते गवाचे;  
 वाहाला अनन्त दृष्ट जोगाचे, रास. २० वाहाला आना स  
 द्वे जागो, वाहाला किंडा कृष्णे वर्जाणोः वाहाला जण प्रवेश म  
 न आणो. रास. २१ वाहाला जणकिंडानी गीत, वाहाला कुडे  
 न आवे प्रोत; वाहाला परदपर थक्त गृत, रास. २२ वाहाला  
 जणथी गमन कर्यु, वाहाला पूष्पीत वन संपर्दु; वाहाला तेजेऽ  
 मन डर्यु, रास. २३ वाहाला नवरंग नाटक साने, वाहाला  
 अंद नीशा अती राने; वाहाला मदन ज्ञेधने लाने,  
 रास. २४ वाहाला राजमे पुछयु एम, वाहाला ध  
 रम शांते ते तेम; वाहाला अधरम प्रवेश ते डम, रास.

૨૫ વાહાલા ધરેમ ચાલ્ય કરી સ્પાષ્ટો, વાહાલા ઘડકતા કરે-  
નાં રાખો; વાહાલા પરદારાંકેમ જાયો, રાસ. ૨૬ વાહાલા  
ચોતે પુરેજ કામ, વાહાલા છરિછિત શુંધુ તેમ; વાહાલા  
અભિપ્રાય હો જોમ, રાસ. ૨૭ વાહાલા શુંધુણુંચે કરો  
દીયાએ, વાહાલા પુરેજ એ અનતાર; વાહાલા અનલ પડે  
સરેન સાર, રાસ. ૨૮ વાહાલા ઈસ્ટર વચ્ચેન પ્રેમાણ,  
વાહાલા આવરણ કરે અણાણો; વાહાલા ખુદ્દ્વાન તે અ-  
ણાણ, રાજ. ૨૯ વાહાલા હણીરમણી ગમ વાખાણો, વા-  
હાલા તવન કરે અણાણો; વાહાલા નેમ હંડું નિય આણ,  
રાસ. ૩૦ વાહાલા ઉચ્ચિન કરે વાચી, વાહાલા ઉચ્ચત વ-  
ગર સુદ્ધાણી; વાહાલા નિઃહાણું જાણી, રાસ. ૩૧ વા-  
હાલા એવું કરે પ્રાણે, વાહાલા છસ્તર કર્ય સહુ જાયે;  
વાહાલા ભડકત મનોરથ આપે, રાસ. ૩૨ વાહાલા લેણી  
પદ રાજ માણે, વાહાલા ખુલ્લાદિક અનુંદાણે; વાહાલા કરમ  
અન્ય શું લાગે, રાસ. ૩૩ વાહાના ગુલાંણી પ્રીત જાણો,  
વાહાલા અંતરણલ્લી માણો; વાહાલા બાંન કુફરેમ વ-  
આણો, રાસ૦ ૩૪ વાહાલા મનુસ્ય દેહ ધર, વાહાલા તે  
કીડા જાયરૂઃ વાહાના ચુણું આપ લક્ષિત પર, રાસ૦ ૩૫  
વાહાલા ગોપ મન ઘાંઢ નાંયું, વાહાના ચોગ માણા કરી છા-  
ક. વાહાલા પાસે દારા દેખાયું, રાસ૦ ૩૬ વાહાલા અદ્ભુ-  
તાની તે જાણો, વાહાના તોંચે નમ ન માણી; વાહાલા  
કેર ગયાં સહુ રાણી, રાસ૦ ૩૭ વાહાલા જે લીલા ને ગા-  
દે, વાહાલા અગણ ઇહે રસ લાણે; વાહાલા લક્ષિત માણા  
કરી પાયે, રાસ૦ ૩૮ વાહાના ધન્ય વરજયંતી ગોપી, વાહા-  
લા મન કરી સરવ સોણી; વાહાલા ધન્ય જમુનાં રસ ગો-  
પી, રાસ. ૩૯ વાહાલા શ્રીમદ વલભ અરણે, વાહાલા શી

વિદુલેશને વરણે; વાહાલા દ્વારકેશ એ શરણે, રાસ રમીશુ  
શ્રી ગોડુળ ચંદ્રશુર લોલ. ૪૦

### ધોળ ૬૪

( ૫ અદ્વિતીય ૫૬ ૯ રાગ ગરેઠી. )

૧ સરખી સાહેલી સહુ મસીને, નવ સત આખણ સજ-  
આરં; સાન કરુને વાહાલાને તેડો, લટકે ગરણે રમીશુ  
માલો જોઈએ. ૧ દ્વારા સ્થાભને મદ્દ્ય અસારી, તાળી  
વાહે હાથેરે; નિરાપતાં વાહાલે શુગીછ, જુવે કંયાકુ સા  
થે, ચાલો. ૨ જા સ્તર એકાસમુ રચનાં, આમ તેણુને એ  
હોરે; રાગછુએ. છત્રીસે ભેગવી, ગાઓ પ્રમાણ ભેદે. ચા  
લો. ૩ આગદારને દુર પતા રસ, સંગીત નૃત્ય ગતી લીનેરે  
મુશક ઈ વાહાલ એ જોયું. અરવે રસમાં લીને, ચાલો. ૪  
શાભળીએ તારે ઉભા થઈને, વેણુંચાઈ કાઢ કીઝુરે; વી-  
નુણ થયાં સાંભળી સરવે, મન આડરશાને લીધું. ચાલો. ૫  
૫ છુડા કેશ સ્વેત અમ શ્રી કર, ભુજ પાંદડા લટકેરે;  
કરણુ પુલ નક અસર દીલાં, કંકણ પોહેંચ્યો મટકે; ચા-  
લો. ૬ અલ્લાનાંદ થકો ઉગારધાં, ભજનાનાંહે લીધારે; રા-  
સ રમી જગ હીડા કોધી, સરવ સતીરથ સીધાં; ચાલો. ૭  
૭ અલ્લાનીક સનકાદીક સંકર, ચઠી દૈમાને જોયે; ગુણુ ગાં  
ધરેન અપસરા કાંનર, પુસ્પ વાટિ ત્યાં હોએ. ચાલો. ૮  
ધત્ય વીદ્યુતાની પેરે સહુને દરશન, એણું શીતે અલ્લ રા-  
ત્રોને લેણે કોધુ, એણું પેરે સરવે જુનો. ચાલો. ૯ ધત્ય  
ગોપી વરજ શ્રી ગુમનાં નથ, જ્યાં છુકે રસ પાખર; ઓ  
વલભને અરણુ પ્રતાપે, દ્વારકેશ નીજ ગાએ. ચાલો. ૧૦

( ૧૦૬ )

## શ્રી ૮૫

અથ શ્રી પંચકી ૭

દી સરદી રાત સોહામણીને, વાહાલે રાત રમતાની છુણા કરી ને. ૧ વાહાલે વાણ વગાડી વનમાને, કન્ય પૂરો સખીના કરેણું રદ્યમાને. ૨ નારી અન્ધે સુણી સહુ નીમરચાં ને; કુણની ર્ધ્યાદા વિસરચાં ને. ૩ તેહેને તત્કષણ અહે ડાન ચેલીઓાં ને, અંગે અટપટાં આભુષણ પેહેશુઅાં ને. ૪ એમ આવતાં તે દીડાં સુંદરીને, ત્યારે ગમન વાયક જોદ્યા હશીને. ૫ તમે થાંને તે આવ્યાં સાડ અળો ને, તમો કુળવંત ડાહાવો ડામની ને. ૬ એમ સોડમાં તે કાંધન લાગશે ને, તમારે પતીવૃત્તા ધર્મ લાગશે ને. ૭ પતીવૃત્તા પતીને છોડે નહીને, પર પુરુષ શુભિત નાડે નહીને. ૮ ઓદન જોહનજી રૂપે ધર્મને, એ પાસે તે સોડાચે ડામની ને. ૯ ગંધ રાને ઓ ગી રધર રાજુઅાં ને, પ્રભુ સાતે રવરૂપ "ારાજુઅાં ને. ૧૦ પ્રભુ સાતે રવરૂપ લીલા કરે ને, ઓછી પેરે તે વરજમાં વિચારે ને. ૧૧ ત્યારે શુદ્ધશુને અલિમાન આવીયું ને, ભાગ પોતાનું સરાવીયું ને. ૧૨ ત્યારે અંતર ધ્યાન હુઅા હશીને, ધરો. વિલાપ કરેછે શુંદરીને. ૧૩ ઓ જુમનાજી પુલીન આશી રહ્યાં ને, ત્યારે નાયજીને મન કરેણું આવી ને. ૧૪ ઓ ગોકુળચંદ્ર માજી રૂપે ધર્મને ત્યારે શુંદરીને દરેશન આપ્યા હશીને. ૧૫ દ્વારકેશ પ્રભુન જરૂર વારણે ને, ઇશી વરજ પ્રગટ્યા હમ ડારણુને. ૧૬

(૧૦૭)

### ધોણ છુટ

માહારા વાહાલાના ભનમાંથ, વાગે ઇડી વાંસલડી; હું  
તા બેણેલી રૂં ધરમાંથ, કોણે દીધી સાંકલડી. ૧ કુંલ  
વિના જળ ભરવા ચાની, શીરપર મહેલી ઉઠાણીરે; ગાંધી-  
છુટે કેદ જળ ગળવારે બેઠી, કુંલની શુદ્ધ પુષ્પ જુની-  
વાગે. ૨ ગુણીયા વના ગડુ હાવારે બેઠી, સાડી લીજાઈ  
નવ જાણીરે; વાછું વાળનાં ગો રીધુરે, ખાળક બાંધ્યાં તા-  
છુરે. વાગે ૩ ધી તાલીને છાસમાં રેઝ્યાં, ને દુધમાં રે-  
ઝ્યાં પાણીરે; નેતર લઈને નાવનીયા બાંધ્યો, ધરને ધખ્યી  
નવ જાપ્યોરે. વાગે. ૪ પાત્ર વિના મે ભાજન પીરસ્પાં  
માદક મરચ્યાં લેણીરે; સાકર વડાનાં થાક વધારચાં, શે-  
સુંદ લેણીરે. વાગે. ૫ સાસુ ડહે વહુને વઈતર વળગ્યાં,  
અવચળિયા ઉતરાવેરે, દીવર કહે ભાજાઈને બાંધ્યી, સાન  
કરુ સમલયોરે. વાગે. ૬ તનમન માહારા પ્રાણ હર્ષીરે,  
માહારો વાહ લોજ મધુરાં જાપરે; રામકલસ મજુઓ રસ  
પીતાં, વારે વારે સમજાવુરે. વાગે ઇડી વાંસલડી. ૭

### ધોણ છુટ

અથ શ્રી વિઠલનાયજી માહારાજનું ધોણ. ૧

માગશર વદી અતુરાસ્યી સાહેલીરે. શુલ વેળા શુલવારે;  
શ્રી વિઠલવર જુનાન પ્રગટ્યાં સાહેલીરે. ૧ ધ-ય ધન્ય માત  
ચારોમતી સાહેલીરે, પુરુષેતમ અવતાર; શ્રી વિઠલ. ૨ ધર  
દેર પેહેણી વધામણી સાહેલીરે, હરખ્યા છે વસા તાત.  
શ્રી વિઠલ. ૪ તોરણું બાંધ્યાં બારછે સાહેલીરે, પેર પેર

ઓછન થાપ. શ્રી વિઠલ. ૪ ધન્ય ધન્ય એ ડાંકડાલી એ  
સાહેલીરે. માનુની અગળ ગાપ. શ્રી વિઠલ. ૫ જાયક સહુ  
ટાણે મજ્યા સાહેલીરે, સુણી અનોપમ વાત. શ્રી વિઠલ. ૬  
વિધશું વેદ સન ન કરે સાહેલીરે, દાન આપે વરજનાથ. શ્રી  
વિઠલ. ૭ થાળ ભરચાં સગ મોતીએ સાહેલીરે, આવાં  
શ્રી વરજની નાર. શ્રી વિઠલ. ૮ વિત્ત વેદ ખુના ઓચરે  
સાહેલીરે, દુષે સહુ આશિસ્પ. શ્રી વિઠલ. ૯ વધાવા આવે  
સહુ લાલને સાહેલીરે, હઢા હરખ ન માય શ્રી વિઠલ. ૧૦  
દાશીજુંએ લીધા ગોદમાં સાહેલીરે, નિરએ સધળો સાથ.  
શ્રી વિઠલ. ૧૧ દેસનાવ ગયા આનંદ શું સાહેલીરે, આજ  
શ્રી નુગદીશ. વિઠલ૦ ૧૨ દેવનાં દુંદળી વાગીયાં સાહેલીરે,  
પૂર્ણની વર્ણી થાપ. શ્રી વિઠલ૦ ૧૩ હૈવી જીવને ડારણે  
સાહેલીરે, રૂપી લીધા અવતાર. શ્રી વિઠલ૦ ૧૪ શરણે  
લીધા જીવને સાહેલીરે. લાલાનો નહો પાર શ્રી વિઠલ. ૧૫  
દાસ વલમ જાય વારણે સાહેલીરે. પૂર્ણોત્તમ અવતાર, શ્રી  
વિઠલાર જૂનગ પ્રગટ્યા સાહેલીરી૦ ૧૬

### ધોળ ૬૮

ડોઈ મને કસુન હેખાડોરે શ્રી ગોડુણમાં, ડોઈ મને પ્ર-  
ભૂજ મળાવોરે મહુંતનમાં; મન મતી હેરો તેરો મરમ ન  
ભાણે, વનમાં કુરે વાહાલે તનમાંરે. મહુંવિનમાં. ડોઈ મને  
૧ શકળ ઘના દુંડચા શકળ વરજ ધરચા, અતીરે ઉદાશી  
માહારા તનમાં. મહું ઘનમાં ડોઈ મને૦ ૨ અમર ચીર  
પેહેરચાં મેધા કણર ઓચાં, કુલડાં ઐનનતી ખાગનમાંરે.  
મહું ઘનમાં ડોઈ મને૦ ૩ કાંઠંતા ઓરને હાર માહારા

( ૧૦૬ )

કુટ્ઠા, નિર ભરાંયાં સોચમાંરે. મહુ અનમાં ડોઈ મને ૪  
સુરદાસ કેહે પ્રણુ તીહારે મીલનકું, અતીરે ઉનટ માહારો  
તનમારે મહુ અનમાં, ડોઈ મને રસન દ્વારાડે માગે કુણમાં, ૫

### ધોળ ૯૬

" માહારે મંદીર પધારો શ્રી નાથજી, હુંતો લેઉ તમારી  
વાટ; માહારે મંદીર પધારો શ્રી નાથજી ૧ હુંતો શરી  
વળ વિને સજ કરે, હુંતો પદરાવું લીના પીંગ પારું. મા-  
હારે ૨ હુંતો કંકું કેસરના ગારા ધાલું, હુંતો માદી, કરુણી  
પડાવું ભાત. માહારે ૪ હુંતો ગોખે ગોખે દીવા કરે,  
હુંએ ઘંધાવું હીંચોળાખાડ. માહારે ૫ હુંતો શયગાર સ-  
જૂરે શાલીના, ચરણા ચોળી ગરચોળાંને ધાઠ, માહારે ૦૬  
હુંતો આડ કરુંરે કેસર તથી, હુંતો ચોખળાયા ચોંકું લેજા  
દ. માહારે ૭ હુંતો સુંદીર માણાવુરે સુખડા, જીવણ જ-  
મણા તમારે ડાજ. માહારે ૮ હુંતો પીડાં વાળુરે પાસટ  
પાનનાં, આરોગાવું શ્રી વળભરાય. માહારે ૯ હુંતો ધાણ  
ભ રે સગમાતીએ, વધાવું શ્રી વળભનો પરિવાર. માહા,  
૧૦ ૧૦ હુંતો કરલેડા કરું વિના, બલોહારી જણ મા-  
ધ વદાસ. માહારે મંદીર પધારો શ્રી નાથજી. ૧૧

### ધોળ ૧૦૦

જીરે વદ્ધશક વદી એકાદશરી, શ્રી વળભર પણ ૧૨નાની  
ધરેરે; શ્રી લક્ષ્મિભગુ ધેર સોદ્દેદા, જીરે અલંબાળાએ મન-  
માં વિચારીયુંરે, જીરે સુાતે પદરાવાએ ધરરૈ. શ્રી લક્ષ્મિભગુ  
૨ જીરે અતિકુંડે માગજ આપિયોર, જીરે બેનુ સ્લતે

વહુંછે અથ નિપત્તરે. શ્રી લક્ષ્મણું ૩ જીરે નિજ જન સર્વે  
ઉપારવારે, જીરે લક્ષ્મિનો કૃધી ઉપદેશરે. શ્રી લક્ષ્મણું ૪  
જીરે ઘણ્ઠ સંખ્યા ડ્રાવીયારે, જીરે શ્રી ડ્રાવી પ્રિયરે. શ્રી  
લક્ષ્મણું ૫ જીરે પુરણી મારગની વધી ગતારે, જીરે ડોને  
તે નવ કુહેવાપરે, શ્રી લક્ષ્મણું ૬ જીરે હેવાના કુળમાં શ્રી  
કુરણ પ્રથમારે, જીરે અડણડ શ્રી વલભરાયરે. શ્રી લક્ષ્મણું  
૭ જીરે નિયધન જનને તે એ પ્રજ્ઞારે, જીરે પ્રગટ હેખાડી  
છે. શીતરે, શ્રી લક્ષ્મણું ૮ જીરે એને ડારાખ હી દેહ  
ધરીરે, જીરે તેમાં તે સંશ્યા નહી લમારારે. શ્રી લક્ષ્મણું ૯  
જીરે અધ્યરમ તે જીવ ઓધારવારે, જીરે શ્રી વલભ શ્રી  
વિલસશરે. શ્રી લક્ષ્મણું ૧૦ જીરે એહુના ચરાખ કુમળ  
નિત શ્રાંગરે, જીરે છોડોએ સરુળ કલેશરે. શ્રી લક્ષ્મણું  
જીરે હૃદાસ શાલા પ્રભુ નિરાતારે, જીરે ચરાખ કુમળ  
ધારી ધારે, શ્રી લક્ષ્મણ બેર સાહીલારે. ૧૧

### ધોણી ૧૦૧

અથ શ્રી પૃષ્ઠિ માર્ગના દસ મર્માં ધોણ લખ્યું છે.  
પુષ્ટી માર્ગ તણ્ઠાં મર્મ દસ જાણીને, નિત્ય આચરાખ કરીને  
ઝીહ વિચારે, તે તેહને વશ ધાવરે આહણી પ્રેમની વલડી  
ત્યાંહાં વિમનારે. ૧ પ્રથમ એક મર્મ શ્રી મહાપ્રલુ જાણી  
ને, વિસ્તાર દ્વારા કરી વચ્ચે પાણે; અયર સાધન સર્વલો  
કુડ કામના, એહુની કાંચા વિના કણ ન ભાણે. ૨ આંણે  
મર્મ તે ડેવણ શ્રી જીર, વાડ વિસ્તાર આચરણે કર્યું;  
ને જે વાણી આવલા એયર, તે તે વિચારાને મન ધ  
રયું. ૩ નીંળે મર્મ તે શ્રી કાર્યના નામનો, માહાત્મ હરિદે

ધાર્મ સહિત જારે; અનેક પ્રકારના ધર્મ કો ઉપરે, કોઈમાં  
 અંસે નહિએ ભારે, ૪ ચોણે તે મર્મ વિસ્તાર આછુ ક  
 રી, પ્રભુજી કરેશ તે અતી રૂડુઃ રાધા રમણ શ્રીખિજ ની  
 હારી હરી, ભજન દરજ અન્ય જાણી કુદુ. ૫ અવર લીલા  
 મદુ અનંત રૂપે કરી, અંતરથામક જારે જાણો; ઓહણ  
 શામળો અનંત રૂપે કરી, નિત્ય લીલા પ્રભુ નત્ય માણો.  
 ૬ ખાંચમાં મર્મ શ્રીકલેશ શરણાંગત, બેદ વાદ સર્વ પરિ-  
 ત્યાગ ભાવે; નિર્બેદું ભાવ તે સવરવત્ર પર્દાધીએ, ત્યારે  
 શ્રીકલેશ દ્વારે આવે. ૭ છોટા મંદે મે કુવળ નાથનો,  
 સરવ પરિત્યાગ શુણું જાન કરીએ; જ્યાના દ્વારા કરી સ  
 રવ લીલા ઘરી, આવરજનાયને રૂદે ધરીએ, ૮ સાતમાં  
 મર્મ તે અંતરી લેતા, વસણાતમક વરજ માંહે ઇશીએ;  
 ભાવાતમક ત્યાંહાં નિરૂપે પોતા તથાં, સખી ભાવે યદુ રાહુ  
 વક્ષીએ. ૯ આઠમાં મર્મ તે કિડા રસ ભાજાના, અં-  
 નરમાં અનુભવ કરેલા; જેમ જેમ સખી સંઘ કોડેરે, તેમ  
 તેમ તે આચરણ. ૧૦ નવમાં મર્મ તે દનદિત લલ ભા-  
 વના, તાપ કળેશ રૂદેમાં ભાવે; જે ઇણ દશા વરજ સું-  
 દરી લોગે, ત્યામ ત્યામ એથેને અનુભવ કદાયે. ૧૧  
 દસમાં મર્મ તે ધીનલા ભાવના, સરવ પ્રકાર કરી રૂદે  
 કુદુઃ આણો; અવર સાધન નાણના વાધી છે ધણા, કલે  
 કાપા વિના કાંઈ અનમાને. ૧૨ એ મર્મ દસ જે કોઈ  
 ગાયને અનુભવે, તેણેને શ્રીકલેશ આધીન યાય, શ્રીમહ વ  
 લભનિપત્ર કરેણા કરે, આપણા દામની ખાંસ સાછુ. ૧૩

( ૧૧૨ )

## ધોળ ૧૦૨ ૫૬ ૨

અથવી પૂર્ણ મારગના સિદ્ધાંતનું ધોળ પરિચા  
એકાદશીનું લઘુયું છે.

પૂર્ણ મારગ સિદ્ધાંતની સાંભળો કહું એક વાત, આ-  
વાય સુદી એકાદશી વયત કહુંયાં ને રત. ૧ શ્રીમદ વલલને  
મન મર્યાદા ઉપની એટા, આશા અનુષ્ઠાની પ્રલુદ  
એ કીધી તેણ; પોતાના જી લાખીને, ચિત્તા ધરી મન  
માણ, ઓતુરેતા કીધી ધરી કીજુ પરારચા ત્યાંહ. ૨  
પુરાણ પુરુષોત્તમ તમેણો: જીવણે દાષ સહીત; ઓધારણ  
કારગ પ્રલુદ, કેડલે ધરુ મત ચિન. ૩ ત્યારે કોજુ એમ  
આણીયા, સાંભળો વલલરાય, નામ સમરપણ ને હારે, તે  
હેના પ્રાયસ્થીત જ્ય. ૧૪ જીવ જંત ને કોઈ આવે, પૂ-  
મારે શરેગ; તે ઉપર કરુંગા કરી, રાખીય માહારે અરણ,  
૫ પરિચન કરીને સુચતું, પહેરાયું કીજુગદીથ; કેશરી રંગે  
રંગીયું, તાર ત્રાણસેહને ત્રાણવીથ. ૬ મીશ્રી નોગ ધરાવી  
ઓ, વઢુ ધરે તાડકાણ, કોર છેડા કરી કેશરી, ઘોતી ઉ-  
પરણા સાર. ૭ શ્વરણે સુષ્પ કારણે, કીજુએ કીદો અમ;  
નામ સમરપણું આણીને, રાખ્યો વધુસાવ ધરમ. ૮ આગ્ના  
રીધારીજુ મંદીર પદાર્થીએ, એ સુષ્પ કહુંયાં નવ જ્ય.  
હૃદાસું શોભા લેછને, અનેક માગળ ગાય.

## ધોળ ૧૦૩

ધન્ય શ્રીવલલ અદેલમાં પ્રલુદ વર્ણિયા જુગનાં તીરે,

ધન્ય વહીસતા જન વહે એ પદ રજને વરેણી તીરે. ધન્ય  
જુમનાજુનો સંગમછે. હેઠા લેણેર રંગ તેરાગ છે; પાવા  
થાપ રથાતર જંગમ છે. ધન્ય. ૨ ધન્ય પ્રયાગ વાણીનિ.  
રાખીઓ, ધન્ય તીરથ સધાગાં કરાખીઓ. ધન્ય ઉ વેળી મા  
ધવ સુખપર વાગી, એની છાંની નિરાખી જાતી અણીહાંગી;  
ધન્ય ધન્ય સરેવ જનના સુખકાંગી. ધન્ય ૪ ધન્ય પ્રયાગ  
તારથ રાન્યછે, વરેણી તીરે દરવાલ છે; તેતો સારે સ-  
રનાં કાજ છે. ધન્ય. ૫ ધન્ય દશાસ્મેષ આરે જાતાં;  
ધન્ય નિરમળ ગંગાજુ નાહાતાં; ધન્ય ધન્ય હરંબે હરી  
ગુણ ગાતાં. ધન્ય. ૬ ધન્ય ધન્ય એ માધવટો નાહાતાં,  
ધન્ય નિરમળ તેણુંનાં તન થાતાં; ધન્ય સેહુને તે વહીકુંડ  
જાતાં. ધન્ય. ૭ ધન્ય અડાયેણ રાને છ, ધન્ય પેણી  
તીરે ખુંગ પીરાને છે મધ્ય વરેણી ગાનેછે. ધન્ય. ૮  
નેણે એ બઢકને ભાગ ધરીઆ, ધન્ય ભવસાગર કેરો  
દળીઆ; ધન્ય પ્રેમ સુધારસમાં ભળીઆ. ધન્ય. ૯ ધન્ય  
જુમનાજુમાં વારા છે, ધન્ય વલભ કુળની પાસ છે; ધ-  
ન્ય શાભા જોઈ હરીદાસ છે; ધન્ય શીવભલ અડેલમાં,  
પ્રભુ ગાંગીઆ જુમનાં તારે, ૧.

### ધોળ ૧૦૪.

ધર આવોરે ગોપીયુંના વાહાલા, આનંદ વધારો નન્દ  
ના લાલા: નાથ નથો કાંઈ નાના ડાલા, તો ખ્યાલા પીજ  
પ્રેમનારે. ૧આવો તો અલીધન દીને, પ્રેણ તણું રસ  
પાઈને પીને; દસાલડાને દરમન દીને, તો નિંબુ કેને  
નામનારે. ૨ જન્મેના જન્મના સ્પાન છોં સાંગી, મળે ગો-  
પિયું એકજ રંગી; નાથ તના નહીં પ્રાલ સંગી; તો ૩

(૧૧૪)

હીએ તીલંગી ટેકમારે. ૩ આપ બજે ગોવરધન ધારીએઓ,  
સુરપત્રી કેરો ગરવજ હરીએઓ; વરજવાસીનાં ખારજ સર્વિએાં,  
તો ગોડુણ રાષ્યું રેલતુરે ૪ માડી માહારે એ વર રૂડો,  
નોંઠી નીકથી કંસરાય ચુઠોનો; ન્હાનો એ પરાકમ પુરો;  
તો ચોઢો અવિચળ ચાંદલોરે- ૫ કુમ કુમ કેરા છડુણ  
દ્વારાવો, મહીરે માતીના ચોક પૂરાવો; તથાએ તારણ  
દ્વાર બંધાવો, તો વાહાલાને વધાવો ક્રેમશુરે. ૬ જોણીડા  
તડો જોશ જોવરાવો; ધરાયાં લગ્ન ઠીક ડરાવો; ખાતીલ  
ચુપના ચોપ કરાવો; તો તેજ જઈ સ્વદન દ્ઘનેરે. ૭ ત  
મારા પીગણ લખ્યાં લેઝે, વાહારને બેના ત્રાગ કર્યા ત-  
મારે; પાકે તો ચોહોચે કોડ અમારા, તો કેહે માધ્યદાસ  
કરગર હુંરે.

### ધોણ ૧૦૪

કુમરી.

સુખડાનું માંડણ માતો. માહારાળ માહારા સુખડાનું  
માંડણ માતો, ચેહે જણગુમનાં ભરત ગઈતી; સુખડ  
ધાતાં જોયું માતી, માહારાળ માહારા સુખડાનું માંડણ  
માતી. ૧ ગાગર ભર પનધદપર સુકી, લાગી કુણ માતો  
જોતી જોતી. માહારાળ. ૨ ધર જઉ તો માગુ સાસ  
લડતાં. નાખું બાલે છે જીણાં દેતી. માહારાળ. ૩ પુરવો  
તમ પ્રલુ આએ અચાનક, માતીકુ દાંડુ ધં માહારા ગોતો.  
માહારાળ માહારા સુખડાનું માંડન માતી. ૪

### ધોણ ૧૦૫

કુમરી.

લારેડી ખાજ કાહાના તેણુ નેરા બાસુદીયાં મેરા જીણાંખરા

( १२५ )

धर नहीं धीर. २०. गोकुग वाल बाल, अर  
जुमनांल के तीरि. भराल आरा. १ भार मुगड अकराकत  
कुण, सुंदीर स्याम थरीर. भरा ज्ञारा. २ पूरखोतम  
प्रभुती छापी निरभी। धन्य मनवाइ थरीर. भरा ज्ञारा  
रा. बो रहो बाल काहाना तरो ऐरेन बासुलीयां भरा  
ज्ञारा धर नहीं धीर.

धोण १०७

हुमरी.

सामरो न जने भरो भीर, कनाईया न जने भरी भीर;  
भीर भीर भीर ओलो अरररररर, सामरो न जने भारी  
भीर. १ मे धधी अयन गहती बंद्रायन, सामरो ने अं-  
च्चा भरो भीर; भीर भीर भीर ज्यम कटो ज्य अररर-  
रर, सामरो न जने भारी भीर. २ भेड़ जर जुमना  
भरा गहती, सामरो ने उरा भाषे नीर; नीर नीर नीर  
छटो ज्यम छरररर, सामरो न जने भारी भीर. ३  
बंद्रायनमे रास रथ्यो है हुहिया हमारा ज्ञ; ज्ञ ज्ञ  
ज्ञ ज्ञ चाध्या ज्यम अररररर, सामरो न जने भारी  
भीर, ४ सुरदास प्रभु लीहारे भीलाकु; बंसरुड़ा झेंक्यो  
भाषे तीर, तीर तीर तीर कपी ज्यम घररररर, सामरो  
न जने भारी भीर. कनधओ न जने भारी भीर.

धोण १०८

ज्ञरे कारतु मास वदी अष्टमी, ज्ञरे प्रगट्या ओ  
गीरधरलाल; आनंद मुने अती खण्डो. १ ज्ञरे धोइ भ-  
क्षणरे गाल रहुं, ज्ञरे वाजेछरे नियान; आनंद. २

જુરે ઘેર ઘેર હસ્ત વનમણું, જુરે ઘેર ઘેર ઓછવ આજ  
આનંદ. ૩ જુરે મંગળ રાજ કરો માનની, વરજ નાચી  
વધારા જાપ આનંદ. ૪ જુરે ગોકૃગ ચુંડારે ઉકળે, જુરે  
તરીયા તોરાથું ધારચ. આનંદ. ૫ જુરે દાન આપે કેસરી  
રાપજી, જુરે ગનરથ અશ્વને ગાય. આનંદ. ૬ જુરે ગો-  
કૃળ વામ રણીયામણું, રણીયામણું શ્રીજીનુભનાં તીર. આ-  
નંદ. ૭ જુરે કિડા કરે ગોધરેલલજી, જુરે રણ ગંગા-  
જીના વીર. આનંદ. ૮ જુરે એ પ્રભુને નવ્ય ઓણાયા,  
તેના કુરો પડગો સાંસાર. આનંદ. ૯ જુરે એ પ્રભુને  
નેણે ઓણાયા, તેના ભાગ તાણો નહીં પાર. આનંદ.  
૧૦ જુરે આથ પડી વાહાસે ભક્તતની. ખલાહારી જાપ  
માધવદાસ. આનંદ ગાહારે આરો ધગે.

### ધોળ ૧૦૮

શ્રી વલમી કુળ ભલે પ્રગટીયા, પ્રગટ્યા શ્રી વીઠલનાથરે  
દાસને મનરે આનંદ ધગોરે વેદપુરાણે આ વાતરે ધન્ય  
માતાજી શ્રી અકાળ, નેણે કર શીતાયજી તુલસીબારે.  
કુંક સનકાદાક ગમ નહીં, પ્રગટ્યા શ્રી પૂર્વોતમ આધ્યારે  
૨ ઘેર ઘેર ચુંડા ઉછળે, તારણુ દ્વારે શ્રોહાયરે; પરમપતો  
નાં સુંદરી, હરજીને નિરાયા જાપરે. ૩ સુંદરી સરવ ટોળે  
મળ્યાં, મુખ્ય લંઈ જોઈ માહૂરે. આનંદ સાગર ઉલટચો,  
નીમાવન જ્ય જ્યનાર દેખારે. ૪ વાળુંત્ર વાગે શોલીતા,  
ઘેર ઘેર ઓછવ થાપરે; કુદંભી વાગે દેવતાનાં, શુકળ  
શ્રી ભાગવત ગાયરે. ૫ કેશર કુમ કુમ છાંટણું, દેવની  
આશિષ થાપરે; દાન આપે શ્રી વલમી ધખું, ઉલટ અગ  
ના આપરે, ૬ લક્ષ્મિત ભારગ સ્વિર ક્ષ્યાપવા પરતવની કરેવા

( ૧૧૭ )

સાહરે; આપણને અનુયો કર્યો; લેગી ન જણે એ વાત રહે, ઉભકી કરે આ વિઠલજીની, ખાજુ કોગટ વાત રે; એરે લીના ને કોઈ જાગશે, તે વરજવાળિનો સાધરે. ૮ માગસર વદ્દને નોમી ભલી, ભલી ભલી આજીની વાત રે; ઓ વિઠલનારે ઇદ્ય હુંયા, પ્રગટચા શ્રી પુરણ અલ્લાંદ ધરણ મંગળ હોય ધણાં, આ સુષ્પ અંગે ન આપરે; મીરણ જુઓ માહારો વાનમો, ભલીહારી માધવદાસરે ૧૧ શ્રી વલભ કૃતા બલે પ્રગટચા શ્રી વિઠલનાર્યે.

ધોણ ૧૧૦

સાંભળ સુજની વધામણી, શ્રીગોડુલપતીને દરખાા; પારવતી ભાતાએ સુત જનમીયા; આ દ્વારકા નાથજી અવતાર, પ્રગટચા શ્રી પુરણાતમ લાલજીરે. ૧ વાજુંન વાગે સોહામણૂં, ચુણૂંજન ગાય છે અ.ન.; માયણ જાયક અણ્યા સહુ, તેમને આપ્યાં પાહુ દાન. પ્રગટચા. ૨ ધન્ય ધન્ય વધશાક માસનો, ધન્ય સુદી પડવાનો દીન; ધન્ય ધડી શુભગરનો, હરખ્યાં સરવેનાં મન, પ્રગટચા. ૩ જુથતી જનરે ટોળે મળી. નવ સમ સંજ્યા રણગાર; આદેં પ્રસુને વધાવાને કર ધરો મંગળ ચારો. પ્રગટચા. ૪ કંચાં કુણશ મુરતક સોહીએ, ગાંં મંગળ ગીત; પ્રીતશું પાંદીએં દરખારમાં, જણે આવા રાણાજીન. પ્રગટચા. ૫ લેટ ધરે મન ભાવતી, વળી વળી વારણે જય; એ જણુ ચરણ પરતાપ થી. નિજદાસ આનંદ ચુષ્પ ગાય. પ્રગટચા શ્રી પુરણાતમ લાલજીરે.

ધોણ ૧૧૧

સેનથેરી અમા અનિયજીને અનાં; અમારે અમા ન-

દરાવ સાંજાં; શેના ગોણે અડી નોહાનવારે, અમાં અ-  
મને આશા વાસત ગોરી, અમાં કેસરીઓ બાંધિએ સો-  
હીએરે, અમાં માગે સોછીએ પાંખ ગોરી, અમાં બાંહે  
ખાંગુખાંખ ઘરખારે, અમાં કુણણ અણકે છે ચાર ગોરી  
અમાં ગોરી કુદણ અણકે મારગોરી, અમાં જુમક લટકે  
ચાર ગોરી, અમાં ભોડે લાનનકુ, ખમાં ફુલરા આખવાં  
પોહાચીએરે. અમાં ગળે ગુંજકા હાર ગોરી, અગાં  
ભી અના ડાડાર લેઠાયેરે. અમાં વરજના પ્રાણ આધાર  
ગોરા, અમાં સેન ગોરી અમાશી નાયજીને ખમા.

### ધોણી ૧૧૨

નાગર નદીના લાલ, માહારી ચુંદીના ચોર; ચુંદી  
ચોરી વાહાલો કદમ અડી બોડા, સાસતીયાં સુતાપદે, ફુર  
થકી દીડો, નાગર ૧ કાનડ કાના ભારલી વાળા; મકર  
ધારારે, આધી રાત્ર મધુરાંથી આઓર, કાસ કારણેરે. વાલા  
નાદના, ૨ લાખ ટકેટી ચુંદી, અજખ રડો ૨ ગ, સાંસ  
રે સંતાપણ ભોરો યુડો થશ આગ વલા. નાદ્કુવર સ્યામ  
સુદીર, મદન ભાહનલાલ; નાદ્કે ગીરધર કુજન ભરો નામ,  
વાહાલા વરજનારે ભરો ચુંદીના ચોર. ૪

### ધોણી ૧૧૩.

શી ગોકુળનાયજીના લાલરે, શી પૂરસોતમ બર ૨ ગ ૨-  
શીઆઃ વાહાલો કીદા વઈસનવ ન્યાલરે, જનમ જનમ મારે  
મન વાણીઆ. ૧ એમતું નખ શીખ અદ્ભુત ઝૂપરે, શી  
પૂરશાતમ; વાહાલો આ કાંડરોલીના ભુપરે, જનમી જનમ  
૨ તમારાં સુંદર નેન વિધાણરે, શી પૂરશાતમ; તમી તી

લકુ મુદ્રા ધરેચાં ભાગરે, જનમો જનમ. ૩ શ્રી મુખ એ  
પૂતમ ચંદ્રરે, શ્રી પૂરશાતમ; જોતાં ભાગ્યાં ભવસુખ હુંરે,  
જનમો જનમ. ૪ તમો શ્રી વરનભુગાળુના જ્ઞાતરે, શ્રી  
પૂરશાતમ, તમો સી જુમણાળુના તાતરે; જનમો જનમ  
૫ તમો વરનદોર જેઠીળુના તાતરે, શ્રી પૂરશાતમ, શ્રી  
ચાણામતી વહુળુના નાયરે, જનમો જનમ. ૬ શ્રી પદમા  
વતી વહુળુના કંથરે, શ્રી પૂરશાતમ; સુત શ્રી ગીરધરજી  
ગુજરાતરે, જનમો જનમ. ૭ તમો રાજનમર સુખ આ-  
ખુરી, શ્રી પૂરશાતમ; મહાપણીત વાચણ હુખ કાંધુરે, શ્રી  
જનમો જનમ. ૮ છોટી કાંકડોણી જનમ દીન આધિરે, શ્રી  
પૂરશાતમ; નિવદ્ધાતને શરણે લીધારે, જનમો જનમ મા-  
ણરે મન વસીપારે, ૯

### ધોણ ૧૧૪

આ કળીમાં કારણ એક, અષાઢુર ભારી, શ્રીવલભ  
શ્રી મુખથી પ્રગટીએ અછિ તારી, શ્રીવલભ વંશની કૃપા  
થકી. ૧૨ અષાઢુંક્ષા વરાણસે, શ્રીમુખથી પ્રમટ્યો એ શ્રી  
વલભ; એ વેળાને કરું પ્રણામ, અતટાદેર ભારીર. ૧ આ  
દ્વી લુચપર દ્વા વિચારી, રસ વરસાવા લારીર શ્રીવિદ  
દ પ્રભુલુંણે કૃપા કરુને. અંધ પ્રગટ્યા નજીવારી; અષાઢુર  
ભારી, ૨ અષાદશ કરંપા રલોક પ્રગટ્યા શ્રીવલભરાજ કૃમા  
રરે; આહા ગું રસ પ્રગટ કરેચા, જાગી વાણ સહિત બ  
દીહ. ૨- અષાઢુરભારી. ૩ પ્રથમ રલોકમાં પ્રગટ ણતાણુ,  
શ્રીકલણ ચંદ્રનું હૃપે; કંશ કંશ કંશ નેતી કરુને, સદ્ગ રમ  
રૂપ, આણાદુરભારી. ૪ આનંદને વળી પરમાનંદનું, સુખ  
અષાઢુર માંદયર; નિરસ્યંતતને વળી નિદળ થઈને, જને એ

જે વરેલ્લરાય, અષાક્ષરભારી. ૫ શ્રી માહાપ્રબુજુણ્યે સાત  
ભક્તિના દાન કર્યાં આમંત્રને; માછા અષોર કળી લુધ  
અષાક્ષરના, સાતે ભક્તિનો એ જંત. અષાક્ષરભારી, ૬  
સાત ભક્તિનાં નામ વખાણું, અવગુ વળી કારતનરે, ક્રમ  
રણુને વળી ગ્રનગુ ભક્તિ, પાંચમી છે અરચન. અષાક્ષર  
ભારી. ૭ પાદાંત્રદન વંદન વાસ તાર, એ સરવે મળી  
ને સાતે; માછા પ્રાકુમી સાતો જાળને, એક એક મળી વી  
ક્ષા. અષાક્ષરભારી. ૮ પુષ્પરાશ્રી પ્રહૃતદ શૈવજી, લક્ષ્મી  
મીને પ્રથુરાજરે; હનુમાન અહે સાતે જાળને, એક એક ભ  
ક્તિએ કીચાં ડાન અષાક્ષરભારી. ૯ હેઠા મોદાને ઘડુ  
પરાષ્ટ્રથો, પ્રામ થયું રતનરે; આ દૈવી જીવપર દ્યા વિચા  
રી. અષાક્ષર ધન્ય ધન્ય અષાક્ષરભારી. ૧૦ આ સાતે  
માંથી એક સાધન, આ કળીના લુન શું કરશરે; અષાક્ષ  
ર માછા મન જપ્તાથી ભવસાગર તે તરણે, અષાક્ષરભા  
રી. ૧૧ ને દીવસની શીયુર કુપાથી, અષાક્ષર મળયું દાન  
રે; તે દીવાથી લુન પરિયંત રડું રાખ્યું ધ્યાન અષા  
ક્ષરભારી. ૧૨ ક્ષવાસો સ્વાસને દુરતાં દુરતાં, અષાક્ષર સુખ  
ગાપરે; નિંદ્રા જયગુ રસ્તે ચાન્તાં, અદરમિશ ચાદ્યાં  
નાય. અષાક્ષર ભારી ૧૩ આન દને દળી પરમાનાંતું,  
સુખ મળે સુખ થપરે; માછા અનૌકીક લાલાનો અનુભવ  
કરી લીલામાં નાય. અષાક્ષર ભારી. ૧૪ પ્રશાગ શ્લોક-  
માં ભી વલબ શી વીઠથ, કુચા બહુ ગુણ ક્રાંધરે; નિજ શુ  
દ્ધિને દાન આપીને સાકુલ કામના શીધી, અષાક્ષર ભારી.  
૧૫ "ના સંબાદમાં સંઘ સર્વદા શીકુસું સમરણ કરું;  
જમના દુતનું ફાઈન ચાલે. લશ માન નકી ડરયું અષા  
ક્ષર ભારી. ૧૬ આધાર ભક્તિ અષાક્ષરની, માછા પતક

સહુ નાસેરે; જોખાલણું ખોબળકની હત્યા, તે સહુ ન્ના-  
 સે નાસે, અષ્ટાકોર ભારી. ૧૭ નીજા સ્લેટ્કમાં માહાતમ  
 જાણી, અષ્ટાકોર નીત જપવોરે; જમનાં દુત પડે નડી દ્વ  
 રે એવો અષ્ટાકોર એવાંઘવો. અષ્ટાકોર ભારી. ૧૮ કાગ  
 ડેમ તેણે નહીં ખાવે, ઉલયા અનુકૂળ થાવોરે; માપા મા  
 હુના આપે તેને, જેતેઅસ્ટાકોર નીત ગાય, અષ્ટાકોર ભા  
 રી. ૧૯ અસાનને શ્રીકશ્મિ ભજનથી, અગણ્યુત પાપ સહુ  
 જપોરે; અન્નમેલની વાત વીચારો, માહા પાપી પાવન થા  
 ય, અષ્ટાકોર ભારી. ૨૦ ચેથામાં શ્રી સહીત અષ્ટાકોર  
 વરણું ઓ વીઠસેશરે; નીજ શ્રદ્ધિ ઉપર હેત વિચારી, ગુરુ  
 ઝેપે છણના પણ. અષ્ટાકોર ભારી. ૨૧ નિર પક્ષ વડે નિર  
 ધાર કરીને, પ્રગટ કર્યા માહારાજારે; પાંચમા ઓ મુખ છ  
 છથી, શ્રીવલભે શ્રીધાં કાજ. અષ્ટાકોર ભારી. ૨૨ શ્રી ગી  
 રીરાજ ધરણે ચિંતા મટાવા, માહા મંત્ર પ્રગટાયોરે; નેમ  
 ઇછ ટાલો ચીનગી બાળો, તેમ જીના દોષ મયાના. અ  
 ષ્ટા કોર ભારી. ૨૩ દ્વાપરમાં પ્રભુ પ્રગટ થધ, પૃથ્વીનો  
 ભાર ઉત્તરયો; નેમ કુળીમાં આ અસ્ટાકોરથી, વાહાલે સંક  
 ણ અણી તરણ્યા. ૨૪ શ્રી વખલ શ્રી વિઠસેશ કાપા  
 કરીને પુઠિ રસ પ્રગટાયોરે; માળા તીલક છાપ અસ્ટાકોર  
 પંચાકોર ધણા ભાવ્યા. ૨૫ છા સ્લેટ્કમાં અષ્ટાકો  
 રેના, અક્ષર વરણ્યા તરણ્યા, શ્રી કશી નામને સુભાગ  
 સાથે દ્વદ્દ કરી મનતુ પરણના, ૨૬ ઓથી અખ'ડ  
 શાભાગ્યની પ્રાપ્તિ મળે અસ્લેટીક ધન્યરે; કુશખ્યદ્વાપ તાપ  
 ને રાળે અશખ્યદ્વાળી અના સાધન. અસ્ટાકોર ભારી. ૨૭  
 સાતમાં સ્લેટ્કમાં શરણું તરણું એ. અક્ષર વરણ્યા આપરે,  
 પ્રથમ શખ્યદ્વાયી લક્ષ્યચોરાશી. ટાળી મરતા તાપ; ૨૮ રૂ

કાર શુદ્ધદેખી મહા અલાકીક, લીલાનુ થાય સાનરે; આવિકા  
 રથી અન્ય આશરો છુટે, દ્રદ ભક્તિમાં રહે એપાન, અં  
 આડમાં સ્લેટુમાં એ મમાએ કૃપા ગુદ બહુ કીધારે; પ્રથ  
 મ માં દ્રદ પ્રીતય ઘતારી, ખીને સ્ત્રાજન સીધી. અં તુ  
 નવમા ઈસેાકમાં માહાત્મ જાણી, અષ્ટકી; નીત્ય ગાપરે; બી  
 ળ શ્રીવલભના ચરણુ પરીત, સદ્યે દ્રદ થાય. અષ્ટાક્ષર  
 ભારી. ૩૧ દસમા સ્લેટુમાં મહા મંત્રીથી, રોગ પાપ  
 સહુ જપરે; રીઢી સીધી સહુ ધરમાં આવે,  
 પરમાનંદ સુખ થાય. અષ્ટાક્ષર ભારી. ૩૨ એકાદ  
 શમ્ના આણુંદને, વળી પરમાનંદ પુરણુરે; સ્નેહ કરી  
 અષ્ટાક્ષર જપે, તેને રોગ જગરનું ચુરણુ. અં ભારી. ૩૩  
 દ્વાદ્યમા વળી પ્રેત ભુત, પિશાચ સરવેને શધિરે; મારે શ-  
 નતો. ૩૪ નહી તેને, અષ્ટાક્ષર રાખ્યા ઢીંગ, અં ભારી.  
 ૩૫ નિયોદસમાં કુંઠિપા કુર્દ્ય અષ્ટાક્ષરથી ત્રાસરે, આ-  
 નંદ મુરતી શી કસનયાદ, નિજભક્તતને રાખ્યા પાસે. અં  
 ભારી. ૩૬ ચતુરદસમા સરવે પ્રકારનું, કુખ્ય મટ સુખ ગા  
 પરે. અહો રાત્ર શીકે ભજનથી, ઉભય લોક સુખ થાય.  
 અં ભારી. ૩૭ પંચદમાં વલભ પ્રભુને, શરણ પછ સુખ  
 ગાપરે; સરવ મંત્રનો રાજ શિરોમણી, જને સ્વર્ગ મટ  
 વરજ થાય. અં ભારી. ૩૮ સનરમા સહુ શ્રદ્ધીના,  
 ઉપર હૃત કરી પ્રગટચારે વેદ શાસ્ત્ર પૂરણુ આદ્યનો, સાર  
 સહુ મન ભાવે. અં ભારી. ૩૯ અષ્ટાદસમા રદ્રાક  
 શી નિઠલ પ્રભુજીએ પૂરણુ ક્રાંધારે; અષ્ટાક્ષરનાં નિધી જાણી  
 સુકુળ મનોરથ સીવે. અં ભારી. ૪૦ એવે વાહાલે

( १२३ )

નિજ અષ્ટીપર, ત્યા વિચારી ભારીરે; ઓછું કૃપાથી વર્ણન  
કીધે, જય દાસનો દાસ ઘલીહારી. અષ્ટાક્ષર ભારો. ૪૧

### ધોળ ૧૧૪

આદો જ્ઞાન જુમનાંર નાહાતા, ગીરધર આવશ ગાયો  
પાત્રાં ૧ ગોવાળની મંડળારે લેઈને, વાહાદો મારો નાચે  
તાતા થેઈરે ૨ સુખની રી કહુંરે સુજનની, વાત કાંઈ  
વરેણ્યની ન જાય વરેજની ૩ વર્ણ વરણાવામાંરે ન આવે,  
એ સુખ અનુભવીયાથી ન આવે ૪ અનુભવમાં છેરે  
એને, એ કચાંદાંથા નેને તેને ૫ એ સુખ પાંડળારેહો  
૫ સે, એ સુખ અરજુનને અભિલાશો ૬ દાસ વલભનારે  
સ્વામી, વાહાદો મારોછે અંતરાલમી; આદો જ્ઞાન જુમનાં  
રે નાહાતાં ૭

### ધોળ ૧૧૯

હશી તને પ્રસન તે કુચમથાએ તારા દીલનું કૃપણ ન જાય,  
પ્રભુ તને પ્રસન તે કેમ થાજુટેક, એ પદ્મશાની ચુંઝે શ્રવા  
બતાવે ત્યારે ત્યાં ગણુગણતું શું આદે, ધરના ળી જ્યારે  
માગે ધરાણું; ત્યારે હરષ મગન થઈ ડાલે, હર્ષાં ૧ હં-  
રીના ભડતને દુષ્પુસુકુ વેઠ વળગી હોય જાણો, સગા ચંદ  
ખાંધી જ્યારે પરૂણા આવે; ત્યારે મિષ્ટાન પીસે પરાણો,  
હર્ષાં ૨ એકાદશી ઉછવ જાગ્રણમાં, ત્યા તને નિંદ્રા લાગે;  
લાંડ લવચ્છપા તૃત્ય નારી સગ, આખી રાત તું જાગે,  
હર્ષાં ૩ હરીની શ્રવા કરતી વેળા કાયા તારી કંપે, ગં-  
જુદો સોગટાં રમતાં; આદે દીવશ ના જાપે હર્ષાં ૪ હ  
રીનું અંદન ધસતી વેળા, અમે શરીર બગડે; કુંડી કેતકુ

મરો મશાલી, બેળી ભાવે ભાગ રગડે, હરી૦ ૫ આણાં  
માત્રી ડાય કોડીએં ભગવત લુષણું ધાલે, સોનું, રૂપ મણી  
સુકૃતાદ્દિણ; ધરની જીને નવ ચાલે, હરી૦ ૬ આ કરવું આ  
ના કરવું, અયા સહુને ચિક્ષા દેછે; કુલ્લા પ્રમાણે કયું ક  
રતો નથી, અનુચ્ચિત કરામ કરેછે, હરી૦ ૭ જગત દેખતાં  
જ્ઞાન એસે બાડી નવ નાહાય ખાવા, ગળુ કાપતાં ધામ  
ગરગણો; એ વૈસ્તરન વાહા ૧, હરી૦ ૮ કુલજન હરીનામ  
રટણમાં આતી આણસ તારે, દૂડાચાં | કુઠણુ પરનિધાણાં  
આએ દીવસ ન હારે, હરી૦ ૯ અતરના ગત્ય કોય ન  
બાળે જાણે અતરણમી, સાચા સાચાં રા સાર્વાંધો; દાસ  
દ્યાતો સામી, હરી૦ ૧૦

## ધે. ૮ ૧૧૭

વરેજ ચોરારી કોસની વન પાત્રાની પરીક્ષામાં  
દ્યારામ કૃતમાં અખી છે.

૧ રે પ્રથમ પ્રમાણ ઓ વિઠલ નાય, એમના શેન્ક. ૧  
નનો મળીએ સાથ. ૧ ચાલો ચાલો રૈસેન્ટ વરેજમાં  
જઈએ, ઓ ગીરધારીજી નિરખી ધંઘુએાતા ધઈએ. ૨  
યોહુલા ઓ જુમનાંજ વિશામ ધાર નાહીએ; પરિક્રમા ક-  
રતાં હરીના ગુણ ગાઈએ. ૩ સરેવે ભગવદી મળી મંડુરન  
જઈએ, તાલ વન ક્રમોદ વન જઈ નાહીએ. ૪ સતુવાખ  
મંસરીને જાહેરાણાં વન, લાંદાં તો ઓ કુંડ નાડો ધઈએ  
પાવન. ૫ નાહાઈએ રાધા કરન કુંડ પ્રભુને ભજીએ, ઓ  
વલલ ઓ વિઠલની બેઠકે નમીએ. ૬ નારેદ કુંડને કુસ  
ચોપરને, ઓ પ્રભુનુ ભજન મનશું કરને. ૭ જુરે જ્વા

લ પોખર નાહીએ તથ, ઓ ગીરખારીછની તલેયિમાં કો-  
 ટ્રીએ હેડ. ૮ ગીરી ધરણ ધરીજ મંદીર જેવાં, ત્યાંહાંતો  
 જન્મ અશાળનાં કુચ્છિઓવાં ૯ નાહીએ માનસી વંગાને  
 ભર્મ કુંડનાં સ્નાન, આહા પ્રભુની બેઠકે કરીએ પરણામ.  
 ૧૦ દાન ધારીથી બીલદુષ લાવુ, તાંતો એક તીરથ માહાદું  
 નાદાવું. ૧૧ જપમાયન રણમાયન વંન, લીલાનાં સ્થળ  
 તતો નંદ નંદન. ૧૨ એ કુપ સરોવર બટ સુખ, મા-  
 હા પ્રભુની બેઠકે ધર્મએ અનુકૂળ. ૧૩ શાકરે ખત કુંડ  
 ગાંદ્રન કુંડમાં નાહીએ, ગોવીંદ કુંડ નાહી કારતારથ યઈ  
 એ. ૧૪ આહા પ્રભુ બેઠકે તાં લાગ ધરીએ, હુતે મળી  
 હરી કૃતીન કરીએ. ૧૫ જીરે અવશ્યા કુંડને પૂછ રીતે,  
 અણી શીળાન લાગ વિટે રાણીને. ૧૬ હરી હાથી ગાયો  
 નાં પગલાં, એક મુગઠ શીળાનઃ દરશન કરવાં. ૧૭ શામ  
 હોક બેઠક શોળુના, એક ગંડા ગોવીંદ શનામીની. ૧૮  
 બાધ બાંધણે સીંહુરી શીળારે ભળી, હરજ પોખર સુર  
 કુંડ નરણે રદ્ર કુંડની. ૧૯ શણા દંડરતીને નમાવ્યાં શીથ  
 ઓ ગોવરધન સ્થળની શાભા અતીશ. ૨૦ પૂજણી શીળાને  
 લાગ ધરવા, નિત્ય આવે લોક બહુ દરશન કરવા. ૨૧  
 ગુલાલ કુંડ ગંડોડી પરમ દાનાં વરણ, જીરે અલકનંદને  
 બદરીનારાયણ. ૨૨ કદમબંડીને હંહાલી કામ વન, નાહી  
 એ પ્રેમકુંડ વિમળકુંડ નિરમળ વન. ૨૩ પીળ કુંડ ધર્મો-  
 રા છે ત્યાંહાં, ગાંધી મીચામણીની યુક્તા ત્યાંહાં ૨૪ ચરણ  
 પાહાડીને ધસ સીક્ષા, ભાજન ઢારીને લાગ કટોરા ભલા  
 ૨૫ જીરે ગંડા એક વચ્છાયુરની, સુરલી કુંડે બેઠક વર-  
 વલભની. ૨૬ સૌનેરી કદમ બડી ધામ, તાતો ચીત-  
 મણી સન્ધાને ચીત\_સન્ધાન રૂપ તતો. ૨૭ કુંડ નાહાડું

ઉચે ગામ, ત્યાંતો દરશન કરવાં રેવતીને ખળગમ ૩૮  
ભાતુક્ષેત્રને ઘરસાના ગામ, ત્યાંહાંતો રાજ કરે દડા બ્રહ્મ  
ભાન, ૩૯ શ્રી રાધાનો સંગે અસ્ટ સખીઓ જાણ, જીરે  
સાંકડી એહ ને ધાંઠી દાણ. ૪૦ જીરે દાન ધદ ભાનધદ  
ના ધદમન, જીરે દાણી કુંડ રલ કુંડને ધેમર વન. ૪૧  
માહા પ્રભુની એકડે માર, જીરે નોયારો ચોયારી ભાનું  
વન. ૪૨ પીરી પોખર સકેન બટમુખ, બીચલા નાસન કુ  
ંડને ઇશી કુંડ. ૪૩ નંદ ગામને નંદનજીશાદા ભાત, શ્રી  
કુમતી સાથે વલભજીરે ભ્રાત. ૪૪ સુરેજ કુંડ ભધુનન  
કુંડ સધળા, આવું જેઠને મન થપું વિમળા. ૪૫ ચરણ  
પાહાડી ચરણ અંકૃશ શીદ્ધા દરશન કરીને ગાવી લીલા.  
૪૬ દધી ગામ શ્રીકુંડને ડાટીપવન, ક્ષીર સાગર સગેસાધને  
દ્વારાવન. ૪૭ શ્રી જુમનાળ ક્રીધાં શ્રી બળરામ, અખે  
અટ કાત્માયની વ્રતના ઢામ. ૪૮ ગોાવી ધાટ ધાટ ચીર  
હંવાનાં, જીરે નંદ ધાટ જિતરચાનાં. ૪૯ ભાંડવન જાઉ ના  
જાની વાટે. ભાંડીર કુવોને બટઘીણોરી ખાડે. ૫૦ વેલ વનમે  
માન સરોવર સુખ ધામ, ભહાકાસીલા પોપરોલીને માટ  
પાન. ૫૧ લોચનરાવન પ્રગટાં રાખા, માહાવન ખજ્ઞાનુ  
થાટ માટી ખાતા. ૫૨ શ્રી ગોકુળ મંદીર પ્રભુના સાત  
ત્યાંછાંતો રમણ સ્વપનની સો કહુ વાત. ૫૩ શ્રી માહા પ્રભુ  
ની એકડ છે જ્યાંહ, જીરે ખજ્ઞાસખંધની આત્મા ત્યાંહ;  
૫૪ પેહેલાં છેાકર હુકરાણી ધાટ નાહીએ, ગોપ કુવો ના  
હી બળહેવ જઈએ. ૫૫ પછે વંદ્રાવન બનશીઅટ જેણ,  
પરીકુમાના રથળ આઠાં તેણ. ૫૬ જીરે મધુરાં જન્મ લુ  
ભી વીચામ, જીરે રથળ સધળાં જેવાની હામ. ૫૭  
ચોરાશી ડોચાની પરીકુમા કરી, સરવે ભગવદી માતી શુષ્ણ

ગાંધી ૬૯૧. ૪૮ ને કોઈ પાડ ભર્ણને નિત્યે ગાય, તે હુને વનપાત્ર કુળ અધીકન થાય, ૪૯ એ કોઈ પાડ કરે નિત્યે નમ તેહને હરીશુ ખાડે અતી ધર્ણો પ્રેમ ૫૦ જીરે વંન જાપવન કીસો કરી લોડ, ઓ વરલભુશાળજીએ પૂરચા કોડ૦ ૫૧ જીરે હરીગુણ ગાંધી વલભદાસ, તેણના મન તથાતો પૂર્ણનો આશ. પર જીરે પ્રથમ પ્રણામ ઓ વિદ્ધનાથ.

હું શું જાણું ને વાહણે સુજમાં શું દીકું. વારે વારે સામું ભાળે સુખ લાગે મીકું, હું શું જાણું ને વાહણે સુજમાં શું દીકું. ૧ જળ ભરવા જાડે તારે પૂંડળ પૂંડળ આવે, વગર બાનાવ્યો વાહણો એડકુ માંબે. હું શું ૨ વંદુ ને તરછોડુ તોએ રીસે ના લાવે, કોઈ મીસે, મા હારે ઘેર આવીને બાનાવે. હું શું ૩ એકલી જાણીને વાહણો પાવણે લાગે, ૨૦ ગ થઈ વાહણો કંઈ કંઈ માગે. હું શું ૪ મને જાતી જાણી વાહણો હાડવો આવે હારે ચૈતાતી માળા થઈ પણ્ણરાવે માહારી કોડે. હું શું ૫ મને જાતાં જાણી આગળ આવી રોકે, ઈયાનો પ્રીતમ બેદુણી કેડલો ના સુકે. હું શું જાણું વાહણે સુજમાં શું દીકું.

### ધોઠ ૧૧૮

શ્રી ગોડુળીયું સુકીને કંઈ નિદ્ધારે નહી, ૨૫. વાસો વસીએ અરણુ કુમળની છાંય જો; શ્રી જી મનાળનાં સુંદર નઽ રણીઆમળાં; જયાંહાં માણારા વાહણાળના પરમ ૨ મણ સુખ ધામ જો. શ્રી ગોડુળીયું ૧ જસેદા ધારે આનંદ સાગર ઉલટચો, સુખ સામર માળારી લે ભક્ત સ માન જો; શ્રી હૃતરાણી ધારે સુંદર એક શ્રાનીતિ, સદા ખીરાને ઓ વલભ પ્રાણુ આધાર જો. શ્રી ગોડુળીયું ૨

શ્રી ગોકુળાચાની વૃક્ષ ભતા સહુ નમી રહ્યાં, અરણ પરમા  
વા શ્રી ગોકુળ અઘ શાખાન્ને; શ્રી વારી ગોવર્ધન રન  
ખચીન સોહીએ ખણાં, આદ્ય વંદ્રાવન નિત્ય રનણનું પા-  
મ ને. શ્રી ગોકુળાચું ૩ આનંદ મંગળ મારગ સિંહ ઉ-  
લથ્યો, કુંજની કુંજમાં એથે શ્રી નંદકુમાર ને; આ નર-  
ણે શ્રી ગોકુળાચું નિરઘ્યું સહુ; આ નરણાંતા ભોગ્ય  
તણો નહીં પાર ને. શ્રી ગોકુળાચું ૪ શ્રી વલભજ પાડે  
પ્રીતમજી એસે ધણા; આનંદ ગલામાં ભીડ તણો નહીં પા-  
ર ને; ૧૦ગીલા ગલી શ્રી ગોકુળપતી મંદીર જાતાં ત્યાં કં-  
ઈ વાહાલો વળી લેછે દાન ને. શ્રી ગોકુળાચું ૫ જગ  
માહનમાં એક સુશેખીની, મનોદ્ય પુરે શ્રા ગોકુળનાય ને  
રમણ રેતિમાં રાસ મંડળ રચતા કરી, હરભી નારભી જ  
નમકતારય થઈએ ને. શ્રી ગોકુળાચું ૬ બેઠ પેહેરામજૂરી  
ભાવ સહીત સહુકો કરે, વૈક્રમ કહે અમને આપો વર-  
જમાં વાસ ને; શ્રી જ્ઞાનાંજી ધેરાં નાર અતી શાખીતાં,  
એવી શુતે કેદુછે શ્રી વલભજાસ ને; શ્રી ગોકુળાચું મુકી  
ને કંઈ જઈએ નદી.

### ધોણ ૧૧૬

વારી વારી શ્રી ગોકુળનાય, તમારા ભટ્ટાને; ૧૬. લટ  
કે શ્રી ગોકુળ ગામ વસાંયુંને મોહાય મંદીરનું રાખ્યે;  
સહુ શેરને અરણે રાખ્યા, ચઉદ જોવનના નાય, દરશન જ-  
પાએ. વારી વારી ૧ પાળાં પીતાંધર પરવટવાળી, હો-  
ડચાં ઉપરણાં સારે; કેસરી કેરાં તીળક ખારાને, શીરપર  
કેસરી પાથ; હરસન જઈએરે, વારી વારી. ૨ કંડે સો-  
હીએ ઝગ ઝગી, ને દીરા કડી અતી સાખીરે; કંડે ભા-

તનથી માળા પીરાને, કુંણ ગજકે ડાન દરેમન જઘ-  
ચેર, વારી વારી. ૩ સુંદર સારાં કડાં પીરાને, ને યાં-  
હાંચી રતન જડાવરે; ખાંડે બાજુઓપણ ઘરખા પીરાને,  
એવા વાહાલાને શાળગાર; દરસન જઘચેર, વારી વારી. એવા  
૪ મદન માહનજી આયે પીરાને, બાડાં વિશ્વાસનાં ભા-  
ગા, દરસન જઘચેર, વારી વારી. ૫ સાતે સ્વરૂપ શ્રી  
ગોકુળમાં પીરાને, સામા વિઠલનાથના લાલ; દરસન જ-  
ઘચેર. વારી વારી ૬ ગોકુળનાથજીને પારવતી વહુજી લિત  
નવી આરતી પુરે, લટકે શ્રી ગોકુળનાથ આરતી ઉતારે;  
શેવકને સુઅ આપે, દરશન જઘચેર; વારી વારી શ્રી ગો-  
કુળનાથ તમારા લટકાને. ૭

### ધોણ ૧૨૭

પ્રાણચા પૂર્ણોતમ લાલરે. સાંભળ મારી શહેલી; વા-  
હાલા છે આનદ્ધારીરે. વાત કરે હરી હરી. ૧ હેવા વિ-  
ઘશનવ જનનાં જીથરે, નિરાય છું નઈથીં ભરી; એવા પુ-  
રસોતમ પાણીઆરે, લીધુ છે સરવર હરી. ૨ એવા  
અતુર શરીરમાં લાણરે, સાન કરી સમજાવે છે. રસીઓછે  
રસનો ભાગીર, પ્રેમ પ્રિત ઉપજાવે છે; ૩ પેઢા કુરીજની  
આતા દીનમાં દાઝ ધણેરી આવે છે; તમાર શ્રીમુખજો-  
વા આવતાંરે. વરહે ધણી સંતાપે છે. ૪ ધરમાં તો નથી  
ગમતાંરે, આંગણીએ નથી રહેવાતા; વાહાલા તમ વિના  
માહારાજરે, અળગાં નથી રૈહેવાતાં; ૫ મારા ડામણગારા  
ડાનરે, વારે વરે શું કડીએ; માર અખગાનું શું લેરે,  
રદન કરી થાકી રહીએ. ૬ મલકરે માહ પામીછુરે, અંગે

આતુરતા ટણે, મને જીજુ નાવે નજરેરે, સાંભળ માહારી સાહેલી. ૭ સંહીએરે સાંહેસો કૃહેલેરે; વિનતિ માહારા વાહાલાની; સહીએર સનનારી કૃહેલેરે, શ્રી ગોકુળનાયજી ના ખાલાને. ૮ પ્રભુ દ્વારા માહારા દ્વારા, કાંઠરાખી ના છો વાચીઃ પ્રભુ પ્રિત કરી પખારારે, અરણ કમળનાંજી દાસી. ૯ પ્રગટ્યા પૂર્વેંતમ ખાલરે, સાંભળ માહારી સાહેલી.

### ઘોણ ૧૨૯

લાલ તમારો લટકો જોઈ મને ચઠકી લાગી પ્રેમ તથી અદ્દાઉંજી તમારો લટકો જોઈ મને ચઠકી લાગી પ્રેમતરી ટેક લટપણી પાદ કેસરીઓ વાધા, જડાવ તીલદાની શાલા ઘની; ભાખો દાઉંદ, ૧ રસીક કુંણ લોભક લણકે, જડાવ જડયારે મહી હીરા મણી; ભાખો દાઉંદ. ૨ બાંહે જાજુ ઘંધ બેરખા સોહીએ, જડાવ પોણાંચીની શાલા ઘણી; ભાખો દાઉંદ, ૩ છત ગોકુળ ઈત મધુરાં નગરી, જીય જુ-મનાંજી નીર વહેઃ ભાખો દાઉંદ. ૪ વંદ્રાવનમાં રાસ ર-ચેહેર, સંહલ ગોધિને વચે ગીરધારી; ભાખો દાઉંદ. ૫ વંદ્રાવનની કુજગલનમાં, જુગ જુગ જુગ રહીએ એ લોડી; ભાખો દાઉંદ. ૬ જુમનાંજીની નીરે તીરે ઘેન ચ-રાવે વાહાસો, બંસી બલવે વાહાસો કદ્યા ચડી; ભાખો દા-ઉંદ. ૭ સુરદાસ પ્રભુ તીહારે ભીલનડુ, રંખ તણા માહા-રાજ ઘણી; ભાલ તમારો લટકો જોઈ; મને ચઠકી લાગી પ્રેમ તથી. ૮

## ધોળ કરણ

આદે આદે કાળીંદ્રીને કંઠડ, ગીરવારી આરે ગાયો.  
ઓ નાથજીને નિરખીએ. ૧ હરીના શીર કુલની શાબા ૫-  
૬૩, એમને છોગલડે શાચુણાર. શીનાથજી. ૨ હરીને ભાસ  
લીલક સોહીએ કેમરી, એમના ઘીરીઆપા. છે કેથ, ઓ  
નાથજી. ૩ હરીને બોલ સદ્ગ રસ મીઠડાં, એમની આંખ-  
લડી અમરીત. શીનાથજી, ૪ હરીને કંને કરાયકુલ શી-  
લીતાં, એમનાં કુડાણ રલ જડાવ, ઓ નાથજી. ૫ હરીને  
હડપચીએ હીરલા અગમગે, એમના તેજ તણેં નહી પાર  
શીનાથજી. ૬ હરીને કંઠે તે માળા શાલીતી, એમને  
ઉરગજ ભાતીના હાર, શીનાથજી, ૭ હરીને ખાંડે ખાંજુ  
ખંધ એરખાં, એમની પેંડુંચી છે રલ જડાવ. શીનાથ  
જી. ૮ હરીને પીળાં પીતાંખર શાલતાં, વાહાલે ઓદ્ધાં  
હંપરણા સાર. ઓનાથજી. ૯ હરીને કેહુડ સોહીએ કદી  
ખેખળા, એમને આંજરનો જમડાર. શીનાથજી, ૧૦ હરી  
ને અરણે ચાખડી શાલતી, એમનો અતુરાઈની આલ. શી  
નાથજી. ૧૧ હરીને હાથે સોઈએ લાલ લાકડા, એતો ધિનું  
અરાવાને જય. ઓ નાથજી, ૧૨ હરીને સંગે તે સરખા  
ગોનાળીપા, તાંહાં વાહાલે મંડુરીસી ચેલબી વાય, શી  
નાથજી. ૧૩ વાહાલે તે શી વંદ્રાવનની કુજભાં, ત્યાંહાં  
એ ઓ નંદુમાર. શીનાથજી. ૧૪ એ શવરૂપની શાલા  
નેછને, ખલીહારુ જય માધવદાસ. શીનાથજીને નિરખી  
એ. ૧૫ ભાસા ભાસા કાળીંદ્રીને કંઠડ; ગીરવારી આરે  
ગાયો.

( ૧૩૨ )

ધોળ ૧૨૪

અધક્ષી ગોસાઇજણો વિવાહ એવ,

શ્રી ગોવર્ધનધારીજી, વારી ઓ મુખપર જાઉજી; ૧.  
જારે કાપા પ્રભુજી તમે, શ્રી વીઠલ વિવાહ તે ગાઉજી, ૨  
એરે વિવાહ વિસ્તારતાં, ને સુખ કાંઈએ કેહેવાયજી;  
એમ કરતાં કાંઈ હેતથી, દાસનડાને સુખ યાયજી ૩ એ  
વા કેપાણ કેપાનાયજી; કાપા કરી એમ તથા જાણ્ણીજી;  
આપજી આરત જાણ્ણીને, એ વાત મીતડામાં આણ્ણીજી,  
૪ હરચ્છાં તે હરચ્છાં એટી ધણ્ણુ, માગ્યું તે અમતાંણું  
દિનેજી; વહેલા ધારોરે વિવાહ કરો, વેદ પુરાણે એ ધા-  
ંણુજી. ૫ આપજી છંધાએ એયાંચા, શીખ હરચ્છાંથને  
દીધીજી; જાણ કરો મહુ ન્યાતમાં, વાત વિવાહ તણી  
કીબીજી. ૬ ધણ્ણારે ધજી ધેર આવલે, એરે વિવાહ તણી  
વાતજી; પરમ પનોતુ છે એ કુંગ, પનાતી છે કંપાના  
માડીજી. ૭ એતારે પનોતો છે જેહનો, જેહો લીધી માણા  
માણી પેરજી; પ્રગચ્છા પૂર્ણાતમ વાયજી, આદર આવણ  
ચેરજી, ૮ કુમ કુમ છડા દેવરાણીના, મારીના ચોક પુ-  
રચાજી; પાટ ધાળોરે પ્રકાશયું, સોહાયણુ ગાવાને આવેજી  
૯ એ ધૂસે ગીત ગાઈચુ, પનોતો ભલોરે વેહવાધજી; તારુ  
તે પૂન્ય છે એટી ધણ્ણું, પામા તે શ્રી વીઠલવર નમાધ  
જી. સકળ શાખાની રીતથુ, નિત્ય તે ભલી એરે પાયજી;  
વિવાહ ભલોરે ઓ નિદલવરનો, માધવદાસ ભલાહારીજી ૧૦

( ૧૩૩ )

## ધોળ ૧૨૫

૫૬, ૧ લં.

વિવાહ મળીએ અનણ શુદ્ધીએ, હું તેં જ્યત્યકારે;  
 આનંદ વાધ્યો અતી ધણો, મન કુળને નહી પારો ૧  
 છેર આવ્યા ભસે ભાવ્યા, સગાં સહુ સહુ વાત, આપણું  
 અતી ખડલાગીએં; આનંદ અતી ધણો ગાતો રે વહુ  
 જુઓ વરજનાથજુને, પુછી પુછી ધર્ષી ગાત; આચરજ  
 બાલાણીએ, હૃદાદે હરાય અપારો રે તમારી પ્રીત જોઈ  
 જોઈ, મેં જાણ્યું મનમાં એમ; વિલોગ તમે કુમળ હા-  
 થ, આવંડું જાણ્યું કેમો ૪ સુઝે બાદ્યાં બધાનેણી, વાણી  
 વેદ તે સત્ય; ગુરુજી તમાંએ અતો ભલેરા, પ્રાણનામ  
 સુરતજ પ એજ માણુ માનડી, મુને આપી સુકોા આજ;  
 માયા કરણે સુજને, લેમ સરે અમારાં કાજો ૬ ગુરુજી  
 શું ગોડ પુછી, તતો પ્રભુજીના પેર; સમાધાન કીધાં ભ  
 લાં, પછી વિપ્ર વાળીએ ધરો ૭ વાત જણી ચિત આ-  
 ણી, માનની મનમાંદ્ય; વિવાહ આદર અતી ધણો, શી  
 નાયજુદે જેહો ૮ એક હમારી વિનતી, તમે આવી ધ-  
 રણે નાથ; માધવાસ બલીહારડે હાવે, શેજ સ્થાપો સ-  
 રવ સાયો ૯

## ધોળ ૧૨૬.

૫૬ ૨ જી.

પનોતીએ દીખીએ આશિષજ, વિવાહ તે કીધા આણીલ  
 ભાસજો ૧ હુએ તમને પુછુંદું ગીરધરજ, જઈ પૂછુંં ગો-

( ૧૩૪ )

વીદ જુવો વરણૂર લોથીડા તેડાવો માહારાજજી, એમ  
કીને શ્રીબક્તિનાં કાજીં. ૩ લોથીડો ઉતાવળો આવેલ,  
લોતિષ સધળે ડાલાવેલું. ૪ આવીને દંડજરત કૃથિાલ,  
હસ્તકમળ શારપર દીધિાજીં ૫ લોથીએ વિચારગુંછે મનજી,  
લોથી ભણુલો. ૬-૭ ધન્યધન્યજીં ૮ લોથીએ લોયું હે  
રીલ, પૂછેછે સધળણી નારીજીં ૯ લોથીએ લોયું હે  
રીલ, નથી ડાંઢ આણે માસે કુકુજીં ૧૦ સંતત સોણ  
હોડા વીસજી, વૈશાક સુરી રોડાછે આજજીં ૧૧ ભગ્ન માક-  
દ્યુંછે મન રેણીજી, માધવદાસ ઘલજાચે વળી વળીજીં ૧૦

ધોઠી ૧૨૭

૫૬ ઉ જું.

ભગ્ન માકદ્યું છે ઓ વિદ્ધિનાયજી, ઝડો ઓ વદભ-  
જીનો સાયજી; કુપા કરો પ્રભુ તમી તચી, કુપાનાય મો  
હોટા માહારાજજી, એમ કીને રાસમણાં કાજજીં ૧ ૬-  
૨એ તે સુરીનર રાજઆ. માંડવે ગાંધરવ નાચેલું; માંડવે  
આર આજોજી, કુંદલી અંતુરી વાનેલું ૨ માંડવે અહેલ  
રચાયજી, વસ્ત્ર અમુલભ રચાયજી; માંડવે અતી ધણો મ-  
ર્મજી. એ સર્વ વિદોગત કર્મજી. એહુ પાસે ગોવીંદજીની  
નારીજી, માધવદાસ ઓ મુખપર વારીજીં ૩

ધોઠી ૧૨૮

૫૬ ૪ યું.

બહુલા થાચો વરજનાય, કુજ સહુ ચેહોટોં કીનેજી;  
એણીપેર કારજ કીનેજી, પ્રભુ એણ્યા વાણી એ સત્યજી.

૧ સમરથ સહીત જફુનાયજુ, કોડ તેવીસે ત્યાંહાં લેય-  
 જુ; કુળ પ્રરમ કરમ સધજું કરેયું, પ્રભુજીએ જાણ્યું એ  
 મનજું ૨ નવલ તેનોયન નાયજુ, યદીઆ તે આવલાલ  
 સુત પણ ધન્યજુ; રાખીરે સાંજનો સમો પયો, ધાડકા  
 ભલ્લુ રૂક ગામજું ૩ પુરે ભલી ધુરગાવતી, સુતી આવી  
 સેતી એ નાયજુ; ખાંત કરી ધણી રાણીએ, વાણીએ  
 હશીરમ ગાચેજું ૪ આદર અતી ધર્ણા કુમજુ, તેરણ આ  
 બો છે અસ્તજુ; નવલ ક્રિયાર તેરણ અદ્યા, જીવો વર  
 માહન સેસ્તજું ૫ કંદ્ર્ય ડોઢી સ્તરપજુ, ભુનળ ભલી પેરે  
 આવ્યાજુ; લણુ કરો વહુજુને ઘર, ડોઢી અદ્યાંડ આવ્યા  
 જુ ૬ વહુજીએ વાત સહીને કહી, ન। કહીં ડોઢે પેણ;  
 અણુચિતબ્યાંરે ડિનાણા, પ્રભુજીએ પદ્ધાસ્યા છે ધેરજુ ૭  
 વચન સમરથ અન્યો અન્ય, મન જાણી ને એમ કીને-  
 જુ; વખ અન્યો અન્ય અષુલખ, નિત્ય તે નવરણી લી-  
 ભાજું ૮ આભજું તે અતી શાલીતાં, આભરણ અંગે છે  
 માતીજુ; બાય જીય ભીત્ર અષુલખ, સખી ધણી ધણી  
 ઘર લેતીજું ૯ નાગ નાગોદર યુમણ. લીલાવણી લીલક  
 તે સોયજુ; નાડે પુલી નથ વેસરા, હઠડી હરખ તે અનુ  
 ધજું ૧૦ સખી તણો રનેહ, અણા તે એણી પેરે બો-  
 દ્યાંજુ; ધર સહે લાણ શ્રો વિધન વરમા, નેલોડ નહીં કો  
 તોનજું ૧૧ તમા એતે એમ જાણનો, કહી લહી વાત  
 એ રુદ્રીજુ; પાનસ નેપૂર વાજુઅં, પાવડીએ જડીએછે  
 ચુનીજું ૧૨ છાને તે બાલ અષુકતી; ગાલે તે ડોઢી પ્ર-  
 કાશજુ, નેત્ર અંજન મૃગાનેનજુ, સંજ ધર્છનિરાખી દ્યો  
 વરજું ૧૩ માંહાનાહે સંકુ એમ કહે, રાખી સંકુ શાલીતો

સાથજુ; માનનીએ ભનમાં લણ્ણીયું. એ આવે સુંદર ના-  
થજું ૧૪ તાંહાં યકી અદ્યા સુણ્ણી નાથજુ, ડામ તે આ  
વડું શું ન'જુ; ગેરસે આવી વધામણી, સોહાવાની તરણ  
ટોડજું ૧૫ ઓવિઠલનાથજુ આવીએ, બાવીએ ભલી  
એરે કાંહાનજુ; પૂર્સ્પ વૃદ્ધિ કરે દેવતા, જોગીએ મુક્તાં છે  
ધ્યાનજું ૧૬ જ્યાન કરે સરવે અનંગ, યેકી અક્રોષનો  
પાંગીજુ; અરવ અસ્ત્રા કંદું કેઠલા, ના લંદું ઘોડલે જીન  
ભીલાજું ૧૮ ઓવિઠલનાથજુ, પેહરચાં પીતાંખર પીળાંજુ  
કનકમે પાટ ટળાવીએ, ઓદ્ધાં પીતાંખર લીલાંજું ૧૯ ગો  
વીદ્ધાંએ વડુને કદ્દું, એ સહુનાં અહિંપાં તે તડચાંજુ;  
માધવદાસ જાય બલીહારું, બીંગે સહુ સાધછે કેડેજુ. ૧૯

### ઘોડી ૧૨૮

૫૬ ૫ સું.

આવો પનોની અધાનેણી, અહુ ગુણવંતી નાર; આવો  
સોહાસણું સુંદરી, સોહાગી ઉભાંદેખાહારૂં ૧ ઓક લેધ  
માનીની થાળ ભરીને, ખીજ લે પૂર્સ્પની છાય; નીજુએ  
તરણ આવીએં, ચોથીએ અંદન લાવું ૨ ઓણીપરે આનંદ  
ઉલગ્યો, ચાસે અંદ્રાવળીને સાય; ગજ ગતી આલે હરએ  
ભરચાં, ઉલટ અંગ ન મયું ૩ પ્રભુજુનો ઉલટ જણાવી-  
તને આન્યો ઉર કેરો હાર; ન્યુરે દીઢા આ વિઠલ વરને,  
નાણે છુટી આધ્યા ગજ રોજું ૪ બેર ભુગળ તાળ મરદં-  
ગણું ગાયે, ઓવિઠલજુનો દાસ; પ્રેમ શય્દ વાને ધણા,  
થાય નક્કેરીના નારૂ ૫ આબ્યાં સુંદરી સોહામણું, માંડવે  
હુંદો જ્યા જ્યકાર; ઓવિઠલનાય પદાર્થાએ, નંવા તે-

## [ ૧૩૭ ]

નીમ કોડ૦ ૬ પદમના એમ કરે ધર્ણા, સગુંયાં તે વહુનાં  
કાજ; ભક્ત તણાં મન હુલીઓં, શ્રી વિલ સુપની રાસ.  
૭ એંખીને પદરાવીઓ, આવીઓ સુંદર જ્ઞેડ; વેદ હુની  
ત્યાં હોય ધર્ણી, હેવ વેમાન ચડી જાય૦ ૮ શ્રી પૂર્વોતમ  
૭ પદરાવીઓ, આરે ભાઈ લાજ; માધવદાસ ઘલોહારે,  
સગુંયાં વેસનવનાં કાજ૦ ૯

## ધોણી ૧૩૦

પદ ૬.

પ્રભુને પાટે તે પદરાવેજી, વહુને લોઈ લોઈ  
તન મન વારેજી. ૧ વર કાજનો આવેજી; કણ્ણાજીને  
વેગે તે પદરાવેજી ૨ સાભપદાજી સાભપદાજી સંભઈયા  
જી, વીજમ ન કીને એક મહ્યાજી. ૩ ચીલોકનાથજી તેડે  
જી, આવુ એમ કીજીએ લેડજી. ૪ પરમ પનોતીજી આ-  
બાંજી, માંદ્યારામાં હડેલાં ભાવાંજી. ૫ વહુને બાણું એ  
ચિતજી, પૂર્વોતમ પામી તે સત્યજી. ૬ શેવા સુખ દ્વિ  
કૃહેવાયજી, શેવક સુખ હેવ હ્યાડજી. ૭ માંદ્યારામાં શી શી  
પેર હોયજી. ૮ શાસ્ત્ર મરજાના સહું હોયજી, ૯ વેહેલા  
ભાગો વરગાળા પેહેરાવેજી. માધવદાસ ઘલોહાર કરેને ડીજ૦

## ધોણી ૧૩૧

પદ ૭ સુ.

શીરણજીની ચાંગીએ આબાજી, સહીપર વહુને કાહા-  
વેજી. ૧ ખાઈ તમે એઠલું ત્યાંહાં કરજોજી, અમને તે  
ચિતડામાં ધરજોજી, ૨ આપની કુળ આજ તે મીજોજી,

ખીડી કરી હુસ્ત કમળમાં દીનેજી. તે મહૂરે રને ભાંડપુછે  
ગ્રયનજી જોયું તમને ડેટલીછે સાનજી. ૪ સુંદીર સરોવર  
થે સાધજી, એવ પાંચે ધ્વણના નાદજી. ૫ તે જોતાં હેઠા�  
છે સ સારજી; હવે મંગાવે છે કાસારેજી. ૬ કંબસાર પીર  
શે કંન્યાજીની માડાજી, પેહેરી છે પચરણી સાગીજી. ૭  
કુંસાર સારો ઇડો સ્વાદજી, એ માહાદી છે પુરિજી. ૮  
અની મુખે ગેમ આશીશ દીધીજી. ચુંદેચે ચોરોકમ ક્રાંતુજી  
૯ ચુંદુજી બાધ્યાજી. ને વાણીજી એ વાત ત્રીસુકે ન-  
છીજી. ૧૦ જુગલ સ્વરંપ ચડાઓ વરષેણેજી માધવદામ  
નાય બણ કરેનોડજી. એક વાર એલો શ્રી રઘુષોડજી. ૧૧

### ધોણ ૧૪૨

૫૬ ૮ મું.

વેવાઈ તારો ભાંડવડો સંભાળ કે ભાંડવડો સંભાળ કે,  
રસીક વર રમી વરચારે; સંગે સોણીએ પદમાવતા નારે.  
આવી ટોળે મળીરે ૧ વળી વહે કંન્યાજીનો ભાજાએકે,  
બાઈ કૃયારે આવશેર; અની વંદ્રાવનચંદ આ વિઠભનાથ કે,  
સાથે ઇડો ભાવશેરે ૨ વળી વહે કંન્યાજીની માડી કે,  
કોહાં રાત ડેટલીર; સુંદરીને શિખામણ દીને કે, થઈ ર  
સ ભિટલીર. તે સુંદર તાહે સુખ રામ તો, વદન જુયે ૩  
ળી વળીરે; સોદાસંધ સાસરે નાય તો, રાહીપર વળાવી ન  
ળીરે. ધન્ય ધન્ય તૈલંગની નાત કે, સંગે બડુ સખીરે; ૪  
હુજીને વળાવીને નાય કે, એ વાત વહે લખીરે. ૫ વાટડી  
વિલંબના કીને તો ફુલે માગુ સહીપરે વળી વળી પંથ  
નાહારે તો આપણુ સાયજીર. ૬ શી વિઠલ વરને વેગે વ-  
ધાવો કે, ધંડ સોદાસણીરે; માધવદામં ખલીદાર નાય કે,

( ૧૩૬ )

એ લોડ રૂડી ખળરે. ૭

### ધોળ ૧૩૬

૫૬ ૯.

“અનુભવ વર પરણીને પંચાંગાજી, સુરીનર જોવાને  
ત્યાંથાં આવ્યાજી. ૧ લોધ શકો તો એ વર લોલોલ, આ  
નાં એણી પેર થાયજી. ૨ કાદ્ર્યપ ડોણી છે સ્વર્યપજી, જુ  
વન ભલી પેર ભાવ્યાજી. ૩ વહુલુએ વાતજ ધેર કાહા-  
વીજ પણી ત્યાંથાં પોહેરામણીએ આપીજી. ૪ ટાં.

પોહેરામણી ભલી રીતથુ, ગ્રો વિઠલનાથજીને મન ભા  
વીજી; સરવે આંણીને દ્રાગે ફરથુ, કારજ વેહેજાઈ તણું સી  
ધુજી. ૫ ભાગપણે વીપરીત થું થુ, કીને કુસ તચી રી-  
તથુ; ૬ અંબ દીવસ પ્રભુજ એટસે એહ, અલોકીક છે રીત-  
જી. ૭ લાક ગુવે લાકની રીતથુ, પ્રભુ ગુવે વરજ કેરા  
સાપજી; કઉતઃ નાહાના પેરનાં ધેર ધેર દીસે છે અંગજી  
૮ વર વહુલુ ઉતાવળાં ભળી, ભળી રણી રમતજી; ૯  
હાલાજ વાર માં કીજીએ, દીજીએ માગુ એ વરદાનજી. ૧૦  
વાહાલાજ વાર માં કીજીએ, વળી વહુની એ જનજી;  
શ્રવનીથી સુખ પાગ્યા દેવતા, જેગીએ મુક્તયાં ધ્યાનજી. ૧૧  
પાતાળેથી શ્રવનાગ રીત આ, ધંડ નિશાન પજડાખ્યાજી;  
માહેટાં ભાગ્ય છે ને તચાં. એ વર નાહી સમતોલજી.  
૧૨ માધવદાસને આશરે, સંસાર સંઘળો છે જળીએાજી  
કુપા કરુ આવિઠલનાપજીએ રસ લેહુરમાં વળીએાજી, ભી  
રે ગોરાધન ધારીજી; વારી આ સુખ પર જહુલ રીજી

## ધોળ ૧૩૪

શ્રી નટવરલાલને વારણેરે, સુંદર શ્રી છોડાલાલ ઘની-  
હારીરે લાલ, શ્રી નટવરલાલને વારણેરે ૧ રાજનગર રણી  
આમણુરે, તેની સુંદર શાભા સાંજરે લાલ, શ્રી નટવરલા-  
લ. ૨ છ્યાન ભાગ સોહામળોરે, શીધી બુદ્ધિ બહુ વિચાર  
રે લાલ; શ્રી નટવરલાલને વારણેરે ક સાખુ સંતત આદર-  
માંરે, અતુરી ચોરાણુંબો શુભકારીરે લાલ; શ્રી નટવરલાલ.  
૪ વેગે વજથાક માસમાંરે, સુદાની સાતમને શામવારરે લાલ  
શ્રી નટવર લાલ. ૫ હેણ દેશથી અ નીયારે, સહુકો આ-  
બ્યાં નરને નારો લાલ; શ્રી નટવરલાલ. ૬ ઓતરથી હરી  
આવીપારે, શ્રી ગોકુળનાયળુંભી જાણી નારારી લાલ; શ્રી  
નટવર લાલ. ૭ શ્રી લક્ષ્મણગુલાલન જોઈનેરે, સહુકોને પ્રિ-  
તી ધર્ણી છે પ્યારીરે લાલ; શ્રી નટવરલાલ. ૮ દક્ષાણથી  
કુઃખ ડાપનારે, આંબા શ્રી કદાખુરાય હેતકારીરે લાલ; શ્રી  
નટવરલાલ. ૯ પુરવથી પ્રભુ પધારીયારે, શ્રી ત્રીકુમળ મા-  
ધવરાય ગીરીધારીરે લાલ; શ્રી નટવરલાલ. ૧૦ પદ્ધિમધી પ્ર-  
ભુ પધારીયારે, આંબા શ્રી મગનલાલજ માહારાજારે; શ્રી  
નટવરલાલ. ૧૧ મદુલાલ મધુરાંનાયળુરે, જીજા બાળકજા  
ઉ ખલીહારીરે લાલ; શ્રી નટવરલાલ. ૧૨ સેને સાતને તા  
રીયારે તેને મણેર કરી માહારાજારે લાલ; શ્રી નટવરલાલ.  
૧૩ સેને દાસ જમનાને દ્યા કરીએ, હેતે લીધી છે ઉઠાડી  
રે લાલ, શ્રી નટવરલાલને વારણેરે. ૧૪

## ધોળ ૧૩૫

નાય કેસે ગજકો બંધ છોડાયો તરે અહી અચર જખ

માપે આયો; નાથ કેસે ગજકો બંધ છોડાયો. ૨૫. જજ  
ઓર આહ લડત જળ લીતર, લદત લદત જજ હાઁયો;  
જવ પૂર શુદ રહી જળ બાહાર; તથ ૬૩ નામ પૂકારચો  
નાથ. ૧ સભારીકે બાર સુદામાકે તાંકુળ, ઇચ્ચી ઇચ્ચી ભોગ  
ધગ્યાયો; કુરચોખનકે ભવો ત્યાગી, બાળ વિદુર બેર પાયો  
નાથ. ૨ એઠ પાણ કાળિ નાગ નાયો; શીંખપર નરત ક-  
રાયો, ગીરી ગોવરધન કરપર ધરાયો, નાદ બેર ભાલ  
કહેવાયો નાથ. ૩ અગાસુર મારે બગાસુર મારે; દાવાનળ  
પાન કરાયો. સ્થંભ ઝોડા હીરાળ કષ્ય મારે, નરસિંહ  
નામ ધરાયો, નાય ૪ અજમેલમિ ગજગુણકા તાંદી, દ્રો-  
પદ્ધકો ઓર પુરાયો; પપપાત કરંતા પૂલા મારી, કુષ-  
ણ્યકો ઇપ બનાયો, નાથ. ૫ કૌરવ પાંડવકો જુધ રમાયો,  
કૌરવકુ માર હઠાયો; કુરચોખનકુ માન ધરાયો, માપે ભ-  
ંસોા આયો, નાથ ૬ સભ સખીઅન મીળી કંગન. ચાં-  
દ્યો, રેથમ ગાંડ બધાયો; છુટે નહી રાધાલુકે કંગન  
કેસે ત ધનુષ ઉડાયો, નાથ. ૭ આળ કોઈડી ઘાણ  
દળ ધારન્યો ગરેડુ નાજ સંતાયો; છુટે નહી રાધાલુકે  
કંગન, ઓર ચ્ચે બળ કચાંહાં છુપાયો, નાથ. ૮ લેગી  
ન્યાકો ધ્યાન ધરતેને, ધ્યાન ધરત નહી આયો; સુરદાસ  
કુંહ પ્રભુ તીહારે મીલનકુ, જસોદાકો ધેન ચરાયો. નાય  
કેસે ગજકો બંધ છોડાયો. ૯

### ધોળ ૧૪૩

જરે જરે પ્રથમ સુરજપોળ જણાજુ, રમા વધુંડ વ-  
ાયો. જરે જરે ૧ નવસીડીયે નવધા ભક્તિજુ, અની  
ગોરધન ચોક મેમ આચકત. જરેજરે ૨ ઇણાંદી મા-

હાસુખ કુંજ, સીગાપોળ જેઈ આનંદ લરેણ્ડ્રેન્ડ એ  
એ હંમ એ દૃષ્ટિ ઘીરાનેજ, ચારે વેદ માહા હુનીગાને.  
લરેણ્ડ્રેન્ડ ૪ કુમળ ચોક રાસ કિડા રમણજ, શીવ આવે  
ગોખીધરી તન લરેણ્ડ્રેન્ડ ૫ એક મારે શામની લનાં ને  
નજી, સાંહાં તો ભુરણ ખાઈ પડચા મીન. લરેણ્ડ્રેન્ડ ૬  
રલયોક સ્યામનીજનાં તનજી, સુર આવ્યા મડી દેમાંમ.  
લરેણ્ડ્રેન્ડ ૭ જગ મોહનમાં આહારાણીજનાં મનજી, મ-  
ણી કોડા જુદતી આસન. લરેણ્ડ્રેન્ડ ૮ ચોક કિર્તની આ-  
ગલીજી, દરથન કરવા આવે સહુ મળી. લરેણ્ડ્રેન્ડ ૯ વેંણું  
ખાને કિરતનીઆ ગાયજી. ત્યાંહાં તો આનંદ ઉર ના સ-  
માય, લરેણ્ડ્રેન્ડ ૧૦ માંનું છડી માંડી પ્રત્યેજી, આશપાસ  
વિત્રામણું લીંતે. લરેણ્ડ્રેન્ડ ૧૧ નિઝ મંદીર આય રન-  
ઃપજી, પાસે સંબ્યા મંદીર અનુપ. લરેણ્ડ્રેન્ડ ૧૨ શીજ  
ના નીચે વખ્ટ સુપડાશીજી, માનુ હે ચંદ્રાવળી નારી.  
લરેણ્ડ્રેન્ડ ૧૩ ચરણ ચોક ગંબિલોક કેહેવાયજી, ત્યાંહાં તો  
દૈની હોય તે જાય. લરેણ્ડ્રેન્ડ ૧૪ પીછો વહ ચંદ્રાવળી  
ખણ્ણાજી, ચંદ્રવો જુમનાં ગન આણ્ણો. લરેણ્ડ્રેન્ડ ૧૫  
માઠી સુંદર મન ભાયકજી, પીઠ તકીયા મારા એક, લ-  
રેણ્ડ્રેન્ડ ૧૬ આશપાસ એ તથીઆ રાનેજી, માદાસુખ  
એકાંત ઘીરાને. લરેણ્ડ્રેન્ડ ૧૭ એ સેસાતર તણાં સુખ  
ધામજી, પડે ચંદ્રાવળીજનું નામ. લરેણ્ડ્રેન્ડ ૧૮ એ જી  
રણી સ્વામનીજનાં તનજી, સરમ જળ આમાહારાણીજનાં  
મન. લરેણ્ડ્રેન્ડ ૧૯ એ જીડા માદા પ્રભુ દક્ષણા ભલો,  
સુખ વખ્ટ મોહન આમ. લરેણ્ડ્રેન્ડ ૨૦ જુગલ અરણેશ્વર  
પદરાયાજી, ગીરારાજ હણીદસ કેહેવાજી લરેણ્ડ્રેન્ડ ૨૧  
એક લક્ષ શી ગોસાણજનું રેપજી, ઉપરે સાત ધળ અ-

નું ૫. જીરેજીરે ૨૨ સંખ્યા ભોગ માદા સુખ કંદળ; શાભા  
નયણે નિરખી સુખ અંદ્ર, જીરેજીરે ૨૩ ઓવે મારગ થ-  
ચા નણી ધારજી, ચી માદા પ્રલુચી કાપા ધકી પુછી કેહ  
વાય, જીરેજીરે ૨૪ છડીનું તાંદા તલડાણજી, ગુણ ગાચે ચી  
વાય, જીરેજીરે ૨૫ છડીનું તાંદા તલડાણજી, ગુણ ગાચે ચી  
વાય, જીરેજીરે ૨૬ પ્રપન સુજીપોળ જણો. ૨૬

### ધોઠા ૧૩૭

પુષ્ટી મારગનાં પાંચ તત્ત્વ નિય ગવાયજી. તેનાં જનમ  
મરણનાં પાંચ સરવે જાપજી ૧ શ્રીજ શ્રીન નિય પિપાળ  
સુખકારી સમરો ચી મધુરાંતાથ કુંજ વીહારીજી. ૨ ચી  
વીહારીથરાય શ્રી દ્વારકેયત્ત્રાજ વીરધારીજી, ચી ગોકુળચંદ્રના  
૩ ચી મદનમોહનપર વારીજી ૪ ખાળુ તત્ત્વ ચી વલભ  
કુળને લજીએજી, કુંડા લોક લાજને કામ સરવે તજીએજી.  
૫ આ વીજુ તત્ત્વ ચી ગોવરધન ધર નિય ગાએજી, ચી  
નાટવરેજાલનું નમતુ સરવે ધારજી. ૬ આ ચેયુ તત્ત્વ ચી  
જીમનાંજી ન જણેજી, કરો રેનાન જળને પાન એ સુ-  
પ માનેજી. ૭ આ પાંચમુ તત્ત્વ શ્રી વરન લોમીને ગાઈ  
એજી, નિય ઉધીપૈશેવજન ૫૮ રજ પાઈએજી. ૮ આ  
પાંચમા તત્ત્વનું ધ્યાન નિરાતર કીનેજી, તે મન વાંછી  
તના કુળ સરવે લીનેજી. ૯ આ પાંચ તત્ત્વ ચી ખ્રિસ્તિક  
ને દુલ્લભજી, શ્રીવલભ પ્રલુ પ્રગટ પ્રમાણું કદ્યાં સરવે સુ-  
દીજી. ૧૦ એ શાબા જોઈ હરીદાસ જાય ખલીહારી, એ  
લોલા ગાન્ધો નિય નરને નારોજી. ૧૦ પૂછી મારગનાં  
પાંચ તત્ત્વ નિય ગાઈએજી.

## ધોળ ૧૩૮

સખી સરદ પૂનમની રાત મુજને વાહાલીણ; એવી જો.  
 કુણ વરજની નાર રમવા ચાલીણ ૧ એવા નાક પ્રમાણે  
 નથ નિરમણ ભાતીણ, એવાં દરપણું લીધાં હાપ સુખડાં  
 જોતારે. ૨ એવાં કાંણી ડલાં આર વીંછવા ચમકેણ, એ  
 વો આંખરનો અમકાર ધુદ્ધરી ધમકેણ. ૩ એવાં ચોણીને  
 પેહેરચાં ચીર પીતાંબર પીળાણ, માદારા વાહાલા સાથે  
 રમવો રાસ કરવી લીલાણ. ૪ એવી લીલા તે ગાંજે નર  
 ને નારીણ, ત્યાંહાં રમે ગોણાએને ડાહાન રમતાં ભારી  
 ણ. ૫ એવા ઘાંહેબાળુભાંધ ઓગનીએં ખળકેણ, એવા  
 હંડે એકાન્ન હાર કુમણાં અળકેણ. ૬ ત્યાંહાં કુદરી કરે  
 ગોપી ચાર વચે ગીરધારોણ, હેલા માધવદાસના દાસ લાડ  
 ઘલહારીણ. ૭ સખી સરદ પૂનમની રાત મુજને વાહાલી.

## ધોળ ૧૩૯

ધન્ય ધન્ય ઓદ્વારકાં નાયજીરે, વંદુ વર્ધશનવજન સાથ  
 રે, ૧ તહીરાણત માહોલ અટારીર, રાય સાગર અનત  
 વારીર. ૨ માહા ભાણ્ય ભેવાડો દેશરે, ન્યાંહાં પ્રિતે કરો  
 પ્રવેશરે. ૩ ધન્ય ધન્ય તે કાંકરોમી ગામરે, માહારે વાહાલે  
 તે કરચો વિશરામરે. ૪ મુગણી અધિક પૂરો માહારાણરે,  
 સદા વર્ધશનવજનને કાજરે, ૫ અમરાપૂરી એ ધરી લાને  
 રે, પ્રભુ પુણી પ્રસાદ ધીરાનેર. ૬ પરયાર અનોપમ દીસેરે,  
 જોતાં જોતાં વર્ધશનવતાં ભન હીસેરે. ૭ ચોક ચાદરવા ધાયુ  
 શાભિરે, જોતાં વર્ધશનવજન સાભિરે. ૮ નિજ માદીરની શા  
 ભાપરે, તેતો મુખે કહી નવ જાયરે, ૯ હીરા હેમ જડાવના

બળીરે, કુલ્લાજી પૂનશાળીરે. ૧૦ હીમ આસને હોરા  
અણકેરે, મુક્તાકુળ ચેદ દીશાએ લણકેરે. ૧૧ દીહુ દરથન  
દ્વારાંધીજે એતા સર્કળ ભાવનના છાસરે. ૧૨ મેધ વરણુ  
મનોહર અંગેરે, જેતાં લાલે છે લક્ષ આનંગેરે. ૧૩  
બહુ પાસે ગોસાંધલ ઉભારે, ઇપ ચારની એકજ શાલારે.  
૧૪ શી વીઠલ ઇપ નિધાનરે. શાના ડોયેક કામ સભાનરે.  
૧૫ શુશ્વરંતશ્રી મોકુળનાપરે, વરણભુષણુ લાલજ સાથરે.  
૧૬ જેતાં નધણાં ત્રણ ન ધારે, ઇમ અધીક અધીક હી-  
ભાપરે, ૧૭ બહુ જીવને એચારવા કાળરે, હેઠું ઇપ ધ-  
રણું માહારાજરે. ૧૮ સુખ સિંહુ હરિય વિંનાદરે, જે-  
તાં ઉપને માહા મન માદરે. ૧૯ ધાણું અરણું કમળની  
આશરે, ગાયે નિરખે તે પ્રભુનામરે. ૨૦ ધન્ય ધન્ય શ્રી  
દ્વારકાં નાથજરે.

### ધોણી ૧૪૦.

શ્રીનિષ્ઠમણુ ભરણને દ્વાર આદે તો જોવા જરૂરેજણ,  
જનમ દીવસણે આજ મળીને ગાઈઝણ. ૧ વાને છે  
હોલ નિષાન નોભત વાને અતી નવી, ધામ છે કુદંલીના  
નાદ વેદની હૃતી ત્વાં હવી. ૨ બંધીજન બહુ કરે ધ્યાન  
વૈક્રમ જાપ વારણે, મીતોના ચોક પૂરાપ તોરણ બાંધપા  
બારણે. ૩ શી વજભને નવરાપા, કેસરચંદ્ર ધરણાં; મરણન  
કરચા કુલેખ, શેવકજનનાં મન હોચાં. ૪ ઉલ્લેખદક પ્રભુજણ  
નાદી, અંગવસ્ત્ર કર ધરણાં; તેથરી ધીતી ઉપરણાં સાર,  
પ્રભુજીએ પેહેરણાં. ૫ કુમકુમ ભાળ તીલક, અક્ષત સેહે  
ખીળાં; પીઠાયે મેઠા શી વજભ, વરસણું નિરખે લીલા ૬

નોવાને દેવતા આવ્યા, મારુંની પૂજા સમિ; થીકળ કોઈણ  
સાર, દ્વારા ને ને ગમે. ૭ સગાં કુદુંઘ સહુ સામ,  
ભોજન કીધાં પ્રીતશું; ખંડિજન વિવિધ પ્રકાર, ખાડાં ચા-  
ંયા રીતશું. ૮ સરવે વઈમનવનને પ્રસાદી, જુઠાણ દીધો  
છે; એ શાલા નોઈ હરીસ, પ્રિય કરી પાધી છે. ૯  
ઓ લક્ષ્માણ ભરળને દ્વાર આણા તો નોંધ કાઢાયો.

### ધોળ ૧૪૨

ઓ વલભ પ્રગટચારે, શ્રી લક્ષ્માણ ભરળને ધ-  
રરે; પછી રહીએ લીલા કોણરે; પુરીની કરેના પ્રેરરે. ઓ  
વલભ૦ ૧ અપાં અવતી ઉપર અજાળાણરે, નીલોકના તી-  
મર ટાણ્યારે; વાહાલે વેણ અમારાં પાણ્યારે, ઓ વલભ૦  
૨ આદૃથી આવ્યા હરા ધરરે, પોતાનાની કરેના પેર્સે;  
શીખની શેવા ક્રીધી નેરરે, ઓ વલભ૦ ૩ માયામત કીદ્યો  
ખંડરે, પાખંડીને દાદો ડંડરે, એહુનો પશ વાદ્યો નવ  
ખંડરે. ઓ વલભ૦ ૪ એ ઓ શ્રી લક્ષ્માણ ભરળના નંદે,  
બાહુદો પૂરવ જનમનાં ચંદ્રે; વરતાયે છે આતી આનંદે,  
ઓ વલભ૦ ૫ એ ઓ એલગાડના ભાલરે, વાહાલે વઈ-  
ણુ ઉપર કીધા વહાલરે; વાહાલે દાન દાધાં ન્યાલરે, ઓ  
વલભ૦ ૬ નવખંડમા નવા નવા દેશરે, એહુના સુખ  
ગાય નિગમ મિહેશરે; એહુનો પાર ન પામ રૂષરે, આ વ-  
લભ૦ ૭ સુખડાની દેહેરા જાપરે, તાંતો આનંદ દર ન  
સમાપ્યે; હરીદાર વલભના જશ ગાપરે, આવલભ પ્રગટચા-  
રે પ્રગટચારે ૮

## દ્વારા

શીવનમ શ્રીવિઠલ શ્રીજ  
 શ્રવા કરો આત્માં આત્માં શ્રીજ  
 દ્વારા આથરો શ્રીમાહારકૃષુ:  
 ભાજે; અણુસમરપિત  
 ગુરુ મરણ મતીજ. ૨  
 યા સરવે ડોઢ ઉપર  
 જો, તો ધરનો ટૂડ  
 વસરખા લેઝા,  
 નાણેનુ યહનો, તો  
 મન હશીના યુણ  
 દુષ્ટ સંગ યકી દુ  
 કલમાંજ. ૫ રિ  
 હારણ એડી; ૬  
 શા કારણેજ.  
 દુરેલભ હશીના  
 માણો નો, ૭  
 માહારા શના  
 ઘૂલ્ય તણ્ણા  
 વલમ શ્રીવિ

તમારાં  
 હર્યાં ને

દારો ઘેણની શી ભાગા; એ  
 પરણ ક્રીધી માહારી કાપા.  
 સતુછી માહારી સજની, વા-  
 પેડા; ચિતમાં ધર ક્રીધું  
 પેડા શ્રીનાથજી. ત સું  
 વાહાએ માહારે ઈણ સારુ  
 । શુડલા તો તને રથીઓ  
 । તમારી મીઠગે ડેઢ,  
 જુગમાં તે જુવમા-  
 મું શ્રીનાથજી. ૫ ત  
 માહારા હું નથી  
 શરીરમણી, જનમા  
 । ૬

, શ્રીવરણનાથજી  
 આવિદુલનાથજી  
 ૧ વાતમારે ખા-  
 તારારે મહેયા  
 , ભારાને ભા  
 લાખ. ૪ લોરે  
 ચાલે ચીતડ  
 હથી હથા  
 । હુરે ખાલ.  
 ૨, નટવરને

લખે ધરીયા રાથને સાલ  
આ શાકિઅન્ન, ચોતાના ।  
એ લેર એની વાંકડા શી ।  
મનડા માહી બયારે દોક  
અન્ને, વાહાભાને લોવાઃ  
વાહાલાની પાસે ૬ સી ૨  
તો નવ ડરે લોન  
પેન્ના, કાલાને વાલાને

ની સહુડો ચાલો  
લટકાગા લાં  
કરુણા સાગર,  
મુખની શાલા  
થરજો નાઈએ  
લા પુરુષોત્તમ  
અને મુડી  
લા વરણપ  
નિરખતાં જ  
કરોલીમાંડે  
નિત્ય નિત  
ભદ્રાસ  
માહુ સરો  
ત્રય ધર્મ

૧૪૬

રા, શુક્ર પદ્મ એકાદશિલ;  
 એ વાત પ્રભુજીને મન વશી  
 અંગુઠાનાં પુલીએ સો-  
 ધામ, કુંજની કુંજ :-  
 ફી લક્ષ્મણ પાસ, દામી  
 મંદ, એલતા આવ્યા  
 અભ રાજ, શુદ્ધાન પ્ર-  
 માન દીધા પ્રભુજીએ  
 રાથ જીવ થાય વળી  
 ૧૨ણે આશીર્વ મળે  
 એક એક રહે ન-  
 ॥ કુરેન ગળથને  
 હૈય, પવીનાં પ-  
 ૧૫, ૩૫ દીઠો  
 ૧૫ અંન વખ  
 ૧ પ્રેમ ભડીત  
 ૧૬, ૯૮ પ્રભુ  
 રાથ રમણુ  
 ૧૫, ૭૭ત  
 ૧ છુટી અ-  
 વ, ત અંગુઠા,  
 લેણ, ગો-  
 અંગ વલભ  
 તુંણ, પુત્ર

પૂર્ણ વર્ષસ ગાહુ લીધેલ. ૧૨ અને તાદ્રથી જનતે સમદે,  
દન અનુગ કુરેલ; જરે રહે હતી રશ શરણ મળ નિત્ય  
આચરેલ. ૧૩ જરે અમભવિત અનાચાર, આવા જરથી  
ખૂદે ધાયુંલ; જરે આસુગ બુદ્ધિ વીચાર, એઠા રહે કાયું  
ખૂનિ કોણુંલ. ૧૪ જરેલ એ વર છે અંગીકાર, વિસ-  
વાસ મનમાં રાખનોલ; જરે સાધન તજ અપાર, ઓ  
કશ ઓ કદે મુખ ભાખણોલ. ૧૫ જરે પૂછ્યે મારણ  
ઓહ, ઓ બગદ્દી સંગ અનુસરેલ; જરે શી વલભ વરે  
નોય, ઓ વલભનાસ સહૃ રહે ધરેઅ ૬

~~~~~  
ધોણ ૧૪૨

શી વલભ કુલેભ જ્યુગમાં કહીએ, પ્રગટચા આણ્ણીવાર  
નોઃ જુલ્યા જુલ્યા લુલ્યા ૭। પાતાના, તેની કણ સંભાળણે. ૧  
અરણુ કુળ મરકણ સોભાળાં, તેનાં ભાગ્ય અપારણે; વ-  
અત સુધારસ અગણે શાસ્યાં, ઓ સુષ્પોધનીલ સારણે. ૨  
વદન માણુલી કૃપ અનુપમ, કીધા વિવિધ શાખગારણે;  
શ્રી ગોડુણ તો ઇશી વસચો, શી વલભ રાજ કુમારણે.  
૩ નંદા વન શી વલભ સુતશ્ય, ખાંધી પ્રીત અપારણે;  
શાખગાર કરીને ગીણથી ઉત્તરચા, ચાલી આસુડાંની ધાર-  
ણે. ૪ ત્રણુનાર પૂછ્યે પરુંકા, હરયે બૂમીના ભારણે;  
એ વીના આવી કોણ કેપા કર, એછે મરમ ઉદારણે. ૫  
દાસ ગોપાળ કરાં જરી વરણે, સકળ વેદ ચોરી ધર ધીરણે  
શી વલભ કુલ્યા જુગમાં કહીએ, પ્રગટચા આણ્ણી વારણે.

## ધોળ ૧૪૮

છખાલા છણી તારી જોઈએ, રહ્યું છે મન માહારું મા-  
હીરે. ૧ વાંચી વરણી તાહારીરે, મનોહર સુખ પર જાઉ  
વાશુરે ૨ મિરલી અધર ધર ઓપીરે, વગાડી વાહાલે પણાં  
ક્રીદાં ગોપી. ૩ વંડાબન વગાડી સુંદર સ્વામરે, ત્યાં  
કરાણાં ધરનાં ક્રમરે. ૪ જાણું ને હવે શી પેરે થાશે,  
જેપા નિના જુન્ડો લશેરે. ૫ હરેણ ભરાચાં આવે વરણની  
નાશેરે, સાચું જીવોને હવ મોરાશુરે. ૬ કનેહ શા માટે ડી-  
ધારે, હમારા ચિત ચોપી લીધારે. ૭ જુખ્યા મને જોણન  
નવ ભાવેરે, સેજલડીચ્છ નિંદ્રા નવ આવેરે. ૮ સેજલડીચ્છ  
નિંદ્રા નવ આવેરે, જાણું ને હશી આ વેળા આવેરે. ૧૦  
વલાણું વલોપી રહુંડે, માંખળીઆં આવે તો ઉતારે. ૧૧  
સાંલે હુંતો બાવનડી હોણીરે, વાહાલાળુંની વાટલડી જોતી  
રે. ૧૨ માર ધેર આવોને હેલારે, રહીષું મરણદા મલી  
રે. ૧૩ આજ આર આનંદનીહેલારે, ગીરધર જોવા થઈ  
શકારે. ૧૪ આજ મારે દ્વિવાળીનો દીતરે, ધેર પધારચા  
જુગળુંનરે. ૧૫ હરીવર આવતો રૂડોરે, અવિભળ ચાંદ-  
લાઓ ચુડોરે. ૧૬ વઅલના સ્વામી છે રથિયારે, હમારા  
રૂદીઆમાં વળીયારે. ૧૭ છખાલા છણી તારી જોઈએ, રહ્યું  
છે મન મારું માહીરે. ૧૮

( ૧૪૩ )

## દ્વારા ૧૪૬

ચેત ચેત ઓરબળજી તો રહેલું નથી લે, શ્રી ગોડુણ  
શ પ્રભુનું સર્વાપ લે માણ લે. ચેત ચેત૦ ૧ નાશી છોા-  
કલું આરાપ નથી તારું લે; મુદ્દુર્જુદ્ધિયી તેને ઠું કેદેછે  
આરું લે ચેત ચેત૦ ૨ તે સહીત ઠું પા પ્રભુકેરી થરણ  
માણ લે, લીલા પામણી કેવાણી પાંચ વરણુમાણ લે, ચેત  
ચેત૦ ૩ ખાંડું પીવું ઓફાંડું ને ને કાંઈ પેહેરવું લે, અ-  
ચરણ સ્પરશ કરુંચા નિના તે સામુન રહેલું લે. ચેત ચેત  
૪ કલું માણી પ્રીત ડરવી હિંદાસમાંનો, ખીક રાયી  
તે અદોકિની આસમાંનો. ચેત ચેત૦ ૫ એવો અગુણ્ય પ-  
તાપ વલગવંશમાંનો, દાસ પાણ છે શા સારું કું અન્ય  
અંકૃતમાંનો. ચેત ચેત૦ ૬ તારું ધનને નોષન જાણ અ-  
ખમારાંનો, શું સુતો છે મોટ લાળમાં ગમારતુંનો, ચેત  
ચેત૦ ૭ અવધ આવી હલ્લુ રહેણી પણ એકમાંનો, મારે  
રૂક રાયો પૃષ્ઠિના વિવિકમાંનો, ચેત ચેત૦ ૮ એમ કરતાં  
માત પેસી વધુ અંગમાંનો, બાંધ્યો પાસ લેતાં હુત આવી  
સાગમાંનો. ચેત ચેત૦ ૯ ખાંડું પીંડું ને ના વાપરણ  
ડોઈ રૂતથીનો, સગાં લેઈ ચાદ્યાં મસાણુ વિપરીતથીનો.  
ચેત ચેત૦ ૧૦ લાગી પગ એકમાં ભર્સે થણ નિયાંનો,  
ચેત નેમ આંદો તેમ પાછો વરથા વહી ગચ્છાનો. ચેત ચેત  
૧૧ એવું લાળી થરણ રહેલું વલભદેવનીનો, હંચા રા-  
ખરી તે થરણ કેરા શૈવકનીનો. ચેત ચેત૦ ૧૨ ભગવત  
મંડળીમાં એસતાં ના લાજવુંનો, અંઝ હાથમાં લેઈને  
ગાતાં આજવુંનો. ચેત ચેત૦ ૧૩ પાપથી ભરેલા જીવ  
તેણે નહી ગમેનો, શુદ્ધ પૂછિ હશે તતો રાધમાંનો.

ચેત ચેત૦ ૧૪ લાજ ઝૈપેરોથ બોટા ખડુ આગમાંનો, તેથી સુખ ના લેવાયું સનસાગમાંનો, ચેત ચેત૦ ૧૫ વેદ શાખાના ભક્તિ એક સારછેનો, તે વિનાના જીવ જગતના ભારછેનો. ચેત ચેત૦ ૧૬ ને કોઈની પૂછી રશદિન થધ આખ્યાશેનો, દાસ ગતશીને શ્રી ગોડુળ પાસ રાખ્યાશેનો. શ્રી ચેત૦ ચૌરણુછુવતો રહેવું નથી. ૧૭

### ધોણ ૧૫૦

શ્રીગોડુળનાં એક નંદનું ખામ, ત્યાં પ્રગટચા શ્રી સુદીર શામ; કરવા શેવક જનનાં કામકે, ધન્ય જગ્યાદા માંવડા. ૧ અધાંશી આઠમ અજવાણી તે રાતરે પ્રગટચા વનમાણી, માંગન ગાય સહુ વરજનાંથી કે, ધન્ય૦ ૨ તરીયા તોરણું બાંધ્યાં છે દ્વારે, સાથીઓ શુભ તણ્ણો નહીં પાર; ૩ ધી છોડી સહુ નરને નારકે, ધન્ય, ૩ કુદંલી દેવનાં વાણું વાગે, પશુ પક્ષી સહુ પાવસે લાગે; શીકુસનની ભક્તિ સદા મુખ્ય માગે કે, ધન્ય. ૪ સહીઅર સહુ મળી સહુ વારણું જાય, ઘેર ઘેર વાત વધામણી થાય; શીજસાદાને હંઘએ હરાય ન માયકે, ધન્ય. ૫ સહીઅર સહુ ત્યાંથાં ગારી આવેરે, વચ્ચે આભુષણ હરએ પેહેરાયેરે; મન થઈ મંદ્રિમાં માહાસે કે, ધન્ય. ૬ જામક જન મળી જયન ગાય, નંદ પાંધારમાં નાહાનું થાય; હેવા આપને મુખે ના કેહેનાય કે, ધન્ય જ વરજ જન દ્વાલ થયાં તે કીને, એમના ભાગ્યનો પાર ન લીને; પૂછિમાં ધાલ્યા નંદજીને છંપએ કે, ધન્ય. ૮ વેદ કહે એતા પુરણુષ્ટિ, કોપ ના જાણું એનો મર્મઃશાં સુક્રિત કરેયાં નંદજીએ એ ધર્મ

( ૧૫૫ )

તા, ધર્મ. ૬ દિન પુંડળ દિન દર્શભાં જાપ, શીગોકુગમાં  
એલ ખડુ થાપ; શ્રી વલલ વેદ પૂરાણ ગાય કે ધર્મ જ-  
સોદા માવડી. ૧૦

### ધોળ ૧૫૨.

શ્રી વલલ પ્રભુજી પરણસું. શી માહા લક્ષ્મીજી શુણ  
વરણું. ૧ એમની કુચ ઉપર જાઉ ખલીણારી. સુત શી  
ગોપીનાથજી પરવાણી. ૨ શ્રીવિષલનાથજી સુત છે છાટા,  
શુણ વરણુંની શેડે નહીંકણી મિહોયા. ૩ શીર્દીકુમણી વહુજી  
ના પ્રાણપતિ, છાટાં વહુજીને પદમાવતી. ૪ અટ પૂત્રે પ્રા-  
ગણ શીર્દીકુમણી, તેજાંગ લિલક નીમાવન ખણી; ૫ આપદ-  
માવતીને એક પુત્ર હુવા, તેમના વેદ પૂરાણુ જશ હુવા, ૬  
શ્રીનીરધરજીને સંગ ભામની, સોભા લોછ એકિત લેઠદા-  
મની. ૭ શીગોવીંદ્રાયજીને વહુ રાણી, એમને લોવાને  
આંદોલણી. ૮ શ્રી બાળ કાશનજીને ડમળા વહુ,  
એમને લોવાને આબ્યાં સહુ. ૯ શી ગોકુળનાથજીને  
પારવતી, સમતુદ્ય ન આવે રઘાવતી. ૧૦ શી રધુ-  
નાથજીને લનકી સોહોગે એમને નિરખી નિરખી નિજ  
જન માહીઓ. ૧૧ શ્રી જડુનાથજીને શ્રી માહારાણી  
શુણ ચનું રી માહુરી. અમરત વાણી. ૧૨ શીનાથજીને  
સડળ સનદ્યપ સોદ્ધામણુંાં, શાભા લોછ હરીદાસ જે લા-  
મણુંાં. ૧૪ શીચલલ પ્રભુજી પ્રશ્નસું.

( ૧૫૬ )

### ધોળ ૧૫૨ ૫૬

કળયુગ સખ જીવતે અધીકાર્થ, જ જીવમે પ્રગતે ઓ  
શીતળ; ઓ વલબ સુખપાઠ. ૧ જો કોઈ શરણે આચ્છે છત  
કે, તન કોણે આપસ હાથો; દાસ મરણ હરીવાક ધારસતી, મ-  
રણ રેખ નાખપાઠ. ૨ કળયુગ સખ જીવતે અધીકાર્થ. ૩

### ધોળ ૧૫૩

તનકડેરી ભાઈ માંખન તનકડેરી ભાઈ, તનક સુખમાં  
દુખકો દ્વારાં; ઓલતહે તો તડાય, માંખન. ૧ તનકને મન  
મોહનાહે, નેત્ર પઢ્યો લય; કંપીએ જાળે શિથ કંભીયો,  
વશુધા ઉઠી અકળાપ. માંખન. ૨ તનક મારોં ઓહેત  
દિનો, લીએ કંડ લગાપ; સુરે પ્રબૂતી તનકી ચોદીએં, ચુ-  
થત માત ઓલાય, માંખન તનકડેરી ભાઈ. ૩

### ધોળ ૧૫૪

ઓ કુસન કુમળ મુખ નિરખવા, ચાલો શ્રી નાદજીને  
દેરે; જણાદાએ ઓ કરન જનભીએા, હરખીએ આનાદ  
મેરુદરે. ૧ અહૃદ ભાગન કરોં ભુષણા, નાદસુત શ્રી ગોકુળ  
આબ્યારે, કુલી કૂરે વરજ સુંદરી; ગોપી ગોવણાને મન  
ભાવ્યારે. ૨ ગોપીકા સરવ ટોણે અળી, હરને વધાવાને  
લયરે; અંતર ધર હિતાવળા, હરીને જોવાની અપેક્ષાપરે.  
૩ પુષ્પ પવિત્ર પ્રભુજ તણુંાં, થાયછે નહિતમ ગીતરે; ગી-  
ત ગાએને સર શાદાએ, યાયદે ઓકાગ્રાણ ચિતરે. ૪

અહુભાવ્યાં બહુ ભામની; ચાંદ્રા ભાંદ ને કુલેરે, ૫ દરઘતાં  
નીરખતાં પ્રીતસ્યુ માહનને વિષ ૨૦ને લીનેરે. લીડ લાઈ  
ધર આંગણે, ૨૬ જશાદાને મન ભાચારે; વરજ ભામીનાં  
સુખ થાં કહુ, નાયને માતીડે વચાચારે. ૬ માધવદાસના  
પ્રભુજી. પરીતાર રથીર કરી સ્થાપેરે; દાસ ઉપર દ્વા કરી  
વાસ વરજમાં આપેરે. ૭ શ્રી કાસુ કમળ સુખ નિરખના  
આલો શ્રી નંદજીને દ્વારે.

### ધારી ૧૫૪

ને શ્રી વલભ રવકી, નેણે પ્રાણુ પ્યારેકી; ને શ્રી  
વલભ નંદી ટેક૦ પ્રાક્તાં ધરમ રહી માહાપ્રભુ, અપાઠત  
વ્યપુ જાણ; ઓ હરી અનલ તગટશે, શ્રી વલભ ઇ૫ ૧-  
ખાણ. નેશ્રી વલભ હૃવી૦ ૧ શ્રી હરી અતા પાલકે,  
ભૂતળ પ્રગટો આચ્યે; દેવીજી અરપણ કૃપે, નિજ સુખ  
માત્ર સુનાએ. નેશ્રી વલભ૦ ૨ શ્રી વિઠલ પદ પરસેકે,  
હૃત સરસ શુસ્તાતા; અધમ રથત આનંદમે, કરત અમી  
રસ પાન, ને શ્રી વલભ૦ ૩ શ્રી મદ્વલભ ઇ૫ કેણે,  
કેણ કરી શકે અખાન; ગુરભાવ નીજ સ્વામની, પ્રગટ ક-  
ણુ સુલન. ને શ્રી વલભ૦ ૪ શ્રી ગીરધર ગોવીંદાં,  
શ્રી આણકશ ગોકુલેશ; શ્રી રધુપતી નજુપતી ધનસ્તામળ.  
બાળક જણ ભુમેશ, ને શ્રી વલભ૦ ૫ પ્રેણ ભાત ગીરદી  
વર ધરે, શ્રી નવનીત પ્રિયાશી ખાળ; શ્રી મધુરાંનાથની  
કુંજમે, શ્રી વિઠલેશ રણાળ. ને શ્રી વલભ૦ ૬ શ્રી દ્વા-  
રકેશ તત્વ ભાવમે, ગોકુળ શ્રી વરજભુપ; અદલુત ગોકુળ  
ચંદ્રમા, શ્રી મદન મોહન સ્વરૂપ. ને શ્રી વલભ૦ ૭

જુલત પાલનમે' ભાદ્યું, ઓ બાળકેન રમણીય; મારે સ-  
કૃઃ ઉંધિા ખુચો, રસ સખ દીચો ગીરીરાય. ને શ્રી વલભ૦  
૮ ભાઈલીઓ માખુન લીઓ; નેપૂર ખાજત પાય નરે તત્વ  
ખાલજુ, તાં હરખત જશાદામાય. જ ઓ વલભ૦ ૮ ગોપી  
ઓ એહી જગતમે', ખલત ઉખરી ગીત; તીનકે પદ ખ-  
ખનકીએ, ખલત કસેન પરે પ્રીતય, ને ઓ વલભ૦ ૧૦ ખ-  
ન્ય ખન્ય ઓ ગીરીરાજજુ, હરીદાસનમે' રાય; શાન્દ્ય  
શાન્દ્ય ડેત હૈ, તુમ ખળ માદનરાય. ને ઓ વલભ૦ ૧૧  
નમી નખ ખયોત કંખન અચો, ઓ ખાંડ્રાવનકી લોમ; હ-  
૬૫ સુંખી લુતળ ખહે, ત્યાં કુણ કુણ જુમ. ને ઓ વલ-  
ભ૦ ૧૨ ઉભે નીજકુણ ખંખહારિ, તરંગઅંડી જન; ઓ  
જુમનાંજુ, વધકુંઠકો. કચમ કરી કરે ખખાન. ને ઓ વ-  
લભ૦ ૧૩ સુરદાસ કસેનદાસજુ, પરમાનંદ કુંભનહાસ  
ચતુરલુજનદાસજુ; છીતક્ષનામી ગોવીદાસ, ને ઓવલભ  
હેવકી. ને પ્રાણુ-પારેકી. ૧૪

### ધોણ ૧૫૯

રાગશાખી—સાધન સખ સુને ભયે; સુને ભયે જખ-  
ન્ય; ડળિકે ૬૩ ખંડન કીએ, શ્રીવલભ કુળકી છાય. નેએ  
ઓ વલભ, નેએશ્રી વિઠલ૦ ૧ ઓ વલભ વર સમરે નહીં  
આલ અડપલા એલ, તાકી જનની ભારે સુઈ; વૃથા ખળ  
ચો ઢોલ. નેએઓ વલભ. ૨ ઓ વલભ એલ જલો કહે,  
શ્રી વલભ અન્તત વેંત; ઓ વલભ તને એંર ભને, તાકે  
કુટ ગંગેહા નેન. નેએઓ વલભ૦ ૩ ઓ વલભ વલભ  
લો કહે, ખસે હલરા ડોસ; તાકે પાંચિત ઉજરે, જયું

સુરનસે ઉલોદ. નેઘેઅભી વલભ૦ ૪ શ્રી વલભ સમરણ  
વિના, મીથા સખ વીમાર; મુઠ કાગદ કે નાવમે, ડહે  
કચમ કરી ઉત્તરે પાર. નેઘેઅશ્રી વલભ૦ ૫ અભી વલભ આપ  
તમે સુનો, કંધ નરહે કંધ હુર; નેન પલક શુ આરીએ,  
વા આરગડી હુર. નેઘેઅભી વલભ૦ ૬ શ્રી વલભ કેદ્વા તे-  
સખ લખો, સકળ શાખકો ભોર; શીવલભ કુળ જણો  
નહી, કુલ્યો કુટુંબ સમેત. નેઘેઅભી વલભ૦ ૭ અભી વલભ  
વલભ જોભને, સદા સોહલો હોપ; હુઃ ખ લાને દારીદુ  
હુર, વેરી ન ગાંને ડોપ. નેઘેઅભી વલભ૦ ૮ શ્રી વલભ  
કુળકું છાંડકે, ઓર દેવકુ ખાપ; તામુખ પતીઓ કુઠીએ,  
જખ લગ કુઠી જાપ. નેઘેઅશ્રી વલભ૦ ૯ ને વલભ કુળકું  
છોડકે, લેને લરવ લુત; અંતે ઇન્દેતી હોપગી, જુઓ સી-  
પાડો પુત. નેઘેઅભી વલભ૦ ૧૦ અભી વલભ પર ઇચ્છી નહી,  
નહી વાદિનવપર રનેહ; તાડો જન્મ વૃથા ભાએ, જયું કો-  
ગાણ કો ભનુ નેઘેઅભી વલભ૦ ૧૧ હરીજન આએ બા-  
રણો, હશી ન જોડ્યાં હાપ; તેનર ભુતળ ભારંગ થાશ, પેટ  
ધસે દીનરાત. નેઘેઅભી વલભ૦ ૧૨ હરીજન આએ પુરણ,  
માગે ચાર રતન; વાણી પાણી ને સાથરી, સમટ સાયે  
અંત, નેઘેઅભી વલભ હેવકી૦ ૧૩

### ધોણ ૧૫૭

અભી વિઠલનાય નામ રસ અમરીત, પાન સદા તું કરે  
રસના. ૧ વારાવાર કલ્યાં હુંતાથ્ય, અહી નામ જો ધરે  
રસના. ૨ એ રસમાં પ્રતિનિધ પરેતા, તાંસુનું અતી ઉ-  
રે રસના. ૩ હરીકા વિમળ જશ ગા નિરતર, જત વિધન

( ૧૬૦ )

સખ રહેર રસતા. ૪ શી વિઠલનાથ ને તુ અપનો ભલા આહુનો એ મારગનું સારે રસતા. ૫ અતુરભુજ પ્રેર્ણ ગોરધર લાલડો, આનંદ હરમાં ભરે રસતા. ૬

### ધોળ ૧૫૮

ચુંદીર ગોકુળાષ્ટ લેવાના મુજને ડોડ, ને મુજને દેખાઉણે. ૧ જ્યાં છે ભાખ ગોરધરીણની લોડ, તે મુજને. ૨ એમનું સુંદીર સોણામણું ઇય, તે મુજને. ૩ એમને ગોણએ અવની ડેરા ભૂપ, તે મુજને. ૪ સુંદીર શી જુમનાંણનું નીર, તે મુજને. ૫ વળી શાખા બેઠીણના વીર, તે મુજને. ૬ જુંદીર શી કુકરાલ્લિનો ધાટ, તે મુજને. ૭ માહારા વાહાદો કરેન્યાં પાઠ, તે મુજને. ૮ નયણાં ભરીને નિહાળું ગારીરાજ, તે મુજને. ૯ નેણે સાખાં માધવ-દાસનાં ડાડ, તે મુજને દેખાઉણે ૧૦

### ધોળ ૧૫૯

રાગ કાશી — શી ગોકુળ સુખ પાસ બગીલે, શ્રી વલભ વિઠલ ચરેણ સ્પર્શ કીને, અતી પુનીત જુમનાં જણ પીને. ૧ શી ગારીધર ગોર્ણિદ ખાળકરન, શ્રી ગોકુળ નાથ નીરઘી સુખ લીને; શ્રી રધુપતી જરૂપતી ધનસાંવળ, સખ મંદીર દરથન નિય કીને. ૨ રમય રેતો પરમ મનોહર, દીક્ષાનદી જાણે લાદી લીને; વલભ છોકર છાંય નારંતર, વ-હસ્તર સંગ ધેરાં રસ ભીને. ૩ શી ગોકુળ સુખ પાસ બસીને.

(૧૬૨)

ધો. ૧૯ ૧૬૦

વિપ્ર શરીરમણ ગૈલં ગનાથ, તેમાં શ્રી લક્ષ્માણ ભડ વી-  
ક્ષાત; પણી જી અનંતાળ સાંન, તે કુણ પ્રગટચા આનલભ  
નાથ તો, વાન શુણો વશુવાનરિ, ૩ હેવનાં કુંદભી વાનાં  
વાણેતો પૂર્ણના વૃદ્ધિર હેરિ; ચંદ્ર ઉગે કમાણાપુદ્ધાં તો,  
કુમણ કુદ્ધાં રવી લોઈનેરે ૨ તેમ તેમ ભક્ત તણાં મન  
કુદ્ધાં, જગન પૂર્ણ પ્રગટચા સેસીએ; કણલુગ જીવ. ઉધાર  
વા કાન્દેતા, કષ્ટિનવને સ્પૂણ આપવારે. શ્રી વલભ દેશન  
ફુલમ હેણ તો ભાગ ભલાને પારીએર. ૪ કાપાદ્રણિટ  
ને ભજૂદી ભલે તો, ડેઢી માહા કુઃખ વાસીએર; ભાગાં  
સાંકટને ફર ચાંપ; શ્રી વલભ નેતાં જમીસુખ, શ્ર-  
વણ પાન કરાં ભાગી છેખુઅ એ ચરેણે ને અથ્યા જીવ  
તે ચરેણે કમણ હેઠા મણ્યારે. ૫ જાવસાગર જન ગયો  
નાખરાજ્ઞા તો ચ્યાળાગતાં વાર કેટલીરે, ઉજ્વળ નિરમળ  
એ ગારગ તો, નેમરે ગંગાનળ વાજનારે. ૬ અનેક ડોઢા  
મારગ લેતા ચ્યાંબાં, અચીક આમને છાજતારે, નામ સમર  
પણ આખાં ને જતાં તો, આનન્દ શેવડ થવા ભાવશ્યારે.  
૭ ઘેર ઘેર શોગા સોંપી ભડતને પ્રેભનાન લડાવશ્યારે, ત્રણશુ  
વાર પ્રથિ પરિક્રમા, ગાયવાદીના ભાગીછે પ્રજ્ઞા; ૮ંડ  
અંડગાં રાધાં ધર્મ તો, ધર્મ ન જણે એ કુળ તણારે. ૯  
આ સુખ તિલ્ય છાંડે તો, લીલા લભીત એ કુળતારે;  
આનંદ અગળ નિન્ય એ છબતો, તાં પ્રગટચા; શ્રી ગોડુણ  
ધર્ઘણારે; કંપા દર્શિછે કામ કુરીનો, કલ્પદરમ શીવલભજનર  
રે; ગંગા પ્રભુ શ્રીહેવડી નંદા કલ્પદરમ શીર દાળીયારે.  
વિપ્ર શરીરમણ શ્રી તૈમંગનાથ.

( ૧૬૯ )

## ધોણ હેઠળ

શ્રી વલભ વિલભ શીજુરે રમવાને આવો; શ્રી નવ નિત્ય  
પ્રીતાજી નાહાતારે. સંગ તેડાને લાવો. ૧ શ્રી બાળ કને  
જુ બાલુડારે, અનડાચે આવો; શ્રી નથવરજી પ્રાણ પારો  
રે, એમને તેડાને લાવો. ૨ રમવું જમવું રંગેરે, વાદાલાની  
સંગે; કલ્યાં હમારાં માનેરે, શું થાઓછો ૩ ગે. ૩ શ્રી  
ગોસાઈ માહાત્માજ તમને કરુંધુરે, ગુજરાત પધારો; ૪ંથાં  
સર્વેને દર્શન દઈનેરે. પૂર્વિ માર્ગ પધારો. ૪ સહુંને સમર  
પણ આપોરે, તેહુંવાં એમને આપો; સહુ વહૃસ્તવને  
તારચારે, હેવા એમને તારો. ૫ મધ્ય રતે મંદિરમાંર વાં-  
સલડી વાગી, ભર નિદ્રામાં સુતારે, અખકીને જગી. ૬  
ઓચંતી અળછુરે, બારણે આવી; પાડે. થણુને પ્રશ્નુરે,  
મારલી ક્યાં વાગી. ૭ ને તારા મંદિરમારે, વાંસલડી  
વાગી; જુમનાળુની તારેરે; મારલી ત્યાં વાગી. ૮ શ્રી પુ-  
રુષેતભજ માહાત્માજ તમને કરુંધુરે, શીજ ૯ ર પધારો;  
શ્રી બામની વહુજીનાં દાઢારે, જુમનાં પાન કરવા સધારે.  
૧૦ ચરણ સરણ એમને રાખોરે, એટલું છે ડામ; અહીં  
નિશ દરશન આપનોરે, દૂર તમારું નામ. ૧૧ શ્રી વલભ  
વિલભ શીજુરે, રમવાને આવો.

## ધોણ ૧૬૯

સરવે સંધયા સમાજી મળી આવોકે, ગીરધારી લાલ-  
જુને માનાચે વધાવોરે. ૧ ચરણાં જીવો શ્રી વરનજીએ-  
ણુજીના લાલરે, દેખનીજ વર્ચમન ડેરા વાદાલારો. ૨ રમ

કુમ કાંખરી કુદરી વાન્નેરે, લીલા જોપા વિના મન દા-  
નેરે. ૩ ક્ષાણુ ક્ષાણુ વાહાલો. કૃપા દ્વાદિ જુઓરે, વાહાલ  
ઉપજથે વાહાલો ભીડી વેળેરે. ૪ મુખ પૂરણુ સરદ સરી  
રાનેરે, જોતાં સજજન ચ્કોર વારાનેરે. ૫ અતી કદી નઢી  
સેડીએ જુણી ધોતીરે. ૨૭ કાંમની કમળ મુખ જોલારે.  
૬ ઉપરથો આંકી ઉભા પ્રભુ પાસેરે, દરતા આરતી ન નિર-  
ઘ્યા ગોકુળદાસેરે. ૭ સરવે સેવર સમાણી મળી આવોરે.

### ધોળ ૧૬૩

શ્રી વલભ દુલભ કુગમાં કહીએ, તે પ્રગટચા આણી-  
વારજી; કુદ્ધા જીજ પાતાના, તેણી છેવા સંભાળજી ૧  
અરણુ કમળ મકરાંદ લોભાણા, તેનાં ભાણ અપારજી;  
વચન સુધારસ અગણે સીએ, શ્રી સુધારની સારજી. ૨  
શ્રી ગોકુળને કરી વસાંયું, શ્રી વલભરાજ કુમારજી; શેના  
શ્રી ગોરીધર લાલની, કરવા બહુ પ્રકાશજી. ૩ કરી થયુ-  
નાર વાહાલો ગોરીથા ઉતારચા, ચાલી આંસુની ધારજી;  
પનક એક રહેવાય નહી પીયુ વિના, એછે પ્રાણ આધાર-  
જી. ૪ મનુશ તન ધર્ય લીલા કીધી, પૂરણુ ખાલ્ખણ સા-  
કારજી, નાણવાર પ્રથિત પરીક્ષમા, ઉતારથો જુભીનો ભારજી.  
૫ એ વિના હેલી કોણુ કાપા કરે, એ છે પરમ ઉદારદ્દજી;  
૬ એ એમાં સંહેદ આણો, સકળ સારમાં સારજી. ૬ દાશ  
ગોપાળદાસ કચાં લગી વરણું, સકળ વેદ ધારીજી; શ્રી વ-  
લભ દુલભ કુગમાં કહીએ, તે પ્રગટચા આણીવારજી. ૭  
શ્રી વલભ દુલભ કુગમાં કહીએ.

( ૧૬૪ )

## ધોળ ૧૬૪

ગોકુળની ગોપીઓરે ચાલી જળ ભરવા, રામણીઓ  
સંતમુખરે; આવ્યા માહારું મન ભરવા. ૧ આતે શું એ-  
ચરણરે, આવ્યા માહારી સેરડાએ, કાઢ હું નજ પાલુંરે.  
એ એજાવેછે. ૨ માઝન માહાનરે, માયા લાગીછે; જીવાય  
ને જોઈતરે, ધર વંદ્ધો ભુલી. ૩ હાંરે મને સાયણ ગમેછે  
રે, એ વરનો લટકો; આગળાઓ નણગયોરે, વાહાલો આવે  
છે. ૪ એ અમ વહુ વાડરે, લાલા લાજ ભરવાં; એલતાં  
ખીલરે, કંથે કેદ કરવાં. ૫ સાસુલડા સુષુષેરે, નાણદલ  
નાહાની છે; માધવના રવામીરે, અન્તની ધડી એ. ૬  
ગોકુળની ગોપીઓરે, ચાલી જળ ભરવા,

## ધોળ ૧૬૫

સાચા સાચાંધીના, શ્રી ગોકુળ ક્યારે જધશું, આપણું એ  
એનડાએ વગળા; શ્રી શ્રુગનાંજીમાં નાહીશું, સાચા સાચાંધી  
ના. ૧ ગોકુળનીઆના ગર્ની ગર્નીએ, શુણ ગોલીંડાન ગાઈ-  
શું. સાચા ૨ શ્રી બીરધારી અલખેલા જોઈ જોઈ, મન  
ચીતનાં લાડ લડાશું. સાચા ૩ લીમના ઠાકોરને જઈને  
ભોગશું, સદ્દ સોણગગુ ધરશું. સાચા સાચાંધીના શ્રી ગો-  
કુળ ક્યારે જધશું. ૪

## ધોળ ૧૬૬

ભલે ગોપાળ ભુન મત લાએ, મનુષ્યા દેહાંક એકીછે  
લાવો. ૧ શુરૂ શૈવા કરી ભગત કમાઈ; જળ તે મનુષ્યા  
દૃષ્ટિ પાઈ. ૨ એ દેહિત સુપરો રેવા; દેહ ધરી કરીએ હરી  
શૈવા. ૩ સુતોહો રાત શરૂઆતી શુત; કરો દોએ અરૂ રા-

ज्ञा प्रीत. ४ प्रती उठी श्रीकृष्ण कहे; ज्ञेही इण मागेसोऽप  
पावे. ५ उने हांडिरको दरशन आयो; ६ वन जन्म सहृदय  
करी लीयो. ७ ने हांडिरकी आरती करे; तीन लोक ताकु  
पाय ८३. ७ ने हांडिरको करे प्रणाम; वधुकुंठ ऐत ताकु  
निज धारा. ८ ले श्री हरीडि सुमरे नाम; ताकु कुण्ड  
नित्य पूराण काम. ९ ने हांडिरको ध्यान लगावे; धूरुन  
प्रदहादकी पदवी पावे. १० उने हांडिरको चरणामृत लीयो;  
वधुकुंठ लोक अपने धर आयो. ११ ने हरी आगे आ.  
उन घलवे; तीन लोक राज्यधानी पावे. १२ ले हरीडि  
शनान करावे; धर्मयोनीमां कथहु न आवे. १३ ले श्रीहु-  
रीडि करे शाश्वार; ताकु पूराण करे अणीडार. १४ ने  
हांडिरकु तीव्रक धरावे, ताको महीमा कहत न आवे. १५  
ले हांडिरको कीरतन सुनावे; ताकु हांडिर निकट भालावे.  
१६ हरी मंदीरमां दीपक करे; अ धुरुप अवगां नही परे.  
१७ ने हांडिरकी सेन भीछावे; निजपदपावे दास कहावे.  
१८ हांडिरको पालने कुनावे; वधुकुंठ सुरु अपने धेर लावे.  
१९ ने हांडिरको धरावे भाग; ताकु परमानंदनित्य ज्ञेग.  
२० पाय पदभी वर्षाहामात; ता सुअङ्गी कथुं कही न ज्ञात  
२१ ज्ञाल मंडली सो गोपालगु गावे; सो हांडिरको सभा  
कहावे. २२ गोकुण गोपरघन लो लीला गावे; चरणकुण  
रस तथही पावे. २३ ने वधशतन विनेकी लाय; ताकु राजत  
नित्य प्रतो हैंप. २४ श्री लाभवत सुनो आनन्द करी; २५  
इह असे श्री हरी. २५ ने हांडिरकु भाग धरावे; श्रीप ता  
इण तथही पावे २६. ने करे गृहसना वृण पान; सो हांडिरके  
रहे सतीवान. २७ हरी मंदारमां करे युहारी; कथहु न  
पावे जमकोप्यारी. २८ नेहु श्री हांडिरकी गागर आणी; पधुकुंठ  
अपने स्थान हरानी. २९ उने हांडिरको मंदीर लोयेः

મનુષા જનમ તેહે જન જીત્યો; ૩૦ જેને ઠાડોરડો શીથિા  
ખીનો; ને તે તાર્ય તહેને કીનો ૩૧ ને ઠાડોરડો એને કુલ;  
સદા અસે છાળંદ્રી કુળ. ૩૨ ને ઠાડોરડો ભાળા પેહરાવે;  
સદા સરેવદા ભગતહી હોવે. ૩૩ ને ઠાડોરડો અંદન ભગાવે;  
શ્રીબીજીધ તાપ સાચ મનકે જાય. ૩૪ ને ઠાડોરડો બાસન ધુવે;  
સદા સરેવદા નીરમળ હુવે ૩૫ ને શ્રીહંદીડો કિરતા કરે,  
મુદ્દિત ચાર તાડે પાય પરે, ૩૬ શૈવામાં ને આળસ કરે; કુદ્ર  
હોય કરે કરે મરે. ૩૭ મનુષાશું નો શૈવા કરે, તઘણી શૈવા  
પૂરીપરે. ૩૮ શૈવામાં નો શંખય લાવે તે કાટીક જનમ  
પ્રાસ્થિત પાવે ૪૦ વેદ પુરાણ શ્રી ભાગવત ભાયે, સમરા  
સાચ વરેજ જન ચાયે. ૪૧ શૈવા હીને અદભુત રોત; શ્રી  
વીઠભનાયશું રાયે પ્રિત. ૪૨ ઓ મહાપ્રભુને પ્રગટ ઘતાઈ,  
કુપા ભઈ તથ મને આઈ. ૪૩ શૈવાડો કણ કહ્યો નવ  
ખાય, ચ્યા સુખ સમરોં ઓ વભભરાય. ૪૪ શૈવાડો કણ શૈવા  
પાવે, સુરદાસ સંભે બલ બલ જાવે- ૪૫ ભનો ગોપાય  
ભુખ મત જવો.

### ધોાઈ ૧૬૭

આવો મહો સાહેલડીજ, કૃષ્ણ કૃષ્ણ ન ભાય, માં-  
હે મહે વધામણાં, પ્રમથા શ્રીવિઠલરાય. ૧ નવ સત  
આભાગુ અંગેસન્યાંજી ચાલી વરેજની નાર; અતી આ-  
નંહે ઉમંગી ભર્યાજ. પોહાંતાં ઓ વલલ દ્વાર. ૨ ધન્ય  
ધન્ય, ઓ વલલ ધર્યાજ; ધન્ય શ્રી અકાજ માત, ઓ  
ગોકુળાયંદ પ્રગટિઆજ, શ્રીગોપીતાયાજના ભાત. ૩ આ-  
પણુને સુખ આપવાજ, શ્રીવલલ રાજકુમાર; કર્મ ગોકુળ

પદ્ધારીએ, અખળાના આધાર. ૪ દૂરપર ચોણ ગીજ, હુદ્ડામાં હુલી હામ; તે પ્રલુલુ પદ્ધારીએાજુ, પુરવા નીગ-  
મના કામ. ૫ માગશર માગ સોહામણોજુ, સોહામણો;  
નોમીનો દીન; કંદન પખવાડીએ પ્રગટીએાજુ. શીગોકુણ  
માંણી રતન. ૬ રાત્ર દીવય સેષે સહાજુ, ઘજ્ઞાદિક ભા-  
હેણ; દરથન માત્ર આપે નજીજુ, સપનાતર નવ સેય. ૭  
શ્રષ્ટ સહસ્ર સુઝે સુતી કરેજુ, નિગમ ના પાસે પાર હે-  
વીનાં હુલુ ટાળવાજુ, પ્રગટ્યા જાજીવાર. ૮ શીવનભજુ  
ના લાડીલાજુ. શીપદમાવતો વહુજીના કંથ; ભગવદી ભાવે  
લીણીએાજુ, અઠંડળ પૂણ્યાનં. ધેર એ છું અતી ધર્ણે।  
૯. વાને તાલ અદંગ, માનુની મંગળ ગાયજુ, હુદ્ડાએ  
ધરી ઉમંગ. ૧૦ કુન્ઝ કુન્ઝ કેસર છાટણાંજુ, બલટ અંગ  
ન ભાય; તરીએા તોરણ બાંબીઅંજુ, માતોના ચોઢ  
પૂરાય ૧૧ ગાય અતી સોહામણાંજુ, પ્રગટ્યા શીવિહલનાય;  
દાન આપે વિનિધ નાય, ઉંદરભી વનભનાય. ૧૨ બંદી  
જન બહુ પણ બણેજુ, શીરણજીવા રાજકુમાર તલગ તી  
બદ્ધ તોલ્યાન પણ્ણાજુ, શીગોકુણપાની આધાર. ૧૩ શી  
વખન ધેર પ્રભીએાજુ, પુરણ ઘજ્ઞ જુગદીએ; સડળ કુળ  
કળીકાળમાંજુ. પ્રમટ્યા પ્રાણુ છથ. ૧૪ કળયુગ જીવ ચ્યાધા  
રવાજુ, ટાળવા નોમીનો ભાર, વદનકમળ અવિલોકીતાંજુ  
પાણેંતી મનડાની આય. ૧૫

### ધોળ ૧૬૮

શી વખન વીઠન હરીના જાણપા તેણે સરવસ આયુરે;  
૨૪. શું લાબ્યા શું લઘને જાણા, વારંવાર વહેવાઆરે. શી  
વખન ૧ પૂર્ણ માર્ગમાં ને જન આબ્યા, વિસ્ત્રાસે ના

વળાંડાં; શ્રવાનું ઇણ શ્રવા થાણ રૂપું પ્રમાણે ભેનારે, શ્રી વલભ૦ ૨ સંપત્ત પ્રમાણે સમપરીત લેજે, તેનું નામ તો શ્રનારે; શ્રવા કરણે ને પાખંડ ઘરણે, તે અયડાતા ગણણે. શ્રી વલભ૦ ૩ જાન વિતા ને ભક્તા કરણે, તે પથરટેમ તરણેદે ગુરુ સાલે આચરણ આણાં, તેને તે ખર કદ્દી-એં શ્રી વલભ૦ ૪ આધુનાસ તો એઠલું માગેછે, તેના રૂપાં ના રહીએરે; શ્રી વલભ નિષ્ઠા હુણી ના જાણ્યા, તેણે સરદાર આણુંર, ૫

### ધોણી ૧૬૯.

શ્રી વલભ પ્રભુજુને શરોળું .. જાયો, જનમ અપનો જારીને, પેસ તોતે કદું ન આચારયો, ઉદ્ર ભરી ન ગ્રા સોયોરે, શ્રી વલભ૦ ૧ અદૃત સુધરસકી આહતા કીણી, મન પાણું જાયોરે; શ્રી વલભ૦ ૨ શુર કહે શા અગાઉ ચેત્યે, નેતન ભરભર રોચેરે. શ્રી વલભ૦ ૩ શ્રી વલભ પ્રભુજુને શરોળું ન આયે.

### ધોણી ૧૭૦

વળી વેગે દરથન આપીઓં, લાદ ગોવરધન ધારીરે; કરે ૧૩ પેરે વરાણીં, સુખપર જાહી અલીહારીરે. ૧ શાભા સુદીર લાહારી શી કદું, માહારે સુખ રસતા એકરે; શ્રેનાગ કહેવા સમર્થ નહીં, કહેણ જીવ કોણ વચ કરે. ૨ જી સોદાને નાયણે નાંદ્રા તણ, ધમ રહી આતુર નારે; વરાના જીવન માહારો વાલણો. કરણે અગારી સાહારે. ૩ ચોડાં ગાહે કણું કમ, વીનતી પિતડાનાં ધરણેરે; દિન નાણી દાનાનાથજી, તાપ ત્રીવિંત તણ્ણાં હાજેરે. વળી વેગે દરથન આપીઓં.

## ધોળ ૧૭૨

શ્રીવલભ કુળ વરજનું જીવણ, ખન્યારી વિઠન પ્રભુ પ્ર-  
ગટીયારે; વેદ વહિતકેત ઓ ભાગવતસત, ભક્ત મનોરથ  
સરવે સરચાંરે ॥૧૩॥ જુરે ભક્ત મનોરથ સરવે સરીયાં  
તે વરજનાં કાજ; શાહસ્ય શકું પ્રમાણે કહે, પુરશાતમ શ્રી  
વિઠલનાથ. ૧ એક રસનાંએ ક્ષ્યમ કહું, રસતણો અધિક  
વિસ્તાર; જીજ જાણુવા નોગ નહીં, પણ અતી ન પાણે  
પાર, ર મન ઈચ્છાએ માહારો વાલમી, પધૌરેચા ઓનાથ  
જ દ્વાર; અધીકારી આશ કહે, રથ સાતવા નિરધાર. ૩  
મીજન કરી પદ્મારીઆ, વાહાલે વચ્ચ પેહેરચાં સારે, કંઈ  
માં આરોપીયો, ઓનાથજીનો ૪૨. ૪ રસ ભરચાં સામગાં  
આજુર ઇદે ભાવ અપાર; હાશ વદને વચ્ચન કહે તે, સાં-  
ભળે નર નાર. ૫ વર્ષશનવ જ્યુથે પરવરથાં, શાલા તણો  
નહીં પાર, તેરંગ લીલા વાયુ વેગે, આંણીયાં સંગ દ્વાર. ૬  
પેંગડે પગ દેઈ નાથ ચઢાયા, વારૂ કોણીક કામ; ચોપાસ  
વર્ષશનવ માંડળી. શાના તે સુખનું ધાગ. ૭ સખીસે  
પધારીયા, જ્યધ નિરખી આતંક કદ; ચડોરની પેરે ભામ  
ની, નિરખે તે શ્રીમુખચંદ, ૮ ધોળ ગાયને શ્વરસોહાયએ,  
ઓઝુમનાંજીને તીર; દુરથી અવિદોક્તાં, નઈછે તે ટાળે  
નીર. ૯ વાલમી વેગે નાહાવા એઠા, પાર પોહોયા જાસું  
ઇંદ્રાસન વારળો, આ રથ કાંઈ વાર. ૧૦ પદ અષ્ટ લોકે  
કથા પ્રસંગે, ચિંતા સહુંની જાય; લીડ રથ પાછળ ધર્ણી,  
આણ્ણ અગ ન માય ૧૧ જુરે મારગ સુખ થાં કહું,  
કહેતાં ન પાસુ પાર; અથ્વ બુધ્ય મદ્દ મારી, ક્ષ્યમ કરું  
કર વિસ્તાર. ૧૨ જુરે સમેતાં સુખ થાં કહું, વાલમી

એવા નાહાવા; ને ને દ્યાના છું છે, તહેણે તે તેવો  
ભાવ, ૧૩ નાય નિગમિ નિકટ પોહોણાયા, મન કુણ અંગ  
ન માય; અવિદ્યાક વાપા આતુર ધણા, વાદાસોળ વેગે  
નહે. ૧૪ જીરે નાહી ધોતી અંગ ચેહેરા, તીજક કાધાં  
સાર; ઉપરણો ઓઢી કરી, પચાશીયા આખાર. ૧૫ પ્રથા-  
મ પરવતને કરી, જઈ લોપા શી સુણ ચંદ્ર; દુષ્પદાં લેઈ  
દંડવરત કરે, અવિદ્યાક શ્રો વલભનંદ. ૧૬ આરતા સેન  
શણગાર ભોજન, નિત્યનો વેહેવાર; ઓણી પેર અનુભવ  
કરે, શ્રી વલભ રાજકુમાર. ૧૭ ઓણી પ્રકારે જન ન ર  
દ્વા, શી નાયજીને દ્વાર; આનંદ ઓછાં અતી ધણો, મ  
ન કુલનો નથી પાર. ૧૮ ઓ નાયજીને નીરખા, નિજ  
ગ્યાન કરે સહુ સાર; અનુભવીને અનુભવ ધણો, કેદીનાં ન  
પ્રીણે કાય. ૧૯ જીરે પરપરના સુનુ ઓહના, ઓડી જા-  
ણી ભાંત; જીવનો ડોષ આશરો, ને કરે ભાણી ખાંત.  
૨૦ જીરે નાયની ગથી જિતસ્યા, વરજ આલવા નિરધરી;  
કંઈ હારને હાય “ાડી, લઃકા વરજરાય. ૨૧ જીરે નીજ  
મંદીર પદાશીયા, ભોજન તણો વેહેવર; પદ્ધ પેહેરી રથ  
ઓઢા, પ્રાગુતા આધાર. ૨૨ પ્રભુજીને ગતમાં શાસ્ત્રના, ર  
રક્તા અધુર રસાણ; તને વેણે જુન ચરણુ, આતુર રમ-  
ણુ ગોપાણ. ૨૩ દરજમાં તે આવી વધામણી, સાંભળી  
સહુ નર નાર; હરણે તે હઠડે ભલપરી, ગુજરાતી કેરા નાર  
૨૪ વરજ જુથે જુથ ગત કુલાને ઉલ્લી, જોવા પ્રાણુ આ  
ધાર; ધાળ આધનદસતું, ગાંગાં ને ઝુલ્લ વારતાર. ૨૫ જી  
શુણે તે શાભીતો સાથીઓ, ઓકમાં ચિત્ર રસાણ; મારગ  
કદળીના સ્થાલ રોાયા, આવતાં આધાર. ૨૬ પ્રાતે તે પ્ર  
લુજી પદાશીયા, નેની શરીરે ન સમાય; શરીર કરી શ્રી

નાયલુ. આવ્યા બેદક માંહ. ૨૭ આરતી કરે ઓનારણ્ણાં  
વાસાલે નડતારી પરી આશ; જુગ જુગ જુરો માહારા વા  
સા, ઘરી જાય ગોપાળદાસ. ૨૮ શ્રી વદ્ધમલકુળ વરજન-  
નું જીવણ.

### ધોણી ૧૭૨

ભલે પ્રગટ્યા શ્રી ગોરીવર પાણીલાલ. શેવક જન સુખ  
કાંખેણુઃ જીરે આતંક મંગળ જાય, તોરણું પાંદ્યાં આર-  
ણ્ણાં. ૧ જીરે ધન્ય શ્રીરૂપભાઈ આય, કુંબર કુમારે પાર-  
ણેણુઃ જીરે વરજ બધું નારખનાને જાય, નારખી હરાખી  
જાય વારણેણુઃ, ૨ જીરે સુરપતી કરે નારથેશ, ઠોલ દદામા  
વાગીભાણુઃ; જીરે વધસના જન કરે કલોલ. પ્રગટ્યા શ્રી  
ગોકુળા રાજુઅાણ. ૩ ॥ધોણી॥ ભલે પ્રગટ્યા શ્રી ગેર-  
વરધારી લાલરે, નીખ શીખ સુંદીર હેપ રશાળરે. ૪ શું-  
દીર શુભગ શાહામણ લાલરે, લાલ કેસણું તીંક ખારાને  
લાલરે. ૫ લોમન ચંચળ મીન સમાનરે, નાથીછા ઝુરયાચુ  
ધનુણ ડાનરે. ૬ તેને તે ને વાંલોવન મોહાયેરે, રેલ જ-  
ડાત ડાને શાહીયેરે. ૭ ઉપર દસે માતીરે, વદન સુધાકરે  
નોતીરે. ૮ ધર ધર શુંદીર મંગળ ગાપરે, વાહ લાળુને ની-  
રખપાને જાપરે. ૯ કરચી કંચન કેરી ધાળરે, મધ્ય સુ  
ગતાદ્યાનો હારરે. ૧૦ આવ્યા શ્રી વિદ્જન રાયજીને દ્વારરે,  
નારખના શુંદીર શ્રી ગોરધર લાલરે. ૧૧ નારખી એ વારણે  
નાયરે, સુખ લોગા જમ ન ધાપરે. ૧૨ એ સુખ અનુભ-  
વીઅારે પ્રમાણે, વરજભુખણું કાયમ કરી વખાણુરે. ૧૩  
ભલે પ્રગટ્યા શ્રી ગોરુંદધારી લાલ.

( ૧૭૨ )

## ધોળ ૧૭૩

અતુરબૂજ છે આરે, રૂપાળા રથીઆ, મુખ મનોહર  
 સુંદરે, શરીતા તીર વથીયા. ૧ અરાણ કમળ ચોત માર્દે,  
 ધૂખશીને ધમકે પાપ વીછવા પેરચારે; જાંઝરને ઠમકે. ૨  
 સ્વેત શરીરે અંહનરે, આનંદથી અરચ્યું; કસ્તુરીનું તીલકરે,  
 અંદન અંગ અરચ્યું. ૩ કાંને કુંડળ લણકરે, અળકે ચુની  
 ચાડે; ભાગ લકુદી નિરખીરે, મન માલ્યા માહારે. ૪  
 અતિ આલ્ઘાચાળી આંખેરે, કાળજ કોરાણું; કીકી કામ-  
 ણગારી; ચિત તેથી ચોળાણું. ૫ પીળા પટકા લણકરે, ચટકે  
 માખડાચો; જમાછે જરકથીઆરે, કરકસી રાખડીચો. ૬  
 મુગટ લટપટ લણકરે, માતનની માળા; રતન સિંહાસન  
 રાન્ધેર, રથીઆ રૂપાળા. ૭ પ્રભાસેકરતા સ્વામીરે, વથીયા  
 ગુજરાતે; ભાવ કરા સહુ ભેડેરે, કરણાંધારી તે, અતુરબૂજ  
 છે માર્દે રૂપાળા રથીયા.

## ધોળ ૧૭૪

શ્રી વલભ પ્રભુને કરું પ્રાણામજી, જેને કરી હોય પુરણ  
 કામજી. ૧ રંગ રસોલ અદ્ભૂત જૈનું નામજી; સકળ છે  
 સાથ ન લેતાં નામજી. ૨ ટેક. નામ લેતાં ઓવલભ પ્રભુનું  
 ફલમીથનો હોય નાથ; એવી દ્રદ્રતા આબ્યાયોરે, શેહેજ  
 ઉપહાસ. ૩ ઉપહાસ સહી ઉપરાંત પામે, અનલ પણ  
 નવ કરે; શ્રી લક્ષ્મણ સુતની કર્યાયો, શહેને ભાવસાગર  
 તરે. ૪ શ્રી વલભ પ્રભુ પ્રગટીયા, જીવની કરવા પેર; ભવ  
 જળમાંહ મન દૃષ્ટિ, ધરુ મનમાં ચેરેર. ૫ વિચાર કીધેલા

શ્રી વલભ પ્રભુજીએ, પોહાચાયા શ્રી જુમનાં તરી; આવણ  
 સુદી એકાદશી, મધ્ય નિશાં શ્રી નીરીજર ધીર. ૬ તે સમી  
 શ્રી વલભ પ્રત્યે, બાધ્યા શ્રી નાથ; અધોર કળદુગ હૃદી  
 જીવને, સોંઘ્યું તમારે હાથ. ૭ અસ્તી શુદ્ધનો નિસ્તરાર  
 કરેવા, વિચારયું મેં લેણ; નામ ઇણી નાહાન બેસારી, ભવ  
 પાર કરવા તેણ. ૮ ઘ્રતીસ દ્વાદ્શ નીવરતશે, ધાર્યે નીરમળ  
 તન; માહારું ભજન અરતન અવળું કરતા, સદ્ગ પ્રકુલીત  
 મન ચાલે સેંદ્ર પ્રકુલીત, મન હરી ગુણું ગાયજી; ૧૨૩૫  
 શેવાનું તા, કૃષ્ણ તેને ધાયજી. ૧૦ અન સમરપી વરસુ  
 નેહજી, મનમાં જાણી નીચે હેવી તેહજી. ૧૧ ક્ષ્યમ ગંગા  
 જળ નીરિધ પ્રકારજી, તેમ આ મારગ છે અતી સારજી.  
 ૧૨ વિચારયું છે તે નારધારજી. ૧૩ એમ કરી પામ્યા અં-  
 તર ધ્યાનજી, શ્રી વલભ પ્રભુજીએ. વિચારયું છે જ્યાનજી.  
 ૧૪ ॥ દાણ ॥ તાણ વિચારયું શ્રી વલભ પ્રભુજીએ, જીવનું  
 કરવા કાણ; શેવા સ્પરણ સોંઘ્યું, શ્રી વલભ પ્રભુજી મા-  
 હારાજ. ૧૫ આત્મા આપીજીને, તમે કરાએહ પ્રકાર; ૧૬ ક  
 જાણી શ્રી નાયજીએ, કરો અગોડાર. ૧૭ તે કાળે કુમારો,  
 સાથ જીવ બાધ્યા જાપ; શ્રી વલભ પ્રભુની રૂપાધકી, માહા  
 પતીત પાવન ધાર. ૧૮ એવો ધર્ય વીસ્તાર વાદ્યો, નર્ધ-  
 લાક ચાલી વાત; પ્રલસન ધના અહણિથા, ન હોયકાળનીધાન.  
 ૧૯ પુછિ મારગ રોણીએ, પુછિ તે પ્રગટો શુરે; ઘ્રતીશ ને  
 દ્વાદ્શ જીવના, તતક્ષાણ કીધા દુર. ૨૦ વીના જાને વીના  
 ધ્યાને, વિના લેણ આચરેણ; લેમ તેમ કરીને જીવ રહે,  
 શ્રી વલભ પ્રભુને શરણ. ૨૧ લેગ ધ્યાન જ્યે તપ વીના,  
 જ્યે નીરાતર ઓક; સરવસ છાંગો નામ નિશ્ચે, રાખીએ મન  
 ૨૨ ૨૧ હું કરમારીને કરું વીતની, મુને શરણે રાખો આજ;

હરીદાસકો કરગઠી, રાખો બાળ અહેડી લાજ. શ્રી વલલભ  
પ્રભુને કરું પરખામજુ.

### ધોળ ૧૭૫

વાણ મધુગીર વાય. તેણે શુધ શુધ માણાણી જય: ૧  
આતર બેનીયરે વાહાલે, તેડ્યાં વરેહે તથાં તે આસે. ૨  
આણાં ઝુપણુરે પસ્યાં, પગનાં નેપૂર ડાને પેહુસ્યાં. ૩ દુ-  
ધ ઉછાળેરે ચાલ્યાં, આજક ધારતારે મેહેલ્યાં. ૪ પતી કુળ  
લગ્યારે લાપી, મનક પૂરું ઓદા મને સાંપી. ૫ આનંદે  
આલારે હેલી, થઈ છે કાનુંડાને મેળી. ૬ વળતા ચાલ્યારે  
વાણી, સાંભળો ગોપીજન મન આંદૂરી. ૭ અરધ નીશા-  
ંગેરે આલ્યાં, લોક વીર્ય તમે કૃપમ કાહાલ્યાં. ૮ કુળનો  
ધરમ નણી એ શીતે, વેદ અર્થાત તણ્ણી એ લીને. ૯ કં  
ધ તમારારે લણે, ડપોકા દેશે કોઈક ટાણે. ૧૦ લાંછન  
લાગેરે કુળને, જાઓ પાણી આપણ ગોકુળને. ૧૧ વાત  
નિચાદુરે લોલો, આલુધારું પ્રભુ શાંતું જાસો. ૧૨ વરેજ  
વીનતારે આલ્યાં, અંતર પડ મન ખરવે ઓદ્ધા. ૧૩ થર-  
ણ તમારેરે આલ્યાં, વેદ ઇંધી સાંકલડાં તોડાલ્યાં. ૧૪ જાં  
છન તેનરે આવે, સ્વરૂપ સાંધી નણી મન લાવે. ૧૫ હે-  
ણીના સાંધી વાહાલા, તેને શું ઉપણે છે ડાલા. ૧૬  
આતમા મળારે વાહાંઓ, સરવે તજુને અમને જાસો. ૧૭  
ચરાણ કુમળનારે આથા, આણી પ્રેમ તણી પાશા. ૧૮ ન  
મન સુધીનારે શાન્દ્યા, ગોપી સભારડ નણી કોઈ વાજન. ૧૯  
રમત માંડરે હઉંચો, સુંદીરે સકેત વનની ગલીઓ.  
૨૦ નારેદ પુનરાપુરે રાતે, રાસ મંડળ રૂચો બંકુ ભાતે

૨૧ તતાયેઈ તતાયે/રે તાળી, સવર ખાંધન ગાંચે નરનાશી  
 ૨૨ ગીડગીડ ગીડરે ૨ જો, થુંગ થુંગ નાચે ઉર તિરપને  
 સંગે. ૨૩ ગતીની બેદમારે જાણે, કનીની શી ગત પોહાચે  
 તે વખાણે. ૨૪ ગોણાચે આનીમાનરે આએયું, અમ સરખું  
 કાઢુંચે ન જાણ્યું. ૨૫ અંતઃ ધ્યાનરે પાણ્યા, સંગ લેઈ  
 અપાં ઓઈ શ્વાખા. ૨૬ તેમનું મનહુરે કુલ્યુ, મુજ વીના સે  
 રૂએ છેરે કુંક. ૨૭ અરણે અભાવ નહીંરે સ્વામી, ખાંધ અડા  
 વો અંતર જામી. ૨૮ અલીમાન એવુરે આંદ્યું, તેથા પ્ર-  
 કુલુંચે મનમાં જાણ્યું. ૨૯ પ્રકુળંચે મેહેલ્યારે વનમાં,  
 તજ ગપા કુણ પાણ્યા ન નમાં. ૩૦ એટલે સખી જનરે અ  
 બાં, હણી ભણાને સામાં એલાબાં; ૩૧ પ્રકુળંચે દીઠારે  
 ખાણા, સોચન સુંદીર ખયન રસાણાં; ૩૨ મનમાં મન જ્યા  
 રે આચ્ચુ, તજ ગપા તમને શું કાહાચ્ચુ; ૩૩ નેત્રે વહેછેરે  
 નરે, ખાસા લેગા જુમનાં તીરે; ૩૪ હૂમને પુછેરે હેલી,  
 કાઈ દીઠા છે વનમાળી. ૩૫ કેદમાં વૃક્ષનેરે પુંચુ, કડીએ  
 પીંગાંધરની શુધ કેણે છં; ૩૬ એમ પુછતારે જાપ, દેહ ગ-  
 તી લુદ્દાં ટાંઈ ન લેવાય; ૩૭ એં કરુનેરે એડાં, દેણ  
 કુરેછે મળી એકડાં. ૩૮ શુધ રણી ન હીરે લગાર, પ્રગટ્યા  
 હરજ તેછી વાર; ૩૯ આનંદ મંગળરે ધાય, વરજનાં જુ  
 વંતી રારા રમાએ. ૪૦ રસના રેલીરે ધાય, સ્વામ પીવત હું  
 ન અપાય; ૪૧ અં વલ્લ કાપાએરે ગાય, દાસ મનોરથ પું  
 રા ધાય; ૪૨ વેણુ મહુરારે વાય, તણે શુધ ચુંખ માર્યાલાય

### ઘોણ ૧૭૬

આજ આહારે દેર આનીમારે, સુંદીર શી વરજખુખાલાં  
 લાલ; શી સુખ લેતાં માહાર મન હસ્તરે, અંમળ નાય

ણારે વિશાળ. ૧ નવરંગ ભાળીક સુરતક શાલીતુરે, ડિપર  
પેચ કેસરી રંગ; સ્વેતનો જમોરે અંગે જેસનારે પટકે બ  
સમાં યુગ્ર સોરંગ. ૨ લટકેને મટકે લાલજી પધારયારે, એ  
ઠાં ગાદી તકીયા અહેરાજી; ચાસાને સહીયરો વાહાલાજીને  
નારખીએરે, તજીએ લાડ કુટખની લાજ. ૩ શેવક જન ચો  
દીય નીરખતારે, મનમાં આંખી અતાશ ઉલાસ, અનીહેં  
સુકી મર્યાદા આનંદ ઉલટયોરે, એ સુખ નારખે વલભદાસ  
આજ માહારે દેર આપારે. ૪

### ધોણી ૧૭૭

પોણી પ્રગટચા શ્રી વરલભુખણલાલ, વાહાયો નખ શીખ  
સુદીર હૃપ રસાળ. ૧ વાહાદો શેવક જન કેરા પ્રતોપાળ,  
વાહાદે દાસનડાની કરીર સંભાળ૦ ૨ જીરે માગસર માસ  
શુક્ଳ પક્ષ દીન, જીરે મંગળજાતને જીજનો દીન; ૩ શો  
ગીરધરલાલજી હરખ્યા મન, જીરે ઉદ્ય થયો કુળજીપ રતન.  
૪ જીરે રતનાગર મીતું વંદાજ વહુ, જીરે પુત્ર જાત  
સુખ પામ્યા મહુ; ૫ જીરે ચારોમતી વહુજીને ઉલટખહુ,  
આપે આભુષણ વખ્નો પાર ન લહુ; ૬ જીરે કુમ કુમ  
હાથા તોરણ બધાય, જીરે વાળું ન વિવિધ પ્રકારનાં વાય.  
૭ જીરે નરેનારી મળી મંગળ ગાય, કેસર અરગળ કુમ કુમ  
સેરાએ છંટાય. ૮ જીરે જાત્ય કરમ નિગમ કેત થાય, જીરે  
નાચક જન જગતી જાય. ૯ ક્ષી ગીરધરલાલજી આપે દાન  
જીરે નાચક જન ખહુ પામ્યા નાન. ૧૦ જીરે આશીષ હે  
વરજ વેદવ દાન, જીરે વલભદાસ સહા ચુબ જ્યાન, ૧૧  
પોણી પ્રગટચારે શો વરલભુખણલાલ.

વંડુ શ્રી વબબનાથનો વંશજી, પૂરણ ખલ્લા શ્રી કરના  
ખંશજી, ૧ જ્યમ્બ ૨ વીજુણ હદુરામજી, વળી અંદ્રવાણીને  
જ્વલનજી. ૨ તેમાં તે તૈલાગ તીલક કુળજી, શ્રી વીઠા  
પ્રગટચા શ્રી ગોકુળજી, ૩ સમત પંદ્ર બોહેલારાં વરસાદે  
સારજી, માગસર વદી નોંભી લગુવારજી, ૪ ખદી એકવી-  
સને પાણ પમાશજી, હરત નક્ષત્ર ખદી છવીશજી. ૫ પળ  
ચુંચાળીણને તૈતળ ડરણજી, પ્રગટચા તે સમે શ્યામ વરણ-  
જી. ૬ ન્યેમ નાંદ જસેદાજી હરખ્યાંજી, તેમ ઓ વલલ  
શ્રીઅકાંજી હરખ્યાંજી; ૭ બાળ લીલા કરી આડ લડાયાંજી,  
પછે તે વહુજીને પરણાયાંજી; ૮ શાભા જુમનાં  
ખદી એ વડાંજી, કમળા હૃદ્યકા ખદી નાનેડાંજી. ૯૦ ખી-  
લ શ્રી પદમાવતી વહુજી, તેના એક પૂરુ શ્રી ધનસ્યામજી  
કહુજી. ૧૧ શ્રી ઇંદ્રભણી વહુજીએ પૂરુ ખટ જાપાજી,  
જુણ્ણુઓ શેવા સહીત લરવાયાજી. ૧૨ પ્રથમ પ્રગટ શ્રી  
ગીરખરજી, શેવા શ્રી નવ નિત્ય રાયની ગમજી. ૧૩ શ્રી  
મધુરાંનાથ સદા સુખડાશી, શ્રી નટવરરાય કુંભમ ખીણાશ-  
જી. ૧૪ એણ તે પૂરુ શ્રી ગોવંદજી, શેવા શ્રી વીઠલે  
સરાય મુકંદજી. ૧૫ નીલે તે પૂરુ શ્રી બાળકશજી, શેવા  
શ્રી દ્વારકાનાનજી સમરથજી. ૧૬ એથા તે પૂરુ શ્રી ગો-  
કુળનાથજી, શેવા શ્રી વીરિધર ધારી સાથજી. ૧૭ પાંચ  
મા તે પૂરુ શ્રી રધુવર કહીએજી, શેવા શ્રી ગોકુળચાદ્રમા-  
જીની બહદ્રેજી. ૧૮ છા પૂરુ શ્રી જ્વલનાથજી માહારાજ-  
જી, શેવા શ્રી વાળકશજી વીરાનેજી. ૧૯ શ્રી પદમાવતી

બૃતુંજીના તનજી, શ્રી ધનસ્યામ શ્રેવા મહન ભાહનજી. ૨૦  
એ લાભાચે શ્રી ગોડુળ એચ્ચુંજી, વર્ચલાગ પીજી વદ્ધા-  
વન એચ્ચુંજી. ૨૧ સુણ શ્રી વલભરામજી કપાળજી, શ્રી  
લિંગ છૈલ રૂધ્ર વરદ્ધા રસાણજી. ૨૨ પ્રસરયો સભા સાખાચે  
જકતજી: નભ અંકુરને ઝણફુલ પત્રજી. ૨૩ એવું નિર્યે  
નાણી સીતળ છાચ્ચેજી, આંદ્રા તે જુદ્ધા લવ દ્વારાજી.  
૨૪ મનમાણે રાણી તે ચોણેણી આશજી, નિશાંત્રે કરયો  
તરે તણે નિવાસજી. ૨૫ પુલદ્વારા રસાદ સુગંદ ને લાણ્ણેજી,  
સુખ શાંકરને નિગમ વખાણેજી. ૨૬ સુણી ધર્યાં ચોદી-  
શાથી નરનાશજી, આબ્યાં તે ચરણ સરણ વરણ અરેજી.  
૨૭ એક દુળ સરણ ગયે ધાણું સુખજી, એવું નાણી અને  
યાં સનમુખજી. ૨૮ ને ગાયે સીએ આરાવેજી, પ્રસા-  
ધર્ષ ઝળ આષ તનેજી. ૨૯ પ્રા.મ પ્રિત્ય વાન પ્રેમ ડ્યાંદાં-  
થોજી, નિશ્ચ કરે નહતી એ વ્યાનમાંથાજી. ૩૦ એ ઝળ  
પ્રભળ પ્રસરયો ક્રૈસ્ટાકજી, સ્વાદ ચાએ તનો જય શ્રાદ્જી.  
૩૧ જર્જ અહી પાંચમી ને હાળજી, છાય કરી શ્રી હેવ-  
અનંદના લાભજી. ૩૨ દ્વારા કરી શ્રી કમ ઝળ દીણુંજી,  
તે ભર્હતો અગાવ ધર્દિએ રસ પીધુંજી. ૩૩ એ સ્વાદ પ્ર.  
મરયો અંગો અંગજી, નિત્ય નિરાસું નવદો તેરણજી.  
૩૪ રધુકુળ જહુકુળ આનંદજી, ગંગ પ્રલુ શ્રી ગોડુળચં-  
દુજી. ૩૫ વડુ શ્રી વલભનાથનો વંશજી.

### ધોણ ૧૭૯

હરીણસો હરીણસો હરીણસો મરે આયે નેતમે હરીણ  
સો. ૧૫. અંતરી કપા કરેસે કેસારાય, કુશળન હાપ તને

કુર કરો ૦ ૧ મરે આપ બડાઈ ઓર પરનીંદા તે મારા  
ચિત્તમાથી કુર કરો ૦ ૨ મરે શીગા નહી આ કાસ ચંદ્રકી  
તેનરાજુગમાં ક્યાં ખસો ૦ ૩ મરે કુરદાસ પ્રસુ બડત લગ્નન  
વીના સ્તાન ધજ ધર ધર ખસો ૦ ૪ મરે આએ નેનનમાં  
દરીખસો ૦ ૫

### ઘોળ ૧૮૦

વાડે અંચોડે ઓ નાથજી, સુને ખળીપા મારેગ માંપ;  
મન હૃદી લિધાંજી, મનદું તે મદાંદી રણું. નિરખી  
છાખાલાને લ્યાંહ; મન હૃદી લાખાંજી. ૧ વાંકી તે પાંથે વ-  
રણાગીઓને, વાંકી ચાલે ચાલ. મન૦ વાંકાં તે નેષ્ટ સો-  
હામણુંને વાંકી વંખ રસાણ. મન૦ ૨ નધાણાં તમારાં ઓ  
નાપજી, હુંનો કેન્દ્રે કુરે વખાખ. મન૦ જોતાં તે શુદ્ધ  
શુદ્ધ વિસરો, માનુનચ્ચે શહેઠાં માંન. મન૦ ૩ કાળાંદ્રીને  
કાંડે, વાહસો ગીરધારી ચારે ગાય મન૦ કદમ કેશું છા-  
પકી, વાહસો મીઠી મારલી વાય. મન૦ ૪ વંદ્રાખનની  
કુંજમાં, અમને રંગલેર રાસે રમાડ્યાં; મન૦ ખાંદે વા-  
ળુઅંખ ઘરખાં, ને પ્યાંહુંચી છે રતા જડાગો. મન૦ ૫  
કાંને તે કુંડા જગમગે, હંશના એઠલીયાણા કેસ. મન૦  
શાલા તે શી કુંદું માહારા સ્યામની, માહારો વાસોજી ને-  
દ્વાર વેશ; મન૦ ૬ સહુ મળીને ચાદ્યા શ્રી જુમનાં-  
જીનાંને ધાય; મન૦ મારેગ જીાં મોહન અણા, ને રોકી  
ઉભા છે વાઢ; મન જ જુમનાં જળમાં બીલતાં, માહારો  
તુટ્યો નવસર હાર; મન૦ જોતી તે જીખળાં વેર્છ અંા,  
ઓક હીંદ્રા લાધ્યો લાડુ; મન૦ શુષ્પ સહખી સુખ શુઠી

કર, અને જીગમ ન પાંચ પાર. મનો શ્વોવજભ પ્રભુ મન  
અહીં મળ્યા; માણાડું મન પાંચું ઉલાસ; મનો દાસનો  
દાસ વીનતી કરે, અમને હજે વરનમાં વાસ; મનો દોન  
લાલી કરેલા કરો, તા પાછાંચે મનની આશ; મનો ૧૦  
વાંકે અંધોડ ભી નાપજુ, મુને મળીપા મારેણ માંય.

### ધોળ ૧૮૧

આવોર આવોર સુહાગી; ઓ વખતી ખાનો સાપ; સ-  
ખી મેળાડે પંચારેચા, ઓં ગોવરષનતાય. ૧ સખી મન  
કરેન વયને, તણે પરનાં કાજ; મેલો વેદ રહ્યાદા, ને કુ-  
ણતી બ.જ. ૨ છાડો મન વીના પતી, સુર અને પરિવાર;  
આપણે નઈએ નિરજો, થા નાંદ કુમાર. ૩ વાહાલો ઇથે  
છે હડલો, ને ભીન લેણે વાં; ગળ સ્થળ માંડાન, કુ-  
ડા લગડે છાન; ૪ એરાને અલડ તોનક, લાલીએ કાચન  
રેખું; નાથા ગજ માતોના, નદર ભેખ; ૫ સીધ પાખ  
સોરાંભો, ઉપર ચંદ્રીકા મોર; વાહાના મનોહર મુરતી, ચી-  
તડાનો ચેર. ૬ વાહાલો બાંક અનીચોકની, અયુદી કમાન;  
એકુનાં નદરણાં અશીખાળાં, લાલીએ મદનસ્યાં ખાલું. ૭  
વાહાલો ચચ્ચા ચયણા, વળું પાંજન મીન; શાલા જે  
ઇતે ખા થયા અધોન. ૮ આયા ધરેણ, અરી અરૂણ  
પ્રાલ; સુખ માણું માણું, વાંસનડી રસાણ. ૯ જીર  
કુશમ જરે, મહે સુસડી હાંસ; બળકે દંત દાદમ, નેમ  
ખીજ પ્રકાશ. ૧૦ કરે રેમરી, ગળે ચુંલનો હારે; બા-  
જુનંદ્ય પોહાચોને, કુમક સાર. ૧૧ પાંચ પોહાણ, નેપૂરનો  
કમકાર; માસ ગજ રી માલ, ધુધરી ધમકાર. ૧૨ કદી ડાઢાણી,

કીં કદ્દળનો ઝમડાર; ૫૫ અણુવટ, વી છવાનો ઠમકાર. ૧૨  
જીરે સોણ કળાએ ડુદીઓ। ચાદ, વરજ જુનની સુદરી; હસે  
મંદમાદ. ૧૪ જીરે એહુની આરતી, ઉતારે ઓ રલભરાય;  
શાખા જેઘને જન વલભ અવીહારી જય. ૧૫ આયોર  
આવોર સોણાગી, શી વગલીઆનો સાથ.

### ધોણ ૧૮૮

હરી ભજન વીના જીવે સો નર કેસા. ૨૬. અંતરે પ્રીતિ  
નહી પૃદ્વેતમ, નર ખર કુર નેસા. હરી ભજન૦ ૧ નહી  
વાકુ સંત સમાગમ, નહી ચુક ઉપદેશ; હરી ભજન૦ ૨ હું  
હું કરકર જનમહી આવા, મનુસ્યા જનમ અંદેશા. હરી ભજન૦  
૩ એસો અવસર બહેત નહી આવે, તાં કેમ નામ છું  
લેગા; હરીભજન૦ ૪ સુદરોદાસ ભગવત ભજન વીના, કાંદાં  
નદી ઉતર દેશા, હરીભજન વીના જીવે સો નર કેસા. ૫

### ધોણ ૧૮૯

૭૫ આદેશ શી વરજરાય લાલની, હેઠ એહેની માહારી  
જય આદેશ ઓ વરજરાય લાલની, મીડી મધુદી વાણી વા  
ણાલાની. હેઠ એહેની માહારી જય આદેશ વરજરાય લાલ-  
ની. ૨૬. ઓ નટવરેલાજ સ્યામલાની શેના કરણ પ્રગટ્યા  
કાકાળ માહારાજને ત્યાંથી સટક્યા, એ એહેની૦ ૧ ઓ  
છોટાળ માહારાજના લાલજ કહાવે, વધશનપને મન ભા-  
વે. એ એહેની૦ ૨ ઓ રાજ્યાળ વહુંલની કુદે રણ જા-  
યા, ઓ વરજકોર માળુએ ગોદ પેલાયા; એ એહેની૦ ૩  
ઓ માહાલકની વહુંલના પ્રાગ્યાળ કઢીએ, એ વાહાનાં

મુખ લેખ રહીએ; એ એહેનો ૪ અંત્રી માહાલક્ષમી ૧-  
કુળ ભાદરે સોહાગી, બાલજી જન્મયા છે બડાલાગી; એ  
એહેનો ૫ બડા મુજ અંત્રી માળજીકુળ ભાલ છે, પદમાન-  
વી વહુણ સરદાર છે; એ એહેનો ૬ અંત્રી રઘનાયલાલ  
જ શ્રીજાના રણીવા, જાનકી વહુણને મન પરીવા; એ  
એહેનો ૭ અંત્રી માહાલક્ષમી વહુણએ માહા તપ કીધા,  
એ ભાલજી વહુણાં સુખ કીધાં; એ બહેનો ૮ મોન  
દુરેલાલ સ્યામલાલે આનંદ દીવિા, આ ગોકુળ માર્ગે આ  
૯ માસો કીધે; એ એહેનો ૧૦ પદ્મેશ પદ્માસ્યા દૈવી જ  
વને જ્ઞાયાસ્યા ભવ સાગરમાં દુષ્ટેલા તાસ્યા; એ એહેનો  
૧૧ ભાલજી વહુણને દેઢને રાનનગર પદારી, શ્રવણને સુ  
ખ વધારીએ; એ એહેનો ૧૨ મુર મ્રતાપે હુંતા વીનંતી ક  
રેખું, ચિન માદાર અરણે ધરેખું; એ એહેની માહારી  
જ્યે એલો અંત્રી વરલાલની. ૧૨

### દ્વારા ૧૮૪

આનંદ સાગર ઉભટ્યો, રસતાંએ વહેછે પ્રથાણ; ગોકુ  
ણપતી પાભીએ. ૧ અંત્રી વક્ષભજનારે લડાલા, પૂછિના  
પૃષ્ઠ માહારાજ. ગોકુળો ૨ શ્રી અકાંજ હરે લાડાલા, જ-  
ગતના પ્રાણ આધારે; ગોકુળો ૩ તેલ અભ્યંગ કરાવીએ,  
વેત્તનને હૃદ્ય ન ભાય; એકુળો ૪ કેસરે નાલ્યા અંત્રી  
ભરું, ચાંદીએ એ. સોદાય; ગોકુળો ૫ અંગ વસ્ત્ર પા-  
દાસ અંગ પસ્યાં, ધરચાં તાલક સુદ્રા ભાણ; ગોકુળો ૬  
ધાતી ઉપરણુરે કેમરા, એહેરને પ્રાણજીવન; ગોકુળો ૭  
અપ્રેસ ગાડી પદારીએ, મુખે રણે છે વાદાસા પાછ;

ગોકુળ૦ ૮ મારેંના શીજુને ચરણ નાચે, રથીપા લેઈલે  
ઈ મારે; ગોકુળ૦ ૯ વર્ષસ્તે સમાજ પ્રમાદ કે વારછુ  
તન મન ધન; ગોકુળ૦ ૧૦ વર્ષઅનુ સમાજ ઓછવ ક  
રે, બહીહારી માધવદાસ; ગોકુળપતી પામીએ. ૧૧

### ધોણ ૧૮૪

શ્રી ભદ્રભાહનનાન આગળ વીનંતી શીધી, રાજ નગ  
ર પદ્ધારચાની આસી લીધી; શ્રી નાથજી ખ્રિયરચાની શી  
કું શીધી, કુંશ્રીને સુધી આપીયારે. ૧ રાજનગરમાં વ-  
ધાઈએ ગવાય, વર્ષસ્તે મન રસ્ય ન પાય; વરણરામ  
જ પ્રભુ સામા જાય, શ્રી બાળ૦ ૨ એક ધામ લોમીનાં  
ધ્રણ્યરે, તે રંગ એલે તેમ ઉડે પવનદ જાય જાય દુષ્ટ શ્રી  
સે વર્ષસ્તે જન, શ્રી બાળ૦ ૩ રાજ બેઠ્યુણ પારણે કુ  
સ, સાત સ્વરૂપની મદ્ય પારાને; એ શાંભા માહારા ના  
થ એર છાને, શ્રી બાળ૦ ૪ માંગણ જમે વાહાલેના અંદ્રે  
પદ્ધારે. અધિકારીને મન આનદ થાય; જુનું ગડીયામાં હા  
કોર કેસરે નાહાય, શ્રી બાળ૦ ૫ શ્રી માહાલક્ષ્મી વહુણ  
ની કુદે રણ જાયા, શ્રી વરણરોર વહુમાણુએ ગોદ એલાવ્યા  
શ્રી બાળ૦ ૬ શ્રી રહુનાથજીના કદીએર ભાત, શ્રીન વીના  
અણું જાણે નશી વાત; શ્રી રાજ બેઠ્યુણના અણું તા  
ત, શ્રી બાળ૦ ૭ શ્રી પદ્માનતી વહુણના કંધજ કડીએ,  
એ વાહાલાને શરણ જઘ રહીએ; તોઢી જન્મનાં પાપ નિઃદ  
ન થઇએ, શ્રી બાળ૦ ૮ શ્રી યુરુ પ્રતાએ હું તો વીનતી  
કરેછું, અરણ કરેણ પ્રભુ ચિન ધરેં; અંગના કપા થક્કો  
વરણમાં રહેંછું, શ્રી બાળકસનલાસે સુધી આપીયારે. ૯

## ધોણ હેડ્ચ

શ્રી ગોકુળ ગામરે અતિ રણીઓમણુંરે, તાંહાં માહારા વાહાલાજુનો વાસ વરજ વીનતા સરવેટોળે અળારે, આરી રંગમિર રમવા રારા. ગોકુળ૦ ૧ નવ લોઘના નવ સમ વરસતીરે, સુંદરીએ કીચ। સોણ થણગારે; સહુ મહી આચારે, આકુળ બ્યાકુળારે, નિરખના શ્રી ગોવીદ રાજકુમારે. ગોકુળ૦ ૨ હંશ સુખ લોઘનેઝ આનંદ પામીઓારે, હેડ્ચ હરખ ન માય; સુંદર જમનાંજુ કાંદુરે, હમચી કુહે ને વળી ગાય. ગોકુળ૦ ૩ રાસ મંડળ પ્રભુજુએ ત્યાંહાં રંગ્યારે, ઇડી ઇડી સરદ પુનમની રત; જુવતીના જુથ વ ચે માહારો વાલમારે, તતાયેછી નાચે ને વળી ગાય. ગોકુળ૦ ૪ રસીઃ શીરોમણ શ્રી કલ્યાણરાયણુરે, રસીપા જત કરે વિશ્વામ; શ્રી વષ્ણવદાસ જાય વારણેરે, પૂરો માહારાં મન વાંધીત કામ. શ્રી ગોકુળ ગામ અતિ રણીઓમણુંરે.

## ધોણ ૧૮૭

શ્રી ગોકુળનાથ સોણમણાંજુ; એમનાં લીલે ઘેર ઘેર ભામણાંજુ; શ્રી ગોકુળનાથ૦ ૧ યજ શીરોમણ રાજુઆ, રે, હેડી સોણ કલા સસી લાજુઅરે; શ્રી ગોકુળનાથ૦ ૨ જુરે તન મન ધન કરે વારણેરે, પ્રભુ બ્રિમટચા છા બકુને કારણેરે; શ્રી ગોકુળનાથ૦ ૩ કેંડ પૂરવી તે ભકુન તણી, સખી પોહાચી છે હંડાની હામ ધણીરે; શાગોકુળનાથ૦ ૪ જુરે માધ્યવદાસ કરે વીનતારે, ચરણ રાખેને શા ગોકુળ પતીરે, આગોકુળનાથ સોણમણાંજુ. ૫

( ૧૮૪ )

## ધોણ ૧૮૮.

૭૫ ૭૫ લાલ ગોવરધનધારી, સુંદર ઇડુ નામજી; શ્રી  
પૂર્વાતમ પ્રગટ્યા હેઠ વાગી. શ્રી વિઠલ ઇંપ નિધાનજી. ૧  
વરણ સુંદરીના પ્રાણજીજન, શેવકના પ્રાણ આધારજી, ગો  
ળે મર્મણ સરવ સુંદરી ને, સોળ કોધા જાણગારજી. ૨ બ્ર-  
ત્રીસગાં એક નહી ઓછો, સોળ કળા સુખ અંદ્રાયજી;  
થાળ ભરી સગ ભાતીએ, વધાવો શ્રીવલભ રોમજી. ૩  
વધાવીને શીમુખ નિરાએ; નિમિત અણગાં થાપજી; પ્રેમ  
સુધારસ પીએરે પદમની, હળી મળી મંગળ ગામજી. ૪  
શ્રીવલભ સુત જો વાહાલા કરીએ; તો ભવસાગર તરી  
એજી; એનેક દેવ જપાસન તજીને વર વાડલને વરીએજી  
૫ તન મન ધન જગપણ કરુને, વર્ધાશનવને અનુસરી  
એજી; માધવદાસ એટલુંરે માગે, શ્રીગાડુળમાં અવતરી  
એજી, ૬ ને ને લાલ ગોવરધનધારી, સુંદર ઇડુ નામજી.

## ધોણ ૧૮૯

સંખ્યારે શ્રીવિઠલ નંદ આવો માહારે બારણે, હુંતો  
નોછિંધું માહારા વાટ. શ્રીવરણસુખણુ ઘેર પધારીએ, ૧  
મંતો પ્રેમે પથાણાં પાથચાયાં, તે પર પધાર્યા શ્રી વિઠલ  
વરજીના લાલ; શ્રી વરણસુખણુ ઘેર પધારીએ. ૨ મે  
તો કુન કુન કેસર ઘોળીએં, હુંતો પૂજુ માહારા વાહાલા  
જીના પાય, આ વરણસુખણુ ઘેર પધારીએ. ૩ સંખ્યારે  
સર્જિએરો રારવે ટોળે મળી, ભાવે લેટ છેને મંગળ ગામ

( ૧૮૬ )

શ્રી વરજનુખણ ઘેર પારીએં. ૪ હુંતો આરતી ઉતાડી કૃપૂરની, હુંતો વળી વળી નિરખુ વાહાજાનું વદન; શ્રીવરેજ સુખણ ઘેર પદ્મારીએં, પ ભાષારે શુજ કરતાં રેહેણી વાણી ગાઈ એટથે ઉચ્ચિત થયા આદીત ભાખું; શ્રીવરેજનુખણ ઘેર પદ્મારીએં. ૫ દાસ સુણજુનો સ્વામી મખ્યો, વાદાલે મારે ઉતારચાછે ભવસાગરને પરિ; શ્રી વરજનુખણ ઘેર પદ્મારીએં,

ધોણ ૧૯૦

તાહારા દલકેરી વાત મે જાણ્યારે, ગીરધર દાણ્યારે. ૨૫, મહુકોને તમો મન કરી જાણો, નક લોયાં દુધ ને પાણ્યારે, ગીરધર ૧ વાદ્યાવનને મારણ જાતાં મહીની નવરંગ સું દડા તાણ્યારે અનિધર, ૨ કાંડરડોમાં મારો માહારા વાહાલા, તો હેણે છે સાઈપર સમાણ્યારે, ગીરધર. ૩ બાલ વરડાનાં મારો માહારા વાહાલા, તો હેણે છે નંદ જુની રાણ્યારે. ગીરધર. ૪ નરશીહના સ્વામીના સંગે ૨ મતાં, એના સુખતી તો મીઠડો વાણ્યારે ગીરધર દાણ્યારે, ૫

ધોણ ૧૯૧

કોમળ અંગેરે ઓ સુજાની, શ્રી બાળકસનજુ દીઢા; ૨ંગ રસ ભીનેર ઓ સુજાની, શ્રી માન મોહનજુ દીઢા. ૧ શ્રી મુખ દ્વાભા શી કરુંને, મરે મુખ વરણુંની ન જાપડે; જોર દ્વાભતો અંગ પારાને, દ્વાભા વરણુંની ન જાપ, કોમળ અંગેરે. ૨ દાર સુગણે કાને કુંઝા, તાકે સોહી

એ માત્રાને; એ વાહાલાને કારણે હુંતો, મંદીર છીંકું લે  
તી, ડોમળ અગેરે. ૩ કુડે સોહીએ કુડેસરીને, લીલાવટ  
જડાનરે, સીર સોલેએ હલકા વળી, દીપાળો સોહીએ અ-  
તુસાર. ડોમળ અંગેરે. ૪ ખાંહે ખાળુખંધ બરખાને,  
કુમત કુરે ચારરે; રત્ન જડીત માંહે હીરનાજડીયા, નેનંગ  
ધરો લખ ચાર, ડોમળ અંગેરે. ૫ કેહેડે સોહીએ કદ્રી એ  
ઘળી ને અંગરનો અમઠારરે; મંદીરમાં હુંટડીએ એલે,  
નામ ધરો નંદલાલ, ડોમળ અંગેરે. ૬ રત્ન જડીત સીં-  
હાસન બેઢા, કલ્યાસ સોહીએ નવ નિત્યરે; નીત્ય નવા શ-  
ખુગરે નીત્ય નવા બોગ, કુલની માળા ધરાય. ડોમળ અ-  
ંગેરે. ૭ વરજ વમજ શાખુભાર ધરાવે, લાલમજૂજ એલ  
એલાનેરે; વરજપાલ લાલજુ ચોપાઈ દાળો, વરણલાલ પંચો  
તાણે. ડોમળ અંગેરે. ૮ ગોપેશરજુ બોગ ધરાવેને, ગોપ  
ણેસજુ બોગ સરવેરે; દ્વાંડી નાથજુ પીડાંદી ધરાવેને,  
જુવણુભાલજુ આરતી ઉતારે. ડોમળ અંગેરે. ૯ સેન સેન  
શ્રી મહુનાલજુ પધારે, શાખનાદ ધંડા થાયરે; શાખનાદ  
સુણીને ભીતરે પધારે, ત્રારી બંદા પદનાય. ડોમળ અંગેરે.  
૧૦ જુવણુભાલજુના મંદીરમાં કાંઈ આનંદ એણન થાય  
રે; દ્વાંડી કુધની કાંડ લધને, આવે સહુ ગોપ ગોતાળ.  
ડોમળ અંગેરે એ સુજની. ૧૧

### દોઢી ૧૪૮

શ્રી દામાદરદાસ હેરસાંની અતી હરએ ભરચા, ઉપરે  
બેઢા લોતા હુતા વાટનોઃ ભાઈ સરવે ધન કાઠીને ઠગભા

કરચા, તેના સાહમાં લેયાં નહીં ભગારણે, શ્રી દામોદરદા-  
 સ૦ ૧ એટલામાં તો પ્રભુ પોતે પદ્માશીલા, આવતાં ની-  
 રખ્યા પોતાના નિજ નાથજ્ઞે; હોઠ મેળાને ઢાડી પાસે આ-  
 વીઅા, પડ્યા પાપને જોડ્યા છે બેહું હાથજ્ઞે. શ્રી દામોદ-  
 ર હાથ સાડીને પ્રભુ તો પોતે ઉડાવીઅા, પૂછ્યું દયલા  
 આવો તેની વારજ્ઞે; સીધું નમાની શવાની પ્રત્યે જોલાવા,  
 વાટ ડ્યારની જોતો હતો માહારોજ્ઞે. શ્રી દામોદર ૩ લાં-  
 થી સાતે તેડી પોતે પદ્માશીલા, આઅા શ્રી ગોડૂળ માંહે  
 શ્રી ગોવીંદ ધારજ્ઞે; અજ્ઞ સભાધની આકા પ્રભુજીએ કરી,  
 વચન સુણ્યાં પણ સમજ્યાં નહીં તમ માત્રજ્ઞે. શ્રી દામોદ-  
 ર ૪ લાંથાંથી શ્રી ગોવરધન ઉપર પદ્માશીલા, આવી પોહે-  
 જ્યા છોકર છાંયા ભાંદ્યજ્ઞે; પછે પદ્મારચા શ્રી ગોવરધન  
 નાથજ્ઞ, હાથ યાલીને રાખ્યા વેગળા ત્યાંદ્યજ્ઞે. શ્રી દામોદ-  
 રારે શ્રી વનભ ઘીજુને બોલીઅા, દાસપાણું તે જાહીને  
 અપ્રાધજ્ઞે, ત્યારે શ્રી મુખેયો આજુ બોલીઅા, દાસ ધરમ  
 રાખ્યો મારે નહીં બાદજ્ઞે. શ્રી દામોદર ૬ એક સમે આવ-  
 લભ પોતે બોલીઅા, પૂરણ મારગ ચમાવો પ્રકાશજ્ઞે; તતો  
 દયલા તાદારે સાર જાગુને, રહેશે ઇદેમાં રહેશે કરીને વા-  
 સણે. શ્રી દામોદર ૭ એવી જીવા જાહી આ ગોસાંઈજ્ઞ  
 એ, પોતે કરાંયું પીનાનું ત્યાહાં આધણાં, દ્યક્ષાણ માગી  
 ત્યારે પોતે કદ્દું, સિદ્ધાંત રહસ્યના હોઠ રસોડની વાતજ્ઞે.  
 શ્રી દામોદર ૮ એવી કાવા જાહી આ વીઠનાયજ્ઞ, એ-  
 સાડતા તો જાણી અડવા હાથજ્ઞે; ચરણાંત્રા તો પોતાનું  
 આપેજ નહીં, એવા માહોટા જાહી શ્રી વનભદ્રાસણે.  
 શ્રી દામોદર ૯ ત્યારે આ વનભ મુખેયો બોલીઅા, સુજમાં

ને શ્રી ગોસાંદુજીમાં નથી કુંઘ લેદાને; આરે અરણાની  
તો તું ખેળે સદ્ગ. ઓ વલભ ગાણી કહી તે જાણીને વે-  
ફળે. શ્રી દામીં ૧૦ લારે પોતે આવીને વીનાત કરી,  
મુને કૃપા કરી પોતે શ્રી માહારાજને; તરે પોતે કૃપા  
કરીને આવીએ, વલભદાસના સરીઓં સખણાં કાળજીએ.  
શ્રી દામીદરદાસ હરસાતી એવી હરએ ભર્યા. ૧૧

### ધોણ ૧૬૩

ગોરધનેસ ગુરુને ચરણે નમુ હોંજુરે, પ્રધન લાગુંછું પાય  
દીન જાણીને કરુણા કરા રાએ ચરણુંની છાંપ, ગોરધને  
સ૦ ૧ શ્રીના સન્મરાષ્ટમાં નથી જાણતા હોંજુરે, નથી જ  
ણનો કાંઈ ખરમ; વિષવાસનામાં વળગો રદ્દો, એવાં અ  
નુચિત કરમ, ગોરધનેસ ગુરું ૨ અમ સરખા અખમને  
ઓવારના હોંજુરે, તમે અધિક છે ક્રમ; અભેદાન હવાને  
કરણે, પ્રગતચા પુરણ ખલ્લ. 'શ્રી ગોરધનેશ ગુરું ૩  
કિરજા કરીને હરી અવારચા હોંજુરે, કરું: ઈચ્છિની સહાય  
માણુ ઉકાર કરુણા નીધો, આવનું આતાર. શ્રી ગોર-  
ધનેસ ગુરું ૪ નામ આલીને નિરમળ કરચા હોંજુરે.  
કરવા ખલ્લ સખંધ; તોણ તમને નથી જાણતા, એવો થ  
દ્ધને સુદો અંધ. શ્રી ગોરધનેસ ગુરું ૫ કાળ કરમાંથી  
કાઢીએના હોંજુરે, ભાડા જમનોરે નાસ; ને જન જંરણ  
આવીએના, તાંઘો દ્રા; વિસ્તાસ. શ્રીગોરધનેસ ગુરું ૬ ત  
એ તો તમારાં ખગદ પાળણા હોંજુરે, કરવા જનનો ઓ-  
ઝાર; દોષ ન વિમારશા છુનનો, તેનો નહી આવે પાર.

શ્રીગોરધનેસ શુરૂ ૭ શ્રીભાગુક્ષનણના લાડીલા હેણરે,  
છગન મગનના તા ૯; શ્રીભાગુરાપ શ્રીમગનલાનજીના કાડા  
જ, શ્રી વીક્ષેપણના ખાત, શ્રીગોરધનેસ શુરૂ ૮ દાસ  
ના દાસની વિનતી હેણરે, પ્રભુ તમે ધરળે કાન; દૃષ્ટિ  
શુદ્ધ હમારી દૂર કા, ગાડ તમારા શુણુ ગ્યાન, શ્રીગોરધ  
નેસ શુરૂને મરણે નહુ હેણરે. ૬

### ધોળ ૧૫૪

૫૬ ગરેખી.

જુમનાં જતારે ધારે, આજ મને પ્રભુજી મળીપા વારે  
૧ મુજ એકલડીરે જાણી, હસીને પોદ્યા સારણ પ્રાણ્ય.  
૨ હરીનું હસવુરે મીઠુ, એવુ ૩૫ કચ્છે નોંધાઈ દીઠુ. ૩  
આજનાં સારારે સુખડા, પ્રભુજીનાં જોવા સરેખાં સુખડાં  
૪ મુખ્ય પુનગરે ચાંદ્ર, વાદાલા તારી આંખડામાં જંચ.  
૫ અધૂરીશી મારલીરે વાને તેતો માદારા સામ સુંદીરને  
જાને. ૬ ડાહાપણ ખાંડૂરે બચ્કે, રામકષણ પ્રભુને નીરખ  
વા બચ્કે, ૭ માધવદાસરે શુણુ ગાન, તેથી ભવનાં પ્રાંશીત  
જાપ, ૮ જુમનાં જતારે ધારે.

### ધોળ ૧૫૫

રાગ સામેરો,

આયો આયોરે શ્રીમાહારાજ, માતી માહાર આયોને;  
માતીને જોતી ને હાર પરોતી, તો હું વંદ્રાવન જોતીરે.

આપો આલેરે નંદના ભાલ માતી માહારે આવોને, ૧  
માતીરે નીપને નવસાગરમાં, તાહાકું સુખ જોતાં રોવાણું  
રે; માતી માહારે આવોને. ૨ બાઈ મીરાં કહે પ્રજુ ગીર  
ધર નાગર, અરણું ડમળ સુખ જોતીરે; માતી માહારે  
આવોને ૩

### ધોણ ૧૯૬

લસે આવી ભાગો માજમ રાતકે, ચૈત્ર વદી એકાદશીજુ;  
પૂછયાં પૂછયારે તૈલાળનો ધારચા શી લક્ષ્મણ ઘેર. પઢા  
સ્થાજ ૧ કીધી કીધી શીઠી શું પ્રિત, મરણાં સુકી અ  
ધ્યાજુ; ભાગા ભાગારે લુચના ઘ્રણ, આનંદ સાગરમાં  
અધ્યાજુ માહારે માગુ આપો માહાજ અદ્ય પુષ હુંદું  
દીનજુ મને શ્વા સુખ દોણે નાથ, મન માહારે યો-  
હેતુ રળીજુ ૩ બલીહારી તે માધવદાર, એ લીલા માહારે  
મન વશીજુ; લસે આવી ભાગી માજમ રાત કે અધ્યત્ર વ  
હાં એકાદસીજુ ૪

### ધોણ ૧૯૭

પાંચ ૧ંગ પ્રજ્વના ગઈએરે, ગાતાં અંગમાં નીરમળા  
ધઈએરે. ૧ પેહેલા ભાલ ગુલાંનીનો ૨ ગરે, તેહેનો સધળો  
ઘનચોછે સંગરે. ૩ ભાલ રંગનું જોણીયું છે રાતુરે, કદીનું  
સુખડુ દિસે અતી નાતુરે. ૪ ભાલ શારલી ૨ંગ રસાણે,  
ભાલ કાટમાં ગુલાંની માળને ૫ ભાલ જમા પેદુરચાજર-  
કસીરે, ભાલ દોભાણી ભાલને અંગ વસીરે. ૬ ભાલ મો-

જડી કનઈએ પેહેરીરે, લાલા દિસોછે। લાલા ક્ષેત્રીરે, ૫ દી  
 સો રંગ પ્રભુજીનો નારોરે, રાતા રંગમાં શાખે સારોરે,  
 ૭ લાલા લાલમ મુગુમાં જડા છે, હરીના તેજની કાંતી  
 બડી છે. ૮ લાલાં પ.ન ખીડલાં ખવાસરે, આપો પ્રેમે  
 ભક્ત ડોઘને દાસરે. ૯ લાલા રંગના સુંધરી સાચીરે,  
 લાલા રંગ બન્યો ગીરદાશરે. ૧૦ લાલા પટડા ખાંધ્યા છે  
 કેઢરે, વરયાગીમાં જાય છે લોહેરે. ૧૧ લાલા તુળથીના  
 હાર શાશીરે, હરી શાલે છે હળધર વીરરે. ૧૨ લાલા વા-  
 ધા તે સારંગ પ્રાણીરે, ધાણું અમર રાધા રોણીરે. ૧૩  
 સાખી પ્રીતમ પીળો રંગરે, સરખી સુંદરી સરવે રંગરે. ૧૪  
 પિળો લાલક ડેસરનાં કરુથારે, અંગે નેપૂર સધળાં ખરી-  
 આરે. ૧૫ પિળો પાદ ડેમરને ભીનોરે, હરીને લટકો  
 બન્યો છે તીનોરે. ૧૬ પીળાં સોના કડાં ડર માંદારે, પીળાં  
 હિમ ઘાળું ધ ખાંડારે. ૧૭ પીળી સોનાની સાંકળી  
 સાશરે, માંણી રખ જડા રહીઅણીરે. ૧૮ હરાએ પાળાં  
 પીળાંધર પેહેરદાંરે, વરણાગામાં જન્મોંઠી। લોહેરે, ૧૯  
 પીળાં સોના પાવલડાં ચરણેરે, મોહાયા સાંત નમે હરીને  
 અરણેરે. ૨૦ હવે ઉજળો રંગ વખાણુંરે, ચારલાધર મનમાં  
 અણુંરે. ૨૧ ઉજળાં જાણાં કુલ બેકરે, હરીએ હારે ધ  
 રચાં કંઠ લેહેકરે. ૨૨ ઉજળાં મુક્તાઈણ કાગરે નો.૫ ૨૩  
 ૨૪ ધરચું તે ધ્યાનોરે. ૨૫ ઉજળાં ધુધરા ખનકારરે, અ  
 રહે શાલી રખા છે ડમકારરે. ૨૬ ઉજળી આંખડી અ-  
 ણીપાળીરે, કાળી કીકા દિસે છે રપણોરે. ૨૭ હવે કન્નતો  
 રંગ વાય છુંરે, સ્વામ ૨ંગ ઝેદમાં આણુંરે. ૨૮ સ્વામ  
 ખીટલાઅણા ડેસરે, અમના જોવા સરખા વેશરે. ૨૯ રૂપામ

નજરણાં કુળ અની ભાગીરદ, કાળી કીડી દસે છે રૂપા-  
જારે. ૨૮ સ્વામ ગોપિનાં આરસ ભરીયારે, મેળે પ્રભુ-  
જીના આગળ ઘરીયારે. ૨૯ સ્વામ મિધ ગરુજના કરતારે,  
પાણી ગોકુળા ઉપર ભરતારે ૩૦ જેણે હડોરમાં કરેચાં  
દરથનરે, તેણે રણછોડરાય પ્રસનરે ૩૧ પાંચ રંગ પ્ર-  
ભુજુના ગાશરે, વર્ષભાન એસી વર્ષફુંડ જાયશરે. ૩૨ પાંચ  
રંગ પ્રભુજુના પુરારે, તેણેમાં એકે નથી અંહરારે, ૩૩ કર  
ને ડા કવીજન કેહુંછરે. એતો અહરનીશ સરણે રેહુંછેરે.  
૩૪ પાંચ રંગ પ્રમુજી ॥ ગાઈએરે.

### ધોળ ૧૬૮

જ્ય શ્રીકાંઠારે ભાઈ. ૧ આદો બાદો વર્ષભરાય, તેતો  
કળી મળીયાએ સાઈ, જ્ય શ્રીકાંઠારે ભાઈ. ૧ વખલી  
વર્ષભરાની એ ગીત, જ્ય શ્રીકાંઠ ધણા પાવન, તેથી પ્રસન  
થાય નવનિત્ય. જ્ય ઓ. ૨ જેણે જ્ય આકાશ ગાયા, તે  
તો આડરાડ તિરથ નાહાયા; તેથી પાંચ પદરથ પાયા, જ્ય  
શ્રી. ૩ નામ તણે પ્રતાપજ મેલાટો, તેથી આ જુગલા-  
ગેછે જાટો; રારવે વરેજ ભામીમાં લોગે, જ્ય આ. ૪ જે  
જન જસોદજ ધારું જાગે, એમના સુતને ઉદ્ધ વખાણે;  
મનમાં ચેદુર કરુને માને. જ્ય ઓ. ૫ જસોદા સુતને પાન  
કરાવે, ગોપીજન સહુ આનંદ પાવે; વાદાદો માહારો વર  
જમાં કાડ લડાવે, જ્યશ્રી ઈ સુતતો પારણામાથી જગ્યા,  
સહુ ગોળી જન આનંદ પાયા; વાદાદે માહારા તનતા  
તાપ સમાયા, જ્યશ્રી ૭ વંદ્રાવનના તે વાટે, મારણ  
રોકાણો શા આટે; વાદાદે માહારે રાસ રમાડ્યાં છે રાત,

જ્યાંશી ૮ નેણે જ્ય અિકુલ ગાયા, તેણેની સારળ થઈ છે દ્વાયાઃ તે તો એમ પદારથ પાયા, જ્યાંશી ૯ રાખ્યા અરણુ કમળની છાય તેણેનો ભવનો ઝ્રો જ્ય; તેતો હરી-દાસ ગુણ ગાય, જ.શી કસારે નાઈ. ૧૦

### ધોળ ૧૬૫

શ્રીઓનીદરાયારે રસીયા, આહારી ઇંડેકમળમાં વસીયા,  
 ૧ શ્રીમુખ સુંદરર દાસે, જેતાં નિજ જનનાં મન છાસે.  
 ૨ ભાળ તિલકરે પારાને, અગુણી ધનુલ્ય કામનું સાને.  
 ૩ નાકે ચોતારે લણકે, જણે જ્યલ્લા વીજળી ચ્યમકે. ૪  
 સામળ વરણેરે સાંચે, જેતાં ભરનાં કુષ્ઠાં જોઈએ.  
 ૫ શ્રીમુખ મધુરૂરે જોયે, શ્રી વચનામૂત નડી ડોઈ તોલે.  
 ૬ શ્રીવિઠલેશ રાયજીરે માયે, જુગ જુગ જોડ પારાને  
 સાયે. ૭ અનુભવ અથ તણ્ણા વિચાર, શ્રીહુરાણ પ્રગ-  
 ટચા પીળ વાર. ૮ શ્રીવિઠલરાયજીરે લાલ, શ્રીગોકુળ ઓ-  
 છવજી સા ધાણું વાહાલ, ૯ પૈત્ર શ્રીગોપેસવરજ છોગાળા;  
 શ્રીનદ્ધામીને દીન દ્વાળા. ૧૦ અંચળ ગનીએ આયે, હં-  
 સતાં વર્ષસ્તન સામું ભાણે ૧૧ એ ધાણું નિજ નને  
 સુખ હેઠે, શ્રીભાગવત નિરિતર કેણે છે. ૧૨ અંવા રવાની  
 સમર્થ રાને, પ્રગટચા હૈલી કુવ ત્વિત ડાને. ૧૩ અંમના  
 શુણનેરે ગાડુ, અરણુ કરળ રજ લેવા ધાડ. ૧૪ પ્રગટચા  
 પૃદ્ધોતમ અ તર, અંમની લાલા અપરાધા. ૧૫ વર-  
 ન શ્વિકનારે સ્ત્રામી, અરણુ કમળ વંકુ સીર નામી. ૧૬  
 શ્રીગોવી દરાયજીરે સીયા.

ઘોળ ૨૦૦

શ્રીલક્ષ્માણ સુતનેરે ગાઉ, શ્રીવલભનાથને જારે, જાઉ,  
 ૧ પ્રગટ્યા પૂર્ણોત્તમ અચીનારી. શ્રી વંદ્રાવન પીઠુ પદન  
 ખીલાસી. ૨ એતો પુરણ પરમાનાના, શ્રી મહાલક્ષ્મીપતી  
 અતી આનંદ. ૩ સુત ગોતીનાથ શ્રીવિલલ કણ્ઠીએ, એમ-  
 ના ચુણુ જસનો પાર ન લડીએ. ૪ શ્રીવિલલનાથ પ્રગટ્યા  
 પૂર્ણોત્તમ, જેણે પ્રગટ કરેચા શ્રી પૂર્ણોત્તમ. ૫ એતો ક-  
 હીએ પર્મ ઉદાર, શ્રી માહાલક્ષ્મી પદમાનતી ભરેયર. ૬  
 એમના સાત કુંચર સુખદાતા, કરવા દઈવીને સુખસાતા.  
 ૭ પ્રથમ શ્રીગીરધરજી માહારાન, શ્રીમાનીજી વહુજી એ  
 સીરતાન. ૮ શ્રીગોવીદરાઃ ધણ્ણ રસ ભરીયા, તે આરા-  
 ણીજી વહુજી વહુજી વહુજીં. ૯ શ્રીઘાણકસ્તુજી ભીને વાત,  
 શ્રીક્રમણ વતી પરી ચતુર સુલાણ. ૧૦ શ્રીગોકુળનાથ વ-  
 નત રસ જણે, શ્રીપારવતી પતી અતી રસ માને. ૧૧  
 શ્રીરધુપતી ઝડા રષે જણે, એતો શ્રીનાનાની જીવન પ્રા-  
 ણ. ૧૨ શ્રીનિદૃપતી ચુગતી જગતમે જણાયે, શ્રીમાહારાણી  
 પતી અતી મન ભાવે. ૧૩ શ્રીવિનસ્યામ પૂરણ કામ, શ્રી-ના  
 સ્નવતી પરી અતી રસ દાન, ૧૪ શ્રીલક્ષ્મગીજી એગ્રાજી  
 સતપ્રામા, શાલા પદ્માના કમળા દેવકી નાન. ૧૫ એ શ્રી  
 વલભનો પરિવાર, નિય પ્રત્યે સમરો નરને નાર. ૧૬ શ્રી  
 મહ વલભપદ; અનુરાગી, જેજન ગાએ તે ખડાભાગી. ૧૭  
 શ્રીલક્ષ્માણ સુતનેરે ગાઉ.

( ૧૫૩ )

ઘોણ ૨૦૧૦

કશ્મારસ ભેધન મન માટ્ઠરે ધાયું, શી વલભ શરીરથ  
ઈને સહુ કુલ પામ્યા જો, કાપા કરીને પોતે પાસે રાખ્યી  
આ, સદા સમીપ રેણે બહું સુધ્ય પામ્યા જો, કસ્નદાસો ૧  
મારગ લાંબાં પાહાડ થકી સથ્યા પાડા, તેને ત્યાં પ  
ણ હાયે થંભી રાખીજો; શી વલભપર વાછલતા કીથી  
ધારી, પોતે પ્રસન થઈને વાણી આખી જો. કશ્મારસો ૨  
માગ માગ ને માગે તે આપૂરુને, માર્ગ દ્રંગ હોય મુ-  
ખરતા નન આવી જો; એ આવતે ત્રીજાની તો ના કહી  
શુરુ દ્વાર તે વેદ વિરધ ડાઢારી જો. કશ્મારસો ૩ વાસ  
નિકામાં પ્રલુ પોતે પદ્ધા ઈયા, પાહાર ઢાડો રેહેને એમ ક  
હી આથ્યા જો; ત્રણ દીપસ લગી અહેં રાત ઢાડા રલ્યા,  
પોતે પ્રસન થઈને કદ્દુ મન ઓચાલી જો. કસ્નદાસો ૪ માગ  
કદ્દુ ત્યારે તેનું તે મારીયું, તે માહે એ આપી તેતો આ  
પણો; શુરુ જધારતી પોતે તો નાહી કરી, શી વલભ સ  
રવેલર સથળે વ્યાચી જો. કસ્નદાસો ૫ ગંગાસાગર પ્રલુ  
પોતે પદ્ધા ઈયા, ધ્યાન મરેમતાની છચ્છા મન કીઝી જો;  
પાર જઈને સીધ કરાની લાવીએ! પોતે પ્રસન થઈને આ  
ક્ષા દીધી જો. કસ્નદાસો ૬ પુછદ્ય ત્યારે તેનું તે મારીયું  
પોતે કદ્દું ને જીવ શું મારી જાણેજી; શુરુ આગળ સમ  
ઘાધા તે સાચા ખરા, શી વલભ પુરેસોતમને વેદ ૧-  
ઘાણેજો. કસ્નદાસો ૭ પ્રિય અધિય તે પ્રલુજુને શું પુ-  
છીયું, ગોત્રસ સ્નેહાર અતિશે પ્રલુજુને ખારણે; ધુંવા  
ધરોણ કલેસ પ્રલુને ન રમે, શી વલભ મુખ્યી ઓચાયા

( १६७ )

निधारने. क्षेत्रासमि पन मन भाद्रे धारु. ८

द्योग २०२

भैमरवाणा दास दामोदरने हरी, पन पमाडी श्री व-  
लभ मरणे लीयोन्ने; श्रवा पपरानी श्री द्वारकांतापनी,  
वणी अक्षित रस भाव धर्णने लीयोन्ने. संभरवाणा० १  
ज्ञ श्रवा पाण्य प्रभुल्लानी पोते करी, लोड लाज कुण अन  
समुरना भहेलीन्ने; सज्ज्या भंदीर मांहे सज्ज्या रामारेतां,  
विपरीत वासना रम्य मनभे इतीन्ने. संभर वाणा० २  
रानभागनी थाण धरी चेकी थकी, प्रभुचे लत भारीने  
पाडी नांझीन्ने; श्रवा कुण्ड झेतुळ कुडीने राज्या धर्णुं,  
वगीती नाड धसीने दीनना भारीन्ने. संभर वाणा० ३  
उत्ताणु काणमे चोपारे सुता जम, प्रभुल्ल उपर वांछलता  
कांप नव लाव्यान्ने; दासी उपर द्या परभु पोते करी,  
भंदीर आणारीने पांझा कराव्योन्ने. संभर वाणा० ४ भ-  
दीर सिफ करावी प्रभु पधारावीभा, राज वर्षभव पेर श्रवा  
सुभ मानीन्ने; अमशुभ राज सरेया ओने जाणुन्ने, एवुं  
श्री वलभ सुभयी शोध्या वाणुन्ने, संभर वाणा० ५  
दास दामोदर हरेसाळा घेर आवीया, अन सुभडी छ-  
वरानी पुरणु प्रीतीन्ने; सुभडानी वीनती ता पोते ना करी,  
श्री माहाप्रभुल्लने शुस यडा ते शतेन्ने. संभर वाणा० ६  
धरभा यडा एवुं पोते जाणीयुं, श्री वलभ पारा जर्द  
अप्राध समावेन्ने; माटे सहु श्री वलभ पद श्रवा करे,  
अनाश्रयनो दाश धण्णा, भनलादीन्ने. संभरवाणा दास  
दामोदरने धरी. ७

( १५८ )

### ધોળ ૨૦૩

પ્રદમ નાભ તે દાસ બ્યાસ સુખ અટી ધાર્થું, શ્રીવલભ  
ભરણ રહીને બહુ સુખ લીધુંનો; અવતા પ્રત કરીને સેવ્યા  
ઓ ગયુરેસજુ, વેપાળને ધન કરેજ કાહાડી દીધુંનો. પ્રદમ  
નાભ તે દાસ ૦ ૧ એહી છોકી કુંવારી પોતાતથી, વર્ષક્રિય  
નાથી પરત્તાનીમાં દીભીનો: ક્રેચી સગાઈ પુણસાં ઘાલી તે  
સમે, ચોત કરું અમે ક્રાદ્ધી તેતો કીધાનો. પ્રદમ નાભ તે  
દાસ ૦ ૨ એહું જીભળી પુણના મન હરખી ધાર્થું, ૧૪૩૫  
ઉપર વાહાલ સરવેને એવોનો; પરિષતી શ્રનાથી પરલુ  
રીક્રા ધાર્થું, સુત રંધુનાયદાસ તે કહીએ તેવાનો. પ્રદમ  
નાભ તે દાસ ૦ ૩ એવા વૈર્યવાન તે વીજા કો નહીં; શ્રી  
વલભ સરણ થઈને લક્ષી રસ પીધાનો; દરથન કરેવા  
સાર અઢેલમાં છોકાલા સમર્પી પ્રભુજુ પ્રસન કીધાનો. ૫૬૫  
નાભ તે દાસ સુખ અટી ધાર્થું. ૪

### ધોળ ૨૦૪

પૂર્વોત્તમદાસ સદા સુખ અટી ધાર્થું, શ્રી વલભ કાપા  
કરીને સુખ દીધુંનો; પાતે સરણ થયા તે સહું ખરિવ ૧૨  
શું, શ્રી મદત જોહનજુ શવીને સુખ લીધુંનો. પૂર્વોત્તમ-  
દાસ ૦ ૧ એછા ૧૮-મ તે પ્રગટ પ્રભુ પોતે કરે, નંદ જ-  
સાદ ગોપ ગોપી રહું આવીનો; દર્ઢી શ્રવયર ધ્યા પ્રભુ  
પાતે કરો, પ્રગટ કૃષ્ણની લીલા સહુ દરસાવીનો. પૂર્વોત્તમ  
દાસ ૦ ૨ એછા નોંધા સાર શા માહાદેવજુ, આવી પોતે  
પરસાદ માગી જાધાનો; ધર ચોકી સાર આસા પોતે કરી;

કુળ અર્થરને હુકમ યેને ક્રીદાન્ને પૂર્વોત્તમદાસ૦ ૩  
 પુની પુન્ય પતીન એક પોતા તણી, નામ તે બાઈ ઇલ્લાં  
 આજી કહીએ તેહનુંનો; ભરતગ સ્ત્રીન કરી હરી સેવા  
 હેતસં, એવું ગાડું ભગત તે કહીએ તેહનુંનો. પૂર્વોત્તમ  
 દાસ૦ ૪ નામ હેવાની આજી પ્રભુ પોતે કરો, દ્વારી જીવ  
 જી ને કોઈ આવે તેહનેનો; વળતી શ્રી વલભ પોતે પ-  
 ધારીઆ, એવી કાપા કરી તેહેની નહી નેનો. પૂર્વોત્તમ  
 દાસ૦ ૫ પત્રાવ લંઘન અંધ્ર પ્રગટ પ્રભુએ કરો,. માયા  
 તતક્ષણ જીવી લીધાનો; બાહીર સુખ સાથે સાંભાપણ  
 નવ કરચા, પૂરણ અદ્ધ આ કંક્રે પ્રસ્તિદ્વ તે કીધાનો. પૂ-  
 ર્વોત્તમદાસ૦ ૭ ગોપાળદાસ ગુણ ગાવું ઉલાસમે, પુત્ર શ્રદ્ધ  
 ના એવા તે વળી કહીએનો; ગાઠે શ્રી વલભ અરણ સદા  
 શ્રવો સહુ, વદ્ધક્રીજન તે સદા તરણે લહીએનો. પૂ-  
 ર્વોત્તમદાસ સદા સુખ આતી ધાર્યું. ૮

### ધોળ ૨૦૪

ગદાધરેદાસ કપીલ કડા માહે ખરા, ક્ષત્રી ડોમડના પરો-  
 હિત તે જાગુનો; શ્રી વલભ સરણ થઈને સુખ પામ્યા  
 ધાર્યું, આંધ્રા વરત રદીને શેવા રસ માનેનો. ગદાધર-  
 દાસ૦ ૧ એ આવે તે સરણ સમરપે નાયને, ધરમાં વાસી  
 તે કાંઈએ નવ રાખેનો; શુણું ગાંધે તે શ્રી ગોવર્ધન  
 નાયના, કરી શીરતનને યેતે સુખ્યથી ભાખેનો. ગદાધર-  
 દાસ૦ ૨ ડોઈ સમે વળી વળતા કાઈ આવ નહી, સરણ  
 નીાગ જી લોહી સમરપણ કીધીનો; ગધરાત્રે જગમાને  
 આપીયું, લારી ઠસે નાચો તે ધરાવી દીધીનો. ગદાધરદાસ

૩ પ્રસાદ બેતાં વજની અહુ પ્રસાન થયા, એ સ્વાદ તે  
અમે નથી કાંઈ આખ્યોજો; લેણી લાગ્યા તેવી છત પોતે  
કહી, સત્ય વયન તે મુખ્યથી પોતે ભાખોજો. ગદાધરદાસ૦  
૪ માધવદાસ નીમધ ભાળ લાગ્યા, આરોગ્યા તે પ્રભુ-  
જી પૂરણ પ્રિતેજો; મુખ્યથી આસીન્ત્રાદ પ્રસાન થઈને કલ્યો,  
હરી લડતી દ્વદ્ધ થઈ રંગની રીતેજો. ગદાધરદાસ૦ ૫ એ-  
વો જસ નગરદીનો પ્રભુ પે.તે ડરસ્યો, આ વલભ પ્રભુ  
કૃપા થઈ મહુ જાહોરો; માટે સહુ શી વલભ પદ્ધતા  
કરો, વજની ઉપર વાહાલ ધાર્યું તે આખોજો. ગદાધર-  
દાસ કષીલ કડા માહેરુંઘરા. ૬

### ધો. ૮ ૨૦૬

આવણ સુદી એકાદશીનું લઘું છે.—ધન્ય ધન્યરે આ-  
નુંનો દીન, આવણ સુદી એકાદશીજી; ધન્ય ધન્ય આજીનુ  
ની રેત, ધન્ય આજીની માહાનીસીજી. ૧ ધન્ય ધન્ય ઓ  
સુખ કેરાં વાયન, અલ્લ સંખાંધ કરાવીઆજી; સોચ્યા ઓ  
પુરુસોતમ હાય, મનડાની આશા પૂરણ થઈજી. ૨ જીવો  
નુંબોરે જીવ્યાનાં ભાગ્ય, વીના સાધન સુખ પામીઆંજી;  
માહા ઓ વલભ સરણ પ્રતાપ, સેહેંચે સક્ષગ હુઃખ વામી-  
આંજી. ૩ વીના સાધન જ્ય તમને નેમ, સક્ષણ જીવ ઉ-  
ધારીઆજી; માહા લીન પતીત ચાડાય, અસ્થી સઉદ્રાહિત  
તારીઆજી. ૪ માહા કઠણું કાળ કળી માંહ, અતી કરીણ  
એ પ્રગટીઆજી; કાધી સરણાંગતની સાહાય, તાપ રહેના  
મીટાવીઆજી. ૫ ચરણણુંબો ઓ લક્ષમણું નદ, સદા ભ-  
ક્ત સીર નારાજતાજી; નિત્ય વરણમાં અભાડ ખાહાર,

સથા વરજ શેરક ક્ષીર ગાજતાણ. ૬ ધૂળ ધોયે આજુ  
નો દીન, શ્રાવણ સુદી એકાદશીણ.

### ધોળ ૨૦૧

વચ્છિાય સુદી એકાદશીનું લઘું છે.

વચ્છિાય સુદી એકાદશી, પ્રગટ્યા અની વલભરાય; મુરી-  
નર મુનીજન હરખીઓ, હરખીઓ. વરજ સહુ સાથ. ૧  
દેવનાં દુદાલી વાખીયાં, ગાજુયાં અર જદાન; અવજરા ન-  
યે ડરે ધર્યું, વ્યાન તે બાંપ્રવ સાંન. ૨ નિન શવરૂપ  
પધારીઓ, ચંપા તે રણ માઝાને; સી હાસન પધરાનીઓ,  
કીધો અન મંડળા! ૩. ૩ તાત નિરખી નિરમે થથા, મંડળ  
મધ્યે શવરૂપ; મુંખપર રવી સંતો વારણે, શાભા અતોસે  
અનુપ. ૪ આ લક્ષ્મણ ભરણ વીમાસીને; એળખ્યા પુ-  
નમય દઃ પૂત્ર ભાવ કુલરાવીઓ, એછ ચે ગોવીં. ૫ ન  
રણની માંદી શુમ છે, પ્રગટ્યા ખાજ વા; લોક પ્રસિદ્ધ  
જાણાનીઓ, માત ગરબ વાસ. ૬ મંડળ દરથન માત્રથી,  
એધારચા જીવ અનેક; અની વલભ નામ ધરાવીને, રાખ્યો  
તે સરવનો રૂક. ૭ પાર ના પાંચું લાલાતણો, રસનાંએ ડ્યુમ  
કુરુવાય; હરોદાસ શાભા નિરખ્યાન, પ્રેન મુદ્દીત શુણ આય.  
૮ વચ્છિાય સુદી એકાદશી, પ્રગટ્યા અની વલભરાય.

### ધોળ ૨૦૮

શી વિઠલનાથજીના ભાનું છે. અતી લટકાણા, વચ્છરનબ-  
ના પ્રાણ આધાર સહુને છે. વાણામા. ૧ અની ગોવીંદરા-  
યજીના પુત્ર, સહુકો અમ કેળે છે; વાહાલે દીધાં અઠળક

દાન, મનગંધીત હેઠે ૨ શ્રી ગોયિસ્વરણના ચાત, રૂપે રૂ-  
ડાઢે; નારખે નર્ધા નો નર નાર, તે નર કુડા છે ઉંમેંવા  
પ્રકૃતીત વદન નિઃબા, શું કરું શાલાને; જાણે ઉદ્દીઘો  
પનમચાદ, થાંડું મન લોલાને. ૪ એમનું સુંદરે ભાળ  
નિમાણ, તીલક શેલે છે; નારખાને લાણે મોરાર; ચિતડાં  
લાને છે. ૫ શ્રી કરું માળ કુસમ તણ્ણી, અતી રાનેછે;  
નિરસ્યાંતો વદ્ધનયાનને, જોહ ઉપાલવે છે. ૬ ચાચળતા  
મીલ ચ્યાંલ, ભારે દીસે છે; જાણે અદ ગજ કુમળ સમાન,  
મન જોઈ જિસે છે. ૭ છાંનાપર જરૂર બલીહારા, હું તમને  
વાડું; પ્રગટચાચી વીઠલનાથ, શ્રાક જનના સાડ. ૮ મને  
હરએ ધરોરો થાય છે, શુંગ ગાવાને; માહારા તનના તાપ  
સમાન, ભવ હુએ જલને ૯ છલ છણાલા ભાલ છે, અતી  
સારારે; હીંડે છં લટડા કરતા કરાં; કામળુગારારે. ૧૦ શ્રી  
સહાડ નગરમાં વાસ, સહુડો જાણે છે; જસ થયો જરૂર  
નિદ્રાત, દાસ વાણે છે. ૧૧ શું કહે વરેજલુખાણ, શુણું  
તમારારે; અવગુણ ન જાણા નાથ, ધણ્ણી અમારારે. ૧૨  
શ્રી વિઠલનાથજીના લાદંડા આતી લઈકાળા.

## ધોણી ૨૦૪

અથ શ્રી કરાનો ભાગ લખ્યાછે ॥ શ્રી કાશ્માપ મનમઃ ॥

૧ કિયા કરને શ્રી વલભ, તો તેને કાઈ નરી દુ-  
લભ. ૨ કરન દ્રષ્ટિએ કરીને શુંયે, તો તેનાં હુએ દાળી  
દું શુંયે. ૩ તાંબાં તેને થાય, શુલભ, કરા કિયા કરે આ  
વલભ. ૪ અખા અસુલોદ્ધર્મિં કરે, પુટિ ભક્તાં માંડું  
પરિષરે. ૫ અખા રૂપાંધ તે કરનો શુંયે, શ્રાવા રમરણ કર-

જો પિતે. ૫ પ્રભુપદ કમળ રૂપેમાં હતી, ખાયા ખરી  
 દ્વારા કરી. ૬ ગગા ચુકુ ગેવીએ ચુણ ગાય, શી. વનભ.  
 ઓ વીઠકરાય. ૭ એવું નારાયાણ કમળ નિત્ય ભજો, અન્ય  
 દ્વારા ઉપારસના તજો. ૮ પ્રભુ મળવાનો કરો ઊપાય, ગગા  
 ચુકુ ગેવીએ ચુણ ગાય ૯ ધમા ધાણું ધનસ્યામ સંભાર,  
 દોડીકમાંથી ચિત નિવાર. ૧૦ વિસ્તા શકીયી દુરજ રહે,  
 લાંહાં ધર મેળ નિરગમ લહે. ૧૧ એવું મનમાં કરી નિ-  
 રધાર, ધમા ધાણું ધનસ્યામ સંભાર. ૧૨ નના નેહ નંદ  
 લાલ શું થાય, તે માટે એ કરવો ઉપાય. ૧૩ એની લી-  
 લામાં મન જો ભરે, તેતો એને અતિશ ગમે. ૧૪ પ્રેમ  
 ધરીને નાસદીન ગાય, નના નેહ નંદલાલ શું થાય. ૧૫  
 અચા ચિત અતુરાઈથી આણ, ઓ ગોરખનાથ નાખાણ.  
 ૧૬ ચિત તથી અચણતા તજો, પુરણ પુરુષોત્તમને ભજો,  
 એછે અન્ન સિધની ખાણ, અચા ચિત અતુરાઈ આ-  
 ણુ. ૧૮ છણ છણી છણીલાણી નોઈ, એ સમાન વી-  
 લાલમાં ડાઈ. ૧૯ નઈએ નિાખી અતી સુખ લાજો,  
 પ્રેમ સુધારસ નિસદીન પીજો. ૨૦ તો સરવે સુખ શેને  
 હોઈ, ૨૧ છણી છણીલાણી નોઈ. ૨૨ જાન નગતમે  
 જસ વાધે, જો એવા પ્રભુને આરાધે. ૨૩ જો સુખથા ઓ  
 કુસું શ્રી કરુણ કહે, તો વરજ વંદ્રાવનનું સુખ લહે. ૨૪  
 મન કરેમ વચન કરીને સાધે, જાણ નગતમે જસ વાધે.  
 ૨૫ અત્મા અકૃતું શું વળી કહીએ, સુખ દુલ્લ દુર સણ સણ  
 છીએ. ૨૬ કાગ કોધ મદ માહેને દાળી, અરજુ કમળ ચિત  
 દીજો વાળી, ૨૭ તે સુખ સરવે સેહેજમાં લહાણે, અત્મા  
 અકૃતું શું વળી કહીએ. ૨૮ કટા ટગમગ ટગમગ નોણા,  
 પ્રભુને ભજ્યા વિના જન્મજ જોણા. ૨૯ ઉતમ દેહ જો

મનુષ્ય ખરી, એ અવસર નહી આવે કરી. ૨૬ નંદી ચેતો  
 તો આગળ રોશા, ટઠા ટગમગ ટગમગ જોશા. ૩૦ ૬૬  
 હગતો ડાળ ડગાપ, હવે કાંઈ એક મનમાં ભય આપ. ૩૧  
 કૃપટ કોથ નીદા પરહરી, પોત પોતાનું સાખન કરી. ૩૨  
 નિરમળ ચિને હરી ગુણ ગાપ, ડાઢ ડગ તો ડાળ ટગાપ. ૩૩  
 ડડા ડાહાપણ એવું કરી, ઓ વલભ વીજલ ચિત ખરી. ૩૪  
 ભલુ ચેરો લે પોતા તાણું, પ્રભુથા ચિત રખે ટાળો કુ  
 ણું. ૩૫ તો ભવ સાગર સે / તરી, ડડા ડાહાપણ એવું કર  
 રી. ૩૬ ટઠા ટોઠ ટોઠાઈ ના કીને, શ્રીના કદા કીરતન મ  
 ન દીને. ૩૭ ભવસાગર ઉત્તરવો એટા, તે તરવાનો મા-  
 રગ મોણા. ૩૮ રસના ગુણ ગાઈ રસ પીને, ટઠા ટોઠાઈ  
 હાઈ ન કીને. ૩૯ છોણા નઈણા સફળજ કરી, માધુંશા  
 મુરે મનમાં ખરી. ૪૦ નાન શીખ રાખો એહુનું ૩૫, સુ  
 દીર ઓ વંદ્રાવન લુપ. ૪૧ હવે રખે વીસાણી હશી, લિણા  
 નઈણાં સફળજ કરી. ૪૨ તગા તનતી તપતજ ટળો, લે  
 ગીરી ગોવરધનધર મળો. ૪૩ લે પોતાનો જનમ સધારા,  
 તો એ સાથે પ્રીત વરારો. ૪૪ પોતે પોતાપણું સંભાળો,  
 તગા તનતા નાપજ ટળો. ૪૫ પથા પડ અડી પાડ નીવા  
 રો, મનુષ્યા જનમ તરવાનો આરો. ૪૬ ભવ સાગર ઉત-  
 રવો પાર, નામ ડુંપી છે નામજ સારો. ૪૭ ઓ ગુહ ઓ શ્રી  
 વલભ વીજલ ખાણી, થપા પડ અડી થાણ નીવાણી. ૪૮ દ-  
 દા દ્વા કરી દેશ દાન, એ આગળ લે ખરી કાન. ૪૯  
 વંશ વંશાદીક કરી એપાર, ભવસ ગર ઉત્તરવો પારો. ૫૦  
 દ્વિજ જનને અતીશ માન, દ્વા દ્વા કરી દેશ દાન. ૫૧  
 ધ્વા ધન્ય દીવસ છે આજ, મંદીર પદ્મરચા શ્રી માહારા  
 જ. ૫૨ નિરખી નિરખી સુખ અતી ધાણું થાપ, તે મુખ

કણા કણાંહા લગી કોણાય. ૫૩ એ ચિત ધરે સરવે  
 કાજ, ધધા ધન્ય દીવસ છે આજ. ૫૪ નતા નાથ દીન  
 લે જપે, એવું ઇણ નકી ડોડી જન્મ તપે. ૫૫. ત૫ કરીને  
 કાં કાટે કાય, કશે નામ લને સરળ ઇણ થાય. ૫૬ આ  
 ઘર એ ઘડુ આવે ઘપે, નતા નિય દીન નામ લે જપે  
 ૫૭ પદા પ્રોત્સાહ પ્રાગ આધાર, જુખમે જુવણ નાદુના  
 ૨, ૫૮ માત જસોદાજીનું જુન, ચોરી લીધું વરજ જત  
 નું મન. ૫૯ વરજમે નીથદીન કરે વીહાર, ૫૫ પ્રિતમ પ્રા-  
 ણ આધાર. ૬૦ રૂઢા રુગતું ના મેલીશ ચિત, રંધે વીસા-  
 રી માહન મીત. ૬૧ એ વિસારે સુઅ નર લહે, તેતો વેદ  
 પુરાણે કહે. ૬૨ વળી વળી શું કહીએ નિત્ય, રૂઢા રુગતું  
 ના મેલીશ ચિત. ૬૩ ઘણા ઘડુ ઘગનું નહીં કામ, થરે  
 ગુપ્તે વશ થાએ સ્વામ. ૬૪ ઓ વલભ વરનો માર્ગ શ્રે  
 હો, મન વાંધીત કુળ, સરવે લહો. ૬૫ થરણ કામણ કરી  
 આ રામ, ઘણા ઘડું ઘગનું નહીં કામ. ૬૬ ભલા ભગ  
 વદી સંગત ભલી, શ્રી વીરન ગુણ ગાએ મળી. ૬૭ એ-  
 વું ચિંતન નીય દીન કરો, ખાજ વાત ના મનમાં ધરો.  
 ૬૮ માટો ગુણ નિરઘા છે કળી, ભલા ભગવદી સંગત  
 મળી. ૬૯ મમા સુકૃત થકી છે માડુ, અક્રિત વીના આ-  
 જુ સાધન આડુ. ૭૦ ઓ વલભ વરણ નમનજ કરી. પો  
 તાના જનને ચિત ધરી. ૭૧ તે કારણ પરરજ લેડુ, મ-  
 મા સુકૃત થકી છે માડુ. ૭૨ જળ જનક રંગ નેમ દાત,  
 તેમાં રંગ રાખે ઓ રાધા કંધ. ૭૩ નેમ રંગ ઉપર મ-  
 ણુદ ચોગ, તે મીઠ રંગમાં ચિત ચોળ. ૭૪ પ્રલુ રસં-  
 માં રહ્ય રસવત, જળ જનક રંગ નેમ દાત, ૭૫ રેરા  
 રસીડ રખીલાનાય, ઓ લખુલાન દુનારી સાથ; ૭૬ એ

નિત્યે રસમાં રસમાન નિરાષુ, રહે કમળમાં રાખી હંશુ.  
 ૭૭ એવું રહ આવું છે હાથ, રેરા રશીક રશીલા નાથ.  
 ૭૮ ભના લાડણું ભાગન સંભ, ૭૯ની અવલેછી વાર્દોચો  
 ઉછિંગ, ૮૦ લક્ષીતાજુ મન લીલા ધરે, સફળ મનોરથ પૂ  
 રાષુ કરે; ૮૧ નમ રેલ કરે શીતળ આગ, ભલા લાડણું લા  
 ભન સંભ; ૮૨ વના વદ્ય થાને વરેજાંદ, તારે ટળે સ  
 કળ કુચ ઈંદ. ૮૩ કુચ ધારું છે આ સંસાર, પ્રભુ વીના  
 કોઈ ના કરે વાહાર. ૮૪ મનની મુક્તિ હન્તે સરવે ઈંદ,  
 વના વદ્ય થાને વરેજાંદ; ૮૫ શશા શામ સુંદરે સુંદરી;  
 નિરાખી નિરાખી છાખી પર ખલીહારી; ૮૬ નિરાખતાં  
 તપત ટળે તન તથી; મનમાં થાપ શીતળતા ધર્થી. ૮૭  
 તન મન ધને સરવે વાળી, શશા શામ સુંદરે સુંદરારી.  
 ૮૮ પણ સાચું સગપણ એહુ, જામ જામ તે એશુ રનેહ.  
 ૮૯ ભમી ભમીને હારી ઠામ, અરણું કમળ થાંગે વિશા-  
 મ; ૯૦ કુરી કુરીને કહુંદું તેહ, પણ સાચું સગપણ એહ  
 ૯૧ સસા સુખમાં સુતો રહે, ને પ્રભુ જાંતુ અરમન  
 લહે, ૯૨ માહારે તાદ્વાર કરતેસ કરે, ભદ્ર ભરચાનું રાધ  
 ન કરે; ૯૩ તેતો જામ વૃથા સંક કહે, સસા સુખમાં  
 સુતો રહે; ૯૪ હેણ હેત હરી સાથે સાચું એ રગે હું અ  
 તિશે રાચું; ૯૫ દીન જાણી પ્રભુ કોને સાર; માહારે તો  
 એઉનો આપાર; ૯૬ દ્રદ આશરા વીના સરવે કાચુ, હેણ  
 હેત હરી સાથે સાચું. ૯૭ ભલા વદ્ધાણ સુત કરી દ્યા, તે  
 જ થકી સંપૂરણું થયા. ૯૮ દીન દ્યાન કરણાનીધી સાગ  
 ર, મન વાંધીત ઈણ પૂરણું આગળ. ૯૯ બહે જાતકર રા  
 એ ઘર્યાં, ભલા વદ્ધાણ સુત કર દ્યા; ૧૦૦ ક્ષાણું ક્ષાણું એ  
 ચિતમાં ધરી, પીજુ વાત સરવે પરહારી; ૧૦૦ ઓ ગયું

શ મનોરથ પૂરે, દુઃખ દાળીદ સકળને ચુરે; ૧૦૧ એપાન  
નારંતર એડનો કુરી, ક્ષેત્ર ક્ષેત્ર એ ચિત્તમાં ધરી; ૧૦૨  
સુ ગાનપાણું નવ જાણું, રસતા શ્રી વલભ નામ વખાણું;  
૧૦૩ હરીદાસ પરીપૂરણું કામ, શ્રીના પરાયી પોણાતી દા-  
અ; ૧૦૪ શ્રી મદન મોહન છાંની તે હર આણું, સુ ગાન-  
પાણું નવ જાણું. ૧૦૫ ધર્તિ ઓ કુઝનો ભાગ, સંપુર્ણું

### ધોણ ૨૧૦

મહેતા તમો મહેતા તમો જાણીઆ, શ્રી ગોદુણકેરા  
રાખ ઓ લાગવનમાં સાંભળીઆ, એ વરજમાંથી અણગા  
ન થાય. ૧ ઓ વંદ્રાવનમાં ઇસ્યોરે વિહાર, ઓ રંધાજ  
તણોર આધાર; ગાઉ ચારણુંમાં હુારે ગોવાળ, ગોપી  
તણું અંગીકાર. ૨ ઈદ્ર તણું મરેડુરે માન, ઓ ગોવરધન  
વરજપાળ; દ્વીજ કુણમાં વાહસો પ્રગટીઆ એ, ઓ વીડલ  
અડે અવતાર. ૩ વર્જન વનભી એ જાણીઆ એ, ઓ  
પૂરુસેતમ નીરણાર; ૪૨ જાતા તમો રાખીઆ એ, અ-  
ખળા તણા આધાર. ૪ માધવદાસ સોભાગીઆ એ, અ-  
ખંડ અવાતળું નારધાર; આપો વરજમાં વાસો એ, કેહેતાં  
ન આવે પાર. ૫ મહેતા તમો મેતો તમો જાણીઆ એ.

### ધોણ ૨૧૧

સજની માસો ઉછન આજળુ, જનમ દીવસ ઓ વલભ  
રાજળુ કુતોરણ ધલ પતાકા દ્વારણ, ધ્વણ મંગળ ગા-  
એ સારજુ, ૨ ધેર ધેર તેજણે વાંધાપળ, મેતુડ ચોકુપુ-

રાયજી. તુમું કુમ હાથા તે હેવરાવીઓણુ, કેસર સ્ત્રાન  
પ્રમુલને ધાયજુ. ૪ વાળુંને વાગે આવ નહીં ભતજુ, અ  
જોએઓ તે સણજન કુદુંય ગાતજુ. ૫ લીડ અચી પર  
આંગાબા માણેજુ, નીજ જન નાચે આનંદ શું ગાયજુ.  
૬ કેસરે નહીં શી લક્ષ્યાખું ન છું, જાણે પુનમ પૂરણાખું  
જુ. ૭ વિઘ્નસ્થાન આખાય કાવેજુ, ચ શોદક કેછને  
તાપ સમાવેજુ. ૮ ડોમળ વસ્ત્ર ઓણ્યાછે અંગજુ, ધેતી  
ઉપરણ્ણા તે કેસરી રગજુ. ૯ તી ક મુદ્રાદીક શોલીત ભા-  
જુ, કરે ઉપરીત ને તુલભેસીની માગજુ. ૧૦ તેહ સમે  
ને ભાગ્યનાન હૈયજુ, આરતી તે કરતાં શીમુખ નોયજુ.  
૧૧ મારકંડ્ય ભાગ્ય વિચારે અનજુ, અમને શ્રી વલભ  
કરે પુજનજુ. ૧૨ પૂજન્યે આપે તે બાંડુ વીધી ધનજુ,  
ભૂહેન જાયક ગન સનમાનજુ. ૧૩ દેવતા તે કરે કુસમની  
વરણીજુ, જુગ જુગ જુગો શ્રી વલભ ધિસજુ. ૧૪ ચો-  
કી તે મંડળી મધે ભારાનેજુ, એ વર વલભ માથે છા-  
નેજુ. ૧૫ સણજી ચાલો ઉછવ આજજુ.

### ધોણી રેણુ

રાગ સારંગ.

જ્યાકુ ઔદ રટત, ધ્રુવા રટત સેસ રટત; નાંદ શુક  
વ્યાસ રટત, નાવત નહીં પ્રાર. જ્યાકુ ૧ ઈજન પ્રેહલાદ  
રટત, કુંતાજુ કે કુંબર રટત; દ્વાર્દીદ સુતા નાસ્ય રટત,  
અનાધન કે નાય જ્યાકુ ૨ ગુણજા ગજ વિપ્ર રટત, ગ-  
ઓમીકી ગ્રહણી રટત; ચિજ રજાની રટત, સુત રાણત હુ  
લરાંગ. જ્યાકુ ૩ નાંદ ધાર સોહી કીલાસ, શ્રી ગાંધુજર

( ૨૦૭ )

ધારી રસીક લાલ; જ્વાસોમતીકા પુજ ખારે, રાંગડો ઉર  
હાર, જ્વાફું બેટ રઠા. ૪

ધોખ ૨૧૩

રાગ કાનડો.

ઉત્તમ કુળ અતિતાર કલ્યાણે, શ્રી વલભ રાજકુમાર ન  
ભણે; અરચા ન કીની અર પલભકી, રદ્ધો યાયાડ કી-  
નો અહુ ખાંયો. ૧ રસીક કથા ક્રન્દે ન સુના. વિષાભાં  
ને રથો લપટાનો; મીઠ્યો ન સોચ ઉર આતરકા, સમજ  
સમજ સનના પરટાનો. ૨ ગીરીનર ધરણ વરેજ વદ્રાવત,  
કૃષ્ણ તથન નારખી સરાંયો, કસનદાસ પ્રભુકો ચુન ન-  
હિના, ગરગ સુતી નહીં જાન પખાંયો. ૩ ઉત્તમ કુળ અ-  
વતાર કલ્યાણે.

ધોખ ૨૧૪

આદો સધયરો સુદીર વરને જોઈએ, સોહીએ કરો શ  
ખગાર. ૧૪. શ્રીઅઙ્ગાજીના કુંવર ડોડામણા, સોહાગણા  
સુદીર નાથરે; આપડા કંજરે પ્રભુજીએ કરચાં, મનકુ મીન-  
હુરે વરેજ રાથરે. ૧ આપડે ઘેરે સરવે એમ કરો, ભરો  
નરો લેટ અમૃતારે; ડળસ ઉપરે સુન ધારી, નીલાવન જ  
મ તુદ્ધરે. ૨ શ્રી વનભજીને ઘેર વધામણા, રળીઅામણા  
રંગમીર ગાપરે; પાલણે પોડાડે પ્રભુજી રમે, એ સુખ કલ્યાં  
નવ જાપરે ૩ મધ્યણો પરિવારરે આપડા ચી નાથજીને,  
ખાંધાંધાં માધવદાસરે; કરણે ડાને છે વિનગી, મને વર-

નમાં તે આપો વાસરે,

**ધોળ ૨૧૫**

પર્મ કૃપાળ શ્રીવલભનાનંદન, કરેત શીરપા નિજ હૃથે ને  
માથે; ને જત સરણે આપે અનુસરહી, અહી સુતાત શ્રી  
ગોવધનનાથ. ૧ પરમ ઉદ્ઘાર ચતુર ચંતામણી, રાખ્યત ભવ  
દારાની સાથ; ભને કસ્ટનાસ કાજ સામસરહી, જે જાળે  
શ્રી નિઠલનાથ. ૨ પરમ શીરપાળ શ્રીવલભ નાનંદન.

**ધોળ ૨૧૬**

॥ રાગ ધંનાશી ॥ વધાંખ ॥

માહેં જુગ મેદ ખયત પ્રતીપાલો, ધમ ગમનાભહી  
જઘ તખહી તઘ તાં તમ વ્યાખયી. ૧ સાયુગગ શૈવાન-  
રાહ ૩૫ ખશી, હણુંકુસ ઉર માર્યો; ત્રેણ રામ૩૫ દસ-  
રથ અદે રાણયુ કુળ સંહાર્યો. ૨ દ્વાપર પર્ગજ ખુડનેત  
રાખ્યો, સુરેપાણ પાર ના પાયો; કાસાદ્વિ દાનન સઘ મા-  
દી, ખસુધા ભાર ઉગરચો. ૩ કષયુગ શ્રી વલભ ગ્રેહ  
પ્રગટચો, માયા વાદ નિવારચો; માણુકયાદ શ્રી નિઠલ પૂર્વ-  
સૌતમ, જગતા પૂર્વ નિહારચો. ૪ માહેં જુગ મેદ વયત  
પ્રપાલો.

**ધોળ ૨૧૭**

શ્રો વલભ નિઠલ હરી ન જણ્યા, તેણે સર્વશ જોયુંદે;  
થું લાલ્યા થું સેધને જણા, લારંવાર વદ્વાયારો. ૧ પૂર્ણિ

( २११ )

માર્ગમાં ને જન આચા, નિસ્ખાસે ન વળવારે; સાધન જર્ણી  
જુદી જાણ, હરીપી રહેશ આગારે. ૨ શૈવા કૃણ શૈવા ક-  
રુણો, ઇતુ પ્રમાણે મેવારે; સાયત પ્રમાણે સમરપિ લજે,  
તેહેનું નામ તે શૈવારે. ૩ શૈવા કૃશે ને પાખાડ ધરશે,  
તે પથર કચમ તરશેરે; ભાવ વિના ને લક્ષિત કરશે, તે  
આયતા મરશેરે. ૪ મીઠુ બેલા ને આયરણ આટાં, તેને  
તે ખણ ડણીએરે. ૫ શ્રીવિલલ વિઠલ હણી ન જાં.

---

### ઘાણ ૨૧૯

તમાર લોના સરખુ ઇપ. શ્રીગોવર્ધન નાથજીરે; ૧ ઐ  
માલ્લા મેહોણા ભુપ, શ્રી ગોવર્ધન નાથજીરે. ૨ વાહાના  
આહારા નગાનગરના વાથી, શ્રી ગોવર્ધન નાથજીરે; ખીજુ  
નગર વસાં ; કાસી, શ્રીગોવર્ધન નાથજીરે. ૩ સાથ મદત  
માહનજી પીરાને, શ્રીગોવર્ધન નાથજીરે; શૈવા શ્રી ગારદ્પર  
લાલજી છાને, શ્રીગોવર્ધન નાથજીરે. ૪ સાથે અહુ એ-  
ગૃહોના સાથ, શ્રીગોવર્ધન નાથજીરે; સામયી કરતાં સારી  
રત, શ્રીગોવર્ધન નાથજીરે. ૫ લાગ ધરાવે દીનાતાય, શ્રી  
ગોવર્ધન નાથજીરે; પીડાં આપે જમણે હાથ, શ્રીગોવર્ધન  
નાથજીરે, ૬ એમ હણી કેહે છે વલભદાસ, શ્રીગોવર્ધન  
નાથજીરે; એ સુખ ના આવે આહારી પાસ, શ્રીગોવર્ધન  
નાથજીરે. ૭ જાપ ખલીહારી માધવદાસ, શ્રીગોવર્ધન  
નાથજીરે; અમને વરનમાં તે આપો વાસ, શ્રીગોવર્ધન  
નાથજીરે. ૮ તમાર લોવા સરખું ઇપ.

---

( ૨૧૯ )

## ધોળ ૨૧૯.

આદે સાચી આજ વંદ્રાવનમાં જઈયે, જોઈ લોઈ સો-  
ભણ સુખીઓં થઈએ. ૧ વાહાલાજુ તો ઐડા છે કુલબા-  
ડી. જેતાં માહારી આંખની થાપ રાહાડી. ૨ કુલના  
તરીઓને કુલની ગાંઠ, કુલના ઘારસાતને બાહારિ. ૩  
કુલનાં છણાં ભેડાં ને અરારી, કુલની ફરતી ચેહેરોના જારી.  
૪ કુલનો વહુજીને પેરણું સાડા, દરેશન કરીએ દાડી દાડી. ૫ કુલથાં કુલથાં કુલદીઓં ઘડું એહુકે, યોડે ચેડ  
પવન પદ્ધારી લેહુકે. ૬ વનમાં માર ડાઢીના બ્રાહે, ના  
આવે કોઈ વલભ કુળને તાલે. ૭ હારે વાહાલો છગન મ  
ગનીઓ એલે, હારે વાહાલો. ૮ લાલા રસ રેલે. ૯ હારે  
વાહાલો પાથ ધોગાડી ને તોચા, હારે છાટાલાનું તે હા-  
ડેર મારા. ૧૦ હારે હુંતો વલભકુળની  
દરી, હારે અમને કોરપા કરો વરજયારી. ૧૧ હારે મને  
વરજનમાં તે આપો વાસ, હારે બલીહારી જાપ માધવદાસ.  
૧૨ માસો સાચી આજ વંદ્રાવન જઈએ,

## ધોળ ૨૨૦

શ્રીપૂરુષોતમજુ પ્રગટ હુવા તે, જેતાં આગે વાહાલા;  
નાય સીય સુંદીર હાપ અનોપમ, શ્રીગોકૃળનાથજીના લા-  
લા. ૧ શ્રીપારવતી માજુ ગોદ એલાવે, ચુંઘન લેછ હુ-  
લાવે; મુખ્યાં પૂનમ ચંદ્રી નોતાં. નિરાખી નેન સરાવે.  
૨ આંખલડી અઝીઝાળી સોહે, ધુધરવાળા કેશ; દ્વિજ  
વર હૃપે ભૂજ અનોપમ, આદે છે લધુવેશ. ૩ ચંપણ વ-

રખી નાથા બોહીએ, ગાલ ગલોઅા અરીણા; દાદા દાદા  
કહીને બાસ, ડામગ મહુરાં વેણ. ૪ આવરજનભૂપણુંછુંની  
ખલ એણ, લોતાં લાગે વાહાલા; બાળ લીલામાં પારેણે  
કુલ, દાસ ગતોદર ગાય. ૫ શ્રીપુરુષોત્તમજુ પ્રગટ હુચા તે,  
લોતાં લાગે વાહાલા.

ੴ ਪਾਖ ਰੂਪੀ

શ્રીવિદ્રા તે વનની વાટેરે, ગીરધારી લાલ; મયડેં કી  
 ધા ત થા માટેરે, ગીરધારી લાલ. ૧ બાંધા નેણુંની  
 પ્રિતરે, ગીર૧૦ સામણીઓ જણે ઘતરે ગીર૧૦ રે ડેઝ  
 કુશી છાંખરે, ગીર૧૦ વલભવરની બાંખરે, ગાર૧૦ ૩ ર ગલેર  
 રેમતા શાલગઢીશરે, ગોર૧૦ પાંચ કસુંની સીશરે. ગીર૧૦ ૪  
 કાનમાં કુઠળ છણકરે, માર૧૦ નાંદે ચુંલના હારે લણકરે.  
 ગીર૧૦ ૫ બાંદુ બાળુંધ ચોચીરે, ગાર૧૦ ૧૮ા જડાવની  
 ચ્ચાક્કોરે. ગીર૧૦ ૬ શ્રી વિદ્રાવની કુંજમારે, ગીર૧૦ જિભલા  
 વાંસલડી ધરી બુલમાર્દિ. ગીર૧૦ ૭ અણુમનણી તારરે,  
 ગીર૧૦ જિભલા હણધર વીરે. ગીર૧૦ ૮ વરણ બડુ લિના  
 જાપરે, ગીર૧૦ દૈસનવ જન સુઅભીએં થાપરે. ગોર૧૦ ૯ ૫  
 લીહારી જય માધવદાસરે. ગાર૧૦ ૧૦ શ્રીવિદ્રા તે વનની  
 વાટેરે, ગીરધારીલાલ.

४०८ २२२

२१८ ०१२ '८१। १

રસીએ રસે ભરચોરે, વાહાયા આવિઠલ વરણાળીએરે;  
વરણ વીનતાયે વરખોરે, એમની છણી ઉપર લેહે લાગી-

## ( ૨૧૪ )

૧. નાગર નંદ તણોરે, નટવર નાચને આપ ગીતરે; વાહાલો  
લાગે ધણોરે, પ્યારો પ્રેમ ઉપલવે છે પ્રિતરે. ૨ સુંદીર  
શામળારે, હરી માહારા હૃડા કેરા હારરે; પ્રિતમ પાત-  
જારે, માહરા પ્રાણુંભવન આધારરે. ૩ લાગે હરી ગૃહડા  
રે, રસીઓ રાસ રમણને બોગીરે; વલલ પ્રભુ દીકડારે,  
તેવી સદ્ગ રણીએ સંજોભીરે. ૪ રસીઓ રસ ભરચોરે,  
વાહાલો શીનિઠન વરખાભીઓરે.

## ધોણ ર૧૩

રાગ ગરણી. ૨

લાગી મને નેહ જડીરે, એથી અળગા કૃપા રૈહેવાપરે,  
નિરાયુ ધડી ધડીરે, સુખડા કોહેણી આગળ કોહેવાપરે. ૧  
ભીડી મને ઘેહેલમારે, વાહાલો શી વંદ્રાવન મદ્રે; સહી  
૫૨ સાથમારે, સોહોએ તારામાં નેમ ચંદ્રે. ૨ ઉમ્મી અજાં  
લડીરે, જુગણ જુમનાંણના તીરરે; લાલમ ઘેહેલડોરે, વેણ  
વગાડે હળધર વીરરે. ૩ સંખી ટોળે મળીરે, જોવા નસો-  
દાણના કાનરે; મરલાદા ટળીરે, વલલ પ્રભુથ્ય આગ્યું કૃપા.  
નરે. ૪ લાગી મને નેહ જડીરે, એથી અળગા કૃપા રૈહેવાપરે.

## ધોણ ર૧૪

રાગ ગરણી. ૩

ઘેલી ધઈ કૃરે, ઘેહેલા ગીરધારીની સંગેરે; ધીરજ ન  
૧ ધરરે, આતુર કીષુ આદાદ મનરે. ૧ નજ ભરવા મ  
સેરે, લાંબું શી જુમનાંણને ધારેરે; હરેએ હસેરે, આ

૩ આવી રેડે વાટેરે. ૨ નારાયણ નઈ ગાં ભરીરે, સુજાની શા-  
ગળીઆનું રપરે; હરાયુ હંડા ભરીરે, સરનસ ડાહાન પર  
શામ સ્વરપરે. ૩ ગાંયુ મને નવ ગમેરે, માહારે સરનસ  
નંદુમારેરે; મન કેડ લમ્બરે, દાસ વલભ પ્રલુ પ્રાણ આ-  
ધારે. ૪ ઘેરૂલી થઈ રહે રહે,

### ધોણ રચન

ગરાણી ૪ થી

પ્રીતની વાતડીરે, જેને લાગી હોય તે જાણેરે; પુજ ષે  
ર લતછીરે, નિરલજ થાય તે એસ માણેરે. ૧ તેમ ત્યા  
ણ પ્રેમ નહીરે, જાંછાં પડહા તાંછાં શાની પ્રીતરે; પ્રેમ  
ત્યાંછાં નેમ નહીરે, જકત લક્કાની અવળી શીતરે. ૨ પ્રી  
ત છે માહારેરે, સુજાની શામળીઆની સાથેરે, એવી નથી  
તાહુરેરે, અમિ વેચાણાં એવું હાથેરે. ૩ તનમન સોંગિયુરે  
હવે ને ધનાર હોય તે ધાપરે; ભવોભવ અરપીયુરે, દાસ  
વલભ પ્રલુ ગુગ જથ ગાપરે. ૪ પ્રીતની વાનડારે, જેને  
લાગી હોય તે જાણેરે.

### ધોણ રચન

ગરાણી ૫ મી.

કારણ શુંચે કહુરે, સુજાને કહાનુડાના કોડરે; કોઠાણી ન  
વ રહેરે, હરએ હંડુ જોડામોડરે. ૧ પ્રીત પ્રગટ રહેરે, સુ  
જાની શેને રાયુ છાનુરે; હરાય હંડુચે ધરેરે. મહારા મ  
નના માંયા માનુરે. ૨ આ ભવ દુઃખ ટણયુરે, હતુ જેમ

## { ઈરું } ૧

શાળી કેવ ગાલો; કુઠિજન રેખી જણો, મહારા શ્રી નાનાનારે. તે પ્રાગુના પ્રાગ સાખીની. જીવણ વસોદાળુના કો  
હાનરે; રાખું હૃદયે લખીરે, વલભ પ્રભુશુદ્ધ લાગું ધ્યાતરે.

## ધોળ ૨૨૭

માહારા રૂણાળા રણચોડ, તમારી મને લેણ લાગી;  
તમારું મુખ જોવના કોડ, તમારી૦ ૧ મને ધરેમાં નવર  
હેઠાપ, તમારી૦ સુતુ મંદીર આગ ધાર; ૧મારી૦ ૨ શ  
વડે રાખો પાસ, તમારી૦ હૃદિદાસની પૂરણે આથ; ત  
મારી મને લેડ લાગી. તે ગાહારી૦

## ધોળ ૨૨૮

અથ શ્રી જગતનાથજીના શાખગાર.

શ્રી ગુરુ ગાયપીને સારદા, પ્રેમ લાગુણ પાપ; ઘડું કે  
૨ જોડીને વરણવું, દરમાન આપો માહારાન. માહાર મન  
ચાચ જગતનાથજી૦ ૧ ચ્યેડીસા ગામ સોદામણુ, તાં જી  
ગતનાથજીનો વાસ; ધેર ધેર કુલની વાડીઓ, નાળીએર  
કુણાં ॥ પાગ. માહારી૦ ૨ ચાર દરવાળ ચ્યેધાળ મંડપ  
રચીયાણ સ્થાન; રામે દુદાને લક્ષ્મીની વસે, જાણીએ  
પુનાગ ચાંદ. માહારી૦ ૩ કે પેઢલી તે પેણમાં પેસતાં, વરણ  
વરણ નારાય રાગુંછોં, નાત્ય નીતાં કીરતન થાપ. માહારી૦ ૪  
વરણરે મંદીરની શ્રાબા વચ્ચા, દીસે ઝડપભ્રમાણ; ચાંદરવા  
૩ કડારેના, ખાખીઓ દા અવતાર, સોણીએ ચિત્રામણ  
સાર. માહારી૦ ૫ નઈણાં તમારાં જગતનાથજી, જાણીએ  
કમળની પાંખ; લેતાં તે શુદ્ધ શુદ્ધ વીસરો, ખળગાડ સુરેન

રાયની કાંત, માહારો ૬ અમા તે વડેરે સોલામણારે, તેની  
 શીતળ છાંપ, વિસામેરે વધજીવ તણોરે, પોહ્લાંચા પરસો-  
 તમરાય, માહારો ૭ કુનનાં તે સુગર કુંડળ બન્યાં, કુન-  
 ના બનીઆજ હારે; કુલના આજુંંધ બરખા, કુલના  
 સોણ શાળગાર, કુલનો ચોસર હાર, માહારો ૮ કાને તે  
 કુંડળ અગમગે, લીલાવઠ તીલક જડાવ; અધર તંદ્રાજ  
 રચી રહ્યુ, કર ઊપર જાઉ ઘણીદાર; માહારો ૯ વરણા તે  
 વરણ જાણે નહીં, કીધો એજ પકાર; નાના મોટાને ગ-  
 ધ્યાં નહીં, પ્રસાદ વરણા ન જાય. માહારો ૧૦ ઉર  
 ઉપર સોલીએ પામશી, ઉપર ડસાની ડોર; વદન દીસેજ  
 હરીનાં કુરડાં, જોતાં રસીયાજ કોજ. માહારો ૧૧ કુલ-  
 ની તળાઈ કુલની પછેવાઈ, કુલના ઉરીડાં સાર; કુનનાં  
 તે ગાંન મશુરીયાં, પોઢચા પરસોતમરાય. માહારો ૧૨  
 કુલના જમા કુનની કાંચણી, કુલનાં કુમતાં આર; પીળાં  
 પીતાંાર પેડશ્યાં, કાંડે તુણસીના હાર. માહારો ૧૩ હ-  
 રખી નરખીને ભુલી ભસું, ડોને કદીએજ વાત; ઘેરથી આ  
 વી હું ઽા એકદી, સનમુખ થયા જગનનાય. માહારો ૧૪  
 જોઠ તે ગાસ અસાડીયો, સુદ પુનમ ચંદ; અહુ વીર ના  
 હાવાને ઉત્તાચા, આસન આપ્યાં આખણુ. માહારો ૧૫  
 જોઠે ગાસ અસાડીયો, સુદ પુનમ ચંદ, વાસો તે માહે  
 વરી રદ્દાં, ચંદન મિલાજ છાટે. માહારો ૧૬ ચ્યાયા ચં-  
 દન ડેનડા, વળી મહેવો મચ્કોડ; અરગજને આતર ધાણાં;  
 કુલ લાંબાં મરદાં. માહારો ૧૭ કંચનના કણસ ભરા-  
 વીઆ, તહેનાં નીરમળ નાર; સેનાના કળસ ભરાવીઆ,  
 વીપ્ર લાવે છે નીર. માહારો ૧૮ વિષે તે નીર નશીલા-  
 વીઆ, કરમાં લીધાં ભીક્ષણ; વાળુંન વાળાં વાગીઆં, સુ-

એ ખાંડાં છે વગ્ર. માહારૂ ૧૬ ઉગળાં વખનાં  
 અનુષ્ઠા, સેહીએ શામ શરીરનું લાલ પીતાંખર પેહેશુાં,  
 નવની દક્ષિણ ભાત કંબર કંચાના પાટ, માહારૂ ૨૦  
 નવાં તે કુલજુ નવરાંથાં, તેણું નવરે જાણું નામ; લાલ  
 તે કુલ સોહામણું, ધરીઆં હસ્તીનાં ૩૫. માહારૂ ૨૧  
 છુંન આગ ત્યાંહાં નીપને. પેહેલી ઘીયડી સાર; સીરો પૂ  
 રીને ભાણથી, કંચન માલપૂત્રા સાર. માહારૂ ૨૨ કુધ્યું  
 રીને જલની ધર્ષા, લાડવે ના આવેજુ પાર. વેઠાં પૂડા  
 ને ઢોકણાં, પીડાં આવેજુ સાર. માહારૂ ૨૩ નાળીચેર  
 કેળાંજુ અતી પાણાં, ભાડા કોળાંજુ શાક; સાણ દાળને ભા-  
 ણ ધર્ષી, અટકાં દીવસને રાત. માહારૂ ૨૪ ચીણાં તે દષી  
 જમાણીઓં, ધી તાચાં તત્કાળ, આરગતા હુંા ઉકાળીઓા,  
 ગરથે ભીધાં દીપન. માહારૂ ૨૫ તુણસી દણરે જમીઓા,  
 જમીઓા જદુરાય; સેનાની બાણી જળે ભરી, આચમન  
 લેલે માહારાન. ૨૬ લવીંગ સોપારીને એલય, "નીડલે  
 બાસટ પાન; બ્રાડલાં તે વાખ્યાં બરાસનાં, આખ્યાં લક્ષ્મી  
 મીજ હાથ. માહારૂ ૨૭ જન્મી એલાને ઉઠીઓાં, આખ્યાં  
 વરજ ગાદીર માંય; લક્ષ્મીની સાથે બોલ્યા નહીં, જાહુને ના  
 આખ્યાં દરશન, માહારૂ ૨૮ પંદ્ર દીનથ ગાં હોલ્લા, નેત્રે ના  
 આખ્યાં દરશન સેહીએ ચોતામણ રાર. માહારૂ ૨૯  
 દષી તાપનારે તાપે ગર્જું, આગળ પડીને નોરેઃ જત્તા-  
 ણ હાથ નોરી રહ્યા. પંચા પાઠું છે સાર; તેડ તે કોઈ-  
 ના આવે નહીં, એવા જુગલ શુશ્શાર. માહારૂ ૩૦ વિ  
 ધ સીએ સહુ પાતો કરી, પછે અટીઓા શીનાય; સહુનેરે  
 સાથે તડીઓા, લક્ષ્મીજીનેરે ના લીધાં સાથ. માહારૂ ૩૧

આટકી મટકીને આસે ખાણું, કટકે ધરીઆજુ ખાખ; સુ-  
ભદ્રા ડોઈ જણે નહીં, બળભદ્ર શીજગતનાથ. માહારે૦  
૩૨ અમાવાસ્યા દિનરે સોણામણો, નેત્ર ચાચ્યાં દરશન;  
અંગ ઉપર હાથનું ફેરવે, ઉર ઉપર લીધા શીનાથ, મા-  
હારે૦ ૩૩ સામળે રથ શાણગાયિયા, લાન ધળજુ સાર;  
પરીકુમારે પાન કરી, તેહનાં સરદીયાંજ છાજ. માહારે૦  
૩૪ માહાકુંડમારે નાહીને, મોરલી સસુદ્ર સ્વય; ચંદ્ર ૬-  
મણુમાં નાહીને, દાચ્યાં પરીયાનાં પાય. માહારે૦ ૩૫  
ઇંદ્ર દમખનીરે જલતરા, ચાદ્યા જદ્વરાય; પથ્ય પકીને પા-  
વન કરેયાં, તેહનાં સરદીયાંજ છાજ. માહારે૦ ૩૬ તરશ  
રથરે ચનાવીયા, એન્ને માયાંજ ત્યાંહ; સીધ પોળે રથ  
રાખીયા, વાળાં વાગેજ સાર. માહારે૦ ૩૭ કે પાંચમે  
રથરે ચનાવીયા, દથમે આયાજ ત્યાંહ; સીધ, પોળે રથ  
રાખીયા, લક્ષ્મીજ લીધાં દરખાર. માહારે૦ ૩૮ વળતા  
ત ઘનભદ્રજ બોલીયા, લક્ષ્મીજ ઉધાડો દરખાર; ઘણ-  
રણે ડુલારે જગનનાથજ, ઇંદ્ર પરસેછેજ જુધાર. માહારે૦  
૩૯ વળતાં તે લક્ષ્મીજ બોલીયાં, સાંભળો. બળભદ્ર  
નેઠ; મંદીર પદ્મારે પોતા તણે, ચનાવીયું દરખાર, મા-  
હારે૦ ૪૦ કે પરસાદ અમેરે ચનાવીયુ, ચનાવીયુ રહેંદ્ર-  
ખાર; કાળો એ કપ્ટની સદાપતો, અમને ના લોધાં સાય.  
અમને દીધાજ છેદ. માહારે૦ ૪૧ કે પરસાદ તમારે આસે  
નહીં, ન ચાલે દરખાર; કાળો એ ઘન અમ તણે, કા-  
ળા વીતા ડોણુ કરેશ રાજ. માહારે૦ ૪૨ વળતારે જગ-  
નનાથજ બોલીયા, સાંભળ સામળા હેહ; માહેદા એ  
ઘંધું અમ તણે, માહેદા બળભદ્ર વીર, લળ્યા તે  
તેમની રાખી નહીં, સાથે સુભદ્રા બેહુત. માહારે૦ ૪૩

વળતારે જગતનાથજી એમ બોલિયા, સાંભળે સામળો  
દેહ, પરીત પુરાવુંજ તમ તાણા, મીથા સીદ કરો ૧૨.  
માહારૂ ૪૪ મેડારો આપુંરે હું તારું રોકડા, દોડા કરો  
શાણગાર; પ્રદુમન પુત્રજ તાં તાણા, તેણે મોતીના હાર,  
માહારૂ ૪૫ કરાખીને લક્ષ્મીની ઉદ્દીઘાં, જધને જિધા-  
જ્યા દરખાર; ચેંકલીને આરાની પોતે કણી, હરખી જઠયા  
જગતનાથ, રતન સીંહારાને પદ્મસાંહિયા. હરખી બેઠા જ-  
ગતનાથ. માહારૂ ૪૬ વડોરે શાણગાર જગતનાથજી,  
કુદુરી પેરે કરે વખાણું; કાયર કુડોણું અરી ખણો, મારે છ  
શીઓના માર. માહારૂ ૪૭ હાર સાણગાર ગાચે સાંભળે,  
તેણે પુરીમાં વાસ; નરે ગાય નર સાંભળે, તેણે ૫ -  
શુનો આતાર, ગાય માદ વદાસ. માહારૂ ૪૮ શી ગુરુ  
નાણાતીને સારદા, બેસે લાગુણું પાય, એડુ કરણીડીને ૧-  
ખુંબું; દરશાન આપો માહારાજ માહારૂ ૪૯

### ધોળ ૨૨૭

શીજુ બાવા લટકાણા, જરે રારસ્તનીને લાગુ પાય. શી  
જુને સતમુખ નિરખા જાય. શીજુયા ૧ તમે ચ-  
છા પાસે રહુાછો, વધુનાને દરથન હોછો. શીજુ બાવા ૨  
ચ ચુદ્યાની શાના ચાણી, ત્યાંહાં કરુની મહિલાવો જાય.  
શીજુયાવા ૩ હૃદ્યે કડાં સાકાણને વેદ વીંઠી; એમની  
શાના નજરે રીઠી. શીજુયા ૪ એમની દશ ઘાંગળી  
એ વેદું, એમને કેહુડે કર્યાપણ ચાયર. શીજુયાવા ૫  
એમને નાક નકરાં મારી, એમના મુખી છણી જોતી.  
શીજુયાવા ૬ એમને ડાંને કુડા લગકે, મોતીના તોરા  
ઝગકે, શીજુયાવા ૭ કેસણી પાખ મોતીના તોરા માહારા

પ્રભુજીના અરણ છે ગોરા. શ્રીજીમાનાં ૮ એમને આરતી ઉત્તર ન્યારે, વઈસ્તવ દરમને આવે ત્યારે શ્રીજીમાનાં ૧૬ એમનો શ્રી ગોડુજનાં વારા, બક્સિહારી જાપ માધવદાસ. શ્રી જીમાના લટકાણાં ૧૦

### ધોળ ૧૩૦

આજ આનંદ માદારે હર ન સગાયજી, પ્રગાચા શ્રી વલભ રામકુમારજી. ૧ ભુનણ ભાષ્ય તણો નહી પારજી, દ્ર્ઘિવી તે જીવને કર । એખાડજી. ૨ માદીર માંડી તે ચાક પૂરાવોજી. તોરણ બારણીએ બંધાવોજી. ૩ હુંતોકરું વિનિધધના શણુગારજી. આજ મારે હઈએ હરએ અપારજી. ૪ નાચુ ગાવું તાળી ને પાંદુ હાથજી, હરએ તેડાંદું સહીઅર સાયજી, ૫ કોને કોણે કોણી લેના કોહુનાયજી, છાંધીપર જન રસીક જળ જન્યજી. ૬ હરએ શ્રી વલભ નંદને ગાવુંજી, શ્રી વીઠલ નાથને વારણો જાઉજી. ૭ એમના તે નામ તણો મહીમાય, સકળ અમંગળ અપણા થાયજી, ૮ જીરે વાહાલે પુછિતાં કીધાં દાનજી, ટાણ્યાં ટાણ્યાં જીવ તણ્યાં અસ્તાનજી. ૯ જીવને તો ખલ રાખંધ કરાયજી, તેજ થકી પૂરસોતમ મન ભાઓયજી. ૧૦ કીધિા કીધિા ન-કતી તણો ઉપહેશજી, ટાણ્યાં ટાણ્યાં અસુરતણાં અવેશજી. ૧૧ રાખ્યા રાખ્યા અણુસમરપિત વસ્તુ ખાતાજી, વારેવારે અન્ય આશ્ચર જીજ જાતાજી. ૧૨ મનડાંતા આશા પુરાણ કીધીજી, શિક્ષા તે શેવા કરવાની દીક્ષીજી. ૧૩ બાંધી બાંધી ભજા સિંહુની સ્વેતજી, દ્ર્ઘિવી તે જીવને કરવા હેતુજી. ૧૪ કીધિા કીધિા માદા મારો ઉપગારજી, દ્ર્ઘિવી તે જીવનો કરવા વિશ્વારજી. ૧૫ જીરે વાહાલા સામતે લાલ

કેરા ને તાતળ, ઓ ગોપીનાથજીને એ જ્ઞાનજી. ૧૬  
શ્રી આડાંળના વરલ તણો એહે રતનજી, ઓ વલભજીએ  
ક્રીષ્ણાં છે રતનજી. ૧૭ તેમની લક્ષ્ણી તણું શીર શાહીએ-  
જી, નિરખતાં નીજ જનનાં મન મોડીએજી. ૧૮ જીરે વા-  
લા ઓ ગોકુળના વાશીજી, જીરે દુંધું ઓ વલભ કુળની  
દાશીજી. ૧૯ જીરે વાલા વરલમાં તે આપો વાસણી, હારે  
ખસીહારી તે માધવદાસજી. ૨૦ આજ મારે આનંદ ઉર  
ના સમાપજી.

### ધોણી રક્તર

તા તે જની ભને વન વારી, શરાગુ આએકી તાપનि-  
વારી. ૧ જન પ્રેરણાં પ્રતિત્તા પાણી, હિરણ્ય કુસ્યુપુણી દેણ  
વિદ રી. ૨ ધરેન નિર્ભય પદ દીજો મારારી, અમર્યાઘ-  
શી ગરલ ગરો ટાળી. ૩ દૂર્યો શુતા જય પ્રગટ પૂડારી,  
અહત ચીર હરી નામ ઉંચારી. ૪ ગજ ગણ્ણીકા જૈતમ  
નીય તારી, ચુરેદાસ સદ સરણ રૂમારી. ૫

### ધોણી રક્તર

હેણો કંઈ જનુકો એક સ્વભાવ, અતી ગંભીર ઉદાર ઉ-  
દ્ધી; પ્રલુ જણુ શિરોમણી રાય. ૨૫. રાય જૃતની શેરાડો  
કુળ માનત મેર સમાન, સથીદાસ અપ્રાદ સિંહુ સમ  
ચુંદન એકો સમાન૦ ૧ દ્રાષ્ટ પરસ્કો હેઠાત અરણુપર જ-  
નત હેણુએ એસી, વિમુખ ભણે કુપા આ સુઅણી  
જય ચેતાવો તથ તેસી૦ ૨ લક્ષ્ણ નિરણ ડાગર કરણા  
મય; દોલત પાછેનાગે, સુરેદાસ એસે પરલુકો કેત દને  
પીઠ અભાગે. ૩

( ૨૬૩ )

### ધોણી ૨૬૩

અથ શ્રી આસરાનાં ૫૬ લખાં છે.

૫૬ ૧.

શ્રી વલભજુડો ભાગી ભરસો, શ્રી વલભ જુડો ભાગી; કાપકુરે મન ભટકેલ ડાલન. જ્યો ચાડીએ ઇણ કાગી, ભરસો શ્રોવલભજુ. તે શ્રી વિઠળ ગીરધર સંપાદક, જ કણ કૃત્યો આધારાં; પુરશ્ચાતમ પ્રભુ નામ મંત્રદે, ઘરણુ ક્રમણ ગીરધારી. ભરસો શ્રોવલભજુડો ભારી૦ ૨

### ધોણી ૨૬૪

૫૬ ૨ રાગ પ્રિહાગ.

શ્રી ગોવરધનકી રહીએ તલેટી શ્રી ગોવરધનકી રહી એ; નિય પ્રત્યે દરથન મદન ગોપાળ લાલકે, ઘરણ કુમ ણ ચીત લહીએ; તલેટી શ્રી ગોવરધનકી૦ ૧ તનુ પુલકીત વરજ રાજમાં લોચત, શ્રી રીંદ કુંડમાં જઈ નાહીએ; રસીક પીતાંખર સંખણદી બતીયા, શ્રી ગીરધારીજી શું છાણે. તલેટી૦ ૨ શ્રી ગોવરધનકી રહીએ.

### ધોણી ૨૬૫

૫૬ ૩ રાગ પ્રિહાગ.

તુમ શરણાગત આયો, શ્રી વલભ તુમ શરેણી જત આયો; સંખ કુંઘ કરે ગયો જન્મ હેખત, સુખમાં પાર ન પાયો. શ્રીવલભ૦ ૧ આત્મા તે શ્રી ગોવરધન ધરકી; અદ્ધ સંખાંધ છાયો; લાલા અપની રારસ હેખાઈ, શૈવા સુખ

( २२४ )

ही अतायो. श्री वलभ० २ श्री भगवत् सुप्रोचन्ती भपडे,  
अपनो पंथ जनयो; एसा उगर श्री लक्ष्मण चुतडे  
रशीक के मन भायो, श्री वलभ तुम शरणागत आयो. ३

धो. ८ २३६

प५ ४.

हमतो श्री विठ्ठलनाथ उपासी, हमतो श्री विठ्ठलनाथ  
उपासी; श्रवु श्री वलभ नंद०, कहा है जर्हि कागी. हम  
त०१० १ छनकु छां च १२नकु लो धावे, सो कहीओ असु  
राशी; छीत स्वामी अ गीरधरन श्री विठ्ठल, खाना नी  
गम प्रकाशी. हमतो श्री विठ्ठलनाथ उपासी.

धो. ८ २३७

प५ ५ राग अमावास.

द्रष्टव्य अरण्णन केरो भइसो, द्रष्ट अरेय केरो; श्री  
पलभनचंभद्र छट, पीना, सप फुगां जयुं हैरो भ  
इसो। द्रष्टव्य० १ साधन ऐ।२ नही आ डणीगां लाशुं  
हात नवरा; सुरे कहु भहारीय आधिगे, पीन मुलडो ए  
हुरो। भइसो। द्रष्टव्य अरण्णन केरो।० २

धो. ८ २३८

प५ ६ राग अमावास.

एक पलक लो रहीओ वंद्रावन, एक पलक लो रही

## [ २३४ ]

એ. નનમ જન્મડો પાપ કરતેં, શ્રી કરુણ શીકણ મુખ  
કહી વંદ્રાવન. એક પલકો ર માણ પ્રસાદ એર લણ જુ  
મનાંડો, તનક તનક પુર લહીએ; સુરદાસ વર્ષુંઠ મધું પુ  
રી, ભાગ્ય વિના કયાં હાંસી પાઈએ. વંદ્રાવન એક પલક  
ને રહીએં ૧

## ધોળ ૨૩૬

૫૬ ૭

શ્રી વિઠલનાથ ઘનસળ આજ્યાડે, તાકી રીત પ્રીત  
છાભીન્યારી; પ્રદૂલીત બદન હરી કૃષ્ણામાં, નેનનમાં અલ્પે  
ગીરધારી. શ્રી વિઠલનાથ૦ ૧ ઉચ્ચ શવભાવે પ્રેમ પરમારથ,  
સ્વારથ લેશ નહીં સંસારી; આ ગુદ ઇપ કરત એક ક્ષેણ્ય  
માં હરજુડી કથા કહેત “ાશ્તરા”. આ વીઠલનાથ૦ ૨ મ  
ન કામ લયન તાકો કિને, પાઈઅન નીરજ સુખડારી કુ  
શનદાર પ્રભુ રથોક સુગટ ભણ્ણી, યુણ નિધાન ઓ ગોવર  
ધનધારો૦ ૩ શ્રી વિઠલનાથ ઘનસળ આજ્યાડે, તાકી  
રીત પ્રીત છાંબા લારો.

## ધોળ ૨૪૦

૫૬ ૮ રાગ નીહાગ.

હરીજનકુ હરેનામ ઘડો, હરીજનકુ હરેનામ; ખીના  
રખનાણ ચેર નાણી ચોરત, સોપતહે સુખધામ ઘડો ધન૦  
૧ દીન દીન બદલ સવાઈ દરી, ધરણ નાદી કષું દામ સુ  
રદાસ પ્રભુ શ્રવા જ્યાડો, પારસસ ડો કુમ ઘડો ધન,  
હરીજનકુ હરેનામ૦ ૨

( २१६ )

## ધોળ ૨૪૧

૫૬ ૮ રાગ પીહાગ

શ્રી વિઠલનાથ ધાણી અમારે, શ્રી વિઠલનાથ ધણીઃ  
ભવસાગારતો કાહાડે શ્રી માહા પ્રભુ, રાખ્યો શરણ અય  
ની અમારે ૧ નિશ હીન રષ્ટ પાર નહી પાવત, રોપ સ  
હસ્તદીષી; ધીન સ્વામી ગીરુધરન શ્રી વિઠલ, શ્રીમોવત  
મુગટ મણી ૨ અમારે શ્રી વિઠલનાથ ધણી.

## ધોળ ૨૪૨

૫૬ ૧૦ રાગ પીહાગ

શ્રી ગોરધન ઓર ડીગર ચલો, શ્રી ગોરધનદી ઓર  
મારગ ઘીન અયો જાહન. નાગર નાંદ ડીશાર. ડીગર  
ચલો ૧ ડોર ટુર દ્રાગ વેલ કુલો, કુંઠા કાહોલા માર;  
કુમનદાસ પ્રભુ જોવસ્થીન મર, રશીક રાય શાર માહાર.  
૨ ડીગર ચલો શ્રી ગોરધનદી ઓર.

## ધોળ ૨૪૩

૫૬ ૧૧

લજુએ શ્રી વલભજુદ અણ લજુએ શ્રી વલભ  
જુદ અરણ; રાડળ પતી ઓધારણ કારણ, પ્રગટ લી  
એ અવતારણ. લજુએ ૧ યુદ શ્રી ભાગવત પ્રતી  
૫૬, આરથ પ્રગટ કરતાં અન્યીન લાલા તેમ સંયુક્ત, દે-  
ખાડ શ્રી ગીરુધરન. લજુએ ૨ આસરોં કરી રહે ને

[ ૨૪૭ ]

જન, મોટે જામને મરણ; કહતું હુદિદારા અમદુ. ઓ.  
નાહીને થરણ. ૩ લાળએ શ્રી વલલજુકે થરણ.

**ઘોટા ૨૪૪**

પૃ ૧૧

શ્રી ગોડુળ રસ ચાંદે, ને કોઈ શ્રી ગોડુળરસ ચાંદે  
તાકો ચીત અનાતા ભટકે, લોલ હૃદાવન લાંદે, ને કે  
ઈ ૧ પોછોડી રહેલા છોકરાની છબાં, નીરખત તરવા  
સાંદે; શ્રી જીમાનાં જળ પાન કરતું, શ્રી વલલ સુખદ  
ભાંદે. ને કોઈ ૨ શ્રી વિઠલ ગીરીનરધર સંપ ભાણક  
દ્યાન રૂદમાં રાંદે; કુશીક પિતમ જુદી ઘાનક ઉપર, નિ  
શ્વ વરણ નાંદે. કે ને કોઈ શ્રી ગોડુળ ચાંદે

**ઘોટા ૨૪૫**

પૃ ૧૩

શ્રી વલલ માહારાજ, ખીરાંજે શ્રી ગોડુળ ગામ; એ  
ને શ્રી ગોણી નાથ શ્રી વિઠલ ગાકત જન કુરણ કામ; ખી  
રાંજે. ૧ ખીરાંજે શ્રી ગીરધર ગોણીંદ શ્રી બાળકશ્રી  
શ્રી ગોડુળપતી અલીરામ. શ્રી રઘુનાતી શ્રી નદુપતી શ્રી  
ધનરામ, પુરુસોતમ પ્રભુ નામ. ૨ શ્રી વલલ માહારાજ,  
ખોરાંજે શ્રી ગોડુળ ગામ.

( ૨૨૮ )

## ધોળ ર ૪૯

૫૬ ૧૪

સમજ સોચ ભીચાર મનરે તુ સમજ સોચ ભીચાર; ભક્તિ વિના ભગવાન દુરલભ, કહેતાં નાગમ પાડાર. મનરે તુ સમજ સોચ ભીચાર૦ ૧ સાંજ સંગત ડારા પાસા, ઈરે રસ્તા સારા; ડાખ અખ્યકે પડો પુરો, જીત છની હાર. મનનું ૨ છાંડ સતરે સુત આઠારે, ૫ અણીંડા માર; દુરેતે દાજાં નકાન યમક ચોંક ભીચાર. મન૦ ૩ લોખ માયા જાલન ભુલો, ઠગો ઠગની નાર; સુરદાસ કહે કહે હાજી પર ભજન વીના, ચ્યાંદા હાજ કરાર. ૪ મનરે તુ સમજ સોચ ભીચાર.

## ધોળ ૨૪૭

૫૬ ૧૫.

આજ કામ કલ ડામ, પરસુ કામ કરનો; પેહેલે દીન જાહીત ડામ, ડામમાં પીછે મરનો. આજ કામ૦ ૧ જ ગત ડામ ચુચત ડામ, એહેર સુખ હઘણો ચલનો; છાંડ કામ સમર ર્યામ, સુર કહે પકડ કરનો. આજ કામ૦ ૨

## ધોળ ૨૪૮

૫૬ ૧૬ મું.

નીથ દીન લેહેરી ગોવીંદ ગા, નીથ દીન લેહેરી ગોવીંદ ગા, જામ જુડો રેહ શંની, શાવન ડાગન આય લેહેરી૦ ૧ પાણીમાં જયું પડત પીંડુકા, પાણીમાં જયું જમાય; માહ

## [ ૨૨૯ ]

માયા લાભ લાગે, કાળે ધેરા આચે. કોહેશીં ર કરેમ કા-  
ગદ બાચ હેણો, જાતે મન પન જાય; કોઈ ઘણાડકો  
ઓજ હેણો, જામા મીઠાહુન જાય. કોહેશીં ર હેદુકે દસ  
દ્વાર ઝંધ, અહિનું પોણુંચો આજા; સુર પ્રલુદા ભજન કર  
દે, જામકો કુચ જાય. ૪ કોહેશીં નાશ દીન ગોચી દગા.

## ધોળ ૧૪૯

૫૬ ૧૭ મું

નો બસુદેવકીએ પૂરન તપ, સો ઇણ કૃણતશ્રી વલભ દવ  
નો ગોપાળ હનો ગોકુળજી, સો અય અહી ખસે નાજ થ-  
ણુ. નો બસુદેવી ૧ નો ગોપ ઘૂંહી ઘજમેં, સો અય  
એધરિમા ભાડગે; છીત સ્વામી ગીરીધરન શ્રી વિઠલ, એઈ  
તેઈ તેઈ એઈ કંજુ નાશ ધે. નો બસુદેવકીએ પૂરન તપ

## ધોળ ૨૫૦

૫૬ ૧૮ મું.

ધીના ગોપાળ ગોપાળ નહી કોઈ અપનો, કુમ પાત  
તાત સુત ધરના એ જાય જગત રૈનકો સપનો. ધીના  
ગોપાળી ૧ ધન કારણ સય જીસનીન ભરકત, વૃથા જ-  
ન્મ હું આહી અપનો; અંતે સાહે કરે નહી કોઈ, નાશ  
કુળ નેમના સુય જરૂના. ધીના ગોપાળી સય તજ હર્ષિ  
લજ જુગલ ડમળ પદ, મેણ ધાડો ચરેણ હી અપનો;  
કહે હર્ષિહાસ ઓ વલભ શ્રી વિઠલ, રસનાએ ઓ વલભ  
નામ જરૂનો. ધીના ગોપાળી ૨

( १३० )

## ધોળ રખુણ

પદ ૧૬ મું.

જીવત નેસે ભજન વિના પ્રેત, ભક્તીન મદ ઘેર ઘેર  
ડાલત. ગોદર ભરન કેહેત ભજન૦ ૧ સુખ કટુણ કરેત  
પરન્દે, સંતનકુ કુખ્ય હેત; શ્રીવા નહી જ્યાંદાં ગોવીંદ અ-  
રણાકી, જીવત ગલનકો પ્રેત. ભજન૦ ૨ કુખ્યકુ પાપ કરી  
પઈસો પાવત ખડ હૃદામાં હેત, સુર રસના કણાં દોષગંદું;  
યુડો કુઠમ સમેત. ઉ ભજન "ધીના જીવત નેસે પ્રેત.

## ધોળ રખર

પદ ૨૦ મું.

નેનમાં આજેરી. ખસો ભરે નેનમાં આજેરી; સુંદર  
સ્થામ કુમળ દળ લાયન, ચી અખુબાન ડીસેરી. ખસો  
મેરો ૧ માર સુકર મહરાં કાત્ર કુંડળ, પીતાંખર જક નેરે;  
રસીક પ્રિતમ પ્રીયા નંગ અમુલ. કટકાખર મન થોરી૦ ૨  
ખસો ભરે નેનમાં આજેરી.

## ધોળ રખડ

પદ ૨૧ મું.

કહું અરાવત ગઉભાં, સ્થામ તુમ કહાં અરાવત ગઉભાં;  
આ વનમાં હું નિસ શીર્તાદુ, કાંહાન દેખી થાઈયાં. સ્થામ૦  
૧ આખનમે અમન ધિન અરાવત, શ્રી વંદ્રાવત છઘાયાં;  
રસીક પ્રિતમ પીયા હસી જોલો, દ્ધી એયત તુમ અધભાં૦  
૨ સ્થામ તુમ કહાં અરાવત ગઉભાં.

( ૨૩૨ )

## ધોણ રૂપ૪

૫૬ ૨૨ મું.

ઓ ભાગવત વિચારી કોઈ, શુક્ર ઓ ભાગવત વિચારી  
કોઈ; હરીકી ભક્તિ જીગ જીગ ઘાંખત; અન્ય ઘરમ દીન  
આર. શુક્ર૦ ૧ કથા સુને કીરતન મુખ લાવો; છોડો મી-  
દ્યા વાદ; ખડ વંગ એ ગાડામાં મુક્તા, ત્યારે રહ્યા દીન  
સાત. શુક્ર૦ ૨ ચીંતા તજહો પરીક્ષાત રાજ. માનને શિ-  
ક્ષા અમારી; કમળ નેનકી લીમા ગાવે, તરંગ એ અનેક  
ખીછારી. શુક્ર૦ ૩ સત્યયુગ મલ્યેનેતા તથ કીનો, દ્વારાય  
પૂળ ચોરી; શુક્ર અજન કરી કેદળ કીરતા, અજન કેદન  
તીવારી. શુક્ર૦ ૪

## ધોણ રૂપ૫

૫૬ ૨૩ મું.

હોત ગોપાળ એ ગાયે, ને સુખ હોત ગોપાળ એ આ  
એ; જ્યાં કશુ નહી જ્યપત્ર વૃત, કેદીક તીરથ નાહે. ને-  
સુખ૦ ૧ ગદ ગદ કંઠ લોયન જા ધારા, પ્રેમ પૂલકીત  
તન છાયે; દીયાનો સેત આર પ્રદારય, હરાડો વરસ ઉર  
નાય, નેસુખ૦ ૨ ત્રીસાડ તરણા કર લેયુ, નાદ નાદ ઉર  
લાય; સુરદાસ કહે પ્રલુ તો રે ગીમનકુ, અલત મનત  
અનાય. નેસુખ હોત ગોપાળ એ ગાયે.

( २३८ )

## ધોળ રથદ

૫૬ ૨૪ રાગ પીઠાગ.

કાહા કીએ તેં આય જુગમે, કાહા કીએ તેં આય;  
 ના હુણી બજ્યા ના હરીજન મેઘે, જનમ પહારથ પાય.  
 જુગમે ૧ નહી દૃ એક આશરો કીનો, શીવલભ વરજ  
 રાય; નહી ન આગામન રાગાવરડો, કરી મન લાડ લડાય.  
 જુગમે ૨ ચુર શેવા નર્ણ નાસે રોટા સુખ, ભાવ સહેત  
 ચુંબ ગાય; શેવા કર્મ માનસી કરેડો, નામ ન ગાયો ઓ-  
 તાય, જુગમે ૩ કીનો નહી નિવેદન હર્ષિકો; દીત ભાવ  
 મન આય; ભુલ્યો નહી પરણાય લીલાદું, ચીત ન કીએ  
 ખતાય. જુગમે ૪ નહી ન અવન અનન સુખ હર્ષિકો,  
 હૃદ અવન સુનાય; તાય ભાવના ભક્તિ કંપારસ, ન કીનો  
 ચીત ઘતલાય. જુગમે ૫ રાધુ સગત કષ્ટહુ ન કીની,  
 અંતર કપટ ગીઠાય; દુર ભાવના ઉર અંતરકો, સો ના દ્રા-  
 ડો મોટાન. જુગમે ૬ કરી વૈરાગ નહી ન દીનો, દુર  
 ભાવ છટકાય; વંદ્રામન ગોકુળ ગોવર્ધન, મંબુધન ખસો ન  
 જાય, જુગમે ૭ સામન ખળ કષ્ટહુ નર્ણ છાડ્યો. પૂછિ  
 ભક્તી ઉર લાય; કીનો નહી કાળ પરમારથ, સ્વાર્થ રાય  
 પીમરાય. જુગમે ૮ કષ્ટહુ ના નિરખ્યા નાય નેન ભર્યુ,  
 સુધ રહ્યો નિત્ય આય; પરસુખ રેખી દાન ઉપજ, ભુ-  
 એ ન દીનો તાય. જુગમે ૯ દાન કહેત સદા જગ ડો-  
 લન, ઓર ના કષ્ટ ઉપાય; રંચક સ્વાદ વિષય કે લાલાય,  
 જરવસુ દીઘે ગમાય. જુગમે ૧૦ સુખ કહેત ઉપાય  
 કરત નિય, પરસુખ સા અંગાય; ઊંચી ભાત હેખી ઓ-  
 રલકી, અંગો અંગ મર જાય. જુગમે ૧૧ શીવલભ

ક્ષીવિદ્બલ ગીરધર, સોમુખ શેડ ન ગાપ; પૂત્ર પૂત્રાદિક જાણી  
 અપૂર્ણ, હેઠી બહેાત હરાય. જુગમે ૧૨ ખડી એક  
 દીન માસ પરસદીન, ગનતી કરત ગીનાય; ઘત ઉત બો-  
 લ્લત ભીન સત્તારથ, આયુષ્ય દીચે ગમાય. જુગમે ૧૩  
 અપને સુષ્ય પૂલી બાત, કરત બનાય બનાપ; કહાયો સાચ  
 લાંદ હસારથ, પૂળ દેહી બડાય જુગમે ૧૪ જનતહે  
 હશી ઉરકી બાત, વેં ચતુર શિરોમણીરાય; ધન બાતનમે  
 અટક બાહુવરે, દીચે જનમ ગમાય. જુગમે ૧૫ આત  
 પાન ચર્ચી તેજુ બેઠે કરી, નીશઆથ ઉડાય; સોચ બી-  
 ચાર નંદી મન કીનો, ભુલો નીપટ અધગાય. જુગમે ૧૬  
 ઉધવ સો કંઈ અપ અંતરકી, આત કહી સુનાય; તામારી  
 અલીએ મન ધરી, એ ડામણ રહે બનાય. જુગમે ૧૭  
 શુક્ષેદા કહો પરીક્ષાત રાન, મારાગ સુગમ બતાય; કણી-  
 માં એક નામ અધિકારી, એર ન કષુ ઉપાય. જુગમે ૧૮  
 ૧૮ કદીએ કાહા બનાય આતકી, એર એર સમજાય, સ-  
 ખડો મુળ એક કરી ભજવો, એર સાચે છીરકાય. જુગ-  
 મે ૧૯ ધર સુક હેઠી બહેાત પૂલત મને, સુત સુષ્ય  
 બચન સુનાય; એ સંપત સ્વપનેકી જનો, હેખત ભાહા  
 જથીરાય. જુગમે ૨૦ ધીક જીવન લકો તકે મન, રહેણ  
 વિશ લપટાય; સુરદાસ ચરણ ઉરલાણો, ચી ગીરી ગોવ-  
 રધનરાય. જુગમે ૨૧ કહાડીએ તે આયે જુગમે, કાહાકી-  
 એ તે આપ ૨૧

ધોણ રૂપ

૫૬ ૨૫ સું.

અનુમારી ડોથુગતી બ્લજનાથ, અખમોરી ડોથુગતી "અ-

જનાથ. ભજનાથી મુખ આર્દ્ધરણ નાહો, શીરત વીથીઆ  
સાથ. અબમોદી ૧ અઘુકુ પતીત અપ્રાધી પુરણ, આ-  
દ્વારુ કરમ એ હાર; કામ કોથ આર લોલ ચીતવંત, નાથ  
તમહી આસાર. અબમોદી ૨ અખમે યરણ શરણ લખ  
દણો, રાખીલા આહારાજ; સુરદાસ પ્રભુ પતીત પાવત,  
શરણકો એરદ સભારો ૩ અબમોદી ડોણગતા.

### ધોળ રઘુ

૫૬ ૨૬ મુ.

રાજો તેસે રહું, નેસે પુમ રાણો તેસે રહું; જાતનદો  
કુઃપ સુખ સંપજનકો, મુખ કરી ડાહા કહુ. નેસેઠુમો  
૧ કાખુક ભાજત હેઠા ક્રપા કરી, કાખુક લુખ સહુ; કાખુ-  
ક અડન તોરંગ આહારાજ, કાખુક લાર સહુ. નેસે૦ ૨  
કમળ નેન ધનરધામ મનોહર, અનુયર અયોમે રહુ; સુરદા-  
સ પ્રજ્ઞ લક્ષ્મિ કપાનિદી તુમારે ચરાણ અહુ. નેસુ ૩

### ધોળ રઘુ

૫૬ ૨૭ મુ.

અરથેર નહી આવે, અવસર અરથેર નહી આવે. નો  
નાણેતો કરલે ભલાધ, જન્મા જન્મ સુખ જાવ. અવસર૦  
૧ ધન જોયન આનન્દનીં પાછું, વાસુસના મેર ન લાગે;  
તન કુટે ધન ડોણ ડામનો, ડા કુ કરવી ડાહાવે. અ-  
વસર૦ ૨ જ્યાકો મન એકે ઉસું કશન સુનાકુ, ગુંડ કાખુન ન  
આવે; સુરદાસકો એક તિનાંતા, હરખ નિરખ ગુણ ગા-  
વે. અવસર૦ ૩

( २३५ )

ધોળ २६०

५६ २८ મુ.

સુંદીર ભિખ બન્યો ગોપાળ, સુંદીર ગાવું સખા સાગ  
સુંદીર; સુંદીર ભિખ બન્યો નાદલાલ, સુંદીર પણ સુંદીર  
હુણી અવની, સુંદીર માધ્લી શય્યદ રશાળ. સુંદીર૦ ૧ સું-  
દીર સાંક વરન સુંદીર, સુંદીર નાદ જસોદજી કે  
લાલ; સુંદીર ભાજન બચન થી સુંદીર, સુંદર હણધર  
કુચે કપાળ. ૨ સુંદીર૦ મોતવન સુંદીર શુન, માધ્વ કે  
કરહી એચાર; સુરદાસ પ્રભુ સખાધ સુંદીર, સુંદીર  
સ્યામ શુલ અવતાર. સુંદીર૦ ૩

ધોળ ૨૬૧

५६ ३६ મુ.

ડો પત રાખે ચેરી, સ્યામ ખીના ડો પત રાખે ચેરી.  
આંધો આંધ દુસ્યાસન, આન સાના ભર્ય એરી. સ્યા-  
મ૦ ૧ માહામતીહીનું નયોએ, રાજ પકર લાઈ જયુચેરી;  
લીધે દ્રોહ કરેણ દુર્યોધન, કીન હુન પાછી હેરી. સ્યામ૦  
૨ જો વિશવાસ રહ્યોએ ગળ્યાએ, કહું કરેણા મય તેરી;  
સ્યામ આઈ રાહે કરો કરેણા નીધી, યુક્ત રાખો એ એ  
રી. સ્યામ૦ ૩ તજ ખાનુ આતુર ઉઠ ખાએ, જેસે ગ-  
જકી એરી; સુરદાસ પ્રભુ ભક્તકે ડાને, કહી અખર્કી  
હેરી. સ્યામ૦ ૪

( २४३ )

### ધોણ ર્દુદ્વારા

૫૬ ૩૦ મું.

કરી મન ઉર સંતનકી શેવા, જુનકે એચાર ભરિસો ન-  
હી, ભરે નિરંજન દેવા; શીળ સતોશ સદા ઉર જુનકે,  
શ્યામ નામ કે દેવા. કરી૦ જુન સુદતી રારે જુગમાંદી,  
જયું નારદ મુની દેવા; જુનકે અરણ કુમળકુ વંછન, ગંગા  
જુમનાં રેવા. કરી૦ ૨ સુરદાસ હિનકી સંખતી, ભીલે ની-  
રંજન દેવા. કરી૦ ૩

### ધોણ ર્દુક

૫૬ ૩૧ મું.

શ્રી ગોડુળમાં રહીએ, સદા મન ઓ ગોડુળમાં રહીએ.  
ગોનીદ ધાર છોડરકી છઈયાં, એટક દરસન પાઈએ. સ-  
દામન૦ ૧ શ્રી જુમનાં કુલીદ સુચ્ચંગ, ઓ વંદ્રાવત  
ગીરી ગોવરધન ભાઈએ; ઘેર ઘેર ભકૃતી ભાગવત શેવા,  
તન મન પ્રાથ એ કહીએ. સદામન૦ ૨ શ્રીવિઠલનાથ બી-  
રાજત નીચીન, અરણ કુમળ ચીત લઈએ; ઓ વલભ  
પ્રભુ કુમળ કીરપા તે, ઉનકે દાસ કેહેવાઈએ. સદામન૦ ૩

### ધોણ ર્દુદ્વારા

૫૬ ૩૨ મું.

નેસે હુ તેસો તીહારો, ઓ વલભ નાદન અખ, જીવ  
છાંડ દેહો માહેક તે, બાહે અહેકી લાજ મન ધરેણો; ન-  
ખણે ભરુસો માહે સાધન ભવ દર તે. નેસો૦ ૧ પુમ  
તળો એચ ડેર નાહી મરે, જ્યાસો જાપ કહું કુઃખ લર

## [ ૧૫૭ ]

કે; રથીક શિરામણ શ્રી વલલ માહા પ્રભુ, રામો માહે  
મરણ શરણ ભવદર તે. નેસો ૧૦ ૨

### ધોણિ ૨૬૪

૫૬ ૩૩ મુ.

રાવલકે કહે ગોપ આજ ઘજ છુનીપર, કાંહાનાડેહ સુ-  
નો બાજ ગોકુળમાં સુડલરા; જસોદાકે પૂત્ર લયો લખુભાન  
ન્યાસુ કહેલા, ન્યાં ત્યાંથી ધાર્મ ગોપ ધ્વી દુધ ગગરા.  
કાંહાના ૧ અંગે ગોપ વદ્રાવન પાછે તરી આ મનો-  
હર ચલન શકતકો પાવત નડગરા; અદ્રારભુજ પ્રેભુ ગીરધા  
ગીક જન્મ સુની, કુળી કુલી ફરત નારોદ નેસે ભમરો. રા  
વલકે કહે ગોપ આજ ઘજ છુની ઉપર.

### ધોણિ ૨૬૬

૫૬ ૩૪ મુ.

નહિતર લીલા હોતી જુની, નહિતર લીલા હોતી જુની;  
નો શો વલલ પ્રગટ ન હોતે, બસુધા રહેતી સુની. નહિ  
તરો ૧ દીન દીન પ્રગટ ક્ષાણું રાજત, હે ન્યો કંચન પીચ  
સુની; છુગનદાસ આગરાકો શ્રવક, ગાવત ન્યાકો સુની. ૨  
નહિતર લીલા હોતી જુની.

### ધોણિ ૨૬૭

આચરાનો કોરેતન રાગ પીઠાગ.

કૃત દીન હથી સરણ પીના ઓચો, કૃત દીન હથી

સમરણ બીજા જોખે; પર નિંદા રસના કે રસમાં, અપના કર્તવ જોખે. કૃતેદીન૦ ૧ તેલ ભગાય કુઝે હશી ભરે દન, ખસતર બનાય કે ઘાયે; તીલથ બનાય શનામી હેઠળ નીકસે, વેસ્ટનકે સુખ જોખે. કૃતેદીન૦ ૨ કંપત કાળ ચાળ મુની ડરપત, ખજાદિક શિવ રાખે; સુરધનકી કહાગત વહેગી, જિદર ભર ભર સોખે. કૃતે દીન હરી સમરણ બીજા જોખે. ૩

### ધોણ રેફટ

રાગ બીહાગ.

કેતી કહી સમજાઈ, તોસુ કેતી કહી સમજાઈ; નંદ નંદનકે ભરણ કમગ ભજ તજ પાયંડ અતુરાઈ. તોસું ૧ સુખ સંપત દારા સુત વેહે, જુદ સણે સમુદ્ધાઈ; ક્રીષુ લંગુર એ ભણે સ્યામ બીજા, અંત સંગ નડી જાઈ. તોસુ કેતી૦ ૨ જળ મરણ ઓહેાત યુગ ખાતે, હજુડ લાજ નકી આઈ; સુરદાસ ભગવાન ભજન બીજા, વાધુએ બાંઠ અમાઈ; તોસુ કેતી કહી સમજાઈ. ૩

### ધોણ રેફટ

રાગ બીહાગ.

હાઉનમે જેડો નહી ભાઈ, હાઉનમે જેડો નહી ભાઈ  
ન હશી ભજાયા ના અહે સુખ પાચે, વરથા બાંછ ગઈ.  
હાઉનમે૦ ૧ જયું સુવા સીમળ ઇળ લળકે લાલય દાહ  
દહી; પરતાનો નેમ ચાંચ ગુદાને, નીક સત તુળ મહી.  
હાઉનમે૦ ૨ હશી વિમુખવે અંદ્ર અડોર જયું ચુગત અગા

## [ રૂપી ]

ર મહી દ્વારા કાંઈ તે ખાગો, સુર પ્રલુબ બાહે અન્યોરા  
મહી દાઉનની એકો નહી ભાઈ. ૩

## ધોળ ૨૭૦

રાગ ખીદાગ.

મન તું જાપગો અમ જાની, મન તું જાપગો અમ જાની. જોગીપતી તાણી જાસે જાપગો, અઝું જાપગો એ જુલી-  
જાની. મન તું ૧ રાઘ્ય કરેંતે રાજ જાપગો, અઝું ૩૫  
તિરાની; વેદ ભાગુંતે ખજ્જા જાપગે, કથા સુનન તે જાની  
મન તું ૦ ૨ આવેગી એક લેહેર લોભકી, ચુડેગો ખાન યા  
છી; સુરદાસ એક લક્ષ્મિત ન જાપગી, જ્યાકી મતી ૬૨  
છી. મન તું જાપગો અમ જાની. ૩

## ધોળ ૨૭૧

રાગ ખીદાગ.

કોણું કામ નહી આયો, ભજન ખીના કોણું કામ નહી  
આયો; આ જુદી આયાડે કારણ, રતનદૂ જન્મ ગમાયો.  
ભજન ખીના ૦ ૧ જચ્ચે જચ્ચે મેહેલ બિન્દ વાચિન ઝીનો,  
ઝચ્ચી ઝચ્ચી જોવન ખ ચ્ચો, તા હું મેસે પરર નિક્સે, ક્ષે  
યુભર રહે ન પાયો. ભજન ખીના ૦ ૨ તરીએ કહતહે  
સંગ સલુંગી, ધૂત ધૂત ધન ખાયો; ચલતી દેર રહી સુખ  
સુડે, ઉગકયું નહી પોઢોયાયો. ભજન ખીના ૦ ૩ જોતે સં  
ગી તેરે હૃત કરતહે, તીનકે હાય ખંધાયો; કાહાડ લીયો  
કાંડ હું-તે હૃરા, કાંડી કુંકી પદ્ધત જલાયો. ભજન ખો

( ૧૪૦ )

ના૦ ૪ અથ તુ સચ કરત્તે અધરમી, મેહેસે કંધ ન કે  
માચો; સુરક્ષાનું બગવાન ભજન ખીના, અથે સીર લટકા  
યો. ભજન ખીના ડોડુ કામ નહીં આયો. ૫

## દ્વાત્ર રૂપી

રાગ બીહાગ.

જીવન એસે જો ઘની આવે, જીવન એસે જો ઘની  
આવે; શ્રી વલય શ્રી વીજલ પ્રલુદી, સરણ તાત જો પાલે  
જીવન૦ ૧ દ્વારા લીલક સંહીત મુદ્રા ધરી, તુલસી કંઠ ધ  
રાવે; પ્રેમ સહીત જો નંદ નંદકે, દીન નનમ કર્મ ચુણ  
ગાવે. જીવન૦ ૨ શ્રી ભાગવત મુખ રેમ ઢીકા, અનુદીન  
અનાશ કરાવે, લુથણ ઘસન ઘીયીત ઘરું રંગ, પ્રલુદુ લા  
ડ લગાવે. જીવન૦ ૩ આધી ભાત સામયી કરેકે, પ્રલુદુ  
લાગ ધનાવે; પ્રલુદુ ભક્તનનસુ હીલ મીલ કે વે પ્રસદ જો પા  
લાગ ધનાવે. જીવન૦ ૪ શ્રી ગોડુળ ગોવરધન ઘમકે, શ્રવ દ્વાન  
ગન લાવે; શામા સ્યામ સાંગમકી લીલા, ધ્યાન ઇહેમાં  
આવે. ૫ શ્રી જ્ઞામતાંજ્ઞથુ અનીક રોહ કો, મુખ જળ  
પાન કરાવે; રસી કરું પાય ઘાંબી ધુધરી, અપનો અંગ  
નાચાવે. જીવન એસે જો ઘની આવો ૧

ડાકોજને જગાડવાનાં ૫૬.

૫૬.

રાગ વીલાસ.

જગો જોપાણ લામ હેણા મુખ તરો; પાછે અહ કોણ

३ नित्य नेम प्रेरा. १ वीरत नीसां अद्वाय दीक्षा उज्जत  
नयो नानः सुंनत आनी पांडव लायन लगडु भगवान्.  
२ द्वार ठाडे पंधीलन करते हुए बीचार, वश प्रसांस गा-  
वत हुई लीका अवतार. ३ परमानंद स्वामी द्योण ज्ञ-  
नत गंगण दैप्य; वेद पूरात पठत ग्यान महिमा अनुप. ४

### लुगवान्ने ऐतावधानां यह.

राग देवगंधार.

बखी यह जेजवेही, मदन गोपाल लाल छाड़की राज्यत  
नाहीन डारी. १ अपने हाथ लेहत बनचरना कुध भात  
धरत सानी; लंते वरले तो आंख हँसावे पर धरकु द्वा-  
रानी. २ सुंनीशी जसोदा करत वसुन के यहले गाट भ-  
यानी; हँसी हँसी हही डारी आलूर्मे डेन सहेनी तहानी.  
३ डाढ़ा हराती नाइलकी रानी, सुंनी कमण सुभ पानी;  
परमानंद दास जनतहु भानी युआ धोआनी. ४

### लुगवतनां नोछावरनां यह.

राग हमीर.

आओ भरे नांद नाद के खारे, भाजा तीकड़ भनोहर-  
वानो। तीमुना के उल्लारे. १ प्रेम सहीत खात उर  
भाहने कहु डरत नहारे रध्य कमण के मध्य "पीराजत  
भी वरजराज कुमारे. ३ कांहां लगुडो। पूर्व प्रगट भजा

( १४२ )

અરે ધરલે પધારે; પરમાનંદ કરી નાળાજર, વારી વારી  
કરી હું વારી. ૩

---

## શ્રી ઠાકેરજીના માહિતમનાં પદ.

૫૬.

રાગ પુરવી.

માહનનાંદ દાય કુમાર પ્રગટ ઘલણી કુંજ નાયક ભક્ત  
હીત અવતાર, પ્રથમ ચરણું સરોજ વંડુ સ્યામ ધન ગો-  
પાળ; મફર કુંઝ ગંડ મંડિત, ચાર વેન વીશાળ; ઘળ  
રામ સહીત વીનાદ લીલા શ્રવ શરીર હેત દાસ પરમાનંદ  
પ્રલુ હરી નાગમ આયે નેત. ૧



# શ્રી નાથદ્વારના સાચોરા બ્રાહ્મણ જગત્તાથ તરફથી મક્લેલી વૈશ્વવને નિત્ય નિયમ રાખવાની શીક્ષા

શ્રી કૃષ્ણાયનમઃ શ્રી ગોપીજલ વલભાવનમઃ વૈષણવને  
પ્રાતઃકાળે વેહેલું કરું, રૂપેદ્ય સમે નિર્દ્રાં નિશેદ્ધે, પ્રથમ  
ઉઠીને કંઠમાં એ માણા તેહનાં દરશન કરનાં, હાય ધોવા,  
તીન ડોગળા કરું અર્જુનન લેવું. ત્યાર પછી જ્યાલ્ય  
શીવલભ પ્રસુ શીવિદ્યેશ સાથે તથા જ્યાલ્ય શીવલભ-  
નંદન પ્રાગઃ સમે ઉડી કરુંઓ. શીલકંભણ સુતગાન પ્રાત;  
સમે ઉઠી કરુંઓ. ઓ વલભ સુત ગાન ઈન વિના આર  
ને આપને કારતન આડતાં હોય તે ગાઈઓ. શીજુમ-  
નાંજુનાં પદ તથા વલભાય્યાન પછે દીશા જગલ જ-  
હુંઓ, તે જતાં વખતે એ માણા કંઠમાં હોય તે અગર  
જનોઈ હોય તે કાને લભાવવી. તીન વાર અત્યક્ત લેઈ  
શુદ્ધ ધોવી તથા દીશા જાંગન જહુંઓ તે પછી ડાયા હા-  
યસ લોટો ન આલવો તથા ડાયો હાય જાંલે અડકા-  
ડવો નહીં. દસ વાર અત્યક્ત લેઈને હાય ધોવા, પછી પગ  
ધોવા, ત્યાર પછી અત્યક્ત લેઈ એ વાર હાય ધોવા, આર  
ડોગળા કરેવા, પછી દાતણું કરું, શુદ્ધ જગોપર લોટો  
સુધી દાતણું કરું, દાતણું કરતાં એડો હાય લોટે લભાવવો  
નહીં. કુશીવતી હાય ધોવા, પેહેલા ડોગળા કરું માહેલું  
શુદ્ધ કરુંને હાય ધોઈને પછી ક્ષપાણ ધીબું, પછી રનાન

કરી વાણી કર્પટે અડકવું નહીં, અપ્રેથમાં રહેવું, પછી એ-  
કાંત જગાએ સુકવેલું ધોતીયું જે તેને કોઈ અડયું ના-  
હોય તાતે ધોતીયાને ચેહેરવું અથવા મુગડો પેહેરવો, પછી  
જ્યાં શવાનું ટુકડાયું હોય ત્યાં આસત ખાંચાવવો, પછી  
આપણે એસવું. એરાને તીલક કરવું; તીલક કરવાની ગીત  
રહેણી પ્રમાણે.

કુમકુમે ન એરે ધિમા તિલકાની દાદ ચિત્તતુ; ॥ લલાટે  
ઉર્ધ્વ પૂંડું સ્યાતુ પદમા ફારંતુ વક્ષસિવેણું પત્રનાભ બાડુ  
અન્ય દિપા કૃતિ અચેત ॥

અરથ—પ્રસાદી કંઈ થકી દાદસ તીલક કરવાં, ઉર્ધ્વ  
પૂંડ જે માર્ત્ઝ અંધગાં શ્રીગિરધરજ માહારાજ કાળી  
વાળાએ નિરણ્ય કરવું છે. લલાટે વિશે ઉર્ધ્વ પૂંડ કરવું  
ઉર્ધ્વપૂંડ ભગવાનના ચાર્ણુંકારી દંડાકાર કરવું, એ તિલક  
નિરગુણ એટલે ગુણ : ૨૫ રજીત દેવી ગીત કરવું, એ  
તીલક શુદ્ધ છે હલ્ય ક્રમગ વિશે ક્રમળના હુલની આકૃતી  
અથવા ભુજાને વિશે વાંસના પતા સરખું, એર ડેડાણે  
ધીવાની જોત સરખાં, એવી ગીતે તીલક કરવાં, હેઠાં ઉર્ધ્વ-  
પૂંડની લીતર એક ગદી ધારણ કરેવી, તેના ઉપર ત્રણ  
સંપ્રદાયની છાપ ધારણ કરેવી. છાપાં કર્યા વિના રહેવું  
નહીં, કલ્યાં છે કે—

॥ ઉર્ધ્વપૂંડ નિપુઢવા મધ્યે શુંખન કાર્યિતે ॥

અરથ—તીલક કીચમાં શુંખ ન રાખવો, ચાંદા કરવો,  
એ શાસ્ત્રમાં કોઈ જગાએ પચન નથી તેથી ચાંદા ન  
કરવો. ભાજવાં નામ રૂપી છાપાં કરેર ધારણ કરવાં

નેટકી વારે નાહીએ તેટકી વારે તીલક કણેણે તેટકી વારે  
છાપાં કરેવા. ઓ માદાપ્રમુજુણે નિયંધમાં ઠથુ છે તે  
સ્લોક—

॥ શંખ ચક્રાદિકં ધાર્મ સૂર્ય પૂજાંગ ભિવતત ॥

॥ ગુલશી કાણા માદા તિલકં લિગ મિવવ ॥

અરથ—શંખ ચક્રાદિ ધારણ કરેવાં, મૂત્રકા વતી ક-  
રવાં એટલે ગોચારિદંન કરાવી ન મળો તો જ્યમાં ધૂટની  
રણવતી કરવાં તથા તે પણ ન મળો તો ગુણારીજીના યડ  
નીતરની મૃત્યકા વતી કરવાં પણ છાપાં વિના ન રહેયું.  
ગુણશી કાણની માણા પેહેરીની તથા તીવ્યક્ત ઉર્ધ્વપૂર્ણ કરવું.

નિયંધ તત્વ દ્વિપ રખો ॥ વનિ નૈવતુ સંપુર્કત ચક મા-  
દાપ વૈષણવઃ ॥ ધાર્યતે સર્વ વિન્દુના હરિજ સોક્ષ્પ કા-  
મ્યયેતિ ॥ તે ધકી તત્ત્વસુદ્રા ધારણ ન કરવી ॥ શાખાદિ  
ચિન્હ રહિત; પૂજાંવર્ષુ સગાયરેત ॥ નિઃકૃપ પૂજાન ત-  
રૂમહરિલાપિન ગુધ્યતિ ॥ અરથ—તે ધકી છાપ વિના શ્ર-  
વામાં ન જાયું શ્રેનામાં જાપ તો હશી ને ભગવાન તે  
પ્રસન ન થાપ તેથી છાપાં કરવાના જરૂર છે વધુનવને  
શ્રેના જરૂર કરવી રહેણાં નિયંધ તત્વ દ્વિપનેશે એક કાલં  
દ્વિશાલાંવાપિ પૂજાયતે ॥ અરથ—અપને ધરમે  
પૂર્ણ ભારગની પરનાળીકા પુંત શ્રેના ન જીરાજતી હેઠાં  
તો હું શુરૂની આસા પ્રમાણે સુક્ષેમ શ્રેના કરવી પણ શ્રે-  
ના વિના રેહેયું નથી. તે શ્રેનાની રીત નખતા નથી. એક  
કાળ જાપું હોય જીની જીન કાળ કાળમાં અથવા જીનો કાળ જાપ  
તો તીલ કાળમાં શ્રેના કરવી પણ સુક્ષેમ શ્રેના કરવા વિના  
ખાવું નહીં. આપણા ઓ ને ભગવાન તે ધકી બડી

મુખ થાય. શ્રવાતા અવકાશમાં જઈયા કરી. કાળનો ત્યાગ થાય પણ કરુનો ત્યાગ ન થાય તેથી શ્રવાતા અવકાશમાં કરી, પછી જ્યે કર્યો, પછી આપને ને શ્રી સરવોતાત્તમજી પાઠ અગર જીને ડોઈ પણ પાઠ આવડતો હોય તે જરૂર કર્યો સરવોતમજીનો પાઠ તો જરૂર કર્યો કેમકે તે વધુભાગી ગાયત્રી છે, ને શું આપણે શ્રવા કર્તા હોઈએ તે કર્યા પછી માહાપ્રસાદ લેવો. લેણ ધરુને અથવા છ પ્રકારના ને પ્રસાદ કર્યા છે તેમાં એકે પણ જરૂર લો. તે છ પ્રસાદ કર્યા કર્યા તેણી વીગત -- ૧ ચાક્ષાત પ્રસાદ, ૨ સ્પર્શી પ્રસાદ, ૩ દ્રોગ પ્રસાદ, ૪ નિશ્ચાત પ્રસાદ, ૫ ચરણસૂત પ્રસાદ, ૬ અદ્ભુત પ્રસાદ, એ શું તે છ પ્રકારના પ્રસાદમાંથી એક પણ લો, આસમરપિત વન્સુ લેવી નહીં.

સાંજની રોત -- વણ વાગ્યા પછી ને શું આપણું શ્રવા કર્તા હોઈએ તે પ્રમાણે કરી તે પછી શ્રી ગોવિધનનાથીનું જ્યાન કર્યું પછી વલભાય્યાન અથવા સુણ પુરુષ અથવા શ્રી ભાગવતની અનુકમણીઓ આદ્ય લોક આપણને ને ધીણ આવડતાં કોણ તેહનો પાઠ કર્યો. પછી વર્ધસ્નવ મંડળીમાં જલ્દી તેહનો નામ રાખ્યા; ને ત્યાંહાં ને વંચક થતું હોય તેહનું જ્યાન ઝેણાં રાખ્યું, ન તેમાં ને સંસાર હોય તેહનો ખુલાસો ને ડોઈ માહારો વધુસ્ના હોય તેહને પુછી કર્યો. ને તે ને પ્રમાણે કહે તે પ્રમાણે આલદું સત સંંગ કરેનાની જરૂર છે, વર્ધસ્નવને સુખ્ય હ્યા રાખ્યા, રાંસાર વીણ વર્ધરાગ રાખ્યાં એટથે સાંસાર વિશે આશકત ન થશું; કાગ, કોધ, લોઅ, મદ મતસર કરાને રહીત રહ્યું, ડોઈના હાંસા ન કરવા, તથા

નિંદા ન કરવી, ડોઈ ઉપર દ્રોષ ન કરવો; અસત્ય ભાષણ ન કરવું, અનાશ્રય ન કરવો, અગત સંગ ન કરવો, આદી કોમા ન કરવી, ભગવાંત ધરમ સમાન જાણે ધરમ ન જાળવાં; પરાક્રમિનું ગમન ન કરવું. જો કરે તો હજાર વરસતી નપસ્થિતીની નાસ્તી થાપ, હજાર વરસતી શ્રીવા નિર્મણ થાપ, દરશન કરુંચા વિના સરવ સ્વાન રેહેવું પરાક્રમાંથી આકાંતમાં એક પળ પણ બેસવું નહીં. જો બેસ તો કામ ઉત્પન થયા વિના રહે નહીં. તે થકી શ્રી ભાગવતા દીકાંતનાં ના કરી છે, આપણી દીકાંતી હોય અથવા એહેઠાં હોય તથા માતા શુરુંગાત્મી અથવા સાસુની જોડે પણ એકાંતમાં ન બેસવું—ઓ માણ પ્રભુજીને આપ્યા કરી છે.  
 || ૫૩૦. ॥ વિષયા કાંત દેલાનાં નાવેશસર્વથાહરે: ॥ અરથ  
 એહેઠાં ભન સાકૃષ્ટ વિશ્વને વીણ છે તેહના દદ્યમાં ડોઈ કાળ ભગવાન પધારતા નથી. વધુસ્તવને શ્રી ઠાકેરજ શ્રી વલભકૃષ્ણનાં એમને વીણ સામાન્ય ઘુંઘી રાખ્યા. તથા વધુસ્તવે હચેણાં પોતાના ધરમમાં દુણશીજની તથા આપ ની શ્રીવા કરવી.

શીરતન સુતી વાયત સુરણું કરી કેદેવું.

જ્યશ્ચી વલભ નાય શ્રીનિઃલ નાય શ્રી જ્ઞાનનાં શ્રીના  
 પજુ; કળીયુગના તો જ્ઞાન ઓપારચા, સુશ્તક ધર્માદા  
 પજુ. વધુસ્તવજન પર કંપા કરુને હેણે વરજ્ઞમાં પાસજ  
 આગે પાછે નાંડ બીરાને, બીમની માહારો નાયજુ. માર  
 ર સુગર પીતાંસર સ્વાદીએ, મારલી શ્રાન્તે હાયજુ; જ્યશ્ચ  
 શ્રી ગીરધર જ્યશ્ચી ગોત્રીદ, જ્યશ્ચી ઘાળાસુલજુ. જ્યશ્ચી  
 ગોકુળ પતી, જ્યશ્ચી રધુપતી. જ્યશ્ચી જ્ઞાપતી, શીધનસ્યા

મજુ. શ્રી ગોકુળ વારે નાથ, ભેરી દોશી પુ માહારે હાથજી. જ્ય જ્ઞાનતાં હું, શ્રી ગોરધનનાથ. માહા પ્રભુજી શ્રી વિઠલ નાથ, નેને શ્રી ગોકુળજી. શ્રેષ્ઠ તરફે કૃતેશ, ક્ષાળુંણું ધણ પળ સરણું કીને, નામ નીરંતર લીનેજી. અરથ શરીરને રાખે માહારે બાહારો. શ્રી ગોકુળજી અવતરણેજી; શ્રી ગોકુળજીનાં તો વાગ્યો વશીઓ, સંતમાત્રતિમાં રહેજી. શ્રી નાલ શ્રોવલલ સુખથી જીવીએ, ભવસાગરતો તરણેજી. નીતા પ્રત્ય રમાણ રોમાં રહીએ, ચુલાં છડા દાયન કરી જો. ને દુર્ભાને અલ્પાને દુરલલ, તે અપને આ જે કરીએ. શ્રી નાનાન ગોરધન વાશી. રાધા માધવ સંદર્ભયામં. હશીજનકો શેવક. દરશન દીને આડાલમ. ઓટલું છી મુખ અરણુાના લેં.

શ્રી નાના પ્રભુજે અપના નિયંધમાં ને આસ્તા કઢીછે તે પ્રમાણે તે શાસ્ત્ર મુખ્ય જ્ઞાનવાં. ૧ વેદ, ૨ વ્યાસસુન, ૩ ગીતા, ૪ શ્રીમદ્ ભાગવત, એ આરેને સર્વાપમા માનવા.

યેવાં કરીને હાથ પગ ધાવા ને ત્યાર પછી ડોગળા વણું કરતા ને જરૂરિને ડોગળા આડ કરવા. નિયય કરીને ડોગળા કરવા પ્રસગે પ્રસગે ડોગળા કરી અરણુાના સુંદરું અશુદ્ધ રહેલું નહીં.

શ્રી લરણપજીની શિક્ષણપત્રી, વર્ણસ્તાવને વાર વાર ચિ-  
શ્રી ગોકુળનાથનું વચ્ચાનાન્ન } ચાર કરવો અને જરૂર  
શ્રી દ્વારકાનાની ભાવના. સાંભળાનું.

## સ્લેઝ.

ચેકડ લગ્ન તુઠાંશી નાણીનાંકી માળા યેમાંડું મુલપરો  
શાલીન શાખ ચડા એવા લલાટ પરસેન સરફુંદું  
પુદુસે વર્ણસ્તાવા જુતાન માશુ પવિત્ર પતિ.

અર્થ.

ને કુમાં તુળશીની માણ છે, અધવા કમર કાકડી  
ની માણ છે; બાહુને વિશ શંખ અફાદી ધારણુ કસ્યાંછે,  
ભલાટને વિશ ઉર્ધ્વપુંદ્ર તીલક છે એવા ને વઈસ્નવ તે  
ન્યાંહાં જયતાંહાં એક માસ સુધી તે ભાવન પવિત્ર રહે.  
અધ્યાય તથા સ્થોષ તથા પ્રકરણનું પ્રમાણ સ્કંધ વિશ.

રોગ કાશી.

ઓ વભલ ચરણે લાગુણ, ગુણ ગાવું વાણી હેવી મા-  
ગુણ. ૧ શ્રી વિલદનાયજી પુરો આશજી, જનમ જનમની  
બાણી દાસજી. ૨ અનુક્રમ શ્રી ભાગવતનું કહીએજી,  
સ્કંધ તે દ્વારા લહીએજી. ૩ અધ્યાય નણુસેંને બન્નિશજી,  
પ્રાકૃત અધ્યાય મળી નણસે પાંચીશજી. ૪ સ્વોક અદ્રાર  
હળર પ્રમાણજી, પ્રકરણ તે તાળીસ પ્રમાણ નિરબાણજી.  
૫ ઓગણીશ અધ્યાય પ્રથમ સ્કંધજી, નણ્ય પ્રકરણ ક-  
લાં પ્રે બંધજી. ૬ હિત પ્રકરણ નણ અધ્યાય લગી થાપ  
જી, પેહુલા અધ્યાય સભિનક પ્રકરણ કેહેવાયજી. ૭ બીજે અ-  
ધ્યાય સુત પુરોણી ઉત્તર દોધાજી, લક્ષિત યોગ તે ઉત્કેષ્ઠ  
ક્રીધાજી. ૮ તીજે અધ્યાય કુથા અવતાર ચાવીશજી, બી-  
જી પ્રકરણ મધ્યમ ડાઢ નામી શીશજી. ૯ ચોયે ચિંતા  
વ્યામજીને થઈ નારે આંધ્યાજી, ઉપદેશ કરી પાંચમે સ-  
મજલબાજી. ૧૦ કીનેજી શ્રી ભાગવત પ્રકાશજી, તેણે  
થાપ તાપ તીમરનો નાથજી. ૧૧ છે પોતાનું વરતાંત ના-  
રહે કહુણી, આગળ જન્મે ને સુખ કુષ લહુણી. ૧૨ તી  
જી તે પ્રકરણ ઉત્તમ જણોજી, તેર અધ્યાયમાં એહ વ-

ખાળોણ. ૧૩ સાતમે અર્દ્યાપમાં જાગુ અસ્તરથામા ડેરાં  
જી, રક્ષા કરી સરવને રાખ્યાં નેરાંજી. ૧૪ આઠમે ઉત-  
સ્યા ગલે રક્ષા કરી લીધીજી, કુંતાજીએ પ્રલુની રતુની  
ક્રીધીજી. ૧૫ નીમને પીતાએ કુંપીરરને જીપદેશ કાધીજી,  
તે સરવને વચે અધીયાપ પ્રસિવોજી. દસમે અધીયાપ કુંધી-  
સ્થરને રાન્ય અસારચાજી, પછે શીજી પોતે દ્વારકાં પદ્ધા-  
રચાંજી. ૧૭ જ્યેષ્ઠાદ્ય અસ્યાપ સગાં સહેલાર સરવ મળી-  
આંજી, માણી માણ પરસપર ભળીઆંજી. ૧૮ ભગવત  
ભક્ત પરિક્ષણ રાયજી, જાને વરણુ દ્વારથ અર્દ્યાપજી.  
૧૯ ત્રયોદશ વીજુરજી હસ્તીનાર્દુ આંધ્રાજી. તિરય યાત્રા  
કરી સરવ મન ભાવ્યાજી. ૨૦ ધતરાદર ગાંધારી લેઈ સા-  
ધજી, વીજુરજી ચાલ્યા ઉત્તરા પંથજી. ૨૧ અઉદમે અર્દ્યા-  
પ દ્વારકાંધા આજુન આબ્યા ધેરજી, મુખ લોઈ કુંધિષ્ટર  
પ્રશ્ન પુછ્યા નેહજી. ૨૨ પંદ્રમે અધીયાપ યાદ્વ કુળ ક્ષે  
થાપજી, પરિક્ષણને રાન્ય હેઠ પાંડન ઉત્તર પંથ જાપજી.  
૨૩ સોણમ અધીયાપ પરિક્ષણ દીગચીને કલ્યાં જી, પ્રથિ-  
ધરમ કળીયુગને તાંદાં લહ્યાજી. ૨૪ ધરમ રક્ષા સતરગે  
અધીયાપ ક્રીધીજી, કળીયુગને સ્થાન હેઈ શીખ દાખાજી. ૨૫  
પરિક્ષણને વિપ્ર શ્રાપ ધ્યો અન્દિષ્ટજી, જોગહુમાં અ-  
ધીયાપ જઈ એઠા ગંગા તારેજી. ૨૬ સર્રા રાન્ય તે લ્યા  
ગ ક્રીડુજી, શુદ્ધજીને પૂર્ણાને વરત લીધુંજી. ૨૭ અધીકાર  
લીલા એ હેઠેલાપજી, જેક રસોના કૃપમ કરી ગુણ ગણાયજી  
૨૮ હણીદારા પ્રલુ શા ગોવરધન ધારીજી, શાલા ની-  
ની નીત્ય પ્રતે જાગી નલીદારીજી. ૨૯ ઈતી પ્રયમનું ધો-  
ળ આખ્યાન સ પૂર્ણુ.

## अथ श्री द्वातीय स्कंध अनुक्रम आख्यान प्रारंभ.

जने लीला द्वितीय संख्ये, अध्याय दस माण्डे; प्रकरण  
ओनां त्रिष्यहे, तत्परीयान येहेलु त्याहे. १ येहेला अधी-  
याय माण्डे कड्यां, साक्षात् योग सान; पोतानाज कारण,  
स्थुण स्वृप्तुं पीयान. २ सुक्षम स्वृप्तुं पीयानहे, ततो  
अधीयाय भाजे; छत्रप्रसाद प्रकरण भीजु, ज्यनु वर्ण्युन  
वीत. ३ उसी हेतुना अरवना यह भजी ते सकाळी;  
सरव तद्यु प्रभुने भजे, एहे अंतर पाभी. ४ भन वां-  
छीत इण पुरश, पुरश डाम. ओह; मंगणायरण सुक्ष्म करुन,  
ओये अधीयाय नेह. ५ तेनां शीजुनी रुठी करी, ते  
इयां लगी कडीओ; तीजु भननु प्रकरण हे, ते छ अधी-  
यायमां भहीओ. ६ एक उत्पत्ती, जीजे जप पती; ज्येना  
षे प्रकार, प्रथम उत्पत्ती प्रकारनो, श्रीयो हे जिच्यार. ७  
नारह पूळ्यु घट्टाज्जने, क्षुद्र पांचमे कडी भान; अधीयाय-  
त्मक सान परीकरण, स्थुण सुक्षम सन, ८ आउ स्वृप्त  
वहरागां, छठे अधीयाय जाणो; सरव उत्पत्ती प्रभुपीयह,  
ते कडी वाखाणो. ९ सातमे अधीयाय शेवा वर्णन, कोवीश  
अवतार; आउमे अधीयायथी जाणीओ, उत्पत्ती प्राई. १०  
नारद्युओ घट्टाज्जने खूडीयुं, ते ओर्मी कडीओ; पोतानी  
उत्पत्ती कडी, ते नवम अधीयाय भहीओ. ११ अनुर श्लोक  
थो भागवतनो, घट्टाज्जने जपहेय श्रीयो; नारद्युओ  
१२ धरी, अवणे रस पीयो. १३ ते उपहेय श्री शुक्ष्म-  
ओ, परिक्षितने कुछो; श्री भागवत रस सांबणी, छतास्थ

થયો. ૧૩ એ અધીયાપ ને વરણવું, આખો દઈવક સ્વ-  
િપ, દશમિ અધીયાપ વરણવું; તે કહીએ અનુપ. ૧૪ અ-  
વણે સુધારસ પીળુએ, રદ્ધિયા માંહે હરી, હરીદાસ પ્રલુ-  
દોભા. નીરઘીએ, શ્રીકુંજ હારી. ૧૫ ઉત્તિશ્રી ભાગવત  
દીલિપકંધ અનુક્રમ આચ્ચાન સંપુરણ.

## અથ શ્રી ત્રતીય સ્કંધ પ્રારંભ

( એનુભાવ વન યાત્રાના ધાળની છે. )

૧૭૬ લીલા નતિપશ્કંધ કહીએ, અધીયાપ તેતીથ પ્રકર-  
ણ એ લહીએ. ૧ પેહેલું અધીકાર પ્રકરણ કલ્ય, અધીયાપ  
યારે, વીદુરજી તીરથ યાત્રા કરી આપ્યા તારે. ૨ વીદુર ઉ-  
દ્વાજ જુમના તૃકુમાં ભાપા સહો, જીને અપોયાપ પાગ  
ચશીત્રની લીલા કહી. ૩ તીને રાજ્ય લીલા ચાદ્ય પ્રભાષ  
લીલા હેઠાપ, પછે ઉદ્વાજ સાંથી ઉત્તર પંથે જાપ. ૪  
જીજુ પ્રકરણ શુણું નીસ પાંચેથી ને; વીદુરજી મૈત્રેને  
પૂછે ભગવાન ભાપા તત્ત્વે તે. ૫ છે ભાપા નીરપથ મૈ-  
ત્ર્ય કીદું, તીને સયુદ્ધ પ્રકરણ અધીયાપ તૃણમાં સીધુ.  
૬ સાતમે ભગવાન મરિય અવતાર કરા પ્રશ્ન પૂછ્યાં ને,  
આદ્ય મુજા પૂર્વપથી અલ્લાજીની ઉત્પની થઈ તે. ૭ ન-  
વન અધીયાપ અલ્લાજ કીળું રહુતી કીધી, દરશન થય  
અણ કરવાતી આત્મા દીધી. ૮ ચોયું કાળ પ્રકરણ દશમિ  
અધીયાપથી લાણો, કાળાતમ કષ્ટક પ્રકાર પથ સાચ્છિ વ-  
ખાણો. ૯ પરમાણું કાળ ગતી અધીયાપ અગ્યારે, નવ અ-  
ધીયાપમાં લાભ મુજાજુનું પ્રકરણ અધીયાપ યારે. ૧૦ અલ્લા  
જીને અંગથી મૃદુ થઈ સનકારીક મરિયાદિને, સરસ્વતાતી

જાયાંતુ અનુષ્ઠાનિકા તે. ૧૧ તેરમે અધીયાપ વારાણસિનો  
જન્મ થયો, ચોદને કસ્પયાળ અદીતી સંતોષ કહ્યો. ૧૨  
પાંચશસ તલ્લ વિજયને સન્માનિકરનો આપ, સોલમે સન-  
ડાદીને દરશન દીધું વઈકુંઠનાથે આપ. ૧૩ સતરમે હીર-  
ખાત વાહાર કુદુર થાપ, અટારમે અધીયાપ પણ એ લીલા  
કૃત્યેવાપ. ૧૪ મોગશ્શુભમે હીરખાકને માણી પ્રથિવ લી-  
ધી, વિશમે અધીયાપ વરાણસી સ્થુતી કીધી. ૧૫ ઘટ ત-  
૧૭ પરેશ્રાણ તેહના બેદ્ધે એ, તેર અધીયાપ કરી વરણવ  
થાપ તે. ૧૬ ચોક્કીસમે સ્ત્રાયંતુ મનુ આંદ્રા, કરેદમ હિ-  
ધીની પરારથના કરી મન ભાંદા. ૧૭ કરેદમ રથી હેવ-  
હુતીનો વિવાહ કરી, ખાવીશમે સ્ત્રાયંતુ આંદ્રા કરી. ૧૮  
નૈવીશમે કરેદમ હથીએ વિમાન રસ્યું, યેઝા અન્યાસને  
ખણે રતનથી જડયું. ૧૯ વઈભવ સુાય લોગ હેવહુતીના  
કલા, નવ કંન્યાના જન્મ તે થયા. ૨૦ કાશિલ હેવણુના  
જન્મ ચોલીશમે કહીએ, નવ કંન્યાના વિવાહ લાદીએ. ૨૧  
પછે કરેદમ હથી વન જર્જ સાધન કીધાં. પાંચશસમે કં-  
પીલજ માતાને હપદેશ દીકા. ૨૨ છનીશમે તાવ સંઘ્ય  
વરણવ નેહ, સતાવીશ બગી વરણવ એ તેહ. ૨૩ ચોંગ  
ધીયાનમાં નેવા જરૂરિયાં ધીયાન કરેલાં, આદાનીશમે અ-  
ધીયાપ તે ૨૪ ધરવું. ૨૪ ચોથાખનીશમે ભક્તિ ચોંગ  
વરણ કલા, ત્રીકુમ વરણવ કરેદમ વીશાકત બદ્ધા. ૨૫ ચોક-  
નીશમે અધીયાપ જીવની અવસ્થા કહી, અરલ ક્ષિયતિ જ-  
-મ મરણ પરયાત બહી. જીન ભક્તિ નિર્દેખ અધીયાપ  
અત્રિસે હેવહુતી કીધુપદ પાંચાં અધીયાપ તેનીશ. ૨૭ મા  
માંચે જીન ભક્તિ ઉપરસ્થિ મિત ધરાયાં, લારે કાશિલહેવજ  
હિતરમંદ્ય પણાયાં. ૨૮ તેર અધીયાપમાં તલ્લ પરેશ્રાણ ધયું,

तेहां व परकरण् धे ते पाणि उद्युः । १६ ऐहेला आर  
अधीयापमां उररम भुजित परकरण् लग्यो, हुग्यास पर-  
लुल्लगी लीला वप्पाणे । १० छितिअी भागवते वितिपस्तङ्घ  
अनुक्रम आप्यान संपुरण् ।

## अथ श्री चतुर्थ स्कंध प्रारंभ

चतुर्थ स्कंधमां विसर्ज लीलाहुक्ष्मी, प्रकरण् आर  
अधीयाप एकत्रीमां जहीये । १ प१म अरथ इम भाक्ष प्र  
करण् आरछेरे, सात प्रकरणमां धरम प्रकरण्यनो विस्तार  
छेरे । २ येना अधिकार ते इस प्रलयतीर, ऐहेला अबो  
पापमां भनुसंततीरे । ३ तेमां सोम इतान्य दुर्वासा ज-  
युगीये, नारद नारायण् उत्त्यादीक वप्पाण्यायेरे । ४ विस्ता-  
सुरेन्द्रना पतमां दक्ष प्रलयती आवीआरे, जीज अदी  
पापमां सरवे आदर कडा आजावीआरे । ५ शिवलु उठया  
नही ते दक्ष प्रलयतीये राष्ट्र अविरे, वाख्यवद्द कुरतां ये  
इ अीजने आप दधीरे । ६ त्रिले दक्ष ना पतमां जवा  
सीख मागी सतीरे, स्तारे ते समेना डाँधी पतीरे । ७ यो  
थे आजाता शिवायन इश्वर सती यपारे, हेह युक्ति परवतनी  
पुनी थपारे । ८ पांचमे नारदल शीव आगण सरवे वात  
हुयेरे, कोध पत्तनो आधी विधवं स वात हेह धरारे । ९  
छठे अल्लादीक शीतल्लगी स्तुता, करा अहारि, सातमे दक्ष  
नो पत्त पुराय छ तहीरे । १० स१वे मणी श्रीस्तुती करा  
ते ज्ञान्यायेरे, जीजु अरथ प्रकरण् अधीयाप पापमे व  
आज्ञायेरे । ११ आउमि अधीयाप उतानपद्दनो वाय क-  
हयोरे, धन्तु अपगाने वचने तप आराधीयुरे । १२ वव-

એ પ્રભુ મણ્યા વરદાન સેઈ આચા ધરે ભદ્રારે, મર્યેને  
ધૂવળ સાથે પ્રિત બ્યાધી ધર્યારે, ૧૩ દશમે ઉતાનપદ પાંખ્યા  
અત્ય કુઃખ રહે ધર્યારે, બાનનું વેર લોગાની મત્યે ધૂવળએ  
જુંધ કર્યારે, ૧૪ એકાદશમે અધોયાય પરલુણ આવીઆ  
રે, કંઈ ધૂવળનું સાગાધાન ધેર આવીઆરે. ૧૫ ધૂવળએ  
રાન્ય કર્યું સા'પૂરણ દ્વારથને અધીયા। કલ્યારે, પછે પુ  
ને સૌંપી રાન્ય અથળપદ લલ્યારે. ૧૬ ધૂવળ માનીતા  
પર પદ ખાખ્યા તે બારમેરે, નીંજુ ટાન પરકરણ અધી  
યાય અગ્રીયારમેરે. ૧૭ એના અધીકારી તે પૃથુરાજ સહી  
એરે, તેહના ચરિતની કથા હેમાં કહીરે. ૧૮ ધૂવનો વંશ  
અધીયાય તેરમે કહ્યોરે, ચાદુદમે રાન્ય વેન ખૂલ્સ આપે મા  
ર્યો। ૧૯ પંચ દશમે પૃથુની જાનપત્રી બીમારીછેરે. ૨૦  
સોલમે પૃથુનું ચરિત થયા એકનીશમેરે, સન્કુમારથી આ  
તે યોગ્ય બાનીશમેરે ૨૧ એતા આઠ અધીયાયમાં છે તે  
કહ્યાં, તેહનો મેદ તે જ અમે લહ્યારે. ૨૨ અલ્લ ત-  
લદ્રશી ત્રણ અધીયાયમાં થાયછેરે, કંશ સાયુન્ય પાંચ અ  
ધીયામાં કહેવાયછેરે ૨૩ અનુંકન પુરીવે ઉત્તર જાણલે  
રે, હવે ચોનિશમે અધીયાય પૃથુનશ વષાણુલોરે. ૨૪ પ્ર  
ચિતાને શ્રી મહાદેવલુણ માણ્યારે, રૂદ્ર ગીત વરાજુવ કહુંડે હુ  
વા હાયારે. ૨૫ પ્રાચીન અહિરસને ન.૨૬ મણ્યા પંચનીશ  
મેરે, પુરીજન આખ્યાનનુંકલ્યું, છીનીથી અઠાનીશમેરે. ૨૬  
પુરીજન આખ્યાન સાંભળી ઓગણુનીશ મને કુઃખ પા  
રે, કૃપીનાથન જઈ.પ્રાચીન અહિરસ સુખ પાંખીયારે.  
પરચેતાને નિશમે પરલુણ પરસન થયા કારાજ સીધુરે. કલ્યા  
દશ હળર વરસ રાન્ય એ વરદાન દીધુરે. ૨૮ એકનીશમે  
નારેણુણ પરચેતાને ભગવદ વારતા કહીરે, એ કથા સાંભ

ણી હસ્તીનાપુર નિરૂરે આંધ્રા સહીરે. ૨૯ હશીદાસ શાભા વિચારુઓર, સદા એમના ચુણુ કીને જાન ઇદેમાં ખાગી ચેરે. ૩૦ છતિમો લાગવતે અતુરેથ સુધે અનુકૂળ આખ્યાન સંપૂર્ણ.

## અથ પંચમ સ્કંધ પ્રારંભ,

રાગ ખાડી.

પંચમ સ્કંધ અધીયાપ છવીસ ડેહેનાય, સ્થાન ભીલા નું વરણુન થાય. ૧ નથુ પ્રકરેણ દસ કાળ સમ કહીએ, એ હેસ ઈશ પ્રકરેણ અધીયા. નથુ લહીએ. ૨ પ્રીય વરતનો વંશ કહ્યો ષેહેલા અધીયાપ માંણે, સમ સમૃદ્ધ દ્વીપ કહ્યાં ત્યાં. ૩ ખીજામાં અગ્નિ ધૂમા નવ પૂત્ર કહ્યા, તે નવ-ખંડના રાજ થયા. ૪ નાંમી રાજને પુત્રનું વરેદાન દીધું, ગ્રીઝ અધીયાપ માંણે પ્રસિદ્ધ. ૫ એકવીસના અધીયાપમાં ખીજુ કાળ પ્રકરેણ જાણો, ચોથા અધીયાપમાં રથઘ દેવનોં ૮૮-મ વચ્ચાંણો. ૬ રથઘ દેવને નાલીરાને રાજ દીધું જયા રે, યોતે ૫૮ પાંચયા ત્યારો. ૭ રથઘ દેવના પુત્ર સોને ખાદ્યણુ એકાશી, નવ ચોગેસ્વર દેશ રાજ સુખ રાશી ૮ પંચમે છે રથઘ દેવ ચરીન લહીએ, સાતમે ભરયને પૂત્ર કહ્યો તે કહીએ, ૯ અટને ભરય ચરિત્ર કહ્યાં પ્રકાશ, અગ સંગત અગ થયા તે પાંચયા નાશ, ૧૦ જે ભરય ચરિત્ર નવમે મુગા થઈ ચાદ્યા. ૧૧ મે રધુગણુ વે-ઠુંમાં ગાદ્યા. ૧૨ ભરયને જાન અપૂરેવ રધુગણે પૂછું અગ્રીઅાર, તેજ કથા કહી છે અધીયાપ બાર. ૧૩ તેજે જડભરત કથા ચરિત્ર કહી, રધુગણુ આત્મ વિદ્યા પાંચયા

અતુર દિસે સહી, ૧૩ પંચ દથમે સુભતીનો વંશ વખ્યા-  
ણીએ, તેમાં ગયા રાજનો જન્મ તે લાણીએ. ૧૪ સે-  
નમે જુગોળ વરણન થાય, તેમાં જાંયુદ્વિપ નવ વરસ  
મિડું પરભાણ. ૧૫ સતરમે ઈષ શ્રવક છેલ્લાય તે કૃથા  
આગણીસચે તે થાય. ૧૬ વિશમે સમ સસુદ્રતું પરમાણ,  
વિશમે એકવીધમે જાંયોતિષ અઠતું પરમાણ તે વખ્યાણ.  
૧૭ ખાવીશ તેવીશ સુધી એ ચરિત્ર કહોએ, અતુરવિશમે  
રાહુતું પરમાણ તે લહોએ, ૧૮ નિણુ સ્વપન પરકરણ એ  
અધીયાપ જેદ એહ, એક જીવાત્મા જાંને પરમાત્મા તેહ.  
૧૯ પંચવિશમે પાતાળ લોક વરણન કહ્યો, નરક વરણન  
છવિશમે લદ્યો. ૨૦ હરીદાસ પરલુ શુણ જ્યાન ડુંગે  
નિતે, શાભા નિરખી ધરી લોળેએ ગિતે. ૨૧ ઈતિભી  
પંચનાસ્કંધ અનુકૂળ આખ્યાન સાપુરણ.

## અથ ભી સષ્ટુમ સ્કંધ પ્રારંભ

તાગ ધાયાઓ.

એની ચાલ શીમદ વલણ પરલુને કરું પરણમજી,  
અણમજીંધ અધીયાપ જ્યોતાણીસમાં પોષણ લીલા વરણન  
કહી; નામ ધીાન ને અરચન નણે પરકરણ એમાં છે  
સહી. ૧ અનામીલતું આખ્યાન અધીયાપ પેઢુલે, ખાંને  
વીણું દુત યમ દુત સંવાદ થયો; માણા દુઃખ આખરણું કરેયું  
તેહું, પરલુ નામ પરતાપે વધુંદ ગયો. ૨ નિણે ધર્મ  
રાને પાતાના શ્રવકને, નામ માણાતમ કહ્યું હશી; અતાણ  
કૃથા કિરતન નામ સ્મરણ કરે. તાંહાં જાઓ રખે કરો. ૩  
યેહું નામ પરકરણ કહ્યું, ૪૧ જાણુ ધીયાન પરકરણ

કહેવાય છે; ચોથા અધીયાયમાં વરણન તેનું, તેતો અગ્નિશ્ચ  
 અધીયાય લગી થાય છે. ૪ પરચોતાનો વંશ છદ્યો છે, તે  
 પણ ચોથા અધીયાયમાં જાણ્યો; દક્ષનો જન્મ થયો તે  
 સરવ, એમાં કદ્દી વખાળ્યો. ૫ પરખુણું પરસન થપા  
 ધણું, દસે એવું તપ કીદું, પરસન વેદને આનાથળ, સંતાન  
 થપાનું વરણન દીદું. ૬ પાંચમે દક્ષના પૂત્ર સરવે ભાક્ત્ર પા-  
 મ્યા, નારેણુંએ ઉપરથ ક્રીધિ; દક્ષને લારે કરોધ અડાયો,  
 નારેણુને આપ દીધિ. ૭ છે દક્ષને કન્યા થઈ તે, છદુ  
 પતી સંતતિ એમાં વખાળ્યો; જાતમે ઈંદ્ર ગુરુ અદૃષ્પતિ  
 ગીસાળા, વિસ્ત ઇપનો ગુરુ ક્રીધિ તે જાણ્યો. ૮ આંદે  
 ઈંદ્રને નારેણણું કન્યમ દીદું, નવમે વિસ્ત ઇપને માયો તે  
 કન્યા કડ્ઢીઃ વત્રાસુરનો જન્મ એમાં કલ્યો, દસમે દ્વિભી-  
 ના અદિપનું વજર કીદું સહી. ૯ એ વજર લેઈ ઈંદ્રે જુ  
 દે કીદું, વત્રાસુર સાથે ત્યાં; એકાદસમે પરસપર યુદ્ધમાં,  
 પ્રસનતાનાં વચન થયાં તાં. ૧૦ દ્વાઃસમે વત્રાસુર માંથી  
 ઈંદ્ર જીત્યો, નરોદાને અલ્લ હત્યા પર્ય; ઈંદ્રે જ્યારે પણ  
 ક્રીધિ, ત્યારે અલ્લ હત્યા ગઈ. ૧૧ પૂર્વ જન્મ વત્રાસુરના  
 ચિન્હિત રાજ, તેણ કંપા અહિદમે કડી; પંચદસમે પૂત્ર  
 શાક થયો, ઓત્રકોને નારેણુંએ સમાધાન કર્યું સહી.  
 ૧૨ સોણમે પૂત્ર શાક સાંભળી, વધરાગ ઉપન્યાસ સાધન  
 કીદું પ્રભુ મન્યા ત્યાં; સતરમે વધમાન એસી કેલાસ અથે  
 પારવતાળુંએ શાપ દીધિ. ત્યાં. ૧૩ વીજુને અરયન પ્ર  
 ક્રોણ, તે અઃરમેથી થાય છે; અદિતિ ને અદિતિના પૂ  
 નતો, એમાં વંશ કહેવાય છે. ૧૪ મહાત જખના ઉત્પ-  
 તી થઈ, એગણીસમે પૂશવત વરત કલ્યું; હાદાસ પ્રભુ  
 નીરણી શાલા, યુદ્ધ જ્વાન કરી ઝેણે પરથું ૧૫ ઈતિજી  
 સાધમ રક્ખાય અનુકૂળ આખ્યાન સંપૂર્ણ.

( १५८ )

## अथ श्रीसमता स्कंध ग्रांति

( श्री लक्ष्मण सुन श्री वक्तव्यराप्तु ) एते भागः

समम् स्कंधं अधिपाप्य पंद्रमे पापं छेदे, एतानां प्रह्लादं  
श्रव्यं केहैवाप्य छेदे : १ असद वासना क्षिरेऽरे, सद्वासना  
प्रकरणं बोग्यु लक्ष्मीयरे; २ चेहैर्लुभ्यं अद्वासना पांच अधिपा-  
प्य लग्नी लग्नेऽरे, चेहैर्लुभ्यं विज्ञप्तना आपनुं कारण्यं एते  
वप्याण्वारे. ३ अल अधीयाप्य मांही हीरण्याक्षं वधं करेतुरे,  
भाताने आप्यानमां समाधान मान करेतुरे. ४ तीने ला-  
तनुं वेर लेना तीभीतद्वे हीरण्या कृथपे लभ्यं क्षीरु धर्मीयि  
तरे, ५ व्यक्तं गुण्यं आग्नी वरदान दीधुरे, लेने हीरण्या  
कृथपे भाग्नी लीधुरे. ६ चोये हीरण्याकृशमे राज कीरु ल्प्या  
इरे; हेता भाग्नी अया ते वारेरे. ७ भगवत भक्तं प्रह्लादं  
८ पुन थपारे, पंचमे अधीयाप्य लक्ष्मीने अपारे. ८ भ-  
ष्या लक्ष्मी नाम ते सारे, ज्ञान्यु इंद्रं न करे उचारे. ९  
९ सद्वासना प्रकरणं बोग्यु क्षीरेऽरे, ते पांच पांच अ-  
धीयाप्यमां लक्ष्मीयरे. १० छठे प्रह्लादज्ज भक्ताना निशागरे  
श्री हरी नाम लभे सर्व भाग्ने. ११ सातमे प्रह्लादज्ज  
ने याए पुण्ड्रु त्यारेरे. तमो एते भक्ताना छेद इपारेरे; १२  
भाताज्जुने उपदेश नारहं कृत्यरे, भृंतो गरलभांया ते क्ष-  
ेत्रारे; १३ आठ मे प्रह्लादज्जने वीताये क्षोधं करी वापा-  
रे, स्थंभयी प्रभृष्ट थप्तने हीरण्याः सप्त भास्यरे. १४ हेवता  
एते प्रलुब्धनी द्युती कुरीरे, नवमे प्रह्लादज्जनी द्युती ३-  
४ चे धर्मीरे. १५ दसमे भक्ति वरदान स्तोत्र दीधुरे, राज  
विसाठा सर्व ठाज कीरुरे. १६ भनामा इर्त पित्रपुर ता-

ઓ નેહરે, પાળી નસમ કસ્યુ ત્યાંડા તેહરે. ૧૭ સદ્ગાસ  
ના પ્રકરણ કૃત્યા ત્યાં થાયરે, એકાદસમે આર વરણ કે-  
હેવાયરે. ૧૮ દ્વાદસમે ખજ્ઞચારીના કહ્યા ધર્મરે, વાત પ્ર-  
સ્થમાં કહ્યા સરવ કરમરે. ૧૯ ત્રૈયાદસમે પતીવૃત્તાના ધ-  
ર્મ કહીએર, અજગરને પ્રબહાદળનો સંવાદ થયારે; ૨૦  
અતુરદસમે અહસ્થામન કેહેવાયરે, ૨૧ ચદસમે કૃત્યાશ ધ-  
ર્મ કેહેવાયરે. ૨૧ ઉત્તમ અધીપતિ કનીએ સરવ પ્રકારે,  
હતિ ભીલા કહી વીસ્તારરે; ૨૨ હશીદાસે પ્રભુ શાલા જી-  
દ્ધાણરે, ગુણ ગાડ તે વળી વળીરે. ૨૩ હતિ શ્રી સમ-  
સ્કંધ અનુક્રમ આઘ્યાન સંપૂરણ.

## અથ શ્રી અષ્ટમ સ્કંધ પ્રારંભ

૨૧ ધનાશ્રી.

જ્યે જ્યે લાભ ગોવરધન ધારી, સુંદર ઇડાં નામળ એ હથી.  
અષ્ટમસ્કંધ મનવંતર લોલા અધીપામ છે ચોનીથળ;  
પ્રકરણ કહ્યાં છે એનાં, તે કહું નામી શિશળ. ૧ તામસ  
સાત્ત્વિક રાજસ ભક્તિ, આર પ્રકરણનાં નામળ; પેહેલુ  
તામસ પેહેલુ અધીપાયથી, વરણિં સરવ તળ ડામળ. ૨  
સ્વપણુ મનુ સ્વારેચિષ મનુ, ઉત્તમ મનુ તામસ મને ક-  
લ્લાણલ; જીને અધીપાપ ગનેદ્રને, જીનમાં આહે ગલ્લાણ. ૩  
નિને શ્રી હરીની સુતિ ડીધી, અહેથી સુકાવીએ ગરનેદ્રલ;  
ભક્તા હેત પ્રભુ પોતો ધાયા, છાંધીપર વાર કોણ્ણુક ચંદ્ર-  
લ. ૪ ચાયે ગજચાહતા પૂરવ જામનું કહ્યુ, માદ્દ થયા  
તે એમ કહીએણુ; પાંચમે રેવત મનુ ચાકસ મનુ થયા તે  
કથા સરવ બહોએણુ. ૫ હેવતા દ્વાતા શ્રયા ક્ષિર જાગા,

અખત ભત નીમીતજુ; સરવ માળી પ્રલુટી સુતિ ભીધી,  
નીરમળ કણીને ચીતજુ. ૬ છે પ્રલુ પ્રસન પછ દીધી, હે-  
વતા મંદ્રયળગીરી લેવા આવ્યાજુ; ઉપાડી ન શક્યા તે  
નોઈ, પ્રલુજુ ગરૂડ ધરી લાવ્યાજુ. ૭ ખાતમે કુરમ અ-  
વતાર ધરીને, સમુદ્ર મથન કીધુંજુ; કરતાં મથન હળાણ  
નીસરયું, તે સીવજુને દાધુંજુ. ૮ આડમે રતન ચહેરે તે  
નીસરયાં હેવ દાનવ પુષ્પ ધર્યુંજુ; હેવતાને અખત પાગાને  
કાને; માહી પુષ્પ પ્રલુ ધર્યુંજુ. ૯ નવમે અધીવાય અ-  
ખત હેવતાને પાઈ, રાહુનું છેદીયું શિષ્યજુ; હેવતાને અખત  
દૃષ્ટિને ટાંબી, અતંર ધીપાન થયા જીગદીશજુ. ૧૦ દથમે  
દૃષ્ટિ મરદસ્પર વહીયા, એકાશમે હેવસુરે સ આમજુ; દ્વાદ્ય  
મે માહી સ્વરૂપ ધર્યું, સીવહીત ડેઢીઠ કામજુ. ૧૧ વા-  
ચાણે રધવસ્તત મનુના રાજમાં, શીવા મનજુ પ્રગટ થયા  
જુ; પછે લવિષ્ય મનતંતર આગળ થાણે, તે પણ સરદ  
કરુંજુ. ૧૨ સરવણું મનુદત સાવરણી, મનુ ધક્ષા સારવણી  
કહીએજુ; રદ સાલરણી હેવ સાલરણી, ઈંદ્ર સાલરણી તે  
લક્ષીએજુ. ૧૩ ચતુર્દશ મનવાદી મનુના પુત્ર ધત્પાદિ, સરવે  
ભગવન્દ અંસ લણીએજુ; હવે નવ લગી પ્રકરણું તે ન્રી-  
જી, રાજ્યસ્ત કણી વખાણીએજુ. ૧૪ અચદશમે ખળી  
રાને રાજ્ય તે કીધું, અસ્વમિધ પત કીધી જ્યારેજુ; સ્નોડ-  
સમે વિતતિપ આદિતી કરી પતિની, પુત્રની કામના ને કાજ  
તમારેજુ. ૧૫ પુત્ર થણી વરેત કરો કણુ પતિ, થયો વરેત  
વિધી કહીજુ, આદિતીએ કર્યું પચોનૂત ત્યારે, સરવે જિધી  
હુદ લહીજુ. ૧૬ સમદ્ય પચોનૂત કિધી, પ્રલુ પ્રસન થયા  
લણીજુ; ગરલ વિશે આચ્યા પ્રલુ તારે જીલ્લાદિક સુતિ  
કરી વખાણીજુ. ૧૭ અછાદ્ય વામનજુ પ્રગટચા, ખાર્યા

ખળી વામની પાસજુ; પત્રશાળામાં મનમાન કરીને, અવિ  
લોકથા અવિનાશજુ. ૧૮ ઓગણામને ત્રણ પદ પૃથિવી સ-  
ક્રોદ્ધી એહજુ; એ પદમાં દ્વાર્ગ જરૂર સરવે ભીષુ,  
વિદેશ એકુ પદની માત્રાય તેહજુ. ૧૯ ત્રીજી પદનું  
‘રાજુ’ ન ટેકાયું, પરસપર વિવાદ વચન થયાંજુ, એકવીધમે  
ઘણાંજુ રાજમાં, શીજુના વરાણ ભણાંજુ. ૨૦ આંગુષ્ઠ  
હાથી અલિશેષ કીધો, ગંગા પ્રગાહ પદ પૃથિવીર વહ્યાં  
જુ, ખળી રાજને વડુંઝુ પદસથી બાંધ્યો, તે પ્રત્યે એમાં  
કહ્યાંજુ. ૨૧ ખાવીસાં ખળી આત્મ નિવેદન, સત્ત્વ વચન  
માટે કીષુંજુ, થિશ ધરેયું ફર્યુ પ્રભુ પ્રસન વધા, રાજ્ય  
સુતળનું દોષુંજુ ૨૨ કેન્દ્રિયમે ખળીને જી દીષું દેવતાને,  
રાજ્ય અધ્યં હતું ને એહનુંજુ. ભરત્ય ખળી રત્નાત કરી પ્ર-  
ભુણી, પ્રભુભીત મન થયું તેહનુંજુ. ૨૩ ચોયું પ્રકરણ ને  
કહીએ ચોવીયમે અધીપાપ. વૈવરતમનું રાજ્યમાં,  
મરછા અવતાર થયો તે કેદેવાપજુ. ૨૪ હરીદાસ પ્રભુના  
શુણું આતાં, તનની જમ તે જપજુ, નિત્ય પ્રદેશેની શાના  
નીરખી હઈંદું રાદાનું થાપજુ. ૨૫.

## અથ શ્રી નવમ સ્કર્ણ પ્રારંભ

રામ એતી ચાલ.

નવમસ્કરણ વરેણું કરે, અધ્યપય ચોવીસ જાણી, પ્રભુ  
કપાથી ઈસાનું કર્પા, પ્રકરણ એ વખાણી. ૧ સુર્ય વંશ મ-  
ર્યાદા પ્રકરણ, તે તો પેહેલું કડીગે, ચંદ્રનંશ પૂર્ણ પ્રકરણ  
છે, તે સાંભળી સુખ લાભ્યે, ૨ પેહેલે અધીપાપથી પે-  
હેલું સુર્પ વંશ તે કહીએ વખાણી, વૈવરતમનુને પૂર્ણ દશ

ખા, ઈક્ષવાકુ આદિ જાળો. ૩ એક કૃત્યા ખર્ત તે એમ  
હવે, કરું જીણો અધીયાય, ચાર સુતને સંતાન થયાં  
નહીં, તે પણ કેહેયાય, આ પછી જણ પૂત્રને વંશ થયો તે  
એમાં કહુંશે, નુંના ભગવાની સંતાન તે દ્વારા લઈશે. ૫  
નીંલે રત્નાતિનો વંશ કહી રેનતી કર્યા નેમાં, એથે નુંપ  
નો વંશ કર્યો. રાજ અમરિય તેમાં. ૬ લ તને પુરુષાયા  
એ ફુલાય દીધું, પોતે ફુલ પાણ્યા તારે. પાંચમે ફરજાથા  
સધળે હરી અરણ્યા, અમરિય ખસે ક્ષ્યારે. ૭ સુદરસન  
ને સમાધાન કરીન, વારચું તારે સુખથયું છે અમરિય  
નો વંશ થયો, તે સાંવે હલુ. પછે ઈક્ષવાકુનો વંશ ક-  
દ્વારો. તેહના વંશમાં માનધારા, તેહના વંશમાં મુજાહિદ  
થયા; તે કરું વિક્ષાતા. ૯ માતમિ માનધારાના પુત્ર પૂરુષ  
નો વંશ જાળો, તેમાં હરીમંડ રાજ થયા. આઠમે એનો  
વંશ વખાણો. ૧૦ નેમાં સગર રાજ થયા, નવમે એનો  
વંશ એદુ; તેહના વંશમાં ભાગીદારી રાજ, ગાંગાળ લા  
વીઆ નેહ. ૧૧ ભાગીરથી વંશ કહો, અડવાંગ થયો;  
દસમે રઘુનો વંશ કહો, રાજા અવતાર કહો. ૧૨ એકાદ-  
શમે રામણું રાન્ય વરેણું, દ્વારથે કૃષનો વંશ કહો  
પૂર્ણી પ્રકરણ અધીયાય, બારમે તેરમીધાં જહો. ૧૩ ઈ-  
ક્ષવાકુના નેમાં તેહના વંશમાં રાજ જનક થયા જાળો,  
ચૌદમે ચંદ્રમાથી પુલ થય; તેહના પુત્ર પૂરુષા વખાણો.  
૧૪ પાંચથિમે પુરુષેવાના વશમાં, શ્રી દરસુરામજી થયા;  
સેણમે દરસુરામ ચશીનો, વિસ્વામિત્ર જનમ લઈથા. ૧૫  
સખતદશમે પુરુષેવાના પુત્ર મોહેરા નહૂથનો વંશ એમાં  
રાજ થયાનો વંશ કહો, અધીયાય અદાર તેમાં. ૧૬  
એ. ગણ્યાથમે ય [૧] પરમગતી પાણ્યા, વાથમે પૂરનો વંશ

કહે; તેમાં એકવીશમિ કુસુકતને પૂત્ર ભરય; તેહનો વંશ  
બઢો. ૧૭ રંતીહવ લેહમાં થયા; જરગામ્યાદય વંશ કહેણો  
રાજ પંચાળના, કૃપામ્યાર્પ કહો લહા. ૧૮ બાવીશમિ ખ-  
પત કહા પછે સંતાનું વંશ વખાણો. ૧૯ પાંડુ ડેરેવનો  
વંશ કહિ, પછે જરાસંધ વંશ કહાયો; તેવીશમિ ભાકી પ-  
યાતિના આર પૂત્રનો વંશ કહિયો. ૨૦ તેહમાં પૂત્રનો વંશ  
થયો. મેઘાવી ઇષિ લેહમાં; ચોવીશમિ જાદુનો વંશ, ને  
અદૂરનો વંશ તેહમાં, ૨૧ ઉચ્ચસેનને હેવકનો કહ્યો વંશ,  
એ માણે વરણ્ણન કહ્યો છે; જામ તે કંશ. ૨૨ સુત્સેન  
નો વંશ કહેણો, ને લેહના સુત વાસુદેવ; તેહના સુત પ્ર-  
ભટ્ટચા શી કાસન ચ'દ્રાણ, નિત્ય કીળાયે સેન. ૨૩ હૃદી  
દાસ પ્રભુ ગુણુ ગાધને, ચિતમાં પર્યાલીને; નિત્ય પ્રતિ  
શાલા નિરખીને નરણે ૨૪ પિને, ૨૪

### અથ દસમ સ્કંધ પ્રારંભ,

શી લક્ષ્મણુ સુતને હું નથુ, કે તે પરમાણુ; વાણી  
ત સુરને આપણો, ગુણુ ગાવું તે વિરતાર,

શી લક્ષ્મણુ સુત ગુણુ ગાધ્યો, શી વખલ પરમ ઉ  
દાઠ; શી વીઠલવરને સમર્યાયો, દ્વિજકુળ ધર્મયો અવ-  
તાર. ૧ એહના પદ વિદાન કરી, માયુ તે વાળી સારે;  
દસમસ્કંધ ઇહ ધરી, અનુકોગઠ કે ઉચાર. ૨ અધ્યાપ  
દસમસ્કંધ ઇહ ધરી, સરને મળી કે-  
સત્તાણી એહના, તરણુ મનવનર ડેહેવાય; સરને મળી કે-  
હેવાય છે, નેવું તે અધીયાય, ૩ નિરોધ લિલા નિરપણ,  
છે પ્રકૃણુ પાંચ તે જાણી, જામ તામસ રાજ્યસ સાતવી  
કુ. ગુણુ પ્રકરણ વાણીય. ૪ જામ પ્રકરણ પ્રહેલં પેહુલા

## [ ૯૬૪ ]

અધીયાયથી, ચાર અધીયાય ભગ્નિ તેહ; રાજએ કરન પુ-  
 છયું તહાને, શ્રી સુક્રેવળ ઉત્તર દીઘા તેહ. ૫ શ્રી વસુ-  
 દેવજીને હેઠાળ, પરણાં કંસરાય કર્યા પ્રિણી; બાને અ-  
 ધીયાય કંસહેવકોળાના, પુત્ર મારચા તે કડી ગુણી. ૬  
 સંકરયળું ગર્ભમાણે પદ્મારચા તે કહું, પણે પ્રભુ પદ્મારચા  
 ગર્ભ માણી; તાંહાં સરવ, હવતા મળીને, સુતિ ભાધી છે  
 તાંહી. ૭ તરીને શ્રીદ્રાળ પ્રગટ થયા, મધુરાંમાં ડાંણાઓન  
 શ્રી વસુદેવજીન શ્રી હેઠાળ, સુતિ કરે છે તેહ. ૮ પુ-  
 ન લેઈ શ્રી ગોકુળ પદ્મારચા, શ્રીપણેશાદાળને આંકુષ; હૃત્યા  
 લેઈ તે જ્ઞાનાચા, મનમાં તે થાય શક. ૯ ચોયે માયા  
 ઉઠી ગઈ, આંકુષ કંસને થયા પદ્માતાપ; પણે એનનું  
 સમાધાન કીદું નોછને સાંતાન. ૧૦ દ્રષ્ટવ્યને તેડી એન  
 કહ્યું, મારો ને દુઃખ દો એક; તામસ પ્રકાર, પ્રમાણ પ્ર  
 મીય કેદેવાય; માધવ ઇણ એ ચાર છે, પ્રમાણ પેહેલું થા  
 ય. ૧૨ પણે શ્રીજીનો જોધન વરજ, કલું અનુ ન  
 માય; પણે કંસને દર દેઈન, ગ્રહાવીચા જ્ઞાનંદ રાય.  
 ૧૩ છે પુતના શાક, સાંતમે સાંકટ ભજન જાહી; ન-  
 ષ્ણુતન મરદન વિરન્દુપ ક્રાંતિ, લાલા એક વખાણી. ૧૪  
 આઠને ગર્જાચાર્ય નામ કર્મ ચૌર્ય લાલાને નતી ભક્ષ;  
 વિશ્વરૂપ દરસન દરસન દેખાયું, જનુનાને તે પ્રતક્ષ. ૧૫  
 નવમે ઉલુભા અધન, દારામય મળીય છે અરાણુન; અ-  
 જન લકુષ્ણ મનુચન ઉધાર, એકાદસમે ન દગ્ધામની લીલા  
 વણાસુર બદાસુર વધનો પ્રકાર. ૧૬ પક્ષાતરે કલમચા બે-  
 દના વણ અધ્યાય, વિરદ્ધ વાદ્ય નેહ; દ્વાદ્શે અગાસુર  
 વધ, નવોસે ગેવાળ મંડળી તેહ. ૧૭ બોનન ચિહ્ના

જથી ભોગન કીદું, ખ્રસ્તાજીએ હેઠ્યાં વછ ખાળ; અહિ-  
દમે પ્રલુલીના નોઈ, ખ્રસ્તાએ રતુની કીચી તત્કાળ. ૧૮ એનું પ્રમેય પ્રવર્ગ ઘે, તેના સાત આદ્યાય; દ્વાદસે  
વન કિંડા કરી, પ્રલુલુએ ચરાવી ગાય. ૧૯ ત્યા ઘેનુક-  
નો વધ કરી, વિશ નણથી રાખી સરવ; વ્રષોદસે કાળા-  
દ્રી અથન કીદું, વિશ દુર કાઢુ નિવાર્યો ગરવ, ૨૦ અહિ-  
દમે કાળી રાખ્યા, ત્યાંહાં તનો તે કદ્યો પ્રકાર; દાવાનણનું  
પાન કીદું, સરવની કરી સાર. ૨૧ પંચદસમે બાળ લી-  
લા પ્રલુલ કરી ચરાવી ગાય; અધિમ રતુ વર્ણવ કરીને પ્રલ  
ય વધ કેહેવાય. ૨૨ સોગમ દાવાનિનું પાન કીદું, વન  
થા પદ્ધારચા ગેઠ; સતરમે વરેણ્યતુ વરેણ્યત થાદ રતુ વ  
રણ્યત તેણ; ૨૩ અષ્ટદસે વેણ્ય ગાત, પછી નીણુ સાધન  
પ્રકરણ કેહેવાય, અનિ પરુને સાંભળો એતા તે સાત આ  
દ્યાય. ૨૪ ચોગણાસમે હુમાત દી, કાત્યાયની વરત વ-  
ખાલ્યી; વરજ ભડતને વરદાન દીદું, એમાં તે જે જાણ્યી.  
૨૫ વીસમે રૂષિ પણિનું અંગ આરાગ્યા; એકાલ મે ઈંડ  
નોંદોજ પાગ; ભાગ ધરાયો ગીણુરાજને, પ્રલુલુએ ક-  
ર્ય અનુરોગ. ૨૬ અન્યાન્ય દુર કરાની, પોનાના આશ્રય  
કરાવ્યો નાથ; બાનારાંગ ઈંડકાળ વૃદ્ધિયા, રાખ્યો સરવ  
રાય. ૨૭ વીસમે એવું પણાકુમ નેંદ્ર, સરવને આશર્ય  
સાન એવું થાય; ચોવીસમે ઈંડગતુની અભિશેક કરી, ગોવી  
દ નામ ધસ્યું કેહેવાય. ૨૮ પચીસમે અનિંદ્રને વરણ પા  
રથા, ચુંડાબ્યા વરજ પુણી; વરજ ભડતનો અલ્લ રૂપમાં  
નિર ધામ હ્રાદય શો જગરીશ. ૨૯ ઈંગ પ્રકરણ કર્યું  
ચ્યાય, સાત આદિય માંદે એહ; છીસમે વેણું નાદ કર્યા  
વરજ અણને નેડચા તેણ. ૩૦ રાસ કિંડા આરંભ કરી,

અંતરેવાન થયા તે વખાણી: સતામની વરજભકુ ત  
લીલા સમરણ કરી, દૂનને શુદ્ધિ પુછતાં ઇસ્યાં જાણી. ત૩  
આડાનીસમે વરજ ભક્ત રણી, સરવે કરેયુ ગોપીકા ગીત  
ગ્યાન; તે ગાણુનીસમે દીન થઈ રદ્દન કીષુ, તત્કાળ પદ્ધા-  
સ્યા ભગવાન. ત૪ નીસમે રાસ રમણ કરી, સુખ દી-  
ષુ વરજ ભક્તને નાય; એકુનીસમે સરપ ઉંશારી નંદરામજ  
મુક્ષાયા, તે દીકુ સર્વ સાય. ત૫ બળહેઠળનો રાસ વરણ-  
બો, તેમાં શંખ ચુડનો વધ કેણેવાપ, બતરીસમે દીનસ  
વીચોગ તાપસ દુર કરના, વરજ ભક્ત કુગળી ગીત ગાપ.  
ત૬ શુણ હ્યાન નીશ દીન કરેયુ, પ્રલુંદુ એ સદા મન હા-  
સ; હશુદાસ પ્રલુ શાભા નીરાયા, માગે અંણ રંજમાં વાસ.

અથ એજુ પદ.

એની આલ ઇકમણી હરણની.

એજુ પ્રકરણ તે રાજસ જાણો, અધ્યાય આડાણી માં  
હે વખાણી; ૧ તેના પાણ બેદ છે ચારે, પ્રમાણુ પ્રમેય સા-  
ધન કુંગ સાર. ૨ તેમાં ષેહેલુ પરમાણુ પ્રકરણ થાપ, તે  
ના જાગુંચે સાત અધ્યાપ. ૩ તેવીસમે તૃષ્ણમાસુર વધ  
કઢીએ, નારહ કંશને ઉપદેશ ઇસ્યો તે બદ્દાએ; ૪ ચાની  
સમે ડેશી દૃઢિ વધ જાણી, નારહ નંદ અદે ભવિષ વાર  
તા વીખાણી. ૫ પછે હ્યામાસુર વધ થયો નેહ, પાંતરી  
સમે અકુર વરજ કંશ મેલા તેહ. ૬ પંચ કુશળ પ્રક્રી પુ-  
છયા ત્પારે, છાડનીસમે અકુર સાય મધુરાં પદ્ધારે ૭ સ્ના-  
ન સમે નારગમાં દરથન દાંડુ. અકુર સાડનીસમે શુદ્ધી ક  
રી સુખ લાંડુ. ૮ આડનીસમે મધુરાં પરવેશ. ૧૯૪ મા-  
સ્યો સુંદરી ધરી વેશ; ૯ વાપણ પરષુ દીની મુક્ષિ,

દીધી ભાળા સુદામાને ભક્તિ. ૧૦ એગાધ્યચાળીસમે કુ-  
 ખજ કાંદી સ્વરૂપ, ધનુલનો લગ સાંભળ્યો કંસ લુપ. ૧૧  
 કંસને દુસુમ થાપ છે ભાગ), ૨૦ ગ મંડપમાં પદ્મા-  
 સ્થા ગીર્ધાશી. ૧૨ સાત આયાપમાં પ્રમેય પ્રકરણ થાપ,  
 ચાળીસમે કૃવણ્ણા પીડ વધ કેદેવાપ ૧૩ રંગ મંડપમાં  
 પદ્માસ્થા પરલુ છદ્દાં, લેને લેવા ભાવ તને તેવાં દરથન  
 દીધાં તીહાં. ૧૪ પરસ્પર મળી માહાત્મ વખણે, એકનાળી  
 સમે મહનુદી યચું તે ટાણે. ૧૫ કંસ સામાને મારા હો  
 ડ્યા, માના પીતાનાં બંધન છોડ્યાં; ૧૬ ગાતા પીતાનું  
 સમાનાન એતાળીસમે કીંદુ, ૧૭ નંદાદાઠને વરજ મેંક-  
 દ્યા નાથે; વસુદેવજીને ગડિદાન દેવરાબ્યાં હાથે. ૧૮ જન્મ  
 સમે સંકદ્ય કીંદુ. લેણ, પરલુજીએ ગાપ દોરાવી તેણ.  
 ૧૯ અંતીકા ગયા નિદ્યા ભણવા કાને, શુરૂ પૂત્ર ભાવી  
 દીધા ગાહારાને. ૨૦ તેતાળીસમે એધિવ વરજ આબ્યા,  
 કુશણ વારતા કરી નદ્દુ ગત લાયા. ૨૧ પ્રાતઃ વરજજ.  
 તને એધિવજી મણ્ણા સહી, ચુંબાળીસમે સાન વારતા ઉ-  
 પર્વથ કહી. ૨૨ વચ્ચા આશકીનાં કદ્દાં વરજ જન, શુદ્ધ  
 સત્ત ઉપન્યું મન. ૨૩ દ્વાંત ભમરનું દેખને કલુ, તે સર્વ  
 ભમર ગીતમાં લલુ. ૨૪ પીતાળીસમે કુશજ ષેર પદ્મા-  
 સ્થા કુશી, તીહાંથી કુશી મનોરથ પૂરણ કુશી. ૨૫ અદૂર  
 પાંડળની શાખ લેવા ગયા તેણ, છેતાળીસમે હસ્તીનાપૂરાભા  
 બ્યા અદૂર એણ. ૨૬ તીહાં સર્વેની શાખ લીધી, કુંતાજી  
 એ હુઃખ્યા વારતા કીદ્દી ૨૭ આનીને પરલુજીને કલુ, પુ-  
 રનાદ્ય સંપૂર્ણ યચું. ૨૮ હશીદાસ પરલુ શાલા શુલુ ગાઉ  
 શોભા નીરખી કુની અગ ન સમાચું. ૨૯સ.પુષ્ટર.

( २६५ )

॥ અથ નિજુ ૫૬ ॥

એની ચાલ રતી વહુને સુંઘુંછે રાણી ઇક્ષમણી.

ઉત્તોષ સાધય પ્રકરાય અધીયાપ સાતનુ, તે તો ઉત્તાર્થમાં  
થાપછે; સુડતાળીશમે અધીયાપ જરાસંધ કુદ્દ થયું, સારે-  
મોંવાર તે કહેવાય છે. ૧ અટારમા વાર જુદ્ધને ડાને  
આયો છાંઠાં, દ્વારાં સમુદ્રમાં પ્રલુબ વાણી ભરવને માંક-  
દ્વા તીણાં. ૨ પંચ મોન પધારયા ત્યાંહાં થકી મુખકંદને  
વર દ્વારિ એણે સુની કરી. ૩ એગણ્યપંચાશી મુખકંદન  
દ્વિકાયમ ગયા, ઘાઢેવ રેવાણ પરદ્યાં જાણીઓ; ઇક્ષમ-  
ણીજનો સંહૃદ્દી શી કબે પાતો, ૫ ચાયે ઇક્ષમણી ક-  
રણ વખાણીઓ. ૪ એડાવનમ કુદ્દમાં શીકદ્દજની સાથે  
રાજ સાંખ્ય, ઇક્ષમણીનાં સુદ્દ ભરતક કુડા ઉદ્દેશનુંએ  
ખાણીયા નિવાણી ગરવછે. ૬ તાંખી પ્રલુબ દ્વારાં ૫-  
ધારયા નિધિ પુરવણ નિવાહ કર્યાયા, બાવનમે પ્રકુમનજ  
પૂત્ર પ્રગણ્યા, સંવર દ્વારિ તે હશ્યાયા. ૬ કુદ્દ કરી સંવર  
દ્વારિને ભાડા, રાણી રતાણ લેઈ ધેર આવીયા, ત્યાં સરવ  
જન જાણ મળીયા, ઇક્ષમણીજ મન ભાવીયા. ૭ તે-  
પનમે ગણી પ્રસંગમાં નાંખુંતી સતભામા એદુધરીયા,  
કુદ્દ પ્રકાણ અનીય સાતમાં, ચોપનાં વરણવ કર્યાયા.  
૮ પ્રલુબ પાંડની થુદ્દ લેવા પધાણીયા, ત્યાં સાંલળયું  
ને સતરાળું નાશ્યાયો લડી, સતભનવાને ભાગું માણિ-  
લીધી તે, સતભામાને પૂત્રે લડી. ૯ સતભામાના આથ-  
દ્યો, શીકદ્દનજ કુદ્દ પધાણીયા, સતભાનુને ગારથો મ-  
ણી મળી નાણી અપવાદ થયો અછિરને તેડાવીયા, અપવાદ  
ગયો મણી આવી તડી. ૧૦ પંચાવનમે શીકદ્દન છદ્દપસ્થ

પદારચા, ને કાલીંગ્રોળ પરછા કલું, ખાડું વનનો દાહું  
કૃધિા, નિત્ર વંદા પરણ્યા તે લલું. ૧૧ સત્તા ભદ્રા ને  
લક્ષ્મણાં, તે છપતમે લોમ મારાઓ છે હરી, સોણ સહખ  
કલ્યા રોડી હતી, તે તો પ્રભુજીને 'વરુ'. ૧૨ સત્તાવનમે  
હાર્ય પૂકયન તેતો લક્ષ્મણાંને કલ્યાં, પ્રતિ ઉત્તર ઇરી  
કૃધિા, તેતો સરવ એમાં હાં. ૧૩ આઠાવનમે શરવેલ્લી  
ને, પુત્ર દશ થપાછે તે જાણીએ, પદરાણી આઠ ને સુઅં  
તેના, પુત્રનાં નામ વણાણીએ. ૧૪ પ્રદ્વામન પુત્ર તે દ-  
ક્ષમણીના. તેહના સુત અનિરૂધ છે, મામાની કંપા પ-  
રાણી લાલ્યા. તેતો કાંદું પુછ છે. ૧૫ ચોગણું સાઠમે ઓ  
અનિરૂધજીને ચિત્રલેખાં હરચા, ઓળ્હાતપુરમાં ખાણા-  
સુર તનયા, સુપનાંતરમાં વરચા. ૧૬ ત્યાં હરેણ કારણે  
પદારચા, ખાંધાંયા નાગપાસછે, સાઠમે ખાણાસુર સાંચામ  
થયો, પછે અનિરૂધજી પરણી પદારચા, પૂર્ણ આશ છે.  
૧૭ અતીરૂધજી પરણી પદારચા. શુણ ગાન કણું ચિત  
ધાર્યાએ; હરીદાસ પ્રભુ શોભા નિરખીએ, તન મન ધન  
સરવ વાણ્યે. ૧૯ છતિમી દશમસંધ અનુક્તમ આખ્યાત  
નીણું પ્રે સંપુરણું.

॥ અથ ચોયું ૫૬. ॥

એતી ચાન ધન્ય ધન્ય શીળુમનાંજુનું નીરણ.

ચોયું પ્રકરણ આત્મિક નૈવિશ અધીપાયણ, જાત અધો-  
પાયમાં પ્રમિય પ્રકરણ પેહેલું ધાયણ. ૧ એકસટે કુપમેયિ  
કરેકલાયનો ઉધાર કૃધિાજી, તેહના પૂરવ જ્ઞામ વૃત્તાંતપ-  
રસિધાજી. ૨ અલ્લ અંશ કડણ ધાણું તે કહીએણ, ખાસટે  
બળદેવજી વરજ પદારચા તે લહીએણ. ૩ સરવને મળિ રાજ

१८ अग्रे चुप्पे लीहुंगु, शीघ्रमनालुनु आकरथण आहुंग.  
 ४ तेसटे पूळशीक कारीनो राज नेहण, तेहनो पूत्र चु-  
 द्धाणु वध करयो तेहण. ५ कारी नासम करीचे न्यारेण,  
 चोसटे नष्टहुंगु द्विविच भारयो सारेण. ६ पांसटे हृ-  
 योधनानी कन्या लक्ष्मीणा लखाणु, जांभुवतीना पूत्र याम  
 परेण्या ते वणाणेणाणु. ७ वणदेवणु विवाह थयो ते कहो-  
 णु, त्वारे हस्तिनापुर वांडु काहुं ते लहीमेणु. ८ छासटे  
 नारेणु आव्या शीकरण ग्रहेणु, ग्रहस्थाधरम नोतां या  
 कुप्पा गोहणु. ९ सोणसहम घेर इरे नव जपणु, अह पते  
 नोतम लाला याणु. १० सडसटे प्रभुजुनी आहुंक वि-  
 धिणु, नेम करता तेम करयुं प्रसरेणु. ११ नारेणुओ  
 आवीने कहुं नेहण, पांडवने राज भनोरय थयो तेक-  
 णु. १२ साधन प्रकरण अधीयाय सातणु, अडसटे प्र-  
 भुल्लेणु उधवणु करा वातणु. १३ फुतने नारेणुओ कला  
 ते चित धरेणु, पांडव पासे धंद्रपस्थ पधारया शीहुणु.  
 १४ अगोतेरमे राज्यापत्र निमित दिशायो गुतीणु, न-  
 रासंध माणु पुत्र राज्य ऐसाज्योणु. १५ वंधनथी राज  
 सरव करी प्रित मुकायाणु, शितेरमे वस्त्र भुपण भाजन  
 करायाणु. १६ अनेदान धंद्रपस्थ पधारया शीनापणु,  
 घडेतेरमे यतमां शिथुपाण वध करुं राज्या अरेण साधणु.  
 १७ ज्ञाहेतेरमे साधव प्रध्यमतणु, माणा पुर्व दाळणु थयुं  
 भणु. १८ चुंवोतेरमे साधव मारयो, करी गदा प्रहारणु;  
 हवे सात अधीयायमां कुण प्रकरण अडारणु. १९ पंचा-  
 तेरमे विहुरय दंतवक ते भारयोणु, पछे प्रबू माणाभा-  
 रय पुर्वमां पदारयाणु. २० छोतेरमे वर्णहेवणु तिर्य  
 पाना करुं आव्या ते कहुणु, पुर्व स पुराण साकृ तेथयुं

૩. ૧૧ સોતોતેર સુદામા ક્લિની અંતાથી દ્વારીકાં આવી  
 લાણે લાઘિ. ૧૨ પ્રોગેરમે પ્રબ્લૂ પ્રેસન થઈ, સુદામાને  
 વહભર દીખોયા. ૧૩ અગત્યાઓસીમ સુર્યા અહંક જાણી  
 કુરૈસેન પધારચા તેહણુ, વરેજના સરેવ મળી કુશળ પુછે  
 સમાપ્તાન કીંચા એહણુ ૧૪ એશીમ પાંડવને મળી કુ-  
 શળ વારતા કીંચીયુ, પટરાછુ સરેવને દ્રોગસિયે પાણી-  
 અહંક વારતા પુછી લીધીયુ ૧૫ એશીએ ઇથી સુની પૂલ  
 કરી પ્રબ્લૂ મન ભાંયાય, વસુદેવણુએ નારેદ પાસે, સાન  
 ઉપદેસ ડ્રાયાયાય. ૧૬ પત્ર ડ્રાયો વિદ્યાય સરેવને કરીયુ,  
 પુછે ચાતે દ્વારીકાં પદારચા ઓહરીયુ. ૧૭ ગુણ પ્રકરણ  
 અધ્યેત્યાપ છુંમાં થાપ એહણુ, બાયીમે હેવાણના પૂત્ર  
 ભાંયા નેહણુ. ૧૮ કંસે છ પૂત્ર મારચા તે જાણીયા,  
 માતાજ જરૂર અણીરાજ પ સેથી આદ્યાય. ૧૯ રતન પાન  
 કરી પૂત્ર સ્વાર્ગ પદારચાય, હેવાણ માતાના ભાહ નિવા-  
 યાય. ૨૦ નાથીમે સુભદ્રા હણુ તે અરજુને કીરુંયુ,  
 પ્રભુય સુત હેત જનક અડ, પદારી સુખ દાઢુયુ. ૨૧  
 એરાશીએ સરેવ ઇપી મળી પરીક્ષા કરીયુ, અલ્લા વીસું  
 શિન તેમાં ચોડ્યા ઓહરીયુ. ૨૨ નિદ્યે કરી ઠરો ચું એ  
 નહીયુ. ૨૩ સુતી કરી તે કહીયુ. ૨૪ પાચાસીએ જનન  
 કેહનું મેછ તે કહાશેયુ, વરાસુરનું આદ્યાન કલું તે  
 જડીશેયુ. ૨૫ લોડા લોડ જદ્ધ વિપનો મારયો પૂત્ર ભા-  
 વા તેહણુ, છાણીમે અધ્યાપ લગી અશીન કહેયાં નેહણુ.  
 ૨૬ સત્યારીએ રાજ નીરી અદૃશ્યાયમ પરારણ, ગણના  
 ન થાપ પાદ્વ કુણ અહુ વીસ્તારણ. ૨૭ શી વલભજના  
 અરસુ કમળના આશણુ, શાભા નારાયી ગુણુ નાઓ દ-  
 ગુણસણ ઉજ.

## अथ एकादस स्कंध प्रारंभ.

मेरी याज थी वज्र गुण गाहिरे, के लीला छे धर्मी।

१ शुक्र एकादस मारे लीला मुक्ति कही, प्रकरण ए अनां  
 २, ज्ञन मुक्ति अद्वा मुक्ति सही। ३ ज्ञन मुक्ति प्रकरण  
 यहुरे, तेना लैद ए जाण्याच्ये; अध्याय ओगणीनीस ल-  
 गीर, ज्ञेह वापाणीच्ये। ४ अतो सरवे संपुर्णिरे, एकत्री-  
 स अध्याय छे; अद्वा भावना अध्यायरे पांच केहुवाप छे  
 ५ येहुला अध्याय नाहीरे, पद्मवृणने अद्वा आप थयो; यी  
 ने वपुष्वल्लने नाहे यान उपदेश कहये। ६ नव योगेस्त  
 रनो संवाद जनक अहु थपा, ते करीने कृपा अहुरे वयने  
 कहया। ७ वीले अंतरीक्ष प्रयु रे कहु, ते अमां लहु। ८  
 योग योगेस्तरे, निश्चय अवतार कहयां, योवीसं अवतार  
 ९ अमां वरण्यवी लहयां। १० पांचमे अमसाकरे, भाभाजन-  
 नो संवाद थयो। ज्ञाणीच्ये, साधुज्ञ मुक्ति अध्याय अमारे  
 ते कही वप्याणीच्ये। ११ छोडेता सरवे सुनी कोर्वरे, पा-  
 द्वने आता धर्मी श्री हरी; प्रभास जै यतादीक हरये।  
 १२ ए वात सरवे चित धरी। १३ उपर आवी प्रभ मीधा  
 १४, सातमे अवधुनो ईतिहास कहयो; योवीस युद्धना गु-  
 ण लीआरे, राज्य दुनो संवाद थयो। १५ आठमे योवीस  
 युद्धनुं द्वाराश्वरे, हसमे उपवल्लने यान उपदेश ते सही; ए  
 कादम्ब भडत सेवा करारे, तेने भापा खाधे नहा। १६  
 द्वादशमे साधु संगतरे, अमां अवु भाजे; वयोदसमे तत्प  
 यान करारे, सरव निश्च सामान्य द्रष्टी राखे। १७ अवृद्ध  
 लक्षितनो योग उत्तर करोरे, पछे ध्यान सप्तरूप कहु; १८

દ્વારા આશાદસ ચુધીરે પ્રાપ્ત થાય તે લહુ. ૧૩ વિભૂતિનું અદ્યાપ, સોણસામે અધ્યાપ જાણો; સમડસે આશાદસરે, વ રણાચ્છવ ધરમ વખાળો. ૧૪ ભક્તિ ચોગ એ નિયમેરે, અધીયાપ ચોગણીસમે; સાનયોગ કરમ ચોગને ભક્તિચોગરે, વિધી લક્ષ્ણ વીસમે. ૧૫ વિધી નિષેધ કરતાચરે, એ. કંઈમ ડેહેવાપ છેરે; તત્ત્વ નિષ્ઠયાત્મકાદિક કરેરે, ખાવાસમે થાપ છે. ૧૬ ભીંખુ ગીતાનું વરણું, અધીયાપ તેવાસમે સાંઘ્ય યોગાદિ ભક્તાચારીર, વરણું ચોવાસમે. ૧૭ પંચવી સમે યોગ લક્ષ્ણાદિરે, છવીસ છલોપાખ્યાન સહી; પુરુષાર્થન વિધીરે, સતાવાસમે અધીયાપ કહીરે. ૧૮ યોગાચાર વરણું, અઠાવીસમે ડેહેવાપ છે; એગણું નીસમે ચોગ ક મારગે ભાર્ગ કહીરે, ઉધવળુંનો વી. ૧૯ થાપ છે. ૧૯ ઘૂ-સુંકિત પ્રકરણરે, અધીયાપ ઘેનુરે; તેના છે લેદ એ, નીસમે ભમતા ત્યાગરે. દ્વારિકાંથી ચાહ્યા પ્રભાસ લીલા કરી. ૨૦ એકનીસગે અહંતા ત્યાગરે, તેતો ઘુણાદીક સુટી કરી; હરીદાસ પ્રભુ શાલા નિરખરે, નિજ ધામ પવારચા ઓ હરી. ૨૧

## અથ દ્વારદસ ઇકંધ પ્રારંભ

એની ચાલ રહેલીરે શીળને નિરખીએ.

૨૦૧૮ સ ૨૫ંધ અધીયાપ એના તેર છે, અધીયાપ એ લીલારે પ્રકરણ પાંચ લાખી; સદા ગુણ ગાઈએ, એક લાડા-શ્રૂપ વિનો વેદાચ્છવે. નીજુ પ્રકરણ વખાણી સદા ગુણ ૦.૧૮એ. ૧ ચોણુ શાદાચ્છવ પાંચસુ અંધાચ્છવ એ પાંચમાં ફેલું લોકાચ્છવ એહુ, સદા ગુણ ગાઈએ ચેહેલા ૨૦

## ( ૨૭૫ )

આધીયાયમાં રાખ તે કહ્યા, ઘીન આધીયાયમાં આગળ થાણે તેથી સદા શુણું છે ઘીનું પ્રકરણ વેદાશ્રમ અધીયાય કોનેથી તેમાં તે હું હુંગના સરવ ધરેન કેણેવાય. સદાશુણું ૪ ચોથે હું હુંગનાં પ્રમાણ કહ્યાં, પ્રલયકાળ નેટે એમાં વરણવ થાય. સદાશુણું ૫ નીનું પ્રકરણ ભગવદાશ્રમ ન્રણ પ્રકરણ અધીયાયમાં પુરાણે, ભગવદાશ્રમની સદા શુણું ૬ પાંચમે પરમાણ લક્ષ્મિ પ્રક્ષિનને સરેપ ડંશ કહ્યો, છેડું પડાક્ષાનેરે માત્ર થયો નીવારણ. સદા શુણું ૭ સરેપ યત્ન વેદ સંખ્યા વરણવ કહું, સાતમે પણ રે વેદ સંખ્યા વરણવ. સદા શુણું ૮ ચોથું પ્રકરણ શબ્દાશ્રમ અધીયાય વરણનું એનો શ્રી ભાગવતનો આશ્રમ કર્ણો એહા. સદા શુણું ૯ ભાગવત શવરૂપ શ્રી ભાગવત છે સહી, ભાવ કરીએ કાને નિત્યે જાન. સદા શુણું ૧૦ આડ અધીયાયથી મારકંડ આખ્યાન છે, નવ દસ લગીરે મારકંડેય આખ્યાન છે મહા શુણું ૧૧ એકાદસે સૂર્ય દ્વારસે પૂરવોક્ત થયું, તે સંક્ષેપે કહ્યા. સદા શુણું ૧૨ નયોદ્ધસે પૂરા શુસંખ્યા કડ્ઢાર, ઇન્દ્ર શૂતિ પાણ એમાં થાય. સદા શુણું ૧૩ નિષ્ઠાધોક્ત સરેત આખ્યાન થયાં; શ્રી ભાગવતરે, મહિમાય અપરમપાર. સદા શુણું ૧૪ હશીદાસ પરલુ શાળા નિરખીને શુણું ગાઠચેરે, જાં હું બજીલાર સદા શુણું ગાઠચેરે. ૧૫

સમાપ્ત

## अथ श्री द्वारकांनी परीक्रमा

शंभो दूरे संभ नारायण, परम पूरुष परमेश्वरजे;  
अद्वितीय ईश्वरात्मक श्रवे, हेली हृत ते तेजीय डोउने. १  
इस अवतारे दरथन शिथां, भीष्या त्रिविषी तन तापने;  
शेष तत्वाश्च स्नान आरंभ्ये, हेलीभटे जनभनां पापने. २  
भडन वडन भडतना लीँह, जनकील्लवत रा भन्ने; भ २१  
शारूप्यन लछमन खाता, हेली आपने पूरुष कामने. ३  
नारायणी शाला सुँदर, लक्ष्मीलगा छंधने; एहेना द-  
रथन आरे प्राणी, भीटे छे मन-॥ भांतने. ४ डेशपराय  
कुरुणामय सागर, हेली जगनाय जगदीशने; आद्यनारा-  
यण अलक नारंजन, सडण ज्ञानपनी छशने. ५ प-य-  
वठ तड्डिस्वर पुल, हेली क्षीरेस्वर भाहोदिवने; नरस-  
द्धल्लनां दरथन भीजां, सडण सुरायुर सेवने. ६ यांद्रभागा  
आरे कुण्ठी चरो, वीडुरे तथा गोपाणने; नागाना नारा-  
यण स्नामी, हेली संत डेता प्रतिपाणने. ७ भीरांभार्त  
हरीनी दासी, गीरधरखल शुं लहुनीने; ईदू भाटनी घडी  
हवेनी, त्यांहां वनभडुगना वासने. पैक्षवज्जन त्यां भी-  
रतन गावे, आनंद भन उलासने. ८ एहुने दरथन  
आवे प्राणी, पाव। करे श्रीनाथने. ९ रमण्यद्वय रण-  
छाइ भीराने, आनंद पुरणु अस्तने; नारें तुमरे त्यां  
गान करे, शुं ज्ञेतां जय भननी भांतने. १० कुसिश्वर  
ओर गणपतल्लने, प्रेमे लायु पापने; नीज भंदीर जह  
शीय नमावे, तेनो जनम इतारेय पापने. १० ज्ञन य-  
मरनी शाला सुँदर, ए चैद साक्षो नाथने; त्रीभवतेन  
प्रताप अपोकु छपी, माधव मदा गोपाणने. ११ १-

ધ્યાણરાય કરી ગ્રામ્ય સાગર, પૂરુષોત્તમ પ્રતીપાળને; માતા દેવાભી ઓ લક્ષ્મીજી, સત્તાભામા શાલા સિંહુલો. ૧૩ પ્રેમપૂજ જ્યોતિઃભાન બડાંતિ, તાંદાં રમે નંદાનંદને; નટ-પરેલાલ ગોવરધનધારી, ગોધીપત ગોપાળને; સુકુમાર અંધુ-સુદન જાંયુનંતિ, શ્રીપતિ પરમકપાળને. ૧૪ નારદારોં સનશ્વરીક શૈવ, હેર તે તેજીસઠોડને; ગરૂ અંધાજ પ્ર-હલાદારીક, શેહુ રદ્ધા કરલેડને ૧૫ અંધુકમળ ગોમતીએ નાદ્યા, તાંદાં સુરજની લોતને: ઇકનાથી કુંડ નાદાનાં ધાતાં, ગરૂછે મનની જાતને. ૧૬ કાળીને કાળંદ્રી નાદ્યાં, શાંખોદ્વાર ધામને; તેણી ધજનાં દરથન કાધાં, તાયાં પામે વાશ્રામને. ૧૭ પદમતીરથ આણુગંગા નાદ્યાં, તાંદાં તુપણીનો વાસણે; સત્તાભામાને આંગણીએ કાંઈ કદ્દુપ્ર-ક્ષત્તું જાહાડને. ૧૮ સેહેણ અઠચારી ઇષો તથાં, લેબા સા ડોટડી ધામને, ઇષો કીપાએ પામીએ; મુક્ષતારાયથતું નામને. ૧૯ આણ ડામાં હુમાન પીરાને, નવતાથ ચારાણી સાધને; એને દરથન લયે પ્રાણી, આપેષે પહું શીધને. ૨૦ પ્રેમલા નીસેનુર સનામી. અભયા અભૈપદ ધામને; મહમાયાને પાંચે ભાગુ. આપ તે પૂરુષ કામ-ને. ૨૧ પરીક્રમા પરમશરર કેશી, પૂરે સહિની આશને; કસસનેણી નાદ્યુંવરનો, જન્મ જન્મનો દાસને. ૨૨

## શ્રી દ્વારકાની પરીક્રમા બીજી

લેલોને રઘુછોડ રંગી, નીકુમરાય માધવરાય અ-  
ગી; કલ્યાણરાય પુરુષોત્તમ સંગી. લેલોને રઘુછોડ ર-  
ગી, ૧ કું અથ પદ્રાણી વાસી, શ્રી રાધાસુખની રાસી;

૨૫ કરે છે બાહું દાસી, જોલેને રણછોડ. ૨ દરશન કે-  
 શી પાવન ધર્મએ, તીરથનો મહીમા લહીએ; પ્રેમે પરીક્રમા  
 જ્ઞાનએ. જોલેને રણછોડ. ૩ પરથમ પંચખાળે નાહા  
 વું, દામોદરરાય ગોમતી લવું; પાંડવ ધારે પાવન ધારું,  
 જોલેને રણછોડ. ૪ ગોડિ ધારે ગજની ખરીએ, પર્યાય  
 ઈપર્યા 'ધરીએ; બ્રોમુખ' ખાદ્યાને કહીએ. જોલેને ર  
 ણછોડ. ૫ તોવાંથી ખાંગુ ગંગા લવું, આવી સાગરમાં  
 નાહાવું; ચચુ તીરથ ચીતમાં ચાહાવું, જોલેને રણછોડ.  
 ૬ સાત પાવન સાને ધાવું, સામે સીધનાથમાં લવું; હા-  
 તાં હરીના શુષુ ગાવું, જોલેને રણછોડ. ૭ ખલ્લા  
 સાવત્રી વાવ્ય, દામોદરરાય કુવે નાહાય; દરશન મેં મેંદરી  
 થાય, જોલેને રણછોડ. ૮ ભાગોરથી ગંગાએ ચાસી, દ  
 ક્ષમણી ડરામાં માહાયો; ગજધાર્યક તાંદાં નીહાળો, જોલે  
 ને રણછોડ. ૯ કકલાસ્ય કુંડ લંઘી અવતાર, કાંચીડાનો  
 ક્રાંધી ઉક્ષારે; હરીના અરાગ શીરોમણુ સાર, જોલેનો.  
 ૧૦ જ્યવને પ્રભુના છે પ્રતિહાર, તેને નમીએ વારવાર  
 અરણાન્ત દે પ્રભુને દ્વાર, જોલેને રણછોડ. ૧૧ જુ  
 ણએ શાખ ચક્કા લખણ, તેનું દરશન નો કરશ; તે લ  
 વ સાગરમાં વરણો, જોલેને રણછોડ. ૧૨ તેનાથી પ્ર-  
 સન થાશ, પ્રેમ પરીક્રમા વાશ; વચ્ચિને જરી વચ્ચિકુંડ  
 લણે, જોલેને રણછોડ. ૧૩ દ્વારકાં માહાતમમાં કેણેછે,  
 મહીમા જોડેરા કેણેછે; નાહીને દાન કરી હેછ, જોલેના  
 રણછોડ. ૧૪ તેનો જન્મ ગુરુણ થાશ; વળી કોષ દ્વારકાં  
 લણે; નાહીને હરીના શુષુ ગાશે, જોલેને રણછોડ  
 ૨ંગી. ૧૫

